



This is a digital copy of a book that was preserved for generations on library shelves before it was carefully scanned by Google as part of a project to make the world's books discoverable online.

It has survived long enough for the copyright to expire and the book to enter the public domain. A public domain book is one that was never subject to copyright or whose legal copyright term has expired. Whether a book is in the public domain may vary country to country. Public domain books are our gateways to the past, representing a wealth of history, culture and knowledge that's often difficult to discover.

Marks, notations and other marginalia present in the original volume will appear in this file - a reminder of this book's long journey from the publisher to a library and finally to you.

### Usage guidelines

Google is proud to partner with libraries to digitize public domain materials and make them widely accessible. Public domain books belong to the public and we are merely their custodians. Nevertheless, this work is expensive, so in order to keep providing this resource, we have taken steps to prevent abuse by commercial parties, including placing technical restrictions on automated querying.

We also ask that you:

- + *Make non-commercial use of the files* We designed Google Book Search for use by individuals, and we request that you use these files for personal, non-commercial purposes.
- + *Refrain from automated querying* Do not send automated queries of any sort to Google's system: If you are conducting research on machine translation, optical character recognition or other areas where access to a large amount of text is helpful, please contact us. We encourage the use of public domain materials for these purposes and may be able to help.
- + *Maintain attribution* The Google "watermark" you see on each file is essential for informing people about this project and helping them find additional materials through Google Book Search. Please do not remove it.
- + *Keep it legal* Whatever your use, remember that you are responsible for ensuring that what you are doing is legal. Do not assume that just because we believe a book is in the public domain for users in the United States, that the work is also in the public domain for users in other countries. Whether a book is still in copyright varies from country to country, and we can't offer guidance on whether any specific use of any specific book is allowed. Please do not assume that a book's appearance in Google Book Search means it can be used in any manner anywhere in the world. Copyright infringement liability can be quite severe.

### About Google Book Search

Google's mission is to organize the world's information and to make it universally accessible and useful. Google Book Search helps readers discover the world's books while helping authors and publishers reach new audiences. You can search through the full text of this book on the web at <http://books.google.com/>

WIDENER LIBRARY



HX 513K A

3254.104

HARVARD COLLEGE  
LIBRARY



BOUGHT WITH INCOME  
FROM THE BEQUEST OF  
HENRY LILLIE PIERCE  
OF BOSTON







Louis H. Gray  
April 1, 1899

RUDIMENTS  
OF  
THE BHILI LANGUAGE

BY THE  
REV. CHAS. S. THOMPSON,  
CHURCH MISSIONARY SOCIETY, RAJPUTANA.



AHMEDABAD :  
UNITED PRINTING PRESS.

1895 //

3254.104



---

*Registered under Act XXV of 1867.*

---

TO

COLONEL J. M. HUNTER, I. S. C.

FORMERLY POLITICAL AGENT, MAHIKANTHA,

IN GRATEFUL REMEMBRANCE

OF HEARTY CO-OPERATION

IN EFFORTS MADE FOR THE WELFARE OF THE BHILS,

THIS BOOK

IS RESPECTFULLY DEDICATED

BY

THE AUTHOR.



## PREFACE.

---

In the year 1880 the C. M. S. began Mission Work among the Bhils inhabiting the Hilly Tracts of Rájputáná. Up to that time no attempt, so far as I know, had been made to reduce to writing the language spoken by the hillmen. For several years I was collecting words which I then thought belonged to a separate and distinct language. Eventually my attention was drawn to Gujarátí, and I found that many of the words in common use among the Bhils were simply corrupt forms of Gujarátí words. Some of the letters had been changed, others had been dropped and a few were differently pronounced. Still I felt that there must be, along with the Gujarátí element, a substratum of a language peculiar to the aborigines. Investigation has, however, considerably weakened this impression.

There may be in the speech of the tribes of Central India a considerable percentage of words unrelated to the Aryan vernaculars, inasmuch as the Bhils of that district are probably of comparatively pure descent. So far, however, as I have yet

been able to discover, the dialect spoken even there is principally a corruption of Gujarátí, Maráthí and Hindí.

The Gujarátís have a proverb to the effect that their language changes every twenty miles. Bhilí changes too, and the changes that are found are due to the Maráthí and Hindí words which have been added to the predominating Gujarátí element. Naturally in those portions of the Bhil country bordering upon districts where Maráthí or Hindí is spoken, one finds a larger admixtnre of Maráthí and Hindí words.

Besides the actual change of letter, there is also to be noted a difference in pronunciation. The tone and the accent are not quite the same in places separated by, say, a score of miles. For example, the dialect in the Kotrá district differs from others in its partiality for the vowel *e* (pronounced as *ai* in *aid*). For the word *pog*, the Kotrá dialect has *peg*; for *hukam*, *hekam*, for *Bhagwan*, *Bhegwan*.

There are a considerable number of words in common use among the Gujarátís and Bhils which are not found in any dictionaries. The question is : Did the Bhils borrow any or all of these words from the Gujarátís, or did the Gujarátís borrow them from the Bhils, or did Gujarátís and Bhils each add special words of their own to the common vocabulary? The enquiry may be pursued even farther: May not many of the words now known as Gujarátí and found in the Gujarátí dictionaries have been obtained originally from the Bhils? This supposition seems not unlikely when we remember that probably the whole of the country of Gujarat belonged at one time exclusively to the Bhils. The language spoken by them must have, more or less, influenced that spoken by the neighbouring

Aryans. This external influence may have operated to some extent in moulding Gujarati to its present form.

As to whether there is a Turanian or Aboriginal element preserved in Bhili, very little can at present be affirmed. From enquiries made, it seems evident there is no connexion between Bhili and the Dravidian languages of Southern India, nor with Gondi, Santali and Kol. Of the words in the following vocabulary about 84% are probably derived from Sanskrit, 10% from Arabic and Persian, while 6% are of uncertain origin.

The Bhili words contained in the Collection now published are in common use in Rajputana and the Mahikantha, but how far they may be in vogue in Central India I am not in a position to state. There are, as will be seen from the column headed "Gujarati Equivalents", comparatively few words not identified with that language. Bhili bearing such a close resemblance to Gujarati, I have, in the absence of any distinctive Bhili character, adopted for this Book the character employed in Gujarati, some slight acquaintance with which language is presupposed on the part of the reader. In the Grammar portion I have followed, in the main, the lines of Taylor's "Students Gujarati Grammar", a work which should be in the hands of all who are studying either Gujarati or Bhili.

The printer being unable to supply at the time the necessary type, no accents have been placed over the long vowels in Bhili or other words transliterated in this Book.

It is not with a view to conserve in any way the Bhili tongue, which is after all only a corrupt form of one of the principal languages of India, that I have compiled this Grammar and Vocabulary. My object will be fulfilled should this Book prove of service to those whose work may lie among the Bhils.

For many helpful suggestions, for advice often sought and always readily given, and for patient kindness in reading over the proofs, I am greatly indebted to the Revd. Dr. G. P. and Mrs. Taylor of Ahmadábád. This work indeed could not have appeared in its present form but for their constant help and ready co-operation, for all which I tender them my warmest thanks.

## HISTORICAL SKETCH OF THE BHILS.

---

The purpose of the following sketch is to place the history of the Bhils simply and concisely before the reader.

Very little is known of the earliest inhabitants of India. Among the few traces they have left behind them are some rude stone circles, upright slabs, earthen pots, agate knives and rough flint-axes. Some of these have been unearthed in the valley of the Nerbudda. It is impossible now to say who the people were that made these implements, for no written annals have been left to tell us anything about them.

Turning from these primitive races, we come to the tribes which entered India by the North-east and North-west passes. They have been divided into three stocks—the Thibeto-Burman, the Kolarian and the Dravidian. The Bhils, *from the language spoken by them*, have been classified as belonging to the Kolarian tribes. We do not know from what material this result has been arrived at. So far as we are aware the conclusion cannot have been based on linguistic affinities, for the Bhili language does not seem ever to have been carefully studied. This much, however, is clear: The Bhils have from remote times

occupied the country in which the rude implements already referred to were found. The strong presumption is that they came in contact with the aborigines, and that the two races, living in proximity, intermixed. We have, therefore, very probably, in the Bhils of to-day some of the blood of the earliest inhabitants of India. For this, if for no other, reason they are a most interesting people. They have, moreover, as will be noticed farther on, some Rájput blood in their veins. They form, therefore, as it were, a completed arch, resting upon two distinct pillars—one representing the aborigines of India and the other the Aryans. There can be hardly any doubt that the Bhils unite in themselves a strain of both these stocks.

In now glancing over the History of the country we purpose to cull from it only such portions as relate to the Bhils.

In old Sanskrit works they are called "Children of the Forest" and "Lords of the Pass". The Mahábhárát contains a long fabulous account of their origin, which we quote later on, and a further legend of the son of a Bhil king. We cannot, however, trust very much to these accounts, seeing they are so interwoven with absurd traditions. In the same poem the aborigines are called "enemies" "servants" "noseless" and "flat-nosed". On the other hand, the Aryans describe some of them as wealthy, possessing castles and forts, and ruling over powerful kingdoms. This statement is confirmed by the fact that in some parts now inhabited by the Bhils traces are still found of ruined towns, indicative of prosperity and power in the past.

At the time of the Aryan invasion of Rájputáná the Bhils were in possession of Márwár, but they soon migrated to the South under pressure from the invaders.

About B.C. 1400 Krishna is supposed to have established a kingdom in Gujarát after a severe struggle with the inhabitants,

many of whom were probably Bhils, inasmuch as Vairátnagar, a town in Gujarát, was at this time governed by Shridoshra, a Bhil Queen.

In B. C. 850 Dhanji was king of Málwá. He is generally considered to have been a Bhil, which view receives support from the fact that the name Dhanji is very common among the hill-men even at the present day. Evidently at that early period the Bhil race was very powerful in Málwá. The descendants of Dhanji reigned 387 years, and his successor is said to have shaken off, in B. C. 730, the yoke of the sovereign of Delhi.

After a long interval of more than 1300 years the scene shifts from Málwá back again to Gujarát, and one of the three Bhil women mentioned in history is brought to notice, in 696 A.D., in the following connexion. Ráni Rupsundri, the wife of Jayashekhar, king of Punchásar, fled into the forest when the capital was besieged. A kind-hearted Bhil woman gave her shelter and food. In this woman's hut Rupsundri gave birth to a son who became the famous Vanráj. The Queen and her child remained with their humble benefactress six years.

In the eleventh century the country called Mewás was held by the hillmen. The chief's name was Ashá whom Karan, the Gujarati king, defeated and slew at Asháwal, the site of the present city of Ahmadábád.

From the history of Udaipur we find that in this same century a great part of Mewár and the North-west parts of Central India belonged to the Bhils.

In 1134 A. D. the king of Udaipur invaded their country, and took a portion of it from them. Some of the predatory Rájput chiefs too, bent on plunder, and desirous of gaining possession of the land, entered the hills with the purpose of

subduing the inhabitants. To effect their object they are said to have broken their caste rules by taking in marriage Bhil women. They gradually blended with that race and gained authority over it. To this cause, doubtless, is due the transmission to the present day of those Rájput features which are so marked in many of the Bhils. The intermixture of the Rájputs and Bhils has produced various castes, such as the Garásiás, Bhilálás &c., who claim to be socially superior to the hillmen.

*Rájput*  
About 1190 A. D. the king of Ábu, Jethsi Parmár, had a daughter, Ichani Kumári. The Gujarát king, Bhimdev II., wished to marry this princess, and sent an ambassador to the Ábu king with a request for his daughter's hand. Jethsi Parmár could not, however, entertain the proposal, as his daughter had been already betrothed to the son of the Ájmír king. Bhimdev, greatly annoyed, declared war against Ábu, and took the fort on the summit of the hill. It may be mentioned that Parmár is the name of a <sup>half-clan</sup> Bhil clan in Mewár at the present time.

The next event in history brings Suká Náik, the Bhil ruler of Jábúá, on to the stage in 1300 A. D. He and the Rájput chief of Dholítá had slain the family and a number of the retainers of a Governor of Gujarát. Kishandás, a favourite of the Emperor Alá-ud-din, received orders from Delhi to avenge the murder. Suká Náik and his principal followers were put to death, and their strongholds taken.

In 1677 an entirely new phase appears in this history, in the attempt made by the Emperor Aurangzeb to pervert the whole of his Hindu subjects to the Muhammadan faith. With this object in view, colonies of the followers of the prophet were placed among the hillmen some of whom eventually embraced Islám.

About 1767 Aliá Bai, the widow of the king of Málwā, was Queen over the kingdom that formerly belonged to Dhanjí. In ruling the Bhils, she first tried gentle measures, but, these failing, she had recourse to a rigorous policy. She, however, continued to allow them their claim to levy a small duty on goods passing through the hills.

Under the Mughals the Bhils were probably never sorely oppressed, except during the reign of the mad Emperor Taghluk. Under the Maráthás, however, they suffered terribly. "During the eighteenth century", writes Sir William Hunter, "the Maráthás, failing to bring the Bhils to order, treated them as outlaws, and permitted their lowest officers to take their lives without trial. A Bhil caught in a disturbed part of the country was flogged and hanged without an enquiry. Torture was freely used. Exposed to the sun with his nose slit and his ears shaved from his head, the Bhil was burned to death, chained to a red-hot iron slab. Hundreds were thrown over a cliff near Antur, and large bodies of them, assembled under a promise of pardon, were beheaded and blown from guns. Their women were mutilated, or smothered by smoke, and their children dashed to pieces against the stones".

From 1804 to 1817 the Pindáris, following the example of the lawlessness of the Maráthás, plundered the hillmen, and laid waste their villages. Parties of two thousand or more horsemen rode rapidly from place to place, and carried off all the cattle and property they could find. Their excursions were characterised by horrible atrocities. Terror and anarchy filled the land, and the inhabitants were driven to choose between throwing in their lot with the Pindári free-booters or of going into exile. Many chose the former, and became robbers and plunderers.

It was in the midst of such troublous times as these that all the Bhils in 1818 came under the protection of the British.

Although possessing only bows and arrows as their national weapons of warfare, they have never been entirely conquered. Their numbers have again and again been decimated by sword and famine and disease, yet there are still two millions of them left as a witness to their vitality. Could they now but have the simpler helps that civilization offers, and were the products of their labours secured to them from the extortions of the tax-collectors, they would undoubtedly develop in time into a great race, and take their place among the classes that are the main-stay of India. They have, as a people, no national aspirations, and, so long as they are left alone, are indifferent as to who their rulers may be. Some of them, however, have been heard to say that the English Government is to retain its power only for a time, and that the good old days are coming back again when one of their own people shall be their king. Be this as it may, it is gratifying to note that during the Mutiny of 1857 the Bhils stood true and loyal to the English, and protected British officers when menaced by sepoys.

\* \* \* \* \*

As indicating some of the various conjectures that have been made with regard to the origin and history of the Bhils, the following quotations from well-known works are appended :—

"The Bhils are quite a distinct race from any other Indian tribe, yet few among the latter have higher pre-tensions to antiquity".

*Malcolm's Central India. p. 517.*

1823.

"The Bhils were regarded both by him (Capt. McDonald) "and the other officers as unquestionably the original inhabitants of the country. This the Rājputs themselves in this "part of India virtually allow, it being admitted in the traditional history of most of their principal cities and fortresses "that they were founded by such and such Bhil chiefs".

*Heber's India.* p. 495. 1829.

"They are assuredly an aboriginal race whether we regard their superstitions, their habits or their language, for although the latter contains much of Sanskrit derivation, their vocables are distinct. I advance this, however, more from the report of their neighbours than from personal investigation".

*Tod's Travels in Western India,* p. 34. 1839.

"There is every reason to believe that the original race of Bhils may claim a high antiquity, and that they were once masters of the fertile plains of India, instead of being confined, as they now are, to the rugged mountains and almost impenetrable jungles".

*Dr. Wilson's Evangelization of India,* p. 308. 1849.

"In the Mahābhārat they appear to the South of the Jamna, and in the immediate neighbourhood of the Rāj of Bhārat, whilst in the Rāmāyan they make their appearance farther to the East, near to the junction of the Jamna and Ganges.

*Talbot Wheeler's History of India,* p. 82. 1867.

"The original settlers are identified with the various tribes

of Bhils, Cols, Gonds, Meenas and Chooars still living in a state almost of nature, in the forests of the Soane, the Nerbudda, and the Muhanudde, and in the hills of Surgooja and Chota Nagpur. Their languages have no affinity with the Sanskrit, and their religion differs from Hindooism. In those fastnesses, amidst all the revolutions which have convulsed India, they have continued to maintain, unchanged, their original simplicity of habits, creed and speech. They were apparently driven from the plains by fresh colonies of emigrants; and these were in their turn conquered by the Hindoos, who brought their religion and language with them from regions beyond the Indus, and, having reduced the inhabitants to a servile condition, branded them with the name of Sudras".

*Marshman's History of India, vol. I, p.p. 2 & 3.*      1871.

"Those pre-Aryans Scythians, by whom I have been supposing the Dravidians to have been expelled from the Northern Provinces, are not to be confounded with the Kóls, Santáls, Bhils, Dóms, and other aboriginal tribes of the North. Possibly these tribes had fled into the forests from the Dravidians, prior to the pre-Aryan invasion, just as the British had taken refuge in Wales before the Norman Conquest. It is also possible that the tribes referred to had never crossed the Indus at all, or occupied Northern India, but had entered it, like the Bhútán tribes, by the North-East, and had passed from the jungles and swamps of Lower Bengal to their present abodes—taking care always to keep on the outside of the boundary line of civilization. At all events, we cannot suppose that it was through an irruption of those forest tribes that the Dravidians were driven Southwards; nor does the non-Sanskritic element supposed to be contained in the Northern vernaculars appear to accord distinctively with the peculiar structure of the Kolarian languages.

The tribes of Northern India whom the Aryans gradually incorporated in their community, as Súdrás, whoever they were, must have been an organized and formidable race. They may have been identical with the 'Ethiopians from the East', who, according to Herodotus, were brigaded with other Indians in the Army of Xerxes, and who differed from other Ethiopians by being 'straight-haired'".

*Caldwell's Grammar of the Dravidian Languages,*

p. p. 108, 109. 1875.

"The Bhils are now a mixed people, but the true original race is easily distinguished by the dark colour, diminutive size, prominent cheek-bones, large nostrils, activity, powers of enduring fatigue and rare qualifications for the chase".

*Captain Rose's Report on the Bhils,*

*Bombay Government Selections Vol. X. p. 226.*

"Whether the Bhils be numbered among the aboriginal tribes of India or not, it is indisputable that they have existed in the country from a remote period. Certainly their habits and characteristics and the barbarism and lawlessness they maintained for many ages lead to the supposition that they belong to the original races of the Indian peninsula, which have never amalgamated with the Hindoos, but have always striven to retain their independent and separate national existence. The Bhils are often alluded to by Muhammadan historians of Gujárat and Málwá as a powerful tribe occupying the hills and forests of Mewár and Udaipur under their own chiefs; from which position they were eventually driven out and gradually

found their way into Khandesh and its vicinity where they are now settled in considerable numbers".

*Sherring's Hindu Tribes and Castes. Vol. II. p. 291. 1879.*

"They represent the lowest and oldest stratum of the population and may be taken to represent generally the barbarian type before the earliest civilizations had brought in ideas and prejudices about food, worship and connubium".

*Sir A. Lyall's Asiatic Studies. p. 160. 1822.*

"Popular tradition ascribes to them a fabulous origin from Mahadev, who is said to have fallen in love with a forest girl by whom he had a numerous progeny, one of the children being particularly ugly and vicious, who distinguished himself finally by slaying his father's favourite "Brisa," or bull, for which he was expelled from the habitations of men. The Bhils pretend to be descended from this outcast, and to have inherited crime and outlawry as "Mahadev's thieves"—that is, with their descent. They are divided into so many tribes that the opinion has been hazarded that the name "Bhil", when it was originally assumed, perhaps only denoted a confederacy of various robber races thrown together and associated by local circumstances and events; but the inference is farfetched and scarcely tenable, for the Bhils are mentioned as an aboriginal people in the Māhabhārat, and the history of India shews that, like the Gonds, they were at one time a ruling race, though not exactly in the places they now occupy. Their original residence, it is supposed, was Mārwār or Jodhpur, whence they were driven South by other races; and the local history of the Rājput princes confirms the belief by stating that the Bhils were expelled from the plain country by the Rājputs".

*Rowney's "Wild Tribes of India," p. 24. 1882.*

" I may mention too that no one in India could give me any  
clue to the ethnical classification of the Bhils ".

*Prof. M. Monier-Williams' Hinduism. p. 2.*      1882.





## CONTENTS.

### PART I :—GRAMMAR.

*Page.*

#### CHAPTER I.

§ 1. The Alphabet ...	...	...	...	1-2
-----------------------	-----	-----	-----	-----

#### CHAPTER II. Nouns.

§ 2. Gender.	...	...	...	3
§ 3. Number.	...	...	...	4
§ 4. Case.	...	...	...	5
§ 5. Declension of Nouns.	...	...	...	8
(a) Nouns not ending in अ, आ, ई or ए.	...	...	...	8
(b) Nouns ending in अ....	...	...	...	9
(c) Nouns ending in आ or ए.	...	...	...	9
(d) Nouns ending in ई.	...	...	...	10

#### CHAPTER III. Adjectives.

§ 6. Adjectives declinable and indeclinable.	...	...	...	12
§ 7. Declension of the adjective with a noun.	...	...	...	13
§ 8. Degrees of comparison.	...	...	...	14

#### CHAPTER IV. Numerals.

§ 9. Cardinals.	...	...	...	...	16
§ 11. Ordinals.	...	...	...	...	16
§ 12. Fractional Numbers.	...	...	...	...	17
§ 13. Multiplicatives...	...	...	...	...	17

#### CHAPTER V. Pronouns.

§ 14. Personal Pronouns.	...	...	...	...	18
§ 15. Possessive and Reflexive Pronouns.	...	...	...	...	20

§ 16.	Relative and Correlative Pronouns.	...	20
§ 17.	Demonstrative Pronouns...	...	21
§ 18.	Interrogative Pronouns....	...	21
§ 19.	Indefinite Pronouns. ...	...	22
§ 20.	Distributive Pronouns. ...	...	22
§ 21.	Compound Pronouns. ...	...	22
§ 22.	Table of Allied Pronominal Forms.	...	23
§ 23.	Pronominal Adjectives. ...	...	23

## CHAPTER VI. Verbs.

§ 24.	The Infinitives...	...	...	...	24
§ 25.	The Participles...	...	...	...	24
§ 26.	The Moods. ...	...	...	...	25
§ 27.	Conjugation of the Verb કોણ, to be.	...	...	...	26
§ 28.	Conjugation of the Verb પડ્યા, to fall.	...	...	...	28
§ 29.	Verbs ending in એ.	...	...	...	31
§ 30.	Verbs ending in એ.	...	...	...	31
§ 31.	Monosyllabic roots ending in એ.	...	...	...	31
§ 32.	The Infinitive in એ.	...	...	...	32
§ 33.	The Infinitive form in એ.	...	...	...	32
§ 34.	Irregular Verbs.	...	...	...	32
§ 35.	The Agential Construction.	...	...	...	33
§ 36.	The Passive Voice.	...	...	...	33
§ 37.	The Passive Voice used in a Potential sense...	...	...	...	35
§ 38.	Causative Verbs.	...	...	...	35
§ 39.	Double Causatives.	...	...	...	36

## CHAPTER VII. Compound Verbs.

§ 40.	Intensives.	...	...	...	37
§ 41.	Completives.	...	...	...	38
§ 42.	Potentials.	...	...	...	38
§ 43.	Frequentatives...	...	...	...	38

**C**

§ 44.	Continuatives.	...	...	...	39
§ 45.	Obligatives.	...	...	...	39
§ 46.	Desideratives.	...	...	...	40
§ 47.	Permissives.	...	...	...	40
§ 48.	Inceptives.	...	...	...	41
§ 49.	Nominal Verbs...	...	...	...	41

**CHAPTER VIII. Adverbs.**

§ 50.	Adverbs of Manner.	...	...	...	42
§ 51.	Adverbs of Time.	...	...	...	43
§ 52.	Adverbs of Place.	...	...	...	44
§ 53.	Adverbs of Affirmation, Negation, Doubt, Degree.	44			
§ 54.	Adjectival Adverbs.	...	...	...	45
§ 55.	Pronominal Adverbs.	...	...	...	46
§ 56.	Adverbial Expressions.	...	...	...	47
§ 57.	Participial Adverbs.	...	...	...	48

**CHAPTER IX. Prepositions.**

§ 58.	List of Prepositions	...	...	...	49
-------	----------------------	-----	-----	-----	----

**CHAPTER X. Conjunctions.**

§ 59.	List of Conjunctions.	...	...	...	50
-------	-----------------------	-----	-----	-----	----

**CHAPTER XI. Interjections.**

§ 60.	List of Interjections.	...	...	...	51
-------	------------------------	-----	-----	-----	----

**Miscellanea.**

§ 61.	The Famine Years.	...	...	...	52
§ 62.	Months of the Year.	...	...	...	52
§ 63.	Days of the Week.	...	...	...	52
§ 64.	Divisions of the Day and Night.	...	...	...	53
§ 65.	Names of Relatives.	...	...	...	55

**D**

**PART II:—VOCABULARY**

<i>(A).</i> Bhili-English Vocabulary....	...	57—198
<i>(B).</i> English-Bhili Vocabulary....	...	199—316

**Miscellanea.**

<b>Short Specimen Sentences.</b>	...	...	317-319
<b>Bhil Proverbs....</b>	...	...	320-322
<b>A Bhil's Prayer when presenting his offerings.</b>			323
<b>A Specimen Bhil Ballad.</b>	...	...	324





## PART I.

---

### GRAMMAR.



## BHILI GRAMMAR.

## CHAPTER I.

## The Alphabet.

The Alphabet may be said to consist of 34 letters—6 vowels and 28 consonants—most of which are pronounced as in Gujarati.

Vowels :— એ, એં, ઉ<sup>1</sup>, ઉં<sup>1</sup>, ઓ, ઓં.

Consonants:— ( ፳, ፻, ፻, ፻,

Mutes :— { ८, ९, ५<sup>२</sup>.  
८, ६, ५<sup>३</sup>, ८, ७.  
८, ४, ८, ५, ८, १,  
५, ६, ५, ८<sup>२</sup>, ८.

Semi-vowels:— $\text{අ}^5$ ,  $\text{ඒ}$ ,  $\text{ඔ}$ ,  $\text{ඖ}^6$ .

### Sibilant:— स.

## Aspirate:—

### **Added Semi-vowel:—**

*Notes*—1. As the ſ sound seems generally long and the ſ sound generally short, each sound is represented by one single vowel.

2. The Gujarati palatals ઔ and એ are not found in Bhili, the letter ા being used instead of them. The letters એ, ઈ represent the sounds z, zh, not j or jh. The letter એ is sometimes pronounced a little like ઔ.

3. The letter શ has often more of an *r* sound than is heard in Gujarati.

4. The letter એ is in many words pronounced so like ક્ષ that it might be optional which letter to use when writing the word.

For example, in the word એટિય �the sound is something between એટિય and ક્ષટિય.

5. There is no initial વ, as the Bhils cannot pronounce it without the help of a preceding શ, e. g. શવાં this.

6. The letter એ has two distinct pronunciations :—*w* when it precedes long *a*, and *v* in all other cases.

7. The aspirate શ is sometimes pronounced so slightly that it is scarcely perceptible, and it becomes optional to spell the word with or without it.

In the formation of compound letters the same rules are followed as in Gujarati.



## CHAPTER II.

---

### Nouns.

Nouns admit of Gender, Number and Case.

#### 2. Gender.

The Gender of many Nouns can be learned only by practice, but as a general rule words ending in એ are Masculine, in ઈ are Feminine and in એ are Neuter.

Exceptions : ગણું m. ધ્રી f. એં ફ.

Several nouns ending in ઈ denoting male members of castes, trades or professions are masculine, e. g. જોગી a *Jogi*; ભોઈ a *palanquin-bearer*.

With regard to nouns not ending in એ, ઈ or એ we may say briefly :—

Nouns ending in આ are usually abstract and feminine, as આયસા *hope*. There are a few, however, which denote males and are consequently masculine, as રાજ �a *king*, આતા �a *father*.

In the few nouns ending in ઉ, all the three genders are found. e. g. દાપુ m. આખરુ f. ગીરુ n.

The only nouns in એ seem to be દે m. વને m. કે m. વેહળોએ f.

For the nouns ending in a consonant no definite rule can be laid down as to gender.

Some few words take their gender from their meaning, as, for instance, the names of the months, the days of the week, and the famine years are masculine, because the words મહિના *month*, વાર *a day of the week*, and કાળ *famine* are masculine.

Names of human beings and animals ending in એ frequently have a feminine in ણ, as સોરો *a boy*, સોરી *a girl*, ખાકરો *a he-goat*, ખાકરી *a she-goat*.

There is sometimes a neuter form in અ, when the word is used without any special reference to sex, સોડું *a child*, ખાકડું *a goat*.

There are also a few feminines having terminations other than ણ.

e.g. જોગી <i>m. a Jogi.</i>	જેગેણું <i>a Jogi's wife.</i>
વાધ <i>m. a tiger.</i>	વાધેણું <i>a tigress.</i>
ભીલ <i>m. a Bhil.</i>	ભીલડી <i>a Bhil woman.</i>

Some few are quite different in the feminine from the masculine.

આતા father,	આઈ mother.	વેઠ a husband,	વડ a wife.
ખાય „	ના „	પાડો a he-buffalo,	લેંસ a she-buffalo.
ભાઈ brother,	ખેન sister.	buffalo.	
			મોર a peacock,
			ટેલ a peahen.

### 3. Number.

The Bhil Noun has two numbers—the Singular and the Plural.

The Nominative Plural is the same as the Singular in all nouns except those ending in એં and ઊ.

Nouns ending in એં substitute આ for એં, as સોરો a boy, સોરાં boys.

Nouns ending in ઊ substitute અં for ઊ, as સોરિં a child, સોરાં children.

[ For Plurals of nouns in the oblique case see § 4. ]

---

#### 4. Case.

There are eight cases, and the meanings attached to, and the purposes served by, them are the same as in Gujarati, with the exception that in Bhili the ablative is used to denote the *place whence*, and not the *person from whom*, an action proceeds. This latter idea is always expressed by the Agential Case wherever the Nominative is not used.

<i>Cases.</i>	<i>Case endings.</i>
<b>Nominative.</b>	
Objective.	Same as Nom. or else એ.
Agential.	એ.
Dative.	એ.
Ablative.	ણો, ણી, ણું, ણા, ણાં.
Genitive.	નો, ની, નું, ના, નાં.
Locative.	અં or માંય and એ.
Vocative.	Same as Nom. or else આ.

In the declension of Nouns in the Singular ending in એં or એ, the terminations એં or એ are changed to અા before affixing the other case-endings.

In the declension of all other Nouns the case-endings are affixed to the form the word bears in the Nominative, except that in nouns ending in ઈ, ઈ is changed to ન્યા before affixing the Objective, Agential and Dative case-endings.

For the declension of Nouns in the Plural:—

(a). Nouns not ending in અા, એં, ઈ, or એ insert the letter એં between the base and the oblique case-endings.

*Exception:* The word બેર, a house, has અં inserted instead of એં.

(b). Nouns in અા have no distinctive plural termination.

(c). Nouns ending in એં and એ change એં and એ to અા and અિ respectively throughout the plural before affixing the case-endings.

(d). Nouns ending in ઈ change ઈ to ન્યા before affixing the case-endings.

In the Agential Case આએ is usually contracted to એ, thus forming a distinction between the Agential and the Dative. The Agential case is used not only with a past tense to indicate the doer of an action,

but is also used with the Infinitive to indicate the person by whom an action must be done.

e. g. सोरे काभ कीदु, the boy did the work.

सोरे काभ कर्वु, the boy must do the work.

The Ablative, properly speaking, should agree with the nominative of the sentence, but it is more frequently used in the form §. It is sometimes combined with the Locative, forming thus अिदु.

The Locative in ए at, on or to, is not used very frequently. The termination is often omitted with nouns denoting a place, but if an adjective precede, then that adjective will take the Locative in ए, as अीजे गाम, at another village.

The Vocative is the same as the Nominative, unless the Nominative ends in ओ or ओ, in which case ओ or ओ changes to आ.

—oOo—

## 5. Declension of Nouns.

(a). Nouns not ending in આ, એા, ઈ, or ઉ.

**ઉકુ** *m.* a camel.

Singular.	Plural.
-----------	---------

Nom.	ઉકુ.	ઉકુ.
Obj.	„ or ઉકુએ.	ઉકુઓ or ઉકુઓએ ( or same as Singular ).
Ag.	ઉકુએ.	ઉકુએએ.
Dat.	ઉકુએ.	ઉકુએએ.
Abl.	ઉકુહું.	ઉકુએહું.
Gen.	ઉકુનો, ની, તું, ના, નાં.	ઉકુએનો &c.
Loc.	ઉકુમાં or ભાંય or એ.	ઉકુએમાં or ભાંય or એ.
Voc.	ઉકુ.	ઉકુ.

**ગેર** a house.

Singular.	Plural.
-----------	---------

Nom.	ગેર.	ગેર.
Obj.	ગેર.	ગેર.
Ag.	ગેરે.	ગેરાંએ.
Dat.	ગેરે.	ગેરાંએ.
Abl.	ગેરહું.	ગેરાંહું.
Gen.	ગેરનો &c.	ગેરાનો &c.
Loc.	ગેરમાં or ભાંય or ગેરે.	ગેરાંમાં or ભાંય or એ.
Voc.	ગેર.	ગેર.

## (b). Nouns ending in आ.

Nouns ending in आ are the same in the Singular as in the Plural, with this exception that the Agential Case Singular ends in ए, and the Agential Case Plural in आए.

राज् m., a king.

	Singular.	Plural.
Nom.	राज्.	राज्.
Obj.	राज्.	राज्.
Ag.	राजे.	राजए.
Dat.	राजमे.	राजमे.
Abl.	राजहुं.	राजहुं.
Gen.	राजनो &c.	राजनो &c.
Loc.	राजमां or भाँय.	राजमां or भाँय.
Voc.	राज.	राज.

## (c). Nouns ending in ए or ओ.

सोरा m., a boy.

	Singular.	Plural.
Nom.	सोरा.	सोरा.
Obj.	सोरा or सोराए.	सोराए.
Ag.	सोरे.	सोराए.
Dat.	सोराए.	सोराए.
Abl.	सोराहुं.	सोराहुं.
Gen.	सोरानो &c.	सोरानो &c.
Loc.	सोरामां or भाँय.	सोरामां or भाँय.
Voc.	सोरा.	सोरा.

સોંડ n., a child.

Singular.

Nom.	સોંડ.
Obj.	સોંડ or સોરાએ.
Ag.	સોરાએ.
Dat.	સોરાએ.
Abl.	સોરાણુ.
Gen.	સોરાને &c.
Loc.	સોરામાં or માંય.
Voc.	સોરા.

Plural.

સોરાં.
સોરાં or સોરાંએ.
સોરાંએ.
સોરાંએ.
સોરાંએ.
સોરાંનો &c.
સોરાંના or આંય.
સોરાં.

(d). Nouns ending in ઈ.

સોરી f., a girl.

Singular.

Nom.	સોરી.
Obj.	સોરી or સોજ્યે.
Ag.	સોજ્યે.
Dat.	સોજ્યે.
Abl.	સોરીણુ.
Gen.	સોરીનો &c.
Loc.	સોરીમાં or માંય.
Voc.	સોરી.

Plural.

સોરી.
સોરી or સોજ્યાએ.
સોજ્યાએ.
સોજ્યાએ.
સોજ્યાણુ.
સોજ્યાનો &c.
સોજ્યામાં or માંય.
સોરી.

The declension of the word આદમી, a man, is peculiar.

આદમી m., a man.

	Singular.	Plural.
Nom.	આદમી.	આદમી.
Obj.	, or આદમન્યે.	, or આદમન્યાએ.
Ag.	આદમન્યે.	આદમન્યા.
Dat.	આદમન્યે.	આદમન્યાએ.
Abl.	આદમીંથું.	આદમન્યાંથું.
Gen.	આદમીનો &c.	આદમન્યાનો &c.
Loc.	આદમીમાં or માંય.	આદમન્યામાં or માંય.
Voc.	આદમી.	આદમી.

The Plural of the word કીરણ, a ray, is declined like the plural of સોરી.

e. g. કીરણ, કીરણન્યાએ, &c.

## CHAPTER III.

## Adjectives.

§ 6. Adjectives declinable and indeclinable.

All adjectives except those ending in એ or ઈ are uninflected.

Adjectives ending in એ for the masculine and ઈ for the neuter change these terminations to આ throughout all the oblique cases singular.

If an adjective qualify a Locative in એ, the termination આ changes to એ.

The plural termination for all the cases is આં in the masculine and આં in the neuter.

Examples.	હાઉ સોરો,	a good boy.
	હાઉ સોરી,	a good girl.
	હાઉ સોરાંએ,	for the good children.
	આકરો આદમી,	a stern man.
	આકરા આદમી,	stern men,
	આગણું ગેર,	the house in front.
	આગલાં ગેર,	the houses in front.
	ઉસા ગેરભાં,	in the high house.
	ઉસાં ગેરાંતું,	of the high houses.

§ 7. Declension of the adjective with a noun.

**Masculine :** થાકો પાંખણો, a tired guest.

	Singular.	Plural.
Nom.	થાકો પાંખણો.	થાકા પાંખણા.
Obj.	થાકો પાંખણો or થાકા પાંખણાએ.	થાકા પાંખણા or થાકા પાંખણાએ.
Ag.	થાકા પાંખણાએ.	થાકા પાંખણાએ.
Dat.	થાકા પાંખણાએ.	થાકા પાંખણાએ.
Abl.	થાકા પાંખણાહું.	થાકા પાંખણાહું.
Gen.	થાકા પાંખણાનો &c.	થાકા પાંખણાનો &c.
Loc.	થાકા પાંખણામાં or માંય.	થાકા પાંખણામાં or માંય.
Voc.	થાકા પાંખણા.	થાકા પાંખણા.

**Feminine:** કડવી આમલી, a bitter tamarind.

	Singular.	Plural.
Nom.	કડવી આમલી.	કડવી આમલી.
Obj.	કડવી આમલી or કડવી આમલીને.	,, or કડવી આમલીન્યાએ.
Ag.	કડવી આમલીને.	કડવી આમલીન્યાએ.
Dat.	કડવી આમલીને.	કડવી આમલીન્યાએ.
Abl.	કડવી આમલીનું.	કડવી આમલીન્યાનું.
Gen.	કડવી આમલીનો &c.	કડવી આમલીન્યાનો &c.
Loc.	કડવી આમલીમાં, માંય or એ.	કડવી આમલીન્યામાં, માંય or એ.
Voc.	કડવી આમલી.	કડવી આમલી.

**Neuter:** હાંકડું બારણું, a narrow door.

Singular.	Plural.
Nom. હાંકડું બારણું.	હાંકડાં બારણું.
Obj. હાંકડું બારણું or હાંકડા બારણુાએ.	હાંકડાં બારણું or હાંકડાં બારણુાએ.
Ag. હાંકડા બારણુાએ.	હાંકડાં બારણુંએ.
Dat. હાંકડા બારણુાએ.	હાંકડાં બારણુંએ.
Abl. હાંકડા બારણુંફું.	હાંકડાં બારણુંફું.
Gen. હાંકડા બારણુાનો &c.	હાંકડાં બારણુંનો &c.
Loc. હાંકડા બારણુામાં or માંય or હાંકડાં બારણુંમાં, માંય or એ.	હાંકડે બારણે.
Voc. હાંકડા બારણુા.	હાંકડાં બારણું.

### § 8. Degrees of comparison.

The Comparative Degree is expressed by the simple adjective preceded by the ablative of the noun with which the comparison is made : e. g.

વણુા જેરહું છધું જેર મોહું હે, this house is larger than that.  
વણુા આદમીહો છચો આદમી ભલો હે, this man is better than  
that one.

The words મુખ, *much*, and ધણું, *much* (plural, *many*), are prefixed to adjectives to express a high degree of comparison : e. g.

વણુા જેરહું છધું જેર ધણું ઉચ્ચું હે, this house is much higher  
than that.

The Superlative Degree is expressed by the simple adjective preceded by હગળાંક or હગળા કરતાં, *than all.*

ઇયો સોરો હગળાંક મોટો હે, this boy is the biggest of all.

The Superlative Degree may also be expressed by placing the noun or pronoun with which comparison is made in the Locative Case in અં with or without હગળું : e. g.

ઇયો સોરો હગળા સોરામાં વાકમ હે. } This boy is the cleverest  
ઇયો સોરો સોરામાં વાકમ હે. } of all.

The words ખુખું and ધાર્થું are used to express a superlative degree, when no idea of comparison is intended : e. g.

ખુખું મોટો ભલક, a very large country.

## CHAPTER IV.

## Numerals.

## § 9. Cardinals.

Bhili has numbers up to 20 only.

1	એક	6	સો	11	અગ્યાર	16	હેળ
2	બે	7	હાત	12	બાર	17	હતર
3	તણુ	8	આદ	13	તેર	18	અડાર
4	સ્યાર	9	નોંધ	14	સૌદ	19	ઓગણી
5	પાંસ	10	દોંડ	15	પનર	20	વીંદ.

The numbers after 20 are reckoned by twenties: e.g.

21	વીંદ ને એક	40	બે વીંદ
22	વીંદ ને બે	60	તણુ વીંદ
30	વીંદ ને દોંડ	80	સ્યાર વીંદ
31	વીંદ ને અગ્યાર	100	પાંસ વીંદ or હો.

The word એક added to a numeral conveys the idea of "about", as વીંદેક, about 20.

The Bhili idiom in indefinite expression is ઐસ્યાર, "two four", a few.

## § 11. Ordinals.

1st.	પેલો	3rd.	તીનો	5th.	પાંસમો
2nd.	બીજો	4th.	સોચો	6th.	સોતમો.

Higher numbers are not much used, but may be formed by adding મો to the cardinal numbers.

The ordinals for the Lunar days are not generally known, but a few are used, such as બીજ, તીજ.

§ 12. Fractional numbers.

$\frac{1}{4}$	પાહેરો.	$\frac{3}{4}$	પોણું.	$1\frac{1}{2}$	દોઢ.
---------------	---------	---------------	--------	----------------	------

$\frac{1}{2}$	અદ્દ.	$1\frac{1}{4}$	હવા.	$2\frac{1}{2}$	અઢી.
---------------	-------	----------------	------	----------------	------

§ 13. Multiplicatives.

2-fold,	ખાહેરો.	Twice as many,	અમણું.
---------	---------	----------------	--------

3-fold,	તથુહરો.	Thrice as many,	તમણું.
---------	---------	-----------------	--------

4-fold,	સ્યારહરો.	Four times as many,	સ્યારગણું.
---------	-----------	---------------------	------------



## CHAPTER V.

## Pronouns.

The declension of many of the pronouns is irregular.

## § 14. Personal Pronouns.

## First Person.

	Singular.	Plural.
Nom.	ખુલ્લો or મૈં, I.	અમાં, We.
Obj.	મય.	અમે.
Ag.	મય.	અમાં or અમાંએ.
Dat.	મય.	અમે.
Abl.	મારાણું &c.	અમારાણું &c.
Gen.	મારો, રી, ઇં, &c.	અમારો, રી, ઇં, &c.
Loc.	મારામાં or માંય.	અમારામાં or માંય.

## Second Person.

Nom.	તુલ્લુ, Thou.	તમાં, You.
Obj.	તથ.	તમે.
Ag.	તથ.	તમાં or તમાંએ.
Dat.	તથ.	તમે.
Abl.	તારાણું &c.	તમારાણું &c.
Gen.	તારો, રી, ઇં, &c.	તમારો, રી, ઇં, &c.
Loc.	તારામાં or માંય.	તમારામાં or માંય.

## Third Person.

He, It.	She.	They.	
Nom. વી or વો.	વે.	વા, મ., ન.	વી, ફ.*
Obj. વણુાય.	વણુાએ.	વણુાએ.	વણુાંએ.
Ag. વણે.	વણીએ.	વણુા or વણુંએ.	વણુાંએ.
Dat. વણુાય.	વણુાએ.	વણુાએ.	વણુાંએ.
Abl. વણુાંહ &c.	વણુાંહ &c.	વણુાંહ &c.	વણુાંહ &c.
Gen. વણુાનો or વનો.	વણીનો or વનો &c.	વણુનો &c.	વણુાંનો &c.
Loc. વણુામાં or માય.	વણીમાં or માય.	વણુામાં or માય.	વણુાંમાં or માંય.

કુ is derived from the Gujarati, and મો from the Hindi.

The 3rd Personal Pronoun is also used for the Demonstrative Pronoun, *that one*. When it is accompanied by a noun, it becomes વણુા throughout all the oblique cases, and the noun alone takes the case-endings.

The pronoun આપડા, *we*, includes the 1st and 2nd person.

Nom.	આપડા, We.
Obj.	આપડા or આપડાએ.
Ag.	આપડે.
Dat.	આપડાંએ.
Abl.	આપડાંહ &c.
Gen.	આપડાંનો &c.
Loc.	આપડાંમાં or માંય.

---

\* વા is used as a respectful feminine plural.

### § 15. Possessives and Reflexives.

The Possessive Pronoun is simply the Genitive of the Personal Pronoun, and is treated as an adjective agreeing with the noun it qualifies.

The Reflexive idea is conveyed by એકલો, *alone*, or by પુરુષ, પુરુષા, or આપાપતો, *self*.

### § 16. Relative and Correlative Pronouns.

	Relative.	Correlative.
Nom.	જી, Who.	તી, That one, Those.
Obj.	જણ્ણાય.	તણ્ણાય.
Ag.	જણે.	તણે.
Dat.	જણ્ણાનો.	તણ્ણાનો.
Abl.	જણ્ણાંડ &c.	તણ્ણાંડ.
Gen.	જણ્ણાનો or જેનો &c.	તણ્ણાનો or તેનો &c.
Loc.	જણ્ણામાં or માંય.	તણ્ણામાં or માંય.

The forms જે and તે are sometimes used instead of જી and તી respectively.

When જી and તી are accompanied by a noun, the forms જણ્ણા, and તણ્ણા are used throughout the oblique cases, and the noun alone takes the case-endings.

## § 17. The Demonstrative Pronoun.

Singular.	Plural.
Masc. & Neut. Fem.	Masc. & Neut. Fem.
Nom. છેયા, છું. છેયે, this.	છ્યા. છ્યી these.
Obj. અણ્યાય. અણીએ.	અણ્યાય. અણીએંએ.
Ag. અણુ. અણ્યોએ.	અણું or અણુંય. અણીએંએ.
Dat. અણ્યાય. અણીએ.	અણુંય. અણીએંએ.
Abl. અણ્યાહું&c. અણીહું.	અણુંહું &c. અણીએંહું.
Gen. અણ્યાનો&c. અણીનો &c.	અણુંનો &c. અણીએંનો &c.
Loc. અણ્યામાં or અણીમાં or માય. માંય.	અણુંમાં or અણીએંમાં or માંય.

When છેયા, છેયે (singular), છ્યા, છ્યી (plural), are followed by a noun, the forms અણ્યા, અણી, અણું, and અણીએં, respectively, are used throughout the oblique cases, and the noun only takes the case-endings.

The form એ is sometimes used for the Nominate and એનો for the Genitive, Singular and Plural, of all three genders.

For the Demonstrative Pronoun, *that, that one,* see Personal Pronouns 3rd person.

## § 18. The Interrogative Pronoun.

Nom.	કોણુ, Who ?	કુ ? What ?
Obj.	કોણ્યાય.	હાય.
Ag.	કોણુ.	હેણુ.
Dat.	કોણ્યાય.	હાય.
Abl.	કોણ્યાહું &c.	હેણાહું &c.
Gen.	કોણ્યાનો or કોનો &c.	હેણાનો or હેનો &c.
Loc.	કોણ્યામાં or માંય.	હેણામાં or માંય.

### § 19. The Indefinite Pronouns.

Masc. & Neut.	Fem.	Masc. & Neut.	Fem.
Nom. કણું.	કણી, some one.	કણુંક, કણીક, any one.	
Obj. કણુાય.	કણીએ.	કણુાયક.	
Ag. કણે.	કણીએ.	કણેક.	
Dat. કણુાય.	કણીએ.	કણુાયક.	
Abl. કણુાણ &c.	કણીણ.	કણુાયકણ &c.	
Gen. કણુાનો or કણીનો &c.	કણીનો &c. કનો &c.	કણુાયકનો &c.	
Loc. કણુામાં or માંય.	કણીમાં or માંય.	કણુાયકમાં or માંય.	

The pronouns કોઈ, *some one*, કોઈક, *any one*, કિંઈ or  
કિંઈ, *anything*, are indeclinable.

### § 20. The Distributive Pronoun.

The Distributive Pronoun એકેક, *each*, is indeclinable.

### § 21. Compound Pronouns.

કણું બીજું,	some other.
કણુંતું કણું,	some one or other.
કંઈ વતું,	some more.
કંઈને કંઈ,	something or other.
બીજું કણું,	some one else.
બીજું હું ?	what else ?
વતું કંઈ,	something else.
હગળા કણું,	several.

§ 22. Table of Allied Pronominal Forms.

Pronoun.	Adjectives.		Adverbs.	
	Quality.	Quantity.	Manner.	Place.
ઇથું or એ.	ઇથું or એવું.	અતં.	ઇમિ or એમ.	ઇથાં.
જ.	જથું.	જતં.	જમ or જેમ.	જથાં-જાં.
તી or તે.	તીવું or તેવું.	તતં.	તીમ or તેમ.	તાં.
વી.	વીવું.	વતં.		વાં.
કોણું.	કીવું or કેવું.	કતં.	કીમ or કેમ.	કયાં-કાં.

§ 23. Pronominal Adjectives.

હગણું, હેતું, આખું all, the whole. એ, both.

પારકું, another's. વધું, more.

એક, one. ધણું, much, (pl. many).

બીજું, another. જુખ, much.

## CHAPTER VI.

## Verbs.

The Verb in its conjugation possesses Infinitives, Participles, Moods, and Tenses.

§ 24. The Infinitives are formed by adding to the verbal stem :—

વો-વી-ંતુ or ઓં-ણી-ંણુ, to express indefinite action.

તાં, „ continuous „

વાનો-વાની-વાંતુ, „ intentional „

જાયો-જાયી-જાંયું, „ completed „

In Transitive Verbs the Infinitive, if declinable, agrees with its object.

§ 24. The Participles are formed by adding to the verbal stem :—

તો-તી-ંતુ. (Present) to express action as continuing:

e. g. પડતો, *falling*.

વાનો-વાની-વાંતુ. (Future) to express action as intended :

e. g. પડવાનો, *going to fall*.

જાયો-જાયી-જાંયું. (Past) to express action as completed :

e. g. પડજાયો, *fallen*.

ઈ or ઇને. (Connective Past) to express action as completed: e. g. પડી-પડીને, *having fallen*.

Instead of વાનો-વાની-વાંતુ, the Hindi terminations વાળો-વાળી-વાંગુ may be used, affixed *not* to the stem but to the oblique form of the Infinitive, as પડવાવાળો.

In the Gujarat portion of the Bhil country, the Gujarati Participle ending in એકો-દી-ણું is sometimes used instead of the Past Participle, as પડેલો instead of પડ્યેલા.

The Connective Past Participle is the only one that is indeclinable. It is most frequently employed as the first finite verb in a compound sentence ; e.g. આવીને કામ કીદું, Having come, he did the work, or He came and did the work.

Similarly a succession of these Participles may take the place of a succession of finite verbs ; e.g., વી આવીને અનાખ જોઈને ઓખદ આવીને ગેર ગીજ્યેલા=Having come, and having seen the man, and having given the medicine, he went home, or He came and saw the man, gave the medicine and went home.

§ 26. The three Moods in Bhili are the Indicative, the Imperative and the Subjunctive. The Indicative has nine Tenses—three Simple and six Compound. The Subunctive has ten—two Simple and eight Compound. The Imperative has two Simple Tenses.

All verbs follow the same method of conjugation. There are about a dozen verbs which may be called Irregular, but they are irregular only in the Past Participle.

§ 27. Conjugation of the Verb होन्, *to be.*

The Verb होन् is conjugated only in the following five tenses, which also enter as auxiliaries into the conjugation of every verb.

Indicative.

Present.	S.	1 हूं or मै* हूं.	I am.
		2 हुं हे.	Thou art.
		3 m. वी हे.	He is.
		3 f. वे हे.	She is.
	P.	1 अभां हां.	We are.
		2 तभां हां.	You are.
		3 m. वा हे.	They are.
		3 f. वे हे.	"
	S.	1 हूं अतो.	I was.
Past.		2 हुं „,	Thou wast.
		3 m. वी „,	He was.
		3 f. वे अती.	She was.
	P.	1 अभां अता.	We were.
		2 तभां „,	You were.
		3 m. वा „,	They were.
		3 f. वे अती.	"
	S.	1 हुं अहो.	I shall be.
		2 हुं अहे.	Thou wilt be.
Future.		3 m. वी अहे.	He will be.
		3 f. वे अहे.	She will be.
	P.	1 आभां अहां.	We shall be.
		2 तभां अहो.	You will be.
		3 m. वा अहें.	They will be.
		3 f. वी अहें.	"      "

\* The pronoun मै, *I* (Hindi मै), is used in the Rajputana States.

## Subjunctive.

Present.	S.	1	ਹੁ ਉਗੁਃ.	I may be.
		2	ਤੁ ਉਗੇ.	Thou mayst be.
		3 m.	ਵੀ ਉਗੇ.	He may be.
		3 f.	ਕੇ ਉਗੇ.	She may be.
	P.	1	ਅਮਾਂ ਉਗਾਂ.	We may be.
		2	ਤਮਾਂ ਉਗਾਂ.	You may be.
		3 m.	ਵਾਂ ਉਗਾਂ.	They may be.
		3 f.	ਵੀ ਉਗਾਂ.	" "
	S.	1	ਹੁੰ ਉਗੇਕ or ਉਗੇਤ.	I might be.
Past.		2	ਤੁੰ " "	Thou mightst be.
		3 m.	ਵੀ " "	He might be.
		3 f.	ਕੇ " "	She might be.
	P.	1	ਅਮਿ,,	We might be.
		2	ਤਮਿ,,	You might be.
		3 m.	ਵਾ,,	They might be.
		3 f.	ਕੇ,,	" "
	S.	1	ਮੋ ਕੁਂ,	2 ਤੁੰ ਕੇ,
		3 m.	ਕੋ ਕੇ,	3 f. ਕੇ ਕੇ.

Alternatives\* for the Subjunctive are :—

Present.	S.	ਮੋ ਕੁਂ,	2 ਤੁੰ ਕੇ,	3 m. ਕੋ ਕੇ,	3 f. ਕੇ ਕੇ.
	Pl.	ਅਮਾਂ ਵਾ,	2 ਤਮਾਂ ਵੇਂ,	3	ਕੇ ਕੇਂ.
Past.	S.	ਮੋ ਅਤੋ,	2 ਤੁੰ ਅਤੋ,	3 m. ਕੋ ਅਤੋ,	3 f. ਕੇ ਅਤੀ..
	Pl.	ਅਮਾਂ ਅਤਾ,	2 ਤਮਾਂ ਅਤਾ,	3 m. ਕੇ >	3 f. ਕੇ

## Imperative Mood.

Present.	ਛੋ.	Be thou, or be ye.	negative. as Ind.
Future.	{ ਛਾਨੋ.	Thou shalt be.	

\* These alternative forms are used both independent and as auxiliaries in the Rajputana States.

§ 23. Conjugation of the Verb વાજ. To fall.

Infin.	Present. 1 વાજ-વાજ. To fall.
	2 વાજ.
	Future. વાજ-વાજ. To be about to fall.
Partic.	Past. વાજ-વાજ. To have fallen.
	Present. વાજ-વાજ. Falling.
	Future. વાજ-વાજ. About to fall.
	Past. વાજ-વાજ. Fallen.
C. Past.	C. Past. વડી or વડીને. Having fallen.

Indicative Mood.

Present Indefin. (I) fall.	S. 1 કુ or મોં કુ, P. અમાં કાં.
	2 તુ પડે,
	3 m. વી પડે,
	3 f. વે પડે,
Fut. Ind. (I) shall fall.	S. 1 કુ પડશી, P. અમાં પડશા.
	2 તુ પડશે.
	3 m. વી પડશે,
	3 f. વે પડશે.
Past Ind. (I) fell.	S. 1 કુ પડજોા, P. અમાં પડજ્યા.
	2 તુ " "
	3 m. વી " "
	3 f. વે પડજ્યોા.
ON- Pres. C. tinnouinal- (I) am stz. ling	S. 1 કુ પદુ કુ, P. અમાં પડા હા.
	2 તુ પડે હે,
	3 m. વી પડે હે,
	3 f. વે પડે હે.

Past Cont. (I) was falling.	S. 1	હું પડતો અતો,	P. અમાં પડતા અતા.
	2	તું „ ,	તમાં „ ,
	3 m. વી „ ,	વા „ ,	
	3 f. વે પડતી અતી,	વી પડતી અતી.	
Pres. In- tentional (I) am a- bout to fall.	S. 1	હુંપડવાનો હું,	P. અમાંપડવાના હા.
	2	તું „ હે,	તમાં પડવાના હો.
	3 m. વી „ હે,	વા પડવાના હે.	
	3 f. વે પડવાની હે,	વી પડવાની હે.	
Past Int. (I) was ab- out to fall	S. 1	હું પડવાનો અતો,	P. અમાં પડવાના અતા.
	2	તું „ ,	તમાં „ ,
	3 m. વી „ ,	વા „ ,	
	3 f. વે પડવાની અતી,	વી પડવાની અતી.	
Present Perfect. (I) have fallen.	S. 1	હું પડજ્યો હું,	P. અમાં પડજ્યા હા.
	2	તું „ હે,	તમાં પડજ્યા હો.
	3 m. વી „ હે,	વા પડજ્યા હે.	
	3 f. વે પડજ્યી હે,	વી પડજ્યી હે.	
Past Perf. (I) had fallen.	S. 1	હું પડજ્યો અતો,	P. અમાં પડજ્યા અતા.
	2	તું „ ,	તમાં „ ,
	3 m. વી „ ,	વા „ ,	
	3 f. વે પડજ્યી અતી.	વી પડજ્યી અતી.	

### Subjunctive Mood.

Present Indefinite, *I may fall.* Same as Indicative.

Future Indefinite, *I may be about to fall.* Same as Ind.

Past Indef. (I) might fall.	S. 1	હું પડક.	P. અમાં પડક.
	2	તું „ ,	તમાં „ ,
	3 m. વી „ ,	વા „ ,	
	3 f. વે „ ,	વી „ ,	

§ 28. Conjugation of the Verb પડવું, *To fall.*

Infin.	Present.	1 પડવો-વી-નું. To fall. 2 પડતાં.
	Future.	પડવાનો-ની-નું. To be about to fall.
	Past.	પડજ્યો-જ્યી-જ્યું. To have fallen.
Partic.	Present.	પડતો-તી-નું. Falling.
	Future.	પડવાનો-વાની-વાનું. About to fall.
	Past.	પડજ્યો-જ્યી-જ્યું. Fallen.
	C. Past.	પડી or પડીને. Having fallen.

Indicative Mood.

Present Indefin. (I) fall.	S.	1 ફું or મોં પડું, P. અમાં પડાં. 2 તું પડે, 3 m. વી પડે, 3 f. વે પડે,	P.	અમાં પડાં. તમાં પડો. વા પડે. વી પડે.
	S.	1 ફું પડહી, 2 તું પડહે. 3 m. વી પડહે, 3 f. વે પડહે,	P.	અમાં પડહાં. તમાં પડહો. વા પડહે. વી પડહે.
	S.	1 ફું પડન્યો, 2 તું , 3 m. વી , 3 f. વે પડન્યો.	P.	અમાં પડન્યા. તમાં , વા , વી પડન્યો.
	S.	1 ફું પદું ફું, 2 તું પડે હે, 3 m. વી પડે હે, 3 f. વે પડે હે,	P.	અમાં પડાં હો. તમાં પડો હો. વે પડે હો. વી પડે હો.
Future.  d.	S.	1 ફું પડણું, 2 તું , 3 m. વી , 3 f. વે પડણ્યો.	P.	અમાં , તમાં , વા , વી પડણ્યો.
	S.	1 ફું પડું ફું, 2 તું પડે હે, 3 m. વી પડે હે, 3 f. વે પડે હે,	P.	અમાં પડાં હો. તમાં પડો હો. વે પડે હો. વી પડે હો.
	S.	1 ફું પડું ફું, 2 તું પડે હે, 3 m. વી પડે હે, 3 f. વે પડે હે,	P.	અમાં પડાં હો. તમાં પડો હો. વે પડે હો. વી પડે હો.
	S.	1 ફું પડું ફું, 2 તું પડે હે, 3 m. વી પડે હે, 3 f. વે પડે હે,	P.	અમાં પડાં હો. તમાં પડો હો. વે પડે હો. વી પડે હો.

\* Thal-  
Sg.

Past Cont. (I) was falling.	S. 1	હું પડતો અતો,	P. અમાં પડતા અતા.
	2	તું „	તમાં „
	3 m. વી „	વા „	
	3 f. વે પડતી અતી,	વી પડતી અતી.	
Pres. In- tentional (I) am a- bout to fall.	S. 1	હું પડવાનો હું,	P. અમાં પડવાના હાં.
	2	તું „ હે,	તમાં પડવાના હો.
	3 m. વી „ હે,	વા પડવાના હે.	
	3 f. વે પડવાની હે,	વી પડવાની હે.	
Past Int. (I) was ab- out to fall	S. 1	હું પડવાનો અતો,	P. અમાં પડવાના અતા.
	2	તું „	તમાં „
	3 m. વી „	વા „	
	3 f. વે પડવાની અતી,	વી પડવાની અતી.	
Present Perfect. (I) have fallen.	S. 1	હું પડુંયો હું,	P. અમાં પડુંયા હાં.
	2	તું „ હે,	તમાં પડુંયા હો.
	3 m. વી „ હે,	વા પડુંયા હે.	
	3 f. વે પડુંયી હે,	વી પડુંયી હે.	
Past Perf. (I) had fallen.	S. 1	હું પડુંયો અતો,	P. અમાં પડુંયા અતા.
	2	તું „	તમાં „
	3 m. વી „	વા „	
	3 f. વે પડુંયી અતી.	વી પડુંયી અતી.	

## Subjunctive Mood.

Present Indefinite, *I may fall.* Same as Indicative.

Future Indefinite, *I may be about to fall.* Same as Ind.

Past Indef. (I) might fall.	S. 1	હું પડક.	P. અમાં પડક.
	2	તું „	તમાં „
	3 m. વી „	વા „	
	3 f. વે „	વી „	

Pres.	S. 1	ફું પડતો ઉણું	P. અમાં પડતા ઉગાં.
Cont.	2	તું „ ઉગે	તમાં „ ઉગોા.
(I) may be falling.	3m. વી „ „	વા „ „ ઉગેં.	
	3 f. વે પડતી „	વી પડતી „	

Past Cont.	S. 1	ફું પડતો ઉગેક.	P. અમાં પડતા ઉગેક.
(I) might be falling.	2	તું „ „	તમાં „ „
	3m. વી „ „	વા „ „	
	3 f. વે પડતી „	વી પડતી „	

Pres. Int.	S. 1	ફું પડવાનો ઉણું	P. અમાં પડવાના ઉગાં.
(I) may be about to fall.	2	તું „ ઉગે.	તમાં „ ઉગો.
	3m. વી „ „	વા „ „ ઉગેં.	
	3 f. વે પડવાની „	વી પડવાની „	

Past Int.	S. 1	ફું પડવાનો ઉગેક,	P. અમાં પડવાના ઉગેક.
(I) might be about to fall.	2	તું „ „	તમાં „ „
	3m. વી „ „	વા „ „	
	3 f. વે પડવાની „	વી પડવાની „	

Present Perf.	S. 1	ફું પડ્યો ઉણું,	P. અમાં પડ્યા ઉગાં.
(I) may have fallen.	2	તું „ ઉગે,	તમાં „ ઉગો.
	3m. વી „ ઉગે,	વા „ ઉગેં.	
	3 f. વે પડ્યી ઉગે,	વી પડ્યી ઉગે.	

Past Perf.	S. 1	ફું પડ્યો ઉગેક,	P. અમાં પડ્યા ઉગેક.
(I) might have fallen.	2	તું „ „	તમાં „ „
	3m. વી „ „	વા „ „	
	3 f. વે પડ્યી „	વી પડ્યી „	

### Imperative Mood.

Present, પડ fall thou.      પડો fall ye.

Future, પડનો thou shalt fall.      પડનો ye shall fall.

In Rajputana the alternative forms જ &c., (§ 27) are generally used instead of ઓણ throughout the Present Subjunctive, and વેણી instead of અણી throughout the Future Subjunctive.

§ 29. When the root of a verb ends in આ, this આ is dropped in the 1st and 2nd pers. plur. of (a) the Pres. Indef. Indic., (b) the Cont. Indic., (c) the Pres. Indef. Subj., also in the 2nd pers. plur. of the Pres. Imperat. Thus in the conjugation of નાનું, *to go*, we have :

Pres. Indef. Indic.	અમાનોનિ,	તમાં જો.
„ Cont.	„ અમાનોનિ હાં,	તમાં જો હોં.
„ Indef. Subj.	અમાનોનિ,	તમાં જો.
„ Imperative.	જો.	

§ 30. When the root of a verb ends in એ, this એ is dropped in the 2nd and 3rd pers. sing. and in the 3rd pers. pl. of the Pres. Indefinite and Pres. Continuous of the Indic., the Pres. Indef. Subj., and the 2nd pers. sing. of the Pres. Imperative.

Thus in the conjugation of કોઝ, *to say* we have :

Pres. Indef. Indic.	જ કો, વી or વે કો, વા or વી કો.
„ Cont.	ગું કે હો, વી or વે કે હો, વા or વી કે હો.
„ Indef. Subj.	ગું કો, વી or વે કો, વા or વી કો.
„ Imperative.	કો.

§ 31. Monosyllable roots ending in દ drop the દ before the ending એ. e. g.

દીકું *to give*, તું દે, વી or વે દે, વા દે.

દીકું *to take*, તું લે, વી or વે લે, વા લે.

§ 32. The Infinitive in દી is used after verbs of learning and teaching :

e. g. કે ગાતાં હીકે, She learns singing.

વી લખતાં હીકાડે, He teaches writing.

દી is also used as equivalent in meaning to the Loc. તાંમાં ; e. g. નીક ફુટતાં, at day-break.

§ 33. The Infinitive form in વી is generally found with Causatives, and with some other verbs the final letter of whose stem is િ : e. g. અવરાવણું, to feed (cause to eat). આવણું, to come.

### *Irregular Verbs.*

§ 34. As any irregularities which occur in the verbs are to be found only in the Past Participles and in the tenses which are formed from them, it will be sufficient to give a list of these verbs along with their Past Participles.

#### Infinitive.

- કરું, to do.
- આવું, to eat.
- નાવું, to go.
- દેખવું, to see.
- દીવું, to give.
- નાહિયું, to run away.
- પેહણું, to enter.
- પીવું, to drink.
- ખીંચું, to fear.
- બેહણું, to sit.
- મરણું, to die.
- લીવું, to take.

#### Past Participles.

- કીર્દા-દી-દું, દા-દી દાં.
- ખાડો &c.
- ગીન્યો „
- દીઠો „
- દીદો „
- નાઠો „
- પેઠો „
- પીઠો „
- ખીંચો „
- બેઠો „
- મુઓ „
- લીદો „

### § 35. The Agential Construction.

The Agential Construction with regard to the Past Tenses of most Transitive Verbs obtains in Bhili just as in Gujarati :

e. g. મય કીદું, =Gujarati મેં કીધું, *I did.*

The Transitive Verbs which form an exception to this rule are :—

આડવું, to touch.	ભણવું, to learn.
આડકવું „ „	લાવવું, to bring.
જમતું, to eat.	વળગવું, to cling to.
પામણું, to obtain.	દીકવું, to learn,
ખીચું, to fear.	હમજવું, to understand.
ઓલવું, to speak.	

These verbs, although distinctively transitive in meaning, are conjugated throughout all their tenses as though they were Intransitives.

### § 36. The Passive Voice.

The Passive Voice is very rarely used to convey a passive idea, but is generally employed to indicate potentiality or possibility. It is formed by inserting આ between the stem of the verb and its termination:

e. g. કરવું, to do,      કરાવું, to be done,  
મોકલવું, to send,      મોકલાવું, to be sent.

The Passive Voice is rarely used except in the Simple Tenses.

મોકલાનું, *to be sent.*

Indicative Mood.

Pres. Ind. (I) am sent.	S. 1	હુ મોકલાડિ,	P.	અમાં મોકલાઆં.
	2	તુ મોકલાએ,		તમાં મોકલાએ.
	3 m. વી	„		વા મોકલાએ.
	3 f. વે	„	વી	„
Past Ind. (I) was sent.	S. I	હુ મોકલાજ્યો,	P.	અમાં મોકલાજ્યા.
	2	તુ „		તમાં „
	3 m. વી	„		વા „
	3 f. વે	મોકલાજ્યી,	વી	મોકલાજ્યી.
Fut. Ind. (I) shall be sent.	S. 1	હુ મોકલાહિ,	P.	અમાં મોકલાહાં.
	2	તુ મોકલાહે,		તમાં મોકલાહાં.
	3 m. વી	„		વા મોકલાહે.
	3 f. વે	„	વી	મોકલાહે.
Subjunctive Mood.				
Past Ind. (I) might be sent.	S. 1	હુ મોગલાક.	P.	અમાં મોગલાક.
	2	તુ „		તમાં „
	3 m. વી	„		વા „
	3 f. વે	! „	વી	„

There is another method of forming the Passive Voice, namely by conjugating the Past Participle of the principle verb with the verb જણું :

- e. g. મોકલાજ્યો જવો, to be sent.
- „ હુ મોકલાજ્યો જગિં, I am sent.
- „ „ ગિજ્યો, I was sent.
- „ જાધ, I shall be sent.

If the root of the verb contains આ, this આ is shortened to અ in the formation of the Passive:

e. g. બંદું, to bind, બંદાવું, to be bound.

§ 37. When the Passive Voice is used in a potential sense, the verb, if originally intransitive, will always be in the neuter, as though agreeing with the inherent idea of the verb. But, if the verb was originally transitive, it agrees in the Passive Voice with what would have been its object, had it remained transitive :

e.g. મય જવાનયું નહીં=Guj. મારાથી જવાયું નહીં, I could not go.

તથ સોપડી વંસાજી નહીં=Guj. તારાથી ચોપડી વંચાઈ નહીં,  
Thou couldst not read the book.

In either case the person by whom the action can, or cannot, be performed will be put in the Agent. Case—not as in Gujarati, in the Ablative.

### § 38. Causative Verbs.

If the stem of a Primary verb end in a consonant, the stem of the Causative derived from it is formed by simply adding આવ or આડ.

When the Causative stem ends in આવ, the Infinitive ending is almost invariably ણ, not ણુ, though in some cases either of these may be used.

If the stem of the Primary verb contains medial

આ, it is shortened to અ before adding causative આવ or આડ :

- e. g. ભણું, to learn, ભણ્યાવણું, to teach.  
 વહું, to dwell, વહાનવું, to colonise (cause to dwell).  
 વળવું, to sound, વળડવું, to cause to sound.  
 બેદવું, to sit, બેહાડવું, to seat.  
 નગવું, to wake up, જગાડવું, to cause to wake.

A few Causatives are formed by adding એ, the stem receiving medial એ :

- e.g. ફરતું, v.i. to turn, ફરવણું, to cause to turn, to change.

If the stem of the Primary verb ends in a vowel, a euphonic એ is inserted before adding આવ or આડ :

- e. g. ગાવું, to sing, ગવાડવું, to make to sing.

Some verbs, neuter or intransitive, become active or transitive (differing not at all in meaning from causatives) by the insertion of આ :

- e. g. ઘળવું, v.i. to burn, ઘાળવું, v.t. to set on fire.

તપવું, „, to become hot, તાપવું, „, to heat.

Note also પાવું, v.i. to drink, પાવું, „, to give to drink, to water.

મરવું, „, to die મારવું, „, to strike.

### § 39. Double Causatives.

From ordinary Causatives, Double Causatives are sometimes derived quite regularly, the former being regarded as primary to the latter. In meaning these Double Causatives are scarcely to be distinguished from Simple Causatives :

- e. g. ખાવું, to eat, ખવાડવું, to feed, ખવડાવણું, to cause to feed.



## CHAPTER VII.

### Compound Verbs.

Compound Verbs, taken in their widest sense, may be classified as I. Intensives, II. Completives, III. Potentials, IV. Frequentatives, V. Continuatives, VI. Desideratives, VII. Obligatives, VIII. Permissives, IX Inceptives.

#### § 40. Intensives.

Intensives are formed by combining the Connective Past Participle of the principal verb with one of the following verbs :

**આવણું**, to come, implying approach :

e. g. લીધું, to take. લી આવણું, to take up.

**જાણું**, to go, imparting idea of thoroughness and finality :

e. g. ખાણું, to eat. ખાઈ જાણું, to eat up.

**દાઢું**, to throw, (of. Guj. નાખું), implying vigour, resoluteness :

e. g. ભાંજાઢું, to break. ભાણ દાઢું, to break to pieces.

**દીઢું**, to give, implying emphasis or intensity :

e. g. દરઢું, to throw. દી દીઢું, to throw down.

**પડું**, to fall, implying suddenness, unpreparedness :

e. g. આવણું, to come. આવી પડું, to come unexpectedly.

**લીધું**, to take, implying acquisition :

e. g. અસકાંધું, to lift. અસકી લીધું, to carry away.

### § 41. Completives.

Completives denote the completion of an action. They are formed by combining the Connective Past Participle of the primary verb with the verb रेतुं, or, less frequently, सुक्तुंः:

e. g. करतुं, to do. करी रेतुं, or करी सुक्तुं, to finish doing.

The Connective Participle with रेतुं sometimes expresses continuity rather than completeness, and might then be placed amongst the Intensives:

e. g. गाउतुं, to resound. गाउ रेतुं, to keep on resounding.

### § 42. Potentials.

Potentials indicate ability to perform a certain action. They are formed by combining the verb कर्तुं, to be able, with the Connective Past Part. of the verb expressing the action:

e. g. जातुं, to go. जाय कर्तुं, to be able to go.

( See also Passive Verb §§ 36, 37 ).

The धने form of the Connective Past Participle is never used in the formation of Compound Verbs.

### § 43. Frequentatives.

Frequentatives indicate the frequent repetition of an action. They may be formed :—

(1) by doubling the root of the principal verb before the verb કરતું:

e. g. એલ એલ કરતું, to speak often.

(2) by combining the mas. pl., past partic. of the principal verb with કરતું:

e. g. કેળ્યા કરતું, to say frequently.

#### § 44. Continuatives.

Continuatives denote the continuance of an unfinished action. They are formed by combining the pres. partic. of the principal verb with the verb જતું or રેતું:

e. g. સાલતું, to walk. સાલતું જતું, to go on walking.

કહું, to say. કહું રેતું, to go on saying.

The participle agrees in Gender and Number with the Subject.

#### § 45. Obligatives.

Obligatives imply duty or obligation. They are formed by placing the Infinitive of the principal verb before પડું. This Infinitive being in reality the subject of પડું, it is doubtful whether obligatives should be regarded as true compound verbs. The person upon whom necessity lies is put in the dative :

e. g. મય નતું પડું, I must go.

If the infinitive be a Transitive Verb it agrees with its object :

e. g. વણીએ રોટી કરવી હે, she must bake the bread.

The idea of obligation may also be expressed by the Infinitive with જુને, *it is necessary*, the person standing in the Agential Case :

e. g. મય જવું જુને, I must go.

The Infinitive is sometimes used with હે in this sense, but it then expresses more or less of desire :

e. g. મય જવું હે, I wish to go.

#### § 46. Desideratives.

Desideratives are formed by adding the verb સાવું, *to wish*, to the oblique form of the Infinitive of the principal verb :

e. g. જવા સાવું, to wish to go.

But it is more usual to use some such periphrastic expression as મય કામ કરવાનું ભન હે, I wish to work.

#### 47. Permissives.

Permissives are formed by combining the verb દીવું, *to give*, with the inflected Infinitive of the principal verb :

e. g. મય જવા દે, Let me go.

વણાય સોરાએ જવા દીદો. He let the boy go.

Under this head we may also include the use of पामङ्गु, and less frequently अगङ्गु, to receive permission :

- e. g. तय जवा न मणे, you are not allowed to go.  
हु जवा पामङ्गयो, I got leave (or managed) to go.

### § 48. Inceptives.

Inceptives indicate the beginning of an action. They are formed by placing the verb आँटङ्गु or लागङ्गु, *to begin*, immediately after the oblique Infinitive of the verb expressing the action :

- e. g. ती काम करवा भाँडे, he is beginning to work.  
वे गावा लाँग्याई, she began to sing.

The verb लागङ्गु sometimes conveys the idea of helping :

- e. g. काम करवा लाँग्येइ, he helped to do the work.

### § 49. Nominal Verbs.

There is another class of verbs which may be ranked as Compound Verbs. In these the substantive or adjective is so united with the verb as to form but one idea :

- |                     |   |
|---------------------|---|
| e. g. उँचुं थाँवुं, | to stand up.  |
| „ राखँतुं,          | to keep (one) standing or waiting.                        |
| „ रैंतुं,           | to wait.  |
| „ करँतुं,           | to raise up.  |
| वेसाँतुं लीँतुं,    | to buy:   |
| वाट जेवी,           | to expect (with genitive of person<br>or thing expected). |
-

## CHAPTER VIII.

### Adverbs.

The following is a list of the Adverbs most commonly in use. As will be seen, a good many are Locatives in એ or માં, and a few are Ablatives.

#### § 50. Adverbs of Manner.

અટકળમાં or અટકેળમાં, By guess.	શીક, Well, exactly.
અણુણણે, Unwittingly.	દીક્કાદ, Neatly.
અમયું, In vain, for no reason.	ડાઢાથી, In a flutter.
અસાઉ, Unexpectedly.	તીમ or તેમ, Thus.
ઘમ, Thus, so.	પનામાં, Breadthways.
ઘમજ or ઉમુસ, Just so.	પાદરં, Straight.
ઉતાવળું, Quickly.	પોગે, On foot.
ઉપરયાટ, Unexpectedly.	અગલમાં, Under the arm.
ઉચ્ચું ઉચ્ચું, Immediately.	ભાડે, On hire.
કસડપસડ, In a state of disorder.	મનહું, Spontaneously.
કીમ? or કેમ? How?	મારમાર, At once, quickly.
જર or જરપટ, Quickly.	મેદિત, For nothing.
જરાધરું, By force.	રણિને, With great difficulty, (lit. having earned).
જુએ જુએ, Separately.	વેઠમાં, On forced labour.
નોરાવરીહું, By force.	વેલાંવેલાં or વેલું, Quickly.
નોરહું or નોરેહું, Vigorously, aloud.	સાનાંસાનાં, Quietly, secretly.
કાલાં કાલાં, For no purpose.	હળેણે, Slowly, gently.
	હાઉ, Well.
	હાતાંહાતાં, Slowly.

§ 51. Adverbs of Time.

अतराक्तमां, Meanwhile.  
 अतरा इरा, So often.  
 आगम or आगળ, Before.  
 आज or आने, To-day.  
 आजकल, Now-a-days.  
 आथमते, At sunset.  
 आथमन्ये, At eventide.  
 ऐवां, Now.  
 ऐषु, The current year.  
 कन्धाक, Sometimes.  
 कन्धातुं? How long ago?  
     Ever so long ago.  
 काल or काले, Yesterday, to-morrow.  
 क्वे? When?  
 क्रेक क्रेक, Now and then.  
 जै, Immediately.  
 देहुं or देहांहुं, From the beginning.  
 ततराक्तमां, Meanwhile,  
 तरत, At once.  
 तरे, Then.  
 दाके, During the day.  
 दाके दाके, Daily, constantly.  
 पमे दाके {The day before  
     or      yesterday.  
 परमदाके, { The day after  
     परभदाके, to-morrow.

परभाते, At break of day.  
 परार, The year before last,  
     or the year after next.  
 पेली, First, formerly.  
 पोर, Last year, next year.  
 शीर or इर, Again.  
 भहीने, Monthly, per month.  
 मेहुं, Late.  
 मेरे, Before.  
 मेरेहुं, Beforehand.  
 राते, At night, to-night.  
 लगतुं, Quickly, soon.  
 वारां वारां, Alternately.  
 वाइवार, Often.  
 वाहकुं, Last.  
 वेषुमां, In the morning.  
 वेलु, Early.  
 सदा, Always.  
 सेले, Lastly.  
 सेले सरवाने, At length,  
     finally.  
 हदवांहे or हदसेहुं, Finally.  
 हवारे, In the morning,  
     to-morrow morning.

§ 52. Adverbs of Place.

અગાડી, In front.	પરમે, Beyond.
અદવેસમાં, Half-way, midway.	પસાડી, Behind.
અહીં, Here.	પાસું, Back again.
આગળી, In front.	પાહે, Near.
આહેપાહે, Around.	પુઠે, Behind.
છથાં, Here.	ખાયરું, Without, outside.
છયુછથાં, Hither and thither.	મેરે, On one side, apart.
એઠે, Beneath.	મેરે મેરે, On all sides.
ક્યાં ? Where ?	મોરે, In front.
જો or જ્યાં, There.	વાંહે, Behind.
ટેં, Right up to the end.	વાંહે મોરે, Behind and before
તેંકું or તેણાં, Thence.	બાં, There.
લાં, There.	બાંગેબાં, In that very place.
ચેડમાં, Near.	સમકેર, Around.

§ 53. Adverbs of Affirmation, Negation, Doubt and Degree.

Affirmation.	ખરું, ખરેખરું, નકી, હાંસેહાંસ,	Certainly, truly.
	તેર or તેરે, તેરહું or તેરેહું,	Of course.
	હોવે,	Yes.
Negation.	આહાં, ઉહું,	No.
	ન, નહીં, નકે,	Not.
	નહું,	Not at all.
	રખે,	Not (with Imperative).

The word નહીં is rendered emphatic by placing

it at the end of a sentence. A click of the tongue means *No!* emphatically.

Doubt.	કદાક, નાણીએક,	Perhaps.
Degree.	ખુઅ, ધણ્યું,	Much.
	લગાર લગાર, સણી સણી,	Very little.
	વતું,	More.

The adverb સાંચે before a pronominal adjective is equivalent to *however, no matter how*:

e. g. સાંચે તીવેા મોટો હિંગે, No matter how great he may be.

The adverbs વળી and વળે are simply conjunctive.

#### § 54. Adjectival Adverbs.

Some adverbs are merely adjectives treated as adverbs. These either remain always in the neuter plural form, as એવાં, *now*; સાનાં, *secretly*, or else they are treated as adjectives agreeing with the subject of the verb, if the verb is intransitive, and with the object, if the verb is transitive :

e. g. સોરી મોડી આજથી, The girl came late.

સોરીએ કામ મોડું કીદું, The girl did the work late.

All adverbs ending in ણ come under this rule.

The following may be considered adjectival  
Adverbs of Direction :

ઓતરાતું, Northward. ઓતરાતોણ, Go N. (addressing a man).

દખણું, Southward. દખણાતી ણ, Go S. (,, woman).

આથમણું, Westward. આથમણું ણો, Go W. (,, men).

ઉગમણું, Eastward. ઉગમણી ણો, Go E. (,, women).

## § 55. Pronominal Adverbs.

Some adverbs are formed from Pronouns.

(a). From the Relative એ with its correlative તી :—

જણીવેલા, ... તણીવેલા, When, ... ... then.

જી or જ્યાં, ... લાં, Where, ... ... there.

જાની or જ્યાંની, ... લાંલ્યાં, Wherever, ... there.

જાંકુદી or જ્યાંકુદી, ... લાંકુદી, Until, ... ... then.

જેરે, ... તેરે, When, ... ... then.

These adverbs may be regarded as partly conjunctive.

In a complete sentence both the relative and its correlative are expressed : e.g. જમ તમાં કરછો તીમ તમાં પામછો, *As you act so will you receive*, but it is more frequent to omit the relative.

In sentences containing a command the correlative alone is used :

e. g. હું આવણી તેરે આવજો, Come ( thou ) when I shall come.

Sometimes even the correlative is omitted, and the relative takes its place in the sentence :

e. g. હું જઈ જેરે તમાં જણો. I shall go when you go.

(b). From the Demonstratives છું, એ, તી, વી :—

છાં, Here.

છયુછાં, Hither and thither.

છમ or એમ, Thus.

એવાં, Now.

લાં or વાં, There.

## (c). From the Interrogative કેણું ? હું ?:—

કેરે ?, When? કન્યાતું ? How long ago?  
 કીમ ? How? ક્યાં ? Where?  
 કેહું? or કેહાં? Whence? હું? Why?

## § 56. Adverbial Expressions.

અણુભીઆર,	On this side.
અતિરા ફેરા,	So often.
એક નજર (with જોવું to look at),	Fixedly, intently.
એક સપાંહું, or એક હાતે,	At once.
કણુભી વેળા,	Sometimes.
કરે નહીં,	Never.
જમણે or ઉપલે હાથ,	To the right, on the right.
ડાલે or નીથલે હાથ,	To the left, on the left.
ટોડને ટોડ,	In the same place.
થાતે થાતે,	Gradually, slowly.
નમતી રાત,	At the turn of night. About 1 A. M.
નમન્યે દાડે,	At the turn of day. About 1 P. M.
પમને દાડે, } પરમ દાડે, }	The day before yesterday. The day after to-morrow.
પરમ પેલે દાડે,	Three days ago, or three days hence.
બારે પોાર,	Always.
પેલી આડ, પેલી પાહ, પેલે હૃદે,	On the furtherside, beyond.
એ આડુણ્યામાં,	On both sides.

The negative particle *ન* may be interposed between two cognate adverbs, or the adverb may be reduplicated to imply a certain kind of indefiniteness :

e. g. કેરે ને કેરે or કેરેક કેરેક, Sometimes.

મેરેમેરે, On all sides.

વારવાર, Often.

Adverbial Expressions of Time are generally in the Locative, or in તાં (= તામાં) :

e. g. ઉગતી કીરણયામાં, જાક દ્વારાતાં, At break of day.

(See Divisions of Day and Night § 64).

#### શ 57. Participial Adverbs.

The Connective Participle united with some noun or adjective is sometimes equivalent to an adverb. This is especially the case with કરીને and થાઈને:

e. g. એક એક કરીને, Singly.

નેમ તેમ, or ગમે તેમ કરીને, No matter how, somehow  
another.

ધારું કરીને, Especially.

ભલાઈ કરીને, Please, kindly.

એકઠા, બેગા, or બેળા કરીને, Together.

The participle કરીને is often used adverbially for *as*.

e. g. હું તથ ભાઈ કરીને રાખું, I look on you as a brother.



## CHAPTER IX.

### Prepositions.

The prepositions govern both the genitive and the objective cases, and apparently with no difference of meaning, whichever of the two cases be governed.

#### § 58. List of Prepositions.

આગે, Before.	બાહ્યં, Outside.
આહેપાહે, Around.	માટે, On account of.
અનુભૂ, Beneath.	માથે, Above, upon.
આખે, On account of.	માપક, Suitable to, like.
કને or કેને, Near, beside.	મારે, By reason of.
કનેહું, From.	મોરે, In front of.
કરતાં, Than.	લગણું, As far as, until.
કરવે, On account of.	લારે, Along with.
કાળજીણું, For the sake of.	વગર, Without.
ગમ, In the direction of.	વિન્દું, Like.
નોટે, Along with.	વડે, With, by means of.
નેરે, By the force of, by means of.	વના, Without.
તણે, Beneath.	વસે, Between.
થાઈને, Past, by the way of.	વાસ્તે, For the sake of.
નીરીસ, Near.	વાંઠેને or વાંછે, Behind.
નીચું or નીસે, Below.	વેસમાંય, In the middle of.
પસે, After.	વેસી or વેસે, About, con- cerning.
પાર, On the other side of.	સમકેર, Around.
પાહે, Near.	હરંક, Like.
પાહે થાઈને, Past, <i>vid.</i>	હાટે, In exchange for.
પુરો, After, behind.	હાતે, Along with,
અદલે, Instead of.	હામાં-મું-મે, Opposed to.
અરોધર, Equal to, like.	હાર, For, for the sake of.
	ફુદી, Until, as far as.

The prepositions ending in એ are treated like adjectives, agreeing with the nouns to which they refer.

## CHAPTER X.

### Conjunctions.

#### § 59. List of Conjunctions.

**Copulative :** ने, and.

शीर, again.

वणी, वण्टे, further, moreover.

**Disjunctive :** सावे, or.

सावेती...सावेती, }  
केती...केती, } Either...or.

३, or [ used as a disjunctive in alternative questions ]:

e. g. तमां जाहो के नही ? Will you go or not ?

**Concessive :** [ने]...तो, If...then.

**Illative :** कीभके, केभके, Because.

तथे, Therefore.

**Final :** ते, In order that [ introducing the subordinate clause].

तथे, In order that [ placed at the end of the subordinate clause ].

e. g. वी जाए तथे मेा आज्यो हु, I have come in order that he may go.

—oo—

## CHAPTER XI.

## Interjections.

## § 60. List of Interjections.

આરે, આરે આરે, હાય હાય, બાપરે, Alas !

અલા, I say !

એર, Well ! No matter !

કુઘ, હાડ હાડ, Get away ! ( said to animals ).

જ્ય ગરીપરવર, Polite form of salutation.

( lit. Victory to the cherisher of the poor ).

રામ રામ, Usual form of salutation.

લા, Oh !

વાડ, Well !

વાહ, વાહ વાહ, Bravo !

સહ, Hush !

### § 61. The famine years.

એગણુસીતરો,	Famine of 1869.	=A. D. 1812.
ઉદજ્યો,	,, marked by a plague of rats.	
ગોહળજ્યો,	,, during which the cattle were reduced to feed on nests.	
એકાહન્યો,	,, of 1881.	=A. D. 1824.
નીવુંઓ,	,, 1890.	,, 1833.
હતરો,	,, 1917.	,, 1860.
પસીહો	,, 1925.	,, 1868.
સેતરીહો.	,, 1934.	,, 1877.

### § 62. Months of the Year.

કાતી,	Oct.-Nov.	વીઠાક,	Apr.-May.
માગસર,	Nov.-Dec.	લેઠ,	May-June.
પો,	Dec.-Jan.	અહાડ,	June-July.
મા,	Jan.-Feb.	હરાંમણુ,	July-Aug.
ક્રાગણુ,	Feb.-Mar.	ઘાદરવો,	Aug.-Sept.
સાધતર,	Mar.-Apr.	ચાહો,	Sept.-Oct.

### § 63. Days of the Week.

દીતવાર,	Suuday.	બ્રદ્વાર,	Wednesday.
હૃમવાર,	Monday.	અરસવાર,	Thursday.
મંગળવાર,	Tuesday.	હકરવાર,	Friday.'
		થાવોર,	Saturday.

## § 64. Divisions of the Day and Night.

The Bhils do not measure time by hours. Their day begins at sunrise, and their night at sunset. The following Tables show the expressions most commonly used to denote the time of day or night.

### Day.

6 A. M.	{	જલ્દ કુટી ગીજ્યો,	<i>lit. The sun has burst forth.</i>
		or ઉગતી કીરણયામાં, , ,	<i>at the rising of the rays.</i>
7 „	વાહડો દાડો સડ્જ્યો,	}	The day has risen the
8 „	એ વાહડા „ „	}	height of one, two,
9 „	તણુ „ „	}	three or four bamboos
10 „	સ્યાર „ „	}	respectively.
11 „	કુળા અફેાર,		Opening noon.
Noon	અફેાર, or દન માથે આજ્યો,		Noon. The day has come over the head.
1 P. M.	{	નમતો દાડો,	At the bend of day.
2 „			
3 „	મોહું ગળાસું,		
4 „	નાનું ગળાસું,		
5 „	વાહડો દાડો,		A bamboo's length of day ( left ).

## Night.

- .. The day has sunk.
- .. ( Sufficient for ) perceiving arrows.
- .. Twilight.
- .. At the falling of darkness.
- .. Darkness has fallen.
- .. One watch of the night.
  
- .. The time of dreaming has fallen.
- .. Half the night.
- .. The bend of night.
  
- .. Long before dawn.
- .. Shortly .. ..
- .. To break of dawn.

§ 65. Names of Relatives.

Grand-father,	$\left\{ \begin{array}{l} \text{Father's father,} \\ \text{Mother's } \end{array} \right.$	ગોટો ખાપ. મામો દાળ.
Grand-mother,	$\left\{ \begin{array}{l} \text{Father's mother,} \\ \text{Mother's } \end{array} \right.$	મોટી આઈ. મામા આઈ.
Uncle,	$\left\{ \begin{array}{l} \text{Father's elder brother,} \\ \text{, younger } \end{array} \right.$ $\left\{ \begin{array}{l} \text{Mother's brother,} \\ \text{Father's sister's husband. } \end{array} \right.$ Mother's , ,	ભાલો. કાંકેઠ. મામો. હુએ અથડો. માહે.
Aunt,	$\left\{ \begin{array}{l} \text{Father's sister,} \\ \text{Mother's } \end{array} \right.$ $\left\{ \begin{array}{l} \text{Father's elder brother's wife.} \\ \text{, younger } \end{array} \right.$	ફેઠ અથડ. માહી. ભાની. કાકી.
Father,	આતા, દાદા, દાળ, ખાપ.	
Mother,	આઈ, મા.	
Brother,	ભાઈ. ( elder sometimes called દાદા ).	
Sister,	બેન.	
Son,	દીકરો, સોરો..	
Daughter,	દીકરી, સોરી.	
Grandson,	$\left\{ \begin{array}{l} \text{Son's son, } \text{ દીકરાનો } \text{ દીકરો, } \text{ સોરાનો } \text{ સોરો.} \\ \text{Daugher's son, } \text{ દીકરીનો } \text{, } \text{ સોરીનો } \text{, } \end{array} \right.$	
Grand-daughter,	$\left\{ \begin{array}{l} \text{Son's daughter, } \text{ દીકરાની } \text{ દીકરી, } \text{ સોરાની } \text{ સોરી.} \\ \text{Daughter's daughter, } \text{ દીકરીની } \text{ દીકરી, } \text{ સોરીની } \text{ સોરી.} \end{array} \right.$	

Night.



§ 65. Names of Relatives.

Grand-father,	$\begin{cases} \text{Father's father,} \\ \text{Mother's } \end{cases}$	મોટો આપ. મામો દાજુ.
Grand-mother,	$\begin{cases} \text{Father's mother,} \\ \text{Mother's } \end{cases}$	મેટી આઈ. મામા આઈ.
Uncle,	$\begin{cases} \text{Father's elder brother,} \\ \text{, younger } \end{cases}$ $\begin{cases} \text{Mother's brother,} \\ \text{Father's sister's husband. } \end{cases}$ $\begin{cases} \text{Mother's } \end{cases}$	ભાબો. કંડો. મામો. કુચો અંગો. માહો.
Aunt,	$\begin{cases} \text{Father's sister,} \\ \text{Mother's } \end{cases}$ $\begin{cases} \text{Father's elder brother's wife.} \\ \text{, younger } \end{cases}$	કાંઈ અંગુધ. માહી. લાલી. કંકી.
Father,	આતા, દાદા, દાજુ, આપ.	
Mother,	આઈ, મા.	
Brother,	ભાઈ. ( elder sometimes called દાદા ).	
Sister,	એન.	
Son,	દીકરો, સોરો..	
Daughter,	દીકરી, સોરી.	
Grandson,	$\begin{cases} \text{Son's son, } \text{ દીકરાનો } \text{ દીકરો, } \text{ સોરાનો } \text{ સોરો.} \\ \text{Daugher's son, } \text{ દીકરીનો } \text{, } \text{ સોરીનો } \text{, } \end{cases}$	
Grand-daughter,	$\begin{cases} \text{Son's daughter, } \text{ દીકરાની } \text{ દીકરી, } \text{ સોરાની } \text{ સોરી.} \\ \text{Daughter's daughter, } \text{ દીકરીની } \text{ દીકરી, } \text{ સોરીની } \text{ સોરી.} \end{cases}$	

Son-in-law,	જમાઈ.
Daugher-in-law,	વડુ.
Brother-in-law,	Husband's elder brother,
	„ younger „
	„ sister's husband,
	Wife's brother, „ sister's husband,
Sister-in-law,	Husband's sister,
	„ elder brother's wife.
	„ younger „ „
	Wife's sister. „ brother's wife,
Nephew,	Brother's son,
	Sister's „
Niece,	Brother's daughter, Sister's „ ભાણુજ f. or ભાણુળ.
Cousin,	ભાઈ m. એન f.





P A R T   I I .

---

VOCABULARY & MISCELLANEA



## BHILI-ENGLISH.

*An asterisk is placed opposite those Bhili words  
for which no equivalent has been found.*

અ.				Gujarati Equivalent.
અકલ, <i>f.</i> Wisdom. અકલવાળું. <i>adj.</i> Wise...				અક્ષલ.
અગડું પડવું, <i>v. i.</i> To stoop. ... ...				આગળ પડવું.
અગદ્યેર, <i>m.</i> A boa-constrictor....				અન્જગર.
અગન કુઓરો, <i>m.</i> A bachelor ... ...				કુવારો.
અગાઠ, <i>m.</i> A memorial-stone erected to male ancestors... ...				અધાઠ.
અગાડી, <i>adv.</i> In front. અગાડી પસાડી, Head and heel ropes for a horse. ...				અગાડી, પછાડી. ...
અંગારો, <i>m.</i> A live coal. ... ...				અંગારો.
અંગાહી, <i>f.</i> The firmament. ... ...				આકશ.
અંગુઠો, <i>m.</i> A toe. ... ...				અંગુઠો.
અંગુસો or અંગોસો, <i>m.</i> A handkerchief...				અંગુછો.
અજવાળું, <i>v.</i> Light. ... ...				અજવાળું.
અટકળ or અટકેળ, <i>f.</i> Conjecture. ...				અટકળ.
અટકળમાં, <i>adv.</i> By guess. મારી અટકળમાં, In my opinion... ...				અટકળમાં. ...
અટકાવણું, <i>v.t.</i> To hinder. ... ...				અટકાવવું.
અડદ, <i>m.</i> A kind of pulse. ... ...				અડદ.
અડવું, <i>v. i.</i> To touch. ... ...				અડવું.
અડસન, <i>f.</i> Inconvenience ... ...				અડચણું.
અડાણી, <i>adj.</i> Obstinate, self-willed. <i>s. m.</i> A rascal... ...				અડાણી. ...

	Guj. Equiv.
અડી, <i>adj.</i> Two and a half. ... ...	અડી.
અડીવીટા, <i>m.</i> A coarse sheet ( $2\frac{1}{2}$ widths wide). ... ...	અડી+વીટા. ...
અંકુ દીનું, <i>v.t.</i> To lean upon. ... ...	આંકુ+દેણું.
અંકુએકે લીજનું, <i>v.t.</i> To mislead, to lead astray. ... ...	આંકુ+એકે+લઘજનું. ...
અંકુણું, <i>n.</i> A pad of leaves for the head on which to place a load. ...	ઉંદણું. ...
અઠેલું, <i>n.</i> Hiring cattle for ploughing under a certain agreement. ...	*
અણુણણે, <i>adv.</i> Unwittingly. ... ...	અણુણણે.
અણીઆડ, અણીપાછ, <i>adv.</i> On this side...	આ+આડ,આ+પાસું.
અતિક, <i>adj.</i> A very little. ... ...	*
અતરા, <i>adj.</i> So many... ... ...	એટલા.
અતરાકમાં, <i>adv.</i> Meanwhile. ... ...	એટલામાં.
અતરા ફેરા, <i>adv.</i> So often. ... ...	એટલા ફેરા.
અતરં, <i>adj.</i> So much. અતરંજ, Just so much.	એટલું, એટલુંજ.
અતો, <i>v. past tense.</i> Was. ... ...	હતો.
અથડાનું, <i>v.i.</i> To stagger... ... ...	અથડાનું.
અથડાનું જવું, To walk in a staggering manner... ... ...	„ ...
અથુઆર, <i>m.</i> An implement, a tool...	હથીઆર.
અથેલી, <i>f.</i> The palm of the hand, a painful.	હથેલી.
અથોડી, <i>f.</i> A hammer... ... ...	હથોડી.
અધમણું, <i>m.</i> Half a maund—20 seers...	અધમણું.
અધમણી, <i>f.</i> A copper water-vessel (containing half a maund )...	„ ...
અદરાત, <i>f.</i> Midnight. ... ... ...	અધર્ભી રાત.

				Guj. Equiv.
અદ્વેસમાં, <i>adv.</i> Half-way, midway...	...	...	...	અર્નું+વચે+માં.
અંધારી, <i>f.</i> Darkness. ...	...	...	...	અંધારું.
અંધારું, <i>adj.</i> Dark. ...	...	...	...	અંધારું.
અદાવત, <i>f.</i> Enmity. ...	...	...	...	અદાવત.
અફુરું, <i>adj.</i> Unfinished... .	...	...	...	અફુરું.
અદેલી, <i>f.</i> Half a rupee. ...	...	...	...	અધેલી.
અદોળ, <i>m.</i> One-sixteenth of a seer. ...	...	...	...	અધોળ.
અનણો, <i>m.</i> A deer. ...	...	...	...	હરણુ.
અનર, <i>f.</i> Care. અનર રાખવી, To take care.				*
અનાજ, <i>n.</i> Corn. ઉંઘું અનાજ, A standing crop.				અનાજ.
અનાડી, <i>adj.</i> Clumsy, foolish. ...	...	...	...	અનાડી.
અતુઆડી, <i>f.</i> Roaring, bellowing. ...	...	...	...	અતુ+આડવું.
„ કરવી, To roar (like a lion). ...	...	...	...	„
અન, <i>n.</i> Food. ...	...	...	...	અન.
અપતાર, <i>m.</i> Incarnation. ...	...	...	...	અવતાર.
અપાહ, <i>m.</i> A fast. ...	...	...	...	અપવાસ.
અઅરોટ, <i>m.</i> Threshold... .	...	...	...	ઉભરો.
અંભાવ માતા, <i>f.</i> The goddess Amba. ...	...	...	...	અંખા માતા.
અમયું, <i>adj.</i> In vain, for no reason...				અમયું.
અમય, <i>pron.</i> Us (Agential case. See Grammar § 13). ...	...	...	...	અમે.
અમલ, <i>m.</i> Opium. ...	..	...	...	...
અમાં, <i>pron.</i> We. ...	...	...	...	અમે.
અમાએ, <i>pron.</i> Us ( Agent. case. See Grammar § 13 ). ...	...	...	...	„
અમારામાં, અમારાફું, અમારું (See Gr. § 13).				„
અમુડો, <i>m.</i> A plait, or coil, of hair... .				અંધોડો.
„ વાળવો, To plait, or roll up, the hair.				„ વાળવો.

	Guj. Equiv.
અમે, pron. Us, to us (See Gr. § 13).	અમે.
અમોર, adj. Immortal.... ... ...	અમર.
અમોહ, m. The day of the new moon.	અમાસ.
અરજી, f. A petition. અરજી કરવી, To request.	અરજી.
અર્ધું, adj. Half. અર્ધું કરવું, To diminish, lessen.	અર્ધું.
અરે, interj. Alas ! ... ... ...	અરે.
અલકું, adj. Light (not heavy ). ...	હલકું.
અલગું, adj. Separate. ... ... ...	અલગું.
અલદી, f. Turmeric. ... ... ...	હળદ.
અલડાયલાડ, adv. In a confused way. ...	અદલાયદલ.
અલપ, adj. Out of sight. અલપ થાવું, To disappear. ... ... ...	અલોપ.
અલા, interj. I say ! ... ... ...	...
અલાઝું, v.t. To cause to give, to distribute. ... ... ...	અલ્યા.
અલાખું, adj. Steep. s. n. A declivity...	આલવું.
અલો, m. A brawl, a quarrel... ...	...
,, કરવો, To create a disturbance. ...	હલ્સો.
અવળું, adj. Inside out, different, the reverse of. ... ... ...	અવળું.
,, હમજું, v.t. To misunderstand. ...	...
અવાદો, m. Possession. ... ...	અવણું સમજવું.
અવાદે કરવું or દીવું, To hand over. ...	હવાદો.
અસકતું. or અસકી લીવું, v.t. To pick up....	હવાદે કરવું.
અસકાવવું, v. t. To lift up. ... ...	ઉચકું.
અસખરી માતા, f. Chicken-pox...	અછખડા.
અસાહિ, adv. Unexpectedly. ... ...	અચાનક.
અસાહો-ની-નું, adj. Unexpected. ...	,,

	Guj. Equiv.
અસાખ, <i>m.</i> An account. ... ...	હસાખ.
અસારી, Name of a Bhil clan at Bhilak.	...
અસારો, <i>m.</i> Help. ... ... ...	આશ્રો.
અસીક, <i>adv.</i> A very little. ... ...	આષું.
અસ્વાર, <i>m.</i> A mounted policeman, a sowar.	અસ્વાર.
અણાડ, <i>m.</i> June-July... ...	આશાડ.
અળાડવું or અળાંડી જવું, To cross, go over. અળાંડી દડવું, To cross right over. ...	અણાંગવું. એણાંગવી જવું.
અળવું, <i>adj.</i> Light (in weight). ...	ફળવું.
,, માનવું, To despise... ...	”
અળિસવું, <i>v. t.</i> To bale out water. ...	ઉલેચવું.
અળેટવું, <i>v. t.</i> To roll over and over. ...	અળેટવું.

## આ.

આઈ, <i>f.</i> A mother. ... ... ...	આઈ.
આઠડો, <i>m.</i> A long necklace... ...	હારડો.
આકર્ષ, <i>adj.</i> Passionate, severe. ...	આકર્ષ.
,, ઉકું, <i>v. i.</i> To get into a passion...	”
આકતું, <i>v. t.</i> To exaggerate (rarely used except in the phrase ગપ આકવી).	ગપ હંકવી.
આંખ, <i>f.</i> An eye. ... ... ...	...
,, આવવી, To have sore eyes. ...	આંખ.
આંખ દેખાડવી, To glare at, to threaten.	આંખ આવવી.
,, મસતામાં, In a twinkling, at once.	આંખ દેખાડવી.
આખું, <i>adj.</i> All, the whole. ... ...	આખું.
આગ, <i>f.</i> Fire. ... ... ...	આગ.
,, ઓળવવી, To extinguish a fire, to pacify. ... ... ...	”

	Guj. Equiv.
આગજમાતનાં, <i>m.</i> Aborigines. ... ...	આગમનત. ...
આંગડી, <i>f.</i> or આંગડું, <i>n.</i> A coat... ...	આંગરખી-ખુ. ...
આંગણું, <i>n.</i> A court-yard. ... ...	આંગણું. ...
„ સોડી દીઉં, To go away in a huff and not come back. ... ...	„ આગમ, <i>adv.</i> Before. ... ...
આગમ. આગણું, <i>adj.</i> Previous, former.... ...	આગમ. આગણું.
આગળ, <i>adv &amp; prep.</i> Before. ... ...	આગળ. ...
„ —ની વાત, Tradition. ... ...	„ આંગળી, <i>f.</i> A finger. ... ...
આંગળી. આગુવો, <i>m.</i> A guide. ... ...	આંગળી. આગુવો.
આજ, <i>adv.</i> To-day. આજ કાલ, Now-a-days.	આજ. ...
આજર, <i>adj.</i> Present. ... ...	હાજર. ...
આજે, <i>adv.</i> To-day. ... ...	આજે. ...
આઠવાઝણું, <i>n.</i> A week. ... ...	અઠવાઝણું. ...
આડ=આડી, Used in such expressions as અણુિઆડ, પેલીઆડ. ... ...	આડ. ...
આડી, <i>f.</i> Side, direction. ... ...	આડ. ...
આડું, <i>adj.</i> Across. આડું પડવું, To lie on one's side, to lie down. ... ...	આડું. ...
આણવું, <i>v. t.</i> To bring, to fetch. ... ...	આણવું. ...
આણી, <i>f.</i> A point. ... ...	આણી. ...
આંતરં, <i>n.</i> Entrails. ... ...	આંતરડું. ...
આતા, <i>m.</i> A father. ... ...	આતા. ...
આથડવું, <i>v. i.</i> To stagger. ... ...	આથડવું. ...
આથડીઓં, <i>n. pl.</i> Staggering. ... ...	આથડિઓં. ...
„ ખાવાં, To stagger. ... ...	„

	Guj. Equiv.
આથમણું, <i>adj.</i> Western. આથમણો દેશ, The west. ... ... ... ...	આથમણું. ...
આથમતું, <i>n.</i> Evening. આથમતે, In the evening. ... ... ...	આથમતું. ...
આથમન્યુ, <i>n.</i> Evening. આથમન્યે, At eventide.	"
આથમવું, <i>v.</i> To set (as the sun). ...	"
આયેડ, <i>f.</i> Giddiness. ... ... ...	આથડવું. "
,, આવળી, <i>v. i.</i> To be giddy (with dat. of pers.) ...	"
આંધો, <i>m.</i> A handle. ... ... ...	હાથો.
આદમન્યા, <i>oblique. pl.</i> of આદમી... ...	આદમી.
આદમી, <i>m.</i> A man, a person... ...	"
આદરવું, <i>v. t.</i> To begin, to undertake... ...	આદરવું.
આંધળું, <i>adj.</i> Blind. ... ... ...	આંધળું.
આપ, <i>pron.</i> Sir, Your Honour (term of respect, but seldom used). ...	આપ.
,, આપકું, <i>pron.</i> One's own... ...	...
આપડાં, <i>pron.</i> We (=you and I, you and we. See Gr. § 13)... ...	આપ.
આપડાએ, <i>pron.</i> Us (obj. and dat. case. See Gr. § 13). ... ...	આપણે.
આપકું, <i>adj.</i> Our... ... ...	...
આપકે, <i>pron.</i> We (Agent.case. See Gr. § 13).	આપણું.
આખર, <i>f.</i> Honour, credit. ... ...	આપણે.
,, રાખવી, To keep one's self-respect...	આખર.
આખું, <i>v.</i> The sky. ... ... ...	આખ.
આંધો, <i>m.</i> A mango-tree. ... ... ...	આંધો.
આમલી, <i>f.</i> A tamarind-tree, the tama-rind fruit. ... ... ...	આમલી.
	...

	Guj. Equiv.
આમળવું, <i>v. t.</i> To twist... ... ...	આમળવું.
આયકન, <i>n.</i> Respect. ... ... ...	આયનો.
,, રાખવું, To show respect to. ...	„
આયડો, <i>m.</i> Hunting.આયડો કરવો,To hunt.	આહેડી.
આયસા, <i>f.</i> Hope. ... ... ...	આશા.
આલયો, <i>m.</i> A niche in a wall... ...	આલય.
આવનો, <i>imperat.</i> Farewell! Come back!	આવનો.
આવજા, <i>f.</i> Coming and going... ...	આવજા.
આવડવું, <i>v. i.</i> To be known ( dat. of person to whom known). ...	આવડવું. ...
આવડેત, <i>f.</i> Practice, habit, experience.	આવડત.
આવણું or આવવું, <i>v. i.</i> To come... ...	આવવું.
આવી સડવું, To attack, to invade...	આવી ચડવું.
આવડો, <i>m.</i> A water-trough at a well...	હવાડો.
આવતે, <i>f.</i> Income, revenue. ... ...	આવક.
આસકી લીવું or અસકી લીવું, <i>v. t.</i> To snatch away. ... ...	ઉચકી લેવું. ...
આસરો, <i>m.</i> A refuge... ... ...	આસરો.
આસરે પેવું, To seek protection...	„
આસરેમાં, About, nearly. ...	આસરે.
આંસોળ, <i>f.</i> A cow's teat. ... ...	આચળ.
આહણું, <i>adj.</i> Near ... ... ...	આહેણું.
આહણું, <i>v. i.</i> To laugh... ... ...	હસવું.
આંહાં, <i>adv.</i> No.... ... ... ...	ભાંદું.
આહેપાહે, <i>adv.</i> Around... ... ...	આસપાસ.
આળું, An affix, signifying "full of",... <i>e. g.</i> ઉનાળું, Summer (the season full of heat)... ... ... ...	આળું. ...

Guj. Equiv.

આળી, <i>m.</i> A ploughman.	...	...
આળેણ, <i>f.</i> Laziness, indolence....	...	...
આળેણયું, <i>adj.</i> Lazy, idle.	...	...

હળ.

આળસ.

આળસુ.

**ઈ.**

ઇક, <i>f.</i> A shooting pain.	...	...
, કુટવી, <i>v. i.</i> To shoot ( of a pain )...	...	,,
, સડવી, <i>v. i.</i> To be uneasy (with dat. of person ).	...	,,
ઇક્ક, <i>f.</i> A brick...	...	...
ઇક્કું, <i>n.</i> An egg...	...	...
ઇથાં, <i>adv.</i> Here, hither...	...	...
ઇથાંચાં, <i>adv.</i> Hither and thither.	...	...
ઇમ, <i>adv.</i> Thus...	...	...
ઇમજ, or ઇમુસ, <i>adv.</i> Just so....	...	...
ઇયો, <i>pron.</i> This...	...	...
ઇવું, <i>adj.</i> Such...	...	...

હીક.

,,

,,

...

હીટ.

ઇંકું.

આહી.

આહી તહીં.

એમ.

એમજ.

H. યા.

એવું.

**ગ.**

ગુકળવું, <i>v. i.</i> To boil.	...	...
ગુકળવું, <i>v. t.</i> To boil.	...	...
ગુકળું આવણું, <i>v. i.</i> To boil.	...	...
ગુપીલ, <i>adj.</i> Barren ( land ), fallow.	...	...
ગુઘેડા, <i>m.</i> Manure in a heap...	...	...
ગુઘેણવું, <i>v. t.</i> To root up.	...	...
ગંગ, <i>f.</i> Sleep...	...	...
, આવવી, To feel sleepy ( with dat. of person ).	...	...

ગુકળવું.

ગુકળવું.

ગુકળવું.

ગુખર.

ગુકરોા.

ગુઘેડા.

ગુઘેણવું.

ગંધ.

,,

...

	Guj. Equiv.
ઉગડવું, <i>v. i.</i> To open... ...	ઉધડવું.
ઉગમણું, <i>adj.</i> Eastern, eastward. ( See Gr. § 51 ). ... ...	ઉચમણું. ...
ઉગમણો દેસ, The East. ... ...	„
ઉગતું, <i>v. i.</i> To grow, to rise (as the sun).	ઉગતું.
ઉગતે કીરણજ્યાઅં, At break of day...	ઉગતું+કીરણ.
ઉંગવું, <i>v. i.</i> To sleep. ... ...	ઉધગવું.
ઉગાડ, <i>f.</i> Fair weather, clearing away of rain. ... ...	ઉધાડ.
ઉગાડવું, <i>v. t.</i> To open... ...	ઉધાડવું.
ઉગાડું, <i>adj.</i> Open, exposed. ... ...	ઉધાડું.
ઉગું, ઉગે, ઉગેક, ( See Gr. § 26 ). ...	હોઉ, હોય, હોત.
ઉજળું, <i>adj.</i> Bright. ... ...	ઉજળું.
ઉજાડ, <i>adj.</i> Waste, uninhabited. ...	ઉજાડ.
ઉટકવું, or ઉટકી દડવું, <i>v. t.</i> To polish. ...	ઉટકવું.
ઉટકણો, <i>m.</i> A thistle... ...	ઉટકણો.
ઉકુ, <i>m.</i> A camel. ... ...	ઉંટ.
„ મો ગોવાળ, A camel-keeper... ...	ઉંટ+ગોવાળ.
ઉદ્વતું, <i>v. i.</i> To rise. ... ...	ઉદ્વતું.
ઉદ્વતે ઐહતે, On all occasions ( <i>lit.</i> on rising and sitting). ... ...	ઉદ્વતું+ઐહતું. ...
ઉદ્વાવણું, <i>v. t.</i> To lift up... ...	ઉદ્વાવતું.
પાલ ઉદ્વાવણી, To desert a Pal, to leave in a body. ... ...	„ ...
ઉડવું, <i>v. i.</i> To fly. ... ...	ઉડવું.
ઉડાડવું, <i>v. t.</i> To cause to fly. ... ...	ઉડાડવું.
ઉડાવતું, or ઉડાવણું, <i>v. t.</i> To spend, to squander.	ઉડાવતું.
ઉડાવણુસ, <i>s. n.</i> Extravagance....	ઉડાડ.
„ કરતું, To be extravagant. ...	„

	Guj. Equiv.
ઉધ્યાવસ, <i>adj.</i> Extravagant. ... ...	ઉડાઉ.
ઉદ્ધુ, <i>adj.</i> Deep... ... ...	ઉદ્ધુ.
ઉદ્ધંષુ, <i>adj.</i> Less... ... ...	ઉદ્ધંષુ.
ઉત્તરખું, <i>v.i.</i> To alight,to descend,to cross ( a river)... ... ...	ઉત્તરખું.
ઉત્તરસર, <i>adj.</i> High and low, uneven....	ઉત્તરસર.
ઉત્તરાણુ, <i>n.</i> Festival of the winter solstice. ... ...	ઉત્તરાણુ.
ઉત્તરાવણું, or ઉત્તરાવખું, To shoo away. ...	ઉત્તરાવણું.
ઉતાનણું, <i>n.</i> Driving away sickness by enchantments. ... ...	ઉતાર.
,, કરખું, To remove sickness by enchantments. ... ...	„
ઉતારખું, <i>v.t.</i> To take down, to let down.	ઉતારખું.
ઉતારી પાડખું, To contradict flatly. ...	„
ઉતાવળિ, <i>f.</i> Haste. ઉતાવળિ કરવી, To hurry.	ઉતાવળિ.
ઉતાવળું, <i>adj.</i> Hasty... ...	ઉતાવળું.
ઉદરથ, <i>f.</i> A cough. ... ...	ઉધરસ.
ઉદરો, <i>m.</i> A rat... ...	ઉદર.
ઉદ્ધુ, <i>adj.</i> Upside down. ઉદ્ધુ હમજું, To misunderstand. ... ...	ઉદ્ધંષુ.
,, પડીને ફુલું, To sleep on one's face.	„
ઉદ્ધૈઠ, <i>f.</i> A white ant... ...	ઉધૈ.
ઉન, <i>n.</i> Wool. ... ...	ઉન.
ઉનણી, <i>f.</i> A small sari... ...	*
ઉનાળો, <i>m.</i> The summer. ... ...	ઉનાળો.
ઉનાળો પાટ, <i>m.</i> The summer crop. ...	ઉનાળો+પાટ.
ઉદુ, <i>adj.</i> Warin... ...	ઉદુ.

	Guj. Equiv.
ઉપડતું, v. i. To be lifted up, to rise....	ઉપડતું.
જી નહીં ઉપડતી, One who refuses to answer ( <i>lit. tongue not lifted</i> ).	„
ઉપર, prep. Over, above.... ...	ઉપર.
ઉપરપાટ, adv. Suddenly, unexpectedly.	„
ઉપરી, m. A superintendent. ઉપરી રવેલ, To superintend. ... ...	ઉપરી.
ઉપરું, adj. Upper. ... ...	ઉપરું.
ઉપરે હાથ, adv. To the right, on the right side. ... ...	„
ઉપાડતું, or ઉપાડી લીધું, To pick up, to raise.	ઉપાડી લેતું.
ઉપાદ્યો, m. A troublesome person. ...	ઉપાદ્યિ.
ઉપેજ, f. Income, revenue. ...	ઉપેજ.
ઉખું, adj. Standing, upright. ...	ઉખું.
„ અનાજ, A standing crop... ...	„
„ થાતું, v. i. To rise, to stand up...	„ થતું.
„ રેતું, v. i. To remain standing, to wait. ... ...	„ રહેતું.
ઉણું દીધું, v.t. To winnow. ... ...	ઉલું.
ઉણુંઉણું, adv. Immediately. ... ...	„
ઉણું ને ઉણું આવીને ભાગતું, To demand something at once...	„
ઉમ, m. A sacrifice. ... ...	હેઠ.
ઉમર, f. Age. ... ...	ઉમાર.
ઉમાર, m. Epilepsy. ... ...	અપ્સમાર.
ઉકેખ, f. Sickness ( vomiting ). ...	? ઉલટી.
ઉકેર, f. A tumult. ... ...	ફક્ટર.
ઉસકાવણું, or ઉસકાવતું, v.t. To stir up, to agitate.	ઉસકેરતું.

## Guj. Equiv.

ઉસાઈ, <i>f.</i> Height. ... ... ...	ગુંચાઈ.
ઉસાટ, <i>f.</i> Care, anxiety. ઉસાટમાં પડવું, To be anxious, to be depressed. ...	ઉચ્ચાટ.
ઉસીનું, <i>adj.</i> On loan. ... ... ...	ઉછીનું.
„ આતવું or દીનું, To lend. ... ...	„ આપવું.
„ લીનું, To borrow. ... ... ...	„ લેવું.
ઉસું, <i>adj.</i> High. ઉસું કરવું, To lift up,to raise.	ગાંચું.
ઉસું કરીને લીજવું, To carry away. ...	„
ઉહાહો, <i>m.</i> Rest. ઉહાહો ખાવો, To rest...	વિસામેા.
ઉહીકું, <i>n.</i> A pillow. ... ... ...	ઉસીકું.
ઉંકું, <i>adv.</i> No. ... ... ...	ઉણું.
ઉહો, <i>m.</i> A festival. ... ... ...	ઉત્સવ.

## એ.

એ, Agential, dative, and locative case ending :—By, with, in... ...	એ.
એ, <i>pron.</i> He. She. It. ... ...	એ.
એક, Affix implying indefiniteness... e. g. વીસ, 20 ; વીસેક, about 20. ...	એક.
એક, <i>adj.</i> One. એક ધરીમાં, Suddenly.	એક.
એક દેરો, Once. ... ... ...	એક દેરો.
એક બાધીવાળો, <i>m.</i> A man with only one wife. ... ... ...	એક બાધીવાળો.
એકલ્ય, <i>adj.</i> Only one. ... ... ...	એકલ્ય.
એકલત, <i>adj.</i> Uniform, very good. ...	એકલત.
એકહું, <i>adj.</i> United, together. ... „ કરવું, <i>v. i.</i> To gather together, to collect. ... ...	એકહું. „ કરવું.

Guj. Equiv.	
એકદાં થાવાં, v.i. To meet together, to assemble.	એકદું થતું.
એકરાધ, f. Pride. ... ... ...	? અંડકાર.
એકલું, adj. Single, alone, only, solely.	એકલું.
એકસપાદું, adv. At once. ... ...	એક+સપાટો.
એકલું, adj. Alike. ... ... ...	એકસરખું.
એકાર, m. Pride... ... ...	? અંડકાર.
એકાહનગો, m. The famine of Samvat 1881 (A. D. 1824)...	એકાહાસી. ...
એકાહણું, n. 'A fast for one day. ...	*
એકુજ, adj. Only one, the same. ...	એકજ.
એકેક, pron. Each, one by one. ...	એકેક.
એકે હાતે, adv. At once.... ...	એક+હાથ.
એજ, pron. This very one, the same.	એજ.
એટકું, adj. Together, united...	એકદું.
એઠે, prep. Under, beneath...	હેઠે.
એને, pron. To him, to; it. એને એલે, For this reason. ... ...	એને. ...
એનો, pron. His, her, its. ... ...	એનો.
એભ, f. Shame, disgrace. ... ...	એભ.
એમન, n. Faith. એમન રાખવું, To trust...	ઇમાન.
એમાની, adj. Faithful, trustworthy...	ઇમાની.
એરાન, adj. Perplexed. ... ...	હેરાન.
s. n. Distress, trouble. ...	...
એલમ, m. A prize. ... ...	ઇનામ.
એવાં, adv. Now. એવાં હું, Henceforth.	એવાં.
એવાં તેરે, Sometimes. ... ...	...
એવું, adj. Such, like this. ... ...	એવું.
એહુંવાં ને વેહુંવાં, Hither and thither...	H. યે+વહ.

## એ।

એખર, <i>m.</i> Common ornaments for the arms, hands, legs, and feet...	...	*
એખાળતું, <i>v.t.</i> To vomit... ...	...	...
એખદ, <i>f.</i> Medicine. એખદ કરવી, To treat patients. ... ...	...	એકત્ર.
એખણતું, <i>v. i.</i> To melt, to be melted...	...	એસડ.
એખાળતું, <i>v. t.</i> To melt... ...	...	...
એખાન્યાં, <i>n. pl.</i> Ornaments worn on the upper part of the ear. ...	...	એખાન્યાં.
એજર્ઝ, <i>n.</i> The stomach. ...	...	હોજર્ઝ.
એટકાર, <i>m.</i> Eructation. એટકાર કરવો, To belch.	...	એટકાર.
એટલો, <i>m.</i> A terrace, a mound. ...	...	એટલો.
એટો, <i>m.</i> An outlet. ...	...	એટ.
એઠ or હોઠ, <i>m.</i> The lip... ...	...	હોઠ.
એઠો, <i>m.</i> Shade... ...	...	એથો.
એઠામાં પેહીરેતું, To lie in ambush, to hide.	...	"
એઠતું, <i>v. t.</i> To cover (the body), to put on (clothes). ...	...	એઠતું.
એટેક, <i>f.</i> A clan. ...	...	*
એણુ, <i>adv.</i> This year, the current year.	...	એણુ.
એણું or ઉણું, <i>adj.</i> Less, insufficient...	...	ઉણું.
એતર, <i>f.</i> The North ...	...	ઉત્તર.
એતરાતું, <i>adj.</i> Northern. ...	...	"
એદ, <i>f.</i> An arrow-head. ...	...	*
એદન, <i>adj.</i> Pregnant. ...	...	એધાન.
એદર, <i>n.</i> A cave, a den. ...	...	ઉદર.

	Guj. Equiv.
ઓયડી, <i>f.</i> A room. ... ... ...	આરડી.
ઓરી માતા, <i>f.</i> Measles... ... ...	આરી ભાતા.
ઓરો, <i>m.</i> A heap of grain. ... ...	આરવું.
ઓલવણું or ઓલવી દીવું, <i>v.t.</i> To extinguish.	હોલવવું.
ઓલા, <i>m.</i> Roasted green grain. ...	આળા.
ઓલી or ઓલો, <i>A</i> ringed dove... ...	હોલો.
ઓલીં, <i>n.</i> A back-room. ... ...	આરડીં.
ઓલે, <i>prep.</i> On account of. ... ...	આલે.
ઓસકવું, or આસકી પડવું, <i>v.i.</i> To start (with fright)... ... ...	આચ્કો.
ઓસુ, <i>adj.</i> Less, wanting. ... ...	આછું.
ઓળ, <i>f.</i> A line, a row... ... ...	આળ.
ઓળખવું, <i>v.t.</i> To know, to recognise.	આળખવું.
ઓળખાવવું, <i>v.t.</i> To cause to be known, to introduce ... ... ...	આળખાવવું.
ઓળખિતો, <i>m.</i> An acquaintance, a friend.	આળખિતો.
ઓળખેણું, or ઓળખેણું પાળખેણું, <i>f.</i> Acquain- tanceship, intimacy... ...	આળખાણું.
ઓળગણો, <i>m.</i> A sweeper. ... ...	*

## ક.

કંઈ, <i>pron.</i> Anything. ... ... ...	કંઈ.
કંઈજા, Anything at all. ... ... ...	કંઈજા.
કકળવું, <i>v.i.</i> To grumble. ... ... ...	કકળવું.
કંગાલ, <i>adj.</i> Poor. ... ... ...	કંગાલ.
કંજુઓ, <i>m.</i> A quarrel, a contention in words. ... ... ...	કંજુઓ.

	Guj. Equiv.
કટારા, Name of a Bhil clan at Natara...	...
કટારી, f. A dagger. ...	કટારી.
કરું, n. A piece of cloth. ...	કરું.
કરી, f. Gleanings of corn... ,, વીણવી, To glean....	*
કરોરી, f. A cup, a bowl.	...
કર્જયો, m. A mason...	કર્જયો.
કર્પણ, f. Stubble. ...	કર્પણ.
કર્તૃ, adj. Bitter. કર્તૃ મીઠું, Acid.	કર્તૃ.
કર્તૃ, or કરી ખાતું, v. t. To bite...	કર્તૃ, કરી ખાતું.
કરડો, m. An axe. ...	કરડો.
કરી, f. A hook, a ring... ,, દીવી, To shut a door.	કરી.
કરો, adj. Stern, severe. ..	કરો.
કરો, m. Coarse bamboo-matting. ...	Skr. કરા.
કરોઈ, f. A frying-pan...	કરોઈ.
કરારવું, v. t. To put to flight ...	ઘરેફતું.
કરારી નાહી જવું, To marry into one's own clan, contrary to Bhil custom;toelope.	„
કરણું, n. An ear of corn. ...	...
કરણિક વેળા, adv. Sometime. ...	કરણિક વેળા.
કરણું or કરણુંક, pron. Some, some one...	કરણું.
કરણું ડેકાણું, Somewhere...	...
કતરાક, adj. Several. ...	કેટલાએક.
કતરણ, adj. How much ?..	કેટણું?
કતરોક, કતરીક, કતરણક, adj. Some, a certain quantity of...	કેટણુંએક.

	Guj. Equiv.
કથલો, <i>m.</i> A crab. ... ... ...	કરચણ.
કદર, <i>f.</i> Deception, shamming. ...	*
„ કરવી, To deceive, to sham. ...	...
કદાક or કદાસ, <i>adv.</i> Perhaps... ...	કદાચ.
કંદુછ, <i>m.</i> A sweetmeat seller, a confectioner.... ... ...	કંદોઈ.
કંદોરો, <i>m.</i> A cord worn round the waist by men... ... ...	કંદોરો.
કને, <i>prep.</i> Beside, by, near, with. ...	કને.
કનેહું, From. ... ... ...	...
કન્યાંક, <i>adv.</i> Some time or other. ...	ક્યારે.
કન્યાંતું, <i>adv.</i> How long ago ? Ever so long ago... ... ...	ક્યારતું.
કપૃષ્ટ, <i>n.</i> Hypocrisy, deceit. ...	કપૃષ્ટ.
કપાળ, <i>n.</i> The forehead, fate... ...	કપાળ.
„ સડી જાવું, To have a head-ache. ...	„
કઘણો, <i>m.</i> Charge, possession...	કઘણો.
કઘણમાં કરવું, To suppress, to subdue...	„
કઘીથી, <i>f.</i> The wood-apple tree. ...	કાઢી.
કઘીયું, <i>n.</i> A wood-apple. .. ...	કાઢું.
કમતી, <i>adj.</i> Less, insufficient... ...	કમતી.
કમદી, <i>f.</i> The corinda tree. ...	કરમદી.
કમદું, <i>m.</i> The corinda fruit... ...	કરમદું.
કમાઈ, <i>f.</i> Earnings. ... ... ...	કમાઈ.
કમાડ, <i>n.</i> A leaf of a door. ...	કમાડ.
„ ઢિકું, To close the door... ...	„
કમાણ્યો, <i>m.</i> A cultivator. ...	*
કમાતું, <i>v. t.</i> To acquire, to earn. ...	કમાતું.

	Guj. Equiv.
કરોટો, <i>m.</i> A kind of lizard...	કાંકીઠો.
કરજ, <i>n.</i> Debt... ... ...	કરજ.
કરજદાર, <i>m.</i> A debtor...	કરજદાર.
કરતાં, <i>prep.</i> Than. ... ...	કરતાં.
કરવત, <i>f.</i> A saw. ... ...	કરવત.
કરવું, <i>v.t.</i> To do, to make. ... ...	કરવું.
કરવે, <i>prep.</i> On account of. ... ...	"
કરાં, <i>n. pl.</i> Hail... ... ...	કરાં.
કરાર, <i>m.</i> An agreement. ... ...	કરાર.
કરાવું, <i>v.pass.</i> To be done, to be made.	કરાવું.
કરાવણું, <i>v.caus.</i> To cause, or order, to be done... ... ...	કરાવણું.
કરીને, <i>adv.</i> As... ... ...	કરીને.
કરીને=કહીને, <i>connect. part.</i> By name ( <i>lit.</i> having called)... ... ...	કરીને.
કરી પૂગવું, <i>v.t.</i> To finish... ... ...	કરી પૂગવું.
કરેણ્યો, <i>m.</i> An end-wall. ... ...	કરા.
કરોળ્યો, <i>m.</i> A spider... ... ...	કરોળીયો.
કલડો, <i>m.</i> A partridge (name possibly derived from the sound it makes).	*
કલાંતરો, <i>m.</i> Coming back to life after being at the point of death....	કાળ+અંતર.
„ વળવો, To recover from the point of death (with dat. of person).	„
કલાલ, <i>m.</i> A liquor-seller. ... ...	કલાલ.
કલી, <i>f.</i> A tickling sensation. ... ...	કલી.
„ કરવી, To tickle. ... ...	...
કખરવું, <i>v. t.</i> To scratch. ... ...	ખુખરવું.

	Guj. Equiv.
કસડપસડ, <i>adv.</i> In a state of dirt and disorder. ... ... ...	કિચડબિચડ. ...
કસર, <i>f.</i> An omission... ... ...	કસર.
„ પડવી, To fall short. ... ...	... ...
કસરતું, <i>v.t.</i> To tread down, to trample down. ... ... ...	કચરતું. ...
કસરો, <i>m.</i> Rubbish. ... ... ...	કચરો.
કસરો, <i>m.</i> A feverish cold. ... ...	*
કણારો, <i>m.</i> A copper-smith, an ornament-maker. ... ... ...	કંસારો. ...
કહેટ, <i>f.</i> Scarcity. ... ... ...	? ખોટ.
કહેટવેઠો, <i>m.</i> A miser... ... ...	”.
કહોળખેમ, <i>m.</i> Comfort, pleasure. ...	કુશળ+ખેમ.
કળગસ, <i>f.</i> The world... ... ...	ખલકત.
કળતર, <i>n.</i> Rheumatism... ... ...	કળતર.
કળથી, <i>f.</i> A certain grain. ... ...	કળથી.
કળતું, <i>v.i.</i> To be painful, to ache. ...	કળતું.
કળાંમેણું, <i>f.</i> The banks of clouds which float from S. W. to N. E. before the Monsoon breaks. ...	કળા+મેણ. ...
કળાઙુઆ, Name of a Bhil clan at Kagdar.	... ...
કળેકળે, <i>adv.</i> Gradually, gently. ...	કળા.
કાઈ, <i>pron.</i> Something, anything. Some, any.... ... ... ...	કાઈ. ...
„ નથી, Nothing, none, no one. ...	કાંઈ નથી.
કાઉ or કાઉડા, A term of endearment to a child. ... ... ...	* ...
કાકડી, <i>f.</i> A cucumber... ... ...	કાકડી.

	Guj. Equiv.
કાકી, <i>f.</i> An aunt (father's younger brother's wife). ... ...	કાકી. ...
કાકો, <i>m.</i> An uncle(father's younger brother)	કાકો.
કાખ, <i>f.</i> The arm-pit... ... ...	કાખ.
કાગડો, <i>m.</i> A crow. ... ... ...	કાગડો.
કાગદ, <i>m.</i> A letter. કાગદકરવો, To write a letter.	કાગળ.
કાગલો, <i>m.</i> Tonsillitis. ... ... ...	કાકડો.
કંગડી, <i>f.</i> Gravel... ... ...	કંગરી.
કંગણી, <i>f.</i> A hair-comb... ... ...	કંસકી:
કાટ, <i>m</i> Form, build (rarely used except in Loc). e.g. કાટમાં ડીક હે. He is well-built.	ધાર. ...
કાટવું મેલવું or દાવું, <i>v. t.</i> To leave a piece of cloth at the burning-ground for the use of the departed in the next world. ... ...	* ... ... ...
કાંઠો, <i>m.</i> A thorn. ... ... ...	કાઠો.
કાદું, <i>n.</i> A feast twelve days after death.	કાયદું.
,, કરવું, To give a feast twelve days after the death of a relative...	„ ...
કાદું, <i>adj.</i> Strong, firm... ... ...	કાદું.
કાડો, <i>m.</i> A hard man, a miser... ...	... ...
કાંડો, <i>m.</i> The bank of a river... ...	કાંડો.
કાડવું, <i>v.t.</i> To take, or put out; to spend (of time)... ... ...	કાડવું. ...
કાટજું, <i>n.</i> Chana-straw... ... ...	કાદું.
કાણ્ણારાઈલો, <i>m.</i> Name of the mythical sweeper who is supposed to cause lunar eclipses by standing	કૃષ્ણ+રાવ. ...

## Guj. Equiv.

in front of the moon to claim from her the payment of a debt.	...	...
કાણું, <i>n.</i> A hole. કાણું પાણું, To perforate.	કાણું.	કાણું.
કાતર, <i>f.</i> Scissors. ... ... ...	કાતર.	કાતર.
કાતરો, <i>m.</i> A horse's mane. ... ... ...	*	*
કાતી, <i>m.</i> November-December. ...	કારતક.	કારતક.
કાંનો તાવ, <i>m.</i> Intermittent fever. ...	એકાનો તાવ.	એકાનો તાવ.
કાચળી, <i>f.</i> A cocoa-nut shell... ...	કાચળી.	કાચળી.
કાદવ, <i>f.</i> Mud... ... ...	કાદવ.	કાદવ.
કાંડો, <i>m.</i> A bulb (like an onion in shape and smell ). ... ... ...	કાંડો.	...
કાન, <i>n.</i> The ear. ... ... ...	કાન.	કાન.
કાનતી જુરી, The lobe of the ear. ...	કાન+જુરી.	કાન+જુરી.
કાનાહારવેલ, <i>m.</i> A centipede... ...	? કાનખજુરો.	?
કાપડું, <i>n.</i> A bodice. ... ... ...	કાપડું.	કાપડું.
કાપવું, <i>v. t.</i> To cut. ... ... ...	કાપવું.	કાપવું.
કાપી દાવું, <i>v. t.</i> To cut off, to cut down.	કાપી નાખવું.	કાપી નાખવું.
કાંપણું, <i>v. i.</i> To shiver... ... ...	કાંપવું.	કાંપવું.
કાંબડી, <i>f.</i> A split bamboo (for matting).	કાંમડી.	કાંમડી.
કાંખડો, <i>m.</i> Thick split bamboo (for roofing).	"	"
કાખરં, <i>adj.</i> Variegated. <i>s.n.</i> The <i>maina</i> bird.	કાખરં.	કાખરં.
કાખરો, <i>s. m.</i> A white leper... ...	"	"
કાખ, <i>v.</i> Work, business. ... ...	કાખ.	કાખ.
,, કરવા લાગવું. To help to do work...	"	"
કામતું, <i>adj.</i> Useful. કામતું હોઇ, <i>adj.</i> Active, energetic. ... ... ...	કામતું.	...
કામજ્યા, <i>m. pl.</i> Wedding-anklets. ...	કાંખી.	કાંખી.
કાંખડી, <i>f.</i> A bow. ... ... ...	કાંખડું.	કાંખડું.

	Guj. Equiv.
	Skr. कंकृ.
કામળી, f. A bangle worn on the fore-arm... ... ...	... કામળા.
કામળો, m. A blanket... ... ...	કામળે.
કાંધણે, m. A barber... ... ...	કાયર.
કાયર or કાયલ, adj. Helpless, tired out.	કાયા.
કાયા, f. The body. ... ... ...	કારબારી.
કારબારી, m. A manager. ... ... ...	કાલ, કાળે.
કાલ or કાલે, adv. Yesterday,to-morrow.	કાલનું.
કાલનું, adj. Of yesterday, of to-morrow.	કાલની વાત,That which happened yesterday, or will happen to-morrow.
કાવ, m. An agreement. કાવ કરવો, To settle, to arrange... ... ...	... કાયદો.
કાવડણ્યાં, n. pl. Imperial copper coins.	? કોરી.
કાસ, m. Glass... ... ...	કાચ.
કાંસળી, f. A shell. The half of a cocoanut shell. ... ... ...	કાચલી.
કાસું, adj. Imperfect, raw. ... ... ...	કાચું.
કાંગણી, See કાંગણી. ... ... ...	કાંસકી.
કાંહણી, m. A farm-labourer. ... ... ...	કરશણી.
કાંઠ, n. Bell-metal. ... ... ...	કાંસું.
કાંહેટ, f. A bell fastened to the neck of cattle... ... ...	" ... કાળ.
કાળ, m. Time, death, famine. ... ... ...	કાળજી.
કાળજી, n. The liver. ... ... ...	કાળજી.
કાણું, adj. Black. ... ... ...	કાણું.
કાણું કાણું થાણું, To frown, to be angry.	"
કાળે પાણી ઉતારવી દીણું, To transport. ...	કાળા પાણી.

	Guj. Equiv.
કીકલી, <i>f.</i> The Bhil war-cry (pron. “ kilki ” by Europeans).	કીકલી.
„ કરવી, To sound the war-cry.	„
કીડલો, <i>m.</i> A weevil that bores into wood.	કીડલો.
કીરી, <i>f.</i> An insect.	કીરી.
કીડુઓ, <i>m.</i> A hay-stack.	કુદું.
કીમ ? or કેમ ? How ? કીમતું ? Whither.	કેમ ?
કીમકે or કેમકે, <i>conj.</i> Because...	કેમકે.
કીરણુ, <i>n.</i> A ray of the sun. [See Gr. § 5 c.].	કીરણુ.
ઉગતી કીરણજ્યાંમાં, At day-break.	„
કીનું ? <i>adj.</i> Of what kind ?	કેનું ?
કુઆરી, <i>f.</i> A maiden. કુઆરી કન્યા, Queen Victoria.	કુવારી.
કુઆરો, <i>m.</i> A bachelor.	કુવારો.
કુછડી or કુઅડી, <i>f.</i> A muzzle.	*
„ „ ખાંદવી or માંદવી, To muzzle (an ox).	„
કુછડો, See કોયડો...	કોયડો.
કુઅડ, <i>m.</i> A large owl (whose cry is much disliked by the Bhils)...	ધુઅડ.
કુએર, <i>m.</i> A prince.	કુંવર.
કુએરી, <i>f.</i> A hole made in a river-bed for drinking water to flow into...	કુએરો.
કુકડી, <i>f.</i> A hen.	કુકડી.
કુકડો, <i>m.</i> A cock. કુકડો ઐલે, Early morning, <i>lit.</i> at cock-crow.	કુકડો.
કુક, A sound made in calling a dog.	*

	Guj. Equiv.
કુગરો, <i>m.</i> A little bell...	બુધરો.
કુગાંડા, <i>m.</i> Husks of grain.	*
કૃત્વં, <i>v. t.</i> To beat the breast...	કૃટ્વં.
કૃટેલ, <i>adj.</i> Disobedient, obstinate.	કૃટિલ.
કુંડળું, <i>n.</i> A circle.	કુંડળું.
કુંકું, <i>n.</i> A basin.	કુંકું.
કુણ્ણી, <i>f.</i> The elbow.	કેણ્ણી.
કુતરી, <i>f.</i> A bitch. કુતરીનો ખદો, A mushroom.	કુતરી.
કુતરો, <i>m.</i> A dog.	કુતરો.
કુતું, <i>n.</i> Assessment on the produce of land.	*
કુંભાર, <i>m.</i> A potter.	કુંભાર.
કુંભી, <i>f.</i> A pillar.	કુંભી.
કુરાડ, <i>m.</i> A witch-finder, a sorcerer...	*
કુરી, <i>f.</i> A certain kind of grain.	*
કુવો, <i>m.</i> A well.	કુવો.
કુસી, <i>f.</i> A key...	કુચી.
કુઠું, <i>adj.</i> Opening (of plants &c.) . young, growing...	કુઠી.
કુળાખેાર, About 11 A. M.	કળી+ખેાર.
કે, <i>conj.</i> Or (used as disjunctive in alternate questions).	કે.
કેન્યાગરે, <i>adj.</i> Obedient...	...
કેજયુ, <i>Past Part.</i> Said, ordered.	કેજયુ+કરનારું.
,, કામ કરું or કેજયુ માનતું, To obey...	કેજયુ.
કેજયામાં રેનું, To submit, to be obedient.	"
કેડ, <i>f.</i> The waist. કેડ તોડવી, To work hard.	કેડ.
,, ખાંદવી or માંદવી, To gird up the loins, to get ready.	"
	...

## Guj. Equiv.

કુણું, To carry a child on the hip.	કૃત્તું.
કેળું, n. A small bamboo. ... ...	*
કેદ, m. or કેદારું. n. A jail... ...	કેદ.
કેડી, m. A prisoner. ... ...	કેડી.
કેનો ? pron. Whose ? કેને ઓછો ? For what reason ?...	કેનો.
કેરી, f. A mango. ... ...	કેરી.
કેરે ? adv. When ? ... ...	ક્યારે ?
કેરેક or કેરેક કેરેક, adv. Sometimes. ...	„
કેવત, f. A saying, a proverb... ...	કેવત.
કેવું ? adj. Of what sort ? ... ...	કેવું ?
કેવું, v.t. To say, to tell. ... ...	કહેવું.
કેસર, m. Saffron. ... ...	કેસર.
કેસરીઓ, A name given to the temple and the town of Rishabh-nath.	કેસરી.
કેહું ? ( કેહો ? કેલી ? કેહાં ? ) Whence ? ...	આંથી ?
કેહાર, m. Saffron. ... ...	કેસર.
કેળ, m. Mud. ... ...	કિચલ.
કેળ, n. The plantain tree. ... ...	કેળ.
કેળું, n. A plantain. ... ...	કેળું.
કુઅદરીલું, adj. Indolent. ... ...	કુઅદર.
કુઅરી, See કુઅરી. ... ...	કુવારી.
કોઈ, pron. Some, any... ...	કોઈ.
કોએક, pron. Some one... ...	કોએક.
કોકાંકું, adj. Ill-formed, ugly... ...	કુધાર.
કોગળું, n. Cholera. ... ...	કોગળીંગ.
કોગળો, m. The throat... ...	ઘોખળો.
„ કરવો, To gargle... ...	„

## Guj. Equiv.

કેગળા મર્થી દડવો, To seize by the throat, to choke. ... ...	શૈખળા. ...
કેગોડા મેરા, m. The black pheasant... કેળી, n. The Seven Sisters bird. ...	કુ+ગોંડા+મેરા. કેળી.
કેંધે આરું, To pour in torrents, to blow fiercely. ... ...	Skr. કટ+આર
કેટ, f. A coat... ... ...	Coat.
કેટ, f. A fort, a city wall... ...	કેટ. ...
કેટ; m. A grey snake. ... ...	કેટ.
કેઠાર, m. A granary... ... ...	કેઠાર.
કેઠારી, m. One who has charge of a કેઠાર. કેઠારી, f. A large earthen vessel for hold-	કેઠારી.
ing grain. A flat-roofed bungalow.	કેઠારી. ...
કેઠાડ, f. Leprosy. ... ... ...	કેઠાડ.
કેઠી, f. A small shell, a cowry. ...	કેઠી.
કેઠું, n. A large shell... ... ...	કેઠેડિયું.
કેલ્ચાળું, adj. Leprous. કેલ્ચો, s.m. A leper.	કેઠી.
કેણું? pron. Who? કેણું જણે, Perhaps (lit. Who knows?) ... ...	કેણું. ... ...
કેથલી, f. A bag. ... ... ...	કેથલી.
કેથલો, m. A sack. ... ... ...	કેથલો.
કેદરા, m. A certain kind of grain... કેદાળો, m. A pick-axe with one	કેદરા. કેદાળો.
prong. ... ... ...	... ...
કેમદ્યાળું, adj. Cruel. ... ... ...	કુ+દ્યાળુ.
કેમાનીહું, adj. Hard-hearted... કેયડો, m. A whip, a scourge...	કુ+માનહું. કેયડો.
કેયડો મારવો, To scourge. ... ... ...	"
કેયલા, m. Charcoal. ... ... ...	કેયલા.

## Guj. Equiv.

કોર, <i>f.</i> An edge, a border, a brim...	કોર.
કોરવું, <i>v. t.</i> To carve, to scoop out...	કોરવું.
કોરાળ, <i>adj.</i> Displeased... ... ...	કુરાળ.
કોરાડ, <i>m.</i> A stable. ... ... ...	થોડાર.
કોરં, <i>adj.</i> Dry, unused... ... ...	કોરં.
કોરું કરવું, To dry. ... ... ...	"
કોરો કાગદ, Blank paper. ... ... ...	કોરો કાગજ.
કોરણું, <i>f.</i> A hurricane... ... ...	કોરણુ.
કોલ, <i>m.</i> An agreement. ... ... ...	કોલ.
કોલ કરવો, To promise. ... ... ...	"
કોલ, <i>f.</i> A small crowbar. A leather bucket. A distance of from two to three miles. ... ... ...	કોસ.
કોળી, <i>f.</i> A small quiver. ... ... ...	...
કોળું, <i>n.</i> A red pumpkin. ... ... ...	કહોળું.
ક્રાં? <i>adv.</i> Where? ... ... ...	ક્રાં?
ક્રાંક, <i>adv.</i> Somewhere... ... ...	ક્રાંકે.
ક્રાડી, <i>f.</i> A square piece of land, under cultivation, banked round so as to hold water.... ... ...	ક્રાડી.

## ૪

ખખડવું, <i>v. i.</i> To rattle... ... ...	ખખડવું.
ખખડાવણું, <i>v. t.</i> To rattle. ... ... ...	ખખડાવવું.
હાંકળી ખખડાવણી, To rattle the door chain (to seek admission). ...	...
ખખલવું or ખખલી જવું, <i>v. i.</i> To crumble, to fall to pieces. ... ... ...	ખખરી જવું.
ખણું, <i>adj.</i> Rough. ... ... ...	*
ખેઠ, <i>f.</i> The poppy-seed. ... ... ...	ખસખસ.

## Guj. Equiv.

અજુરાં, <i>n. pl.</i> The date fruit...	...	અજૂર.
અજુરી, <i>f.</i> The date-palm. ....	...	અજૂરી.
અટપદ, <i>f.</i> Intrigue. ....	...	અટપદ.
અટલો, <i>m.</i> Household property. ....	...	અટલો.
અ'સ, <i>m.</i> A division of the globe. ....	...	અ'સ.
અડક, The name given to the Kher-wara district. ....	...	...
અડખુને, <i>m.</i> A water-melon. ....	...	અડખુને.
અડા, <i>f.</i> Rezin. ....	...	*
અંતોડા, <i>m.</i> Hiring cattle for ploughing land under a certain agreement.		કંધોડા.
અણુઅણુણું, <i>n.</i> Twilight....	...	અણુઅણુણું.
અણુણું, <i>v.t.</i> To dig. ....	...	અણુણું.
અણુહોં, <i>m.</i> Care, attention. ....	...	*
,, રાખવો, To be careful, to apply oneself (to study &c). ....	...	...
અપ, <i>m.</i> Use, demand (gen. used in Loc. case, e. g. અપમાં હે, It is in use, in demand).	...	અપ.
અપવું, <i>v.i.</i> To be used, to be in demand.		...
અપર, <i>f.</i> News. ....	...	અપર.
અપર પુસવી or ધીવી, To enquire. ....	...	...
,, રાખવી, To look after, to take an interest in (with Gen.)...		"
અપરદાર, <i>interj.</i> Beware ! take care !....		અપરદાર.
અભોં, <i>m.</i> The shoulder. ....	...	અભોં.
અરસ, <i>m.</i> Expense, expenditure. Marriage or funeral expenses.	...	અરસ.

	Guj. Equiv.
અરસ કરવો, To spend....	અરચણ કરવો.
અરવું, v.i. To fall off (as leaves).	અરવું.
અરહાડ, f. Foot and mouth disease...	? અરી+સાડવું.
અરાડી, Name of a Bhil clan at Kherbo.	...
અરી, f. A hoof...	અરી.
અરેલી પડવું, v.i. To collapse, to crumble away...	અરવું.
અરે, adj. True...	અરે.
અરેઅરે, adj. Real. adv. Truly, certainly.	અરેઅરે.
અરેરોા, m. A curry-comb.	અરેરોા.
અલી, f. A squirrel.	અસકોલી.
અવડાવણું, v.t. To feed...	અવડાવવું.
અળું, n. A threshing-floor.	અળું.
આઈનજું, v.t. To eat up, to peculate...	આઈ નજું.
આખરો, m. A certain tree.	આખરો.
અંટ, m. Name of an agricultural caste in Idar State.	...
આટલો, m. A bed-stead.	...
અટખામાં પડ્યાનું ને પડ્યાનું રેવું, To be confined to bed...	આટલો.
આદું, adj. Sour. આદું ખર, Very sour...	ાદું.
અસ, f. Sugar.	અંડ.
અંડું, adj. Broken, bruised.	અંડું.
આડો, m. A pit...	આડો.
આડાકુરસ્ય, f. Uneven-ground...	...
અંણું, f. A mine, a quarry.	અંણું.
આતર, f. A breach in a wall...	આતર.

	Guj. Equiv.
આતર પાડવી, To commit burglary. ....	આતર પાડવી.
આતર, <i>n.</i> Manure. ....	આતર.
આતરી, <i>f.</i> Assurance. ....	આતરી.
આતરીહું વસન દીવું, To promise faithfully.	"
આદી, <i>f.</i> Coarse cotton cloth....	આદી.
ઘાંદ, <i>n.</i> The hump on the back of an ox.	ઘાંધ.
આખળી, <i>f.</i> A drum-stick. ....	*
આર, <i>m.</i> Malice. આર કરવો, To shew malice.	આર.
આરી, <i>f.</i> Salt (of an inferior kind). ....	"
આલ, <i>f.</i> A skin, a hide. ....	આલ.
આલી, <i>adj.</i> Empty, vain, vacant. ....	આલી.
,, જગા, <i>f.</i> Vacancy... ....	"
આવાતું, <i>n.</i> Food, victuals. ....	આવાતું.
આતું, <i>v.t.</i> To eat. ....	આતું.
ઘાંઢી, <i>f.</i> or ઘાંઢું, <i>n.</i> A shoe, a slipper.	આસંદુ.
આહલાદ, <i>f.</i> Land held direct from Government, or land of which the State is sole proprietor. ....	આલસા. ....
ખીખી, <i>f.</i> Giggling. ....	ખીખી.
ખીજવતું, <i>v.t.</i> To provoke. ....	ખીજવતું.
ખીલ, <i>m.</i> A pimple. ....	ખીલ.
ખીલો, <i>m.</i> A nail. ....	ખીલો.
ખુટું or ખુરી જવું, <i>v.i.</i> To be lacking, to be insufficient, to fall short. ....	ખુટું. ....
ખુડું, <i>adj.</i> Insufficient .....	ખુરવું.
ખુંદી, <i>f.</i> A peg, a stake. ....	ખુંગી.
ખુણો, <i>m.</i> A corner. ....	ખુણો.

				Guj. Equiv.
ખુદ્વં, v.t. To vaccinate...	...	...	...	ખોદ્વં.
ખુદારો, m. A vaccinator.	...	...	...	"
ખુની, m. A murderer...	...	...	...	ખુની.
ખુઅ, adv. Much, very ..	...	...	...	ખુઅ.
ખુલાસો, m. Explanation.	...	...	...	ખુલાસો.
ખુલાસો કરવો, To explain.	...	...	...	...
ખુલું, adj. Open.	...	...	...	ખુલું.
ખેખી,f. A silver fox (the name possibly derived from the sound it makes).	...	...	*	...
ખેડું, v. t. To till. ખેડવા હરકું, Arable.	...	...	...	ખેડું.
ખેતર, n. A field.	...	...	...	ખેતર.
ખેતી, f. Agriculture, cultivation.	...	...	...	ખેતી.
ખેપ, f. An effort.	...	...	...	ખેપ.
ખેપ કરવી, To work diligently...	...	...	...	...
ખેર, interj. Well ! No matter !	...	...	...	ખેર.
ખેર, n. The <i>minosa catechu</i> tree.	...	...	...	ખેર.
ખેહ, f. Dust.	...	...	...	ખેહ.
ખેહ or ખેહડો, n. Itch.	...	...	...	ખસ.
ખેહવણું, v. t. To push....	...	...	...	ખસણું.
ખો=ખાઓ, Eat (ye).	...	...	...	ખાઓ.
ખોટ, f. A mistake, a blunder.	...	...	...	ખોટ.
ખોટી,f.Delay, ખોટી કરવી,To keep waiting.	...	...	...	ખોટી.
ખોઢું, adj. Untrue, false, bad...	...	...	...	ખોઢું.
ખોટા હમ ખાવા, To swear falsely.	...	...	...	ખોટા સમ ખાવા.
ખોડ, f. A defect, a blemish.	...	...	...	ખોડ.
ખોડવું, v. t. To rake.	...	...	...	ખોડવું.
ખોડાવું, v. i. To limp.	...	...	...	ખોડાવું.
ખોડી, f. A rake.	...	...	...	ખોડવું.

## Guj. Equiv.

ઘોડીખાજું, <i>n.</i> A stile.	...	...	*
ઘોડું, <i>adj.</i> Lame.	...	...	ઘોડું.
ઘોબો, <i>m.</i> The two hands full.	...	...	ઘોબો.
ઘોમણી, <i>f.</i> Jeering.	ઘોમણી પાડવી, To jeer.	...	*
ઘોરવું, <i>v. t.</i> To fashion, to shape.	..	..	ઘોરવું.
ઘોરાક, <i>m.</i> Good food.	...	...	ઘોરાક.
ઘોલડી, <i>f.</i> An umbrella made of leaves.	...	...	ઘોલ.
ઘોલવું, <i>v. t.</i> To open....	...	...	ઘોલવું.
ઘોલું, <i>n.</i> A shelter made of leaves to sit under in the fields when watching the crops.	...	...	ઘોલ.
ઘોલું, <i>n.</i> A young donkey.	...	...	...
ઘોલેહું, <i>adj.</i> Evident.	...	...	*
ઘોલો, <i>m.</i> A donkey.	...	...	ઘોલેહું.
ઘોવાઈ જતું, <i>v. pass.</i> To be lost.	...	...	*
ઘોવું, <i>v. t.</i> To lose.	...	...	ઘોવું.
ઘોળદ્યું or ઘોળીજા, <i>n.</i> The body.	...	...	ઘોળદ્યું.
ઘોળેતર, <i>adj.</i> Adopted,	ઘોળેતર લીવું, To adopt.	...	ઘોળેતર.
,, કુએર,	An adopted prince.	...	,, + હુંવર.
,, સોરો,	An adopted son.	...	,, + હોકરો.
ઘોળો, <i>m.</i> The lap.	...	...	ઘોળો.
ઘાલ, <i>m.</i> A scheme, imagination.	...	...	ઘાલ.

## ગુ

ગાઉ, <i>m. pl.</i> Wheat.	...	...	ધાઉ.
ગંગાળ, <i>adj.</i> Poor.	...	...	કંગાલ.

			Guj. Equiv.
ગાજાય, <i>m.</i>	Violence, oppression.	A	ગાજાય.
wonder...	... ...	...	...
ગાજવેલ, <i>f.</i>	Steel.	...	ગાજવેલ.
ગાટન્યો, <i>m,</i>	A dwarf, a little man.	...	ઘટવું.
ગડ, <i>m.</i>	Smoke...	...	ગિરદ.
ગડુંહ, <i>n.</i>	A snake.	...	*
ગણ્ય, <i>n.</i>	An eclipse.	...	ગ્રહણ.
ગણ્યાણું, <i>n.</i>	See ગણ્ય.	..	ધરેણું.
ગણ્યતરી, <i>f.</i>	A calculation, an estimate.		ગણ્યતરી.
„ કરવી, To calculate.	...	...	”
ગણ્યતું, <i>v. t.</i>	To count, to reckon.	...	ગણ્યતું.
ગઢોા, <i>m.</i> ગઢેડી, <i>f.</i> ગઢેકું, <i>n.</i>	A donkey...		ગધેડોા.
ગનર્ભ, <i>n.</i>	An ornament(of silver or gold).		ધરેણું.
ગનશ્ય, <i>adj.</i>	In pawn, pledged.	...	ધરેણું.
ગનશ્ય મેલવું, To pledge.	...	...	”
ગનો, <i>m.</i>	A fault.	...	ગુનો.
ગપ, <i>f.</i>	Rumour, gossip.	...	ગપ.
„ આકફી or ભારવી,To spread idle reports.			”
ગઢ્યાધ, <i>f.</i>	Negligence.	...	ગઢ્યાધત.
ગમ, <i>f.</i>	Understanding.	...	ગમ.
ગમદ્યંનું, <i>n.</i>	A waist-band.	...	? કમરાંપદ્યા.
ગમતું, <i>v. t.</i>	To be pleasing.	...	ગમતું.
ગમે તીમ કરીને, No matter how.	...	...	ગમે તેમ કરીને.
ગમાર, <i>m.</i>	A boor.	...	ગમાર.
ગમેતી, <i>m.</i>	A village-chief.	...	? ગામપતિ.
ગર્ગેડ, <i>f.</i>	The back-bone.	...	*
ગર્જ, <i>f.</i>	Need.	...	ગર્જ.
ગરજ, <i>adj.</i>	Needful.	...	”

	Guj.	Equiv.
ગરથ, <i>m.</i> Money. ... ... ...	ગરથ.	
ગરદ, <i>m.</i> A vulture. ... ... ...	ગરદ.	
ગરભો, <i>m.</i> The song sung at the Dasara festival. ... ... ...	ગરભો.	
,, રમવો, To sing the Dasara song, with dancing and clapping of hands.	...	ગરભો રમવો.
ગરાસ્યો, <i>m.</i> A Grassia (a caste somewhat higher than that of the Bhils).	...	ગરાસ્યો.
ગરી પડું, <i>v. i.</i> To fall... ...	H. ગિરના.	
ગરીપરવર, <i>interj.</i> A form of salutation ( <i>lit.</i> Cherisher of the poor)...	ગરીધુ+પરવર.	
ગરીધ, <i>adj.</i> Poor, meek, humble. ...	ગરીધ.	
ગરીધાઈ, <i>f.</i> Meekness, poverty. ...	ગરીધાઈ.	
ગરૂડી, <i>f.</i> The wife of a ગરૂડો... ...	ગરૂડી.	
ગરૂડો, <i>m.</i> A priest who officiates for the weaver caste. ... ...	ગરૂડો.	
ગરેડી, <i>f.</i> A pulley. ... ... ...	ઘરેડી.	
ગલાખ, <i>m.</i> A rose. ... ... ...	ગુલાખ.	
ગલાખૂનયુ, <i>adj.</i> Pink. ... ... ...	ગુલાખી.	
ગલી or ગળી, <i>f.</i> A street. ... ...	ગલી.	
ગવાઈ, <i>m.</i> A witness... ...	ગવાહી.	
ગવાળ or ગોવાળ, <i>m.</i> A cowherd. ...	ગોવાળ.	
ગળજાખી, <i>f.</i> A throat disease among cattle. Quinsy ... ...	ગણજાખ.	
ગળદ્યુ, <i>adj.</i> Sweet. ... ... ...	ગળદ્યુ.	
ગળવું, <i>v. i.</i> To trickle through. ...	ગળવું.	
v. <i>t.</i> To swallow. ... ...	...	

## Guj. Equiv.

ગળાંખ રાત, <i>f.</i> A certain time of the night—about 2 a. m. ...	*
ગળાસું, <i>n.</i> The period from 3 to 5 p.m.	...
નાનું ગળાસું, 4 p. m... ...	...
મોહું ગળાસું, 3 p. m... ...	...
ગળું, <i>n.</i> The throat. ... ... ..	ગળું.
ગાઉ, <i>m.</i> A distance of a mile and a half.	ગાઉ.
ગાંગડવું, <i>v. i.</i> To make a gurgling sound (as a camel). ... ...	ગાંગડવું.
ગાજવું, <i>v. i.</i> To thunder. ... ...	ગાજવું.
ગાંઝે, <i>m.</i> Dried hemp flowers... ...	ગાંઝે.
ગાંઠી, <i>f.</i> A low mountain-pass. ...	ધાર.
ગાંટો, <i>m.</i> A high mountain-pass. ...	„
ગાકું દાવું. See કાકું દાવું. ... ...	*
ગાંઠ, A knot. ગાંઠ વાળવી, To make a knot.	ગાંઠ.
ગાંઠડી, <i>f.</i> A bundle. ... ... ...	ગાંઠડી.
ગાડકું, <i>n.</i> A sheep. ... ... ...	ગાડકું.
ગાડવો, <i>m.</i> The smaller of the two water pots which women carry on their head.[The larger one is called બોળી, and the two together are called ઘેણું].	ગાડવો.
ગાંઢું, <i>adj.</i> Mad, crazy... ... ...	ગાંઢું.
ગાંડી ભાંગ, An intoxicating tobacco...	...
ગાણ્યું, <i>n.</i> A song. ... ... ...	ગાણ્યું.
ગાંનધું, <i>n.</i> A large earthen vessel...	*
ગાંફળ, <i>adj.</i> Careless. ... ... ...	ગાંફલ.
ગાણેર, <i>f.</i> The neck. ... ... ...	? શીવા.
ગાણો, <i>m.</i> A rag. An ear of Indian corn.	ગાણો.

	Guj. Equiv.
ગામ, <i>n.</i> A village. ... ...	ગામ.
ગામેગામો ફરવું, To wander from village to village... ...	„ ...
ગાયરી, <i>m.</i> A shepherd... ...	ગાડર.
ગાયરો, <i>m.</i> A ram. ... ...	„ ગાર.
ગાર, <i>f.</i> A mixture of cow-dung, earth and water for keeping...	...
ગાલ, <i>m.</i> The cheek. ... ...	ગાલ.
ગાળ or ગાળી, <i>f.</i> Abuse. ગાળ દીવી, To abuse.	ગાળ.
ગાળવું, <i>v. t.</i> To strain... ...	ગાળવું.
ગીર, <i>n.</i> Blight on corn. ... ...	ગેર.
ગુઘેડ, <i>m.</i> A large owl... ...	ધૂઅડ.
ગુણરો, <i>m.</i> Maintenance. ... ...	ગુણરો.
ગુણું, <i>n.</i> A pocket. ... ...	ગાજવું.
ગુડી, <i>f.</i> The knee. ગુડી વાળવી, To kneel.	ધુંધળી.
ગુડન્યે ગુડન્યે હીડવું, To crawl (like a child).	„
ગુણું, <i>m.</i> Kindness. ગુણું ભાનવો, To be grateful, to thank. ... ...	ગુણું. ...
ગુદરવું, <i>v.i.</i> To pass by, to happen. To die.	ગુજરવું.
ગુદરેલી વાત, A thing that has happened.	„
ગુનો, <i>m.</i> A fault, a sin. ... ...	ગુનો.
ગુખું, <i>n.</i> An abscess.... ...	ગુમકું.
ગુમાર, Name of a Bhil clan in the Bhanswara district. ... ...	...
ગુર, <i>m.</i> A spiritual guide. ... ...	ગુર.
, કરવો, To have a <i>guru</i> as a spiritual guide by paying certain fees...	„ ...

		Guj. Equiv.
ગેઅાન, <i>n.</i> Knowledge....	...	ગ્યાન.
ગેઅાન હીકવણું, To preach.	...	”
ગેટી, <i>f.</i> A sheep. ગેટા, <i>m.</i> A ram.	...	ઘેટું.
ગેર, <i>n.</i> A house.	...	ઘર.
,, કરીને કામ કરવું, To attend to one's own business.	...	”
ગેરાન્જર, <i>adj.</i> Absent...	...	ગેરાન્જર.
ગેલો, <i>m.</i> A track, a foot-path.	...	*
ગેલે ગેલે, By, or along, the foot-path...	...	...
ગેહેડા, <i>m.</i> A club, a cudgel.	...	ગદા.
ગોઅાળ or ગોવાળ, <i>m.</i> A cowherd.	...	ગોવાળ.
ગોઅાળેણુ or ગોવાળેણુ, <i>f.</i> A cowherdess...	...	ગોવાળેણુ.
ગોઅેડ, <i>f.</i> A herd of cattle.	...	*
ગોખ્લો, <i>m.</i> A nest.	...	ગોખ્લો.
,, <i>m.</i> A niche in a wall.	...	”
ગોઠ, <i>f.</i> A feast. A present given at the <i>Holi</i> festival.	...	ગોઠ.
ગોઠો, <i>m.</i> A friend, a companion....	...	...
ગોાડ, <i>m.</i> An incline.	...	*
ગોડાડામેર, Name of a Bhil clan at Dhankawara.	...	...
ગોદું, <i>n.</i> A mattress....	...	ગોદું.
ગોઝણુ, <i>f.</i> A sling.	...	ગોઝણુ.
ગોઝણુવણું or ગોઝણ્યે દણું, To sling.	...	”
ગોર, <i>m.</i> Snoring. ગોર ફરવો, To snore.	...	ઘોરવું.
ગોલી, <i>f.</i> A female slave.	...	ગોલી.
ગોલો, <i>m.</i> A man slave.	...	ગોલો.

## Guj. Equiv.

ગોણજ્યો, <i>m.</i> The famine during which the cattle were reduced to feeding on nests...	...	બાસ્તા.
ગોળો, <i>m.</i> A nest. ...	...	...
ગોળ, <i>m.</i> Molasses. ...	...	”
ગોળ, <i>m.</i> A circle. <i>adj.</i> Round. ...	...	ગોળ.
ગોળી, <i>f.</i> The larger of the two water vessels carried by women on their head. See ગાડવો... ...	...	ગોળી.
ગોળી, <i>f.</i> Gun shot. A ball. A pill....	...	ગોળી.
ગોળી સોડવી, To fire off a gun. ...	...	”

## ધ.

ધર, <i>m.</i> A lime-mill. A gong. ...	...	ધર.
ધરું, <i>v. i.</i> To be expended, to be les- sened. To be right, befitting.	...	ધરું.
ધરી, <i>f.</i> A small mill. ...	...	ધરી.
ધરો, <i>m.</i> A gong. ...	...	ધર.
ધડતેલ, <i>adj.</i> Fashioned with the hand.	...	? ધડવું.
ધડીઆલ, <i>f.</i> A watch, a clock. ...	...	ધડિઆલ.
ધડું, <i>adj.</i> Old. ...	...	ધરું.
ધડો, <i>m.</i> An earthen vessel. ...	...	ધડો.
ધણું, <i>adj.</i> Much, ( <i>pl.</i> ) many. ...	...	ધણું.
ધણું કરીને, Possibly. ...	...	ધણું કરીને.
ધા, <i>m.</i> A wound. ...	...	ધા.
ધાધરો, <i>m.</i> A petticoat. ...	...	ધાધરો.
ધાટ, <i>m.</i> Shape, form... ...	...	ધાટ.
ધાયલ, <i>adj.</i> Wounded... ...	...	ધાયલ.
ધાલવું, <i>v.t.</i> To thrust into, to put into.	...	ધાલવું.

## Guj. Equiv.

ધાંસી, <i>m.</i> An oil-man. ...	... ...	ધાંસી.
,, હરતું, <i>adj.</i> Dirty ( <i>lit.</i> like an oil-man).		”
ધી, <i>n.</i> Clarified butter. ...	... ...	ધી.
ધૂટી, <i>f.</i> The heel. ...	... ...	ધૂટી.
ધેરતું or ધેરી લીલું, <i>v. t.</i> To besiege. ...		ધેરતું.
ધોા, <i>f.</i> The bis-cobra. ...	... ...	ધોા.
ધોગળો, <i>m.</i> The throat. ...	... ...	*
<del>ધોધિશા</del> , Name of a Bhil clan at Vada.		...
ધોટવું, <i>v. t.</i> To pound. ...	... ...	કૂટવું.
ધોઅલો, <i>m.</i> A weevil that bores into wood.		*
ધોડો, <i>m.</i> A horse. ...	... ...	ધોડો.
,, પલાણુલો, To saddle a horse. ...		”
ધોર, <i>m.</i> A grave. ...	... ...	ધોર.
ધોડાડ, <i>m.</i> A stable. ...	... ...	ધોડાડ.

## ૭૪.

૦૮, An emphatic particle = Certainly, exactly : e. g. જાહે, He will go.		૦૮.
જાહેજા, He will certainly go...		...
જાહેજાતું, <i>v. i.</i> To shake (as the branch of a tree). ...	..	જાહેજાતું.
જગનાથી, <i>f.</i> Jaconet. ...	... ...	જગનાથી.
જંગલ, <i>n.</i> A forest. ...	... ...	જંગલ.
જંગલી, <i>adj.</i> Wild. ...	... ...	જંગલી.
જગા, <i>f.</i> A place. ...	... ...	જગા.
જગાડવું, <i>v. t.</i> To awaken. ...	... ...	જગાડવું.
જધડો, <i>m.</i> A quarrel, a dispute. ...		જધડો.
જરૂર or જરૂરપણ, <i>adv.</i> At once, quickly. ...		જરૂર.

Guj. Equiv.

જરૂરી, <i>m.</i> A wound. ...	...	...	જરૂરી.
જરૂર, <i>f.</i> A root... ...	...	...	જરૂર.
જરૂરું, <i>v.i.</i> To be found. <i>v.t.</i> To join, to fix.			જરૂરું.
જરૂરી, <i>com.</i> A person. ...	...	...	જરૂરી.
જરૂરાતું, જરૂરામાં, જરૂરાય, જરૂરાહું. See Gr. દ્વારા 14.			ને.
જરદાર, <i>adj.</i> As much as. ...	...	...	જરદાર.
જરાણું, <i>adj.</i> Bankrupt... ...	...	...	*
જરાખર, <i>n.</i> An animal... ...	...	...	જરાખર.
જરપતી, <i>f.</i> Attachment of property. ...			જરપતી.
જરપતીદાર, <i>m.</i> An officer employed to attach property. ...	...	...	જરપતીદાર. ...
જરાધાર, <i>f.</i> Force. ...	...	...	જરાધાર.
જરાધારહું કરાવણું. To force one to do a thing.			„
જરાદાર, <i>adj.</i> Strong, stout. ...	...	...	જરાદાર.
જરાયાય, <i>m.</i> An answer... ...	...	...	જરાયાય.
જરાયાય દીવો, To answer... ...	...	...	„
જરાયાય or જોયાય, <i>m.</i> The angel of death....			જરાયાય.
જરાયાયં, <i>adj.</i> Right (opp. to left). ...			જરાયાયં.
જરાયાય હાથ, To the right. ...	...	...	જરાયાય હાથ.
જરાયાયન or જરાયાયા, <i>m.</i> A security. ...			જરાયાયન.
જરાયાયં, <i>v. i.</i> or <i>v. t.</i> To dine. ...	...	...	જરાયાયં.
જરાડારું, <i>v.t.</i> To feed, to give a dinner to.			જરાડારું.
જરારી, <i>adj.</i> Lasting. ...	...	...	*
જરી, <i>f.</i> Land... ...	...	...	જરીન.
જરેણો, <i>m.</i> A blister. ...	...	...	જરેણો.
જરાયાય, <i>m.</i> Sunshine. જરાયાય ફાટતાં, At day-break.			જરાયાય.
જરામ, <i>m.</i> Birth. ...	...	...	જરામ.
જરાયાય, <i>m.</i> An aperient. ...	...	...	જરાયાય.

## Guj. Equiv.

જળ, <i>n.</i> Water.	જળકુકું, <i>n.</i> The water-fowl.	જળ.
,,	જળ બંધારકાર થાતું, To pour in torrents.	...
જળવી, <i>f.</i> A leech.	...	જળો.
જળાંદરો, <i>m.</i> Dropsy.	...	જળાંદર.
જનો or જયા, <i>adv.</i> Where.	જંડુદી, Until.	જયા.
જાક, <i>f.</i> Mist.	જાક ફાટાં. In the early morning ( <i>lit.</i> at the clearing away of the mist)...	જાકણ.
જાંખ્ય, <i>f.</i> Dimness.	...	જાંખ્ય.
જાંખું, <i>adj.</i> Dim.	...	જાંખું.
જગતું, <i>v. i.</i> To awake.	...	જગતું.
જાજ, <i>n.</i> A ship.	...	જાજ.
જાજરા, <i>m.</i> Anklets with small bells attached.	...	જાજર.
જડાઈ, <i>f.</i> Thickness, coarseness.	...	જડાઈ.
જડું, <i>adj.</i> Thick, coarse, stout,	...	જડું.
જાણ, <i>f.</i> Knowledge.	...	જાણ.
જાણું, <i>v. t.</i> To know...	...	જાણું.
જાણુંએક, <i>adv.</i> Perhaps.	...	જાણું કે.
જાણુંઘ, <i>adj.</i> Known, famous.	...	જાણુંઘ.
જત, <i>f.</i> A tribe. A kind, quality.	...	જત.
જેકનત, <i>adj.</i> Uniform, good...	...	જેકનત.
જત્રા, <i>f.</i> A pilgrimage.	...	જત્રા.
જત્રાવાળો, <i>m.</i> A pilgrim.	...	"
જદું, <i>adj.</i> More.	...	જદું.
જાન, <i>f.</i> The procession accompanying a bride-groom on his way to the bride.	...	જાન.

	Guj. Equiv.
જાતિ, f. The female friends in the marriage procession.	જાન.
...	...
જાંયા, m. The male friends in the marriage procession.	જાનેથા.
...	...
જાંતુઓ, n. A swelling of the right knee.	જાતુ.
જાપ, m. An incantation.	જાપ.
જાપો, m. A field-gate.	અંપો.
જાપો થારો, v.i To be delivered of a child (with dat. of the mother).	સાંપડતુ.
જાળી, f. A small bell attached to armlets.	...
જાણુ, n. A bell which women wear at their back...	*
...	*
જાયગ, f. Land...	જાયા.
જાર, adj. Known, manifest.	જાહેર.
,, કરવું, To publish, to make known.	"
જાર, f. Jowar (a kind of grain).	જુવાર.
જાવું, v.i. To go. જાતું રૈવું, To disappear.	જાતું.
જાળ, f. A net...	જાળ.
જો, pron. Who (used with its correlative તી. See Gr. § 16)...	જો.
...	...
જાળું, adj. Fine (not coarse)...	જાળું.
જતવું, v.t. To conquer, to beat (in a contest)...	જતવું.
...	...
જતાડનાર, m. A redeemer.	જતાડનાર.
જાથ, f. The tongue.	જાથ.
જામ or જેમ, adv. As.	જેમ.
જામ તીમ કરીને, Somehow or other.	જેમ તેમ કરીને.
જાલવું, v.i. To bathe.	*
જાવ, m. Life.	જાવ.

Guj. Equiv.	
અવ કકળવો, To be vexed, to grumble (with genit. of person)...	અવ કકળવો.
„ ખળવો, To fret. „ „ „	... અવ ખળવો.
અવતુ, pres. part. Living, alive. ...	અવતુ.
અવતુ, v.i. To live. ... ... ...	અવતુ.
અવી, adj. Living, alive. s.n. A living person. ... ... ... ...	અવ.
અવીની હેર જોવી, To feel the pulse. ...	અવ+સેર+જોવું.
અતુ or જેતુ, adj. Like, the same as....	જેતું.
ઝૂ, f. A louse... ... ... ...	ઝૂ.
જુઆર, f. Indian corn... ...	જુઆર.
જુદું, adj. Different. ... ... ...	જુદું.
જુધ જુધ જતતું, Various... ...	”
જુએ જુએ, adv. Separately. ... ...	”
જુને, def. verb. It is necessary ( with agent. of person)... ... ...	જોઈએ.
જુદું, adj. False. s.n. A lie. ... ...	જુદું.
„ પાડતું, To contradict flatly...	”
„ બોલવાવાળો or જુડો, m. A liar. ...	”
જુડી, f. A pair, a couple. ... ...	જોડા.
જુતું, adj. Old.... ... ... ...	જુતું.
ને or તો, pron. Who (used with its cor- relative તે or તી. See Gr. § 16).	ને.
ને...તે or ને...તો, conj. If...then. ...	ને.
નેઠું, m. May-June. ... ... ...	નેઠ માસ.
નેટું, m. A husband's elder brother...	નેટું.
નેર, n. Poison. નેર સરાવણું, To provoke.	નેર.
નેરખણ્દ, m. A whip. નેરખણ્દ મારવો, To flog.	નેરખણ્દ.

	Guj. Equiv.
નેરી, <i>adj.</i> Poisonous. ... ... ...	નેરી.
નેરે, <i>adv.</i> When (used with its correlative તેરે. See Gr. § 55)... ...	ન્યારે. ... ન્યારે લારે.
નેરે તેરે, Now and then... ...	ન્યારે.
નો...તો or ને...તે, <i>conj.</i> If...then ( See Gr. § 59)... ...	નો...તો. ... નોખમ.
નોખમ, <i>n.</i> A wound. ... ... ...	નોખમ.
નોખવું, <i>v.t.</i> To weigh, to estimate. ...	નોખવું.
નોષો, <i>m.</i> A contrivance for catching fish.	*
નોગી, <i>m.</i> A priest who officiates for the Bhils... ... ...	નોગી. ... નોગેણું.
નોગેણું, <i>f.</i> The wife of a Jogi... ...	નોગેણું.
નોડા, <i>m.pl.</i> Shoes. ... ... ...	નોડા.
નોડો, <i>m.</i> A couple. ... ... ...	નોડો.
જોમ or જમ, <i>m.</i> The angel of death....	જમ.
જોર, <i>n.</i> Strength, force. Oppression...	જોર.
જોરફું or જોરેફું, By force. Loudly. ...	"
જોરાવર, <i>adj.</i> Strong. ... ... ...	જોરાવર.
જોરાવરી, <i>f.</i> Force. Oppression. ...	જોરાવરી.
જોરાવરીફું, By force. ... ... ...	"
જોવ, <i>m.</i> Barley. ... ... ...	જવ.
જોવન, <i>m.</i> A young man. ... ...	જુવાન.
જોવું, <i>v.t.</i> To see. ... ... ...	જોવું.
જોહાર, <i>interj.</i> A form of salutation....	જુહાર.
જોળી, <i>f.</i> A fakir's wallet. ... ...	તોળી.
જોખ્યા, <i>m.pl.</i> Twins. ... ... ...	જોળ.

## 3.

આકૃતિ, <i>v i.</i> To shine. ...	...	...	આકૃતિ.
અટા, <i>f.</i> Matted hair. ...	...	...	જરા.
ઝડ, <i>n.</i> A bush. ...	...	...	ઝડ.
ઝડો, <i>m.</i> Diarrhoea, a stool ...	...	...	ઝડો.
,, થાવો, To have the bowels moved (with dat.of person)...	...	...	„
ખુલ્ય ઝડો લાગવો, To be purged (with dat. of person)...	...	...	ઝડો.
આપકી, <i>f.</i> Dusk. આપકી પૂજાયી, Darkness has fallen. ...	...	...	આપ.
અપોણ, <i>m.</i> A field-gate...	...	...	અપોણ.
અપોટ, <i>f.</i> A shower. ...	...	...	આપંકુ.
આઘ, <i>f.</i> Reflection, shadow. ...	...	...	? છાયા.
આરી, <i>f.</i> The bottle-bird. ...	...	...	*
આલેર, <i>f.</i> A gong (used especially by the waitis). ...	...	...	આલર.
કુંપડી, <i>f.</i> A small hut....	...	...	કુંપડી.
કુલદી, <i>f.</i> A small coat...	...	...	કુલદી.
ઓર, <i>m.</i> A spring of water. ...	...	...	ઓરો.
ઓળ, <i>f.</i> A cobweb. ...	...	...	ઓળ.
ઓખાં, <i>n. pl.</i> Nodding from sleep. ...	...	...	ઓખાં.
,, ખાવાં, To nod from sleep. ...	...	...	„
ઓટ, <i>f.</i> Butting. ...	...	...	ઓટો.
,, મેલવી, To butt,to strike with the horns.	...	...	„
ઓડો, <i>m.</i> A web of cloth. ...	...	...	*

૬.

દગરાટ, <i>f.</i> A dispute, a contention. ...	તકરાર.
„ કરવી, To quarrel. ...	”
દગલો, <i>m.</i> A pace, a step. ...	ગલો.
દેડો, <i>f.</i> The curlew. [ Its cry sounds like “ Did you do it ? ”]. ...	*
દેટા, <i>m.</i> A quarrel. દેટા કરવો, To quarrel.	દેટા.
„ લગાડવો, To begin to quarrel. ...	”
દ્રુષ્ટિ, <i>n.</i> A pony. ...	દ્રુષ્ટિ.
દ્રાંદિ, <i>n.</i> Cattle (usually combined with સોયાં, as દ્રાંદિ સોયાં). ...	*
દ્રોપો, <i>m.</i> A distance. ...	દ્રોપો.
દ્વાળતું, <i>v. i.</i> To be troubled, to chafe...	દ્વાળતું.
દ્વાંકતું, <i>v. t.</i> To close, to shut...	દ્વાંકતું.
(ધૂ)દ્વાંકવી, To roughen a grinding stone.	”
દ્વાંગતું, <i>v. t.</i> To hang. ...	દ્વાંગતું.
દાઢ, <i>f.</i> Dandruff. ...	*
દાંદણું, <i>n.</i> Carrion. ...	*
દાંદચો, <i>m.</i> A leg. દાંદચા રેઈ જવા, To be paralysed in the legs. ...	દાંદિઓ.
દાઢ, <i>f.</i> Cold. દાડ લાગવી, To be cold.	...
„ સડવી, To tremble with cold. ...	દાડ.
દાઢું, <i>adj.</i> Cold, cool, pacified...	”
„ પાઢતું, To pacify, to cool... ...	દાડું.
દાડો પોર, or દાડો પોર, The afternoon...	દાડું+પોર.
દાયો, <i>m.</i> A large flat tile. ...	થાપો.
દાયડા ફેરવણું, To turn tiles. ...	”

## Guj. Equiv.

દાયુ,	<i>m.</i>	An island.	... ... ...	દાયુ.
દાયો કરાવવો,	<i>v.t.</i>	To dun, to urge for payment.	... ...	દાયું.
દાલ,	<i>f.</i>	Baldness.	... ... ...	તાળ.
દાઢી,	<i>f.</i>	A cow. દાઢી રે, The cow gives milk.	... ...	*
દાહેં,	<i>m.</i>	A bull.	... ... ...	*
દીટકો,	<i>m.</i>	A stick.	... ... ...	*
દીડ,	<i>m.</i>	A locust.	... ... ...	દીડ.
દીપ,	<i>f.</i>	Imprisonment...	... ...	દીપ.
દીપમાં નાંખવું,		To send to jail...	... ...	"
દીપ,	<i>n.</i>	A drop.	... ... ...	દીપું.
દીપકી,	<i>f.</i>	A tiny drop. A spot, a blot.	... ...	"
દીપણું,	<i>v. t.</i>	To hammer out (metal)...	... ...	દીપણું.
દીપણું,	<i>n.</i>	The tip of the finger.	... ...	? ડેસ્ટું.
દીપાવણું,	<i>v. caus.</i>	To get hammered out.	... ...	દીપાવણું.
દીભરણું,	<i>n.</i>	A certain wild fruit (red when ripe).	... ... ...	*
દીભરણો	<i>s.</i>	સીતરો,	<i>m.</i> A leopard...	... ...
દીંહું,	<i>n.</i>	Sectarian mark on the forehead.	... ...	દીંહં.
કુંકું,	<i>adj.</i>	Short, too short, insufficient.	... ...	કુંકું.
,, કરવું,		To shorten.	... ... ...	"
કુંકું,	<i>adj.</i>	Broken.	... ... ...	કુંકું.
કુટથો,	<i>m.</i>	An arm. કુટથા રેધ જવા, To be paralysed in the arms...	... ...	કુટથો+ચિતરો.
કુડી,	<i>f.</i>	A small hut.	... ... ..	કુડી.
કુસ,	<i>f.</i>	Top (as of a hill, tree &c)	... ...	કુસ.
કેકરી,	<i>f.</i>	A hillock.	... ...	કેકરી.
કેકરો,	<i>m.</i>	A hill...	... ...	કેકરો.
કેકો,	<i>m.</i>	Strength. કેકો કરવો, forth strength.	... ...	કેકો.

## Guj. Equiv.

ટેકું or ટેગું, adj. Glaring at. ...	ટેગરટગર.
„ s.com. One who glares at another.	...
ટેકું, n. The young of any animal...	*
ટેકું, n. A clod of earth. ... ...	ટેકું.
ટેલો, m. A turtle-dove... ...	*
ટેવ, f. A custom, practice. ... ...	ટેવ.
ટેવ પાડવી, To accustom. ... ...	...
ટેલી, f. An ear-ornament. ... ...	ટેલી.
ટેપલી, f. A small basket. ... ...	ટેપલી.
ટેલ, n. (more usu. ઢોલ) A drum. ...	ઢોલ.
ટેળવું, v.t. To swing. ... ... ...	ઢોળવું.
સમરો ટેળવો, To fan, to drive away flies. ... ... ...	અમર+ઢોળવું. ...
ટેલું, n. A crowd, a herd. ... ...	ટેલું.

## ૬.

કાદાઈ, f. Weakness. ... ... ...	કાદું.
કાપકાવણું, v.t. To hinder. ... ...	કાપકો.
કાપકો, m. Censure. કાપકો દીવો, To censure.	„
કરવું or કરી જવું, v.i. To congeal. ...	કરવું.
કરાવ, m. A decision. કરાવ કરવો, To decide.	કરાવ.
કાકોર, m. A chief. ... ... ...	કાકોર.
કાંખું or કામું, n. An earthen vessel...	કામ.
કાર, m. Dew. ... ... ...	કાર.
કાણું, adj. Empty. કાણી જગા, Vacancy.	કાણું.
કાણું કાણું, adj. Empty-handed. In vain.	„
કાવું, adj. Experienced. At the head of affairs; e.g. કાવકો આદમી, An overseer.	કાવું. „

## Guj. Equiv.

કાણું, adj. Known.	કાણું કરું, To find out.	કાણું.
કીક, adj. Right, proper, correct.	...	કીક.
કીકદાક, adv. Neatly, correctly.	...	કીકદાક.
કેકતું કેકતું, Jumping, leaping.	...	કેકતું.
કેકતું, v. i. To jump.	...	”
કેકતું લાગું, To go leaping along...	”	”
કેકાણું, n. A place, abode, address.	...	કેકાણું.
કેકાણું, prep. Instead of, in the place of.	”	”
કેદ, adv. Right up to...	...	કેદ.
કેદું or કેદમાંદું, From the beginning...	”	”
કેપ, f. A stumble.	કેપ લાગવી, To stumble:	કેસ.
e. g. આદમન્યે કેપ લાગવી, The man stumbled (with dat. of person)...	...	...
કેલવું, v. t. To push.	...	કેલવું.
કેલાઠેલ કરીને, Pell-mell. In utter confusion.	”	કેલાઠેલ.
કોડ, adj. Stupid, dull. s.m. A blockhead.	”	કોડ.
કોડાં, f. A place.	કોડની કોડાં, In the same place.	કોડાર.

## ૬.

કંક, f. A sting, a bite (of a snake).	”	કંખ.
કંકતું, v. t. To sting, to bite (as a snake).	”	કંખતું.
કકારી, f. Indigestion...	...	? ઓડકાર.
કકારી પડવી, To suffer from indigestion...	”	”
કંડ, m. A fine. કંડ કરવો, To fine	...	કંડ.
કડુએકું or કડુએટું હીંડવું, To grope.	...	*
કષ્યકષ્યક, adv. In a flutter.	...	કષ્યકષ્યક.
કષ્યકષ્યક કરવું, To palpitate	...	”
કમરા, Name of a Bhil clan at Tankawara.	”	”

## Guj. Equiv.

ડમેણે, <i>n.</i> A boil, a tumour. ....	...	*
ડમાડવું, <i>v.t.</i> To mislead, to misinform...		H. ડામ.
ડર, <i>m.</i> Fear. ....	...	ડર.
ડરખું, <i>v.t.</i> To fear. ....	...	ડરખું.
ડરાવણું, <i>v.t.</i> To frighten. ....	...	ડરાવણું.
ડસકી, <i>f.</i> A small bird, black with a red spot under its tail....	...	દ્વાયકલી.
ડશી, <i>f.</i> A pad-cloth placed under saddles.		...
ડાક, <i>f.</i> The mail, the post. ....	...	ડાક.
ડકડો, <i>m.</i> A leap, a spring. ....	...	ડુકડો.
ડકડો ભરવો, To leap. ....	...	”
ડાકેણું, <i>f.</i> A witch. ....	...	ડાકેણું.
„ સોટવી, <i>v.t.</i> To bewitch : e.g. ડાકેણું સોનયે સોટનારી, The witch cast a spell over the girl. ....	...	...
ડાગ, <i>f.</i> A very cold wind causing frost-bite.		ધગા.
ડાગ, <i>m.</i> A spot, a blot, a stain. ....	...	ડાધ.
ડાગળો, <i>m.</i> A watch-hut. ....	...	*
ડાહ્યણું, <i>n.</i> A kind of muffler....	...	ડારી.
„ ભીડવું, To cover up the mouth, to muffle up. ....	...	”
ડાડણા, <i>n.pl.</i> The jaws...	...	...
ડાડણું, <i>n.</i> The chin. ....	...	*
ડાડી, <i>f.</i> The beard. Moaning. ....	...	*
ડાડી કરવી, To moan....	...	”
ડાડો, <i>m.</i> A pole. ....	...	ડાડો.
ડાણી, Name of a Bhil clan in Gujarat.		...
ડાખ, <i>m.</i> A brand. ડાખ દીવો, To cauterize.		ડાખ.

	Guj. Equiv.
ગામખુ, <i>n.</i> or ગામસો, <i>m.</i> A small watch-hut.	ગામચીંઘો.
ગામેણુ, <i>f.</i> A string of oxen which tread out corn... ... ... ...	ગામણુ. ...
ગામેણુ ફેરવણી, To drive round the oxen... ...	ગામણુ ફેરવણી. ...
ગામેર, Name of a Bhil clan at Dhan- kawara. ... ... ... ...	... ... ...
ગાલવું, <i>v.t.</i> To put down. ... ...	H. ડાળના. ગાયું..
ગાવું, <i>adj.</i> Left. ગાને હાથ, To the left...	ગાયાં+ભરવાં.
ગાસાં ભરવાં, To maul (as a tiger). ...	*
ગાહી or ગાહી, <i>f.</i> A cow.... ...	ગાળી.
ગાળી, <i>f.</i> A branch. ... ...	દરિદ્ર.
ગાળીદર, <i>adj.</i> Weak, poor. ... ...	ડિંગણું.
ગિગણું, <i>n.</i> A block of wood. ... ...	”
„ માંદું, To fasten a log to the neck of roaming cattle. ... ...	... ...
ગીલ, <i>n.</i> The body. ... ...	ગીલ.
ગીલકોરાં, <i>adj.</i> Active, energetic. ...	ગીલ+કોરાં.
કુંગરાણુ, <i>adj.</i> Hilly. ... ...	કુંગર.
કુંગરો, <i>m.</i> A hill... ...	”
કુંગળી, <i>f.</i> An onion. ... ...	કુંગળી.
કુષ્ટું, <i>v.i.</i> To sink, to dive. ... ...	કુષ્ટું.
કુલવું, <i>v.i.</i> To swing from side to side.	તોલવું.
કેડકો, <i>m.</i> A small frog. ... ...	દેડકો.
કેરો, <i>m.</i> A tent. કેરો કરવો, To encamp.	કેરો.
કોકરી, <i>f.</i> An old woman. ... ...	કોકરી.
કોકરો, <i>m.</i> An old man. ... ...	કોકરો.
કોક્ખણાં, <i>n. pl.</i> Peeping. ... ...	કોકિયાં.

	Guj. Equiv.
ગ્રાહકાં કરવા, To peep. ... ...	ગ્રાહિયાં કરવાં. .
ગ્રાટ, <i>m.</i> A ball made of rags. ...	દો.
„ રમવો, To play a game something like hockey. ...	„
ગ્રાટડી, <i>f.</i> A small ball... ...	દી.
ગ્રાંડ, <i>adj.</i> One and a half. ...	દોં.
ગ્રાડીઅાર, Name of a Bhil clan at Palihora. ... ...	...
ગ્રાડો, <i>m.</i> An ear of corn. ... ...	ગ્રાડો.
ગ્રાણુ, Name of a Bhil clan at Thur.	...
ગ્રાણી, <i>f.</i> A she-buffalo. ... ...	ગ્રાણુ.
ગ્રાલવું, <i>v. i.</i> To shake (as a tree, the earth &c). ... ...	ગ્રાલવું.
ગ્રાસી, or ગ્રાહી, <i>f.</i> An old woman. ...	ગ્રાસી.
ગ્રાસો or ગ્રાહો, <i>m.</i> An old man. ...	ગ્રાસો.
ગ્રાળ, <i>f.</i> The seed of the <i>mowra</i> tree.	ગ્રાળી.
ગ્રાળ, <i>n.</i> A jungle. ... ...	*
ગ્રાલસો, <i>m.</i> An iron well-bucket. ...	ગ્રાળચી.
ગ્રાળું, <i>adj.</i> Blunt. ... ...	*
ગ્રાળો, <i>m.</i> The eye-ball. ... ...	ગ્રાળો.
ગ્રાળો કાડવા, To glare, to scowl....	„

## ૬.

ગ્રાલો, <i>m.</i> A heap. ... ...	ગ્રાલો.
ગ્રાણુ, <i>m.</i> A copper coin, a pice. ...	ગ્રાણુ.
ગ્રાંકણી, <i>f.</i> A lid, a cover. ... ...	ગ્રાંકણી.
ગ્રાંકવું or ગ્રાંકીદીવું, <i>v.t.</i> To cover,to close...	ગ્રાંકવું.
ગ્રાલ, <i>f.</i> A shield. ... ...	ગ્રાલ.
ગ્રાળ, <i>m.</i> A slope, an incline. ... ...	ગ્રાળ.

## Guj. Equiv.

દાળો, <i>m.</i> The settlement of a dispute.	... ...	તાળો.
,, કરવો, To settle a dispute...	...	”
દીકવો, <i>m.</i> A basket-lift for water	...	*
,, ડાલવો, To irrigate by means of a basket-lift.	... ...	... ... ...
દીંહું, <i>adj.</i> Loose, slack.	... ...	દીંહું.
દુલવું or દુલી દીંહું, <i>v. t.</i> To pour out.	...	દોલવું.
દેખરે, <i>n.</i> The Indian jay.	... ...	*
દેલ, <i>f.</i> A pea-hen.	... ...	દેલ.
દોલ, <i>n.</i> A large drum...	... ...	દોળ.
દોસ, <i>f.</i> Sawars or sepoys billeted upon a person until he comes to terms.	...	*
„ મેલવી, To place a દોસ.	... ...	... ...

## ત.

તંગ, <i>m.</i> A girth.	... ...	તંગ.
તગડીર, <i>f.</i> Fate, luck.	... ...	તકડીર.
તંગાઈ or તંગાસ, <i>f.</i> Scarcity, want.	...	તંગાસ.
તડકો, <i>m.</i> The heat of the sun. Glare.	...	તડકો.
તથુષોણુંચું, <i>adj.</i> Three-cornered.	...	ત્રિકોણું.
તથ્યાપુદે, <i>adv.</i> Afterwards.	...	તે+પુદે.
તથે, <i>conj.</i> That is to say, to wit.	...	તેણે.
તતરાકમાં, <i>adv.</i> Meanwhile.	...	તેઠલામાં.
તતરં, <i>adj.</i> So much.	... ...	તેટંહું.
તતુલવું or તતુલવું મેલવું, <i>v.t.</i> To suspend, to hang.	...	તોલવું.
તપ, <i>m.</i> Asceticism. Religious austerities.	...	તપ.
તપસી, <i>m.</i> An ascetic....	... ...	તપસી.
તપાસ or તપાહ, <i>f.</i> Inquiry, investigation.	...	તપાસ.
„ „ „ કરવી, To examine, to enquire.	„	„

## Guj. Equiv.

તંધુ, <i>m.</i> A tent.	...	...	...	તંધુ.
તંધુરો, <i>m.</i> A guitar with four strings.				તંધુરો.
તમય, <i>pron.</i> You [ agent. case. See Gr. § 14].	...	...	...	”
તમાં, <i>pron.</i> You.	...	...	...	”
તમારામાં, તમારાદુ, તમારાં. [See Gr. § 14]...				”
તથ, <i>pron.</i> Thee, by thee, to thee. (See Gr. § 14).	...	...	...	જ.
તર, <i>f.</i> Thirst...	...	...	...	તરસ.
„ લાગવી, To be thirsty ( with dat. of person).	...	...	...	”
તરકારી, <i>f.</i> A bier.	...	...	...	કરકારી.
તરગેહ, <i>n.</i> A large quiver.	...	...	...	તરકસ.
તરગેળ, <i>f.</i> An earth-quake.	...	...	...	? થરકવું.
તરત, <i>adv.</i> Immediately.	...	...	...	તરત.
તરતતું, <i>adj.</i> Urgent.	...	...	...	”
તરવાર, <i>f.</i> A sword.	...	...	...	તરવાર.
તરવું, <i>v. i.</i> To float, to swim....				તરવું.
તરહાડી, <i>m.</i> An intercessor.	...	...	...	તરફદરી.
તરી, <i>f.</i> Cream...	...	...	...	તર.
તલખ, <i>f.</i> A leap, a spring.	...	...	...	તલખ.
તલપતું or તલપતું જવું, <i>v.i.</i> To gallop,to leap.				તલપતું.
તથી, <i>f.</i> Sesame...	...	...	...	તથ.
તવન્યાદ, Name of a Bhil clan at Lambawara.	...	...	...	...
તવી, <i>f.</i> An iron plate for baking bread.				તવી.
તળવું, <i>v. t.</i> To fry.	...	...	...	તળવું.
તળાવ, <i>m.</i> A tank, a lake.	...	...	...	તળાવ.

	Guj. Equiv.
તફુ, <i>m.</i> An inch. . . . .	તસુ.
તાકવું, <i>v. t.</i> To lie in wait for... . . . .	તાકવું.
તાકીદ; <i>f.</i> Haste. તાકીદહું, Quickly. . . .	તાકીદ.
તાજગ્ઝો, <i>m.</i> A whip. . . . .	P. તાજીઆના.
તાજું, <i>adj.</i> Fresh, green, new. . . . .	તાજું.
તાણું, <i>v. t.</i> To stretch, to pull, to draw. . . . .	તાણું.
તાણુંને, <i>adv.</i> With great difficulty. . . . .	તાણુંને.
તાણુંને ખાંધવું, To tie tight. . . . .	તાણુંને ખાંધવું.
તાપ, <i>m.</i> Heat. . . . .	તાપ.
તાપવું, <i>v. t.</i> To heat. . . . .	તાપવું.
તાંખડી, <i>f.</i> A drinking vessel. . . . .	તાંખડી.
તાંખુ, <i>n.</i> Copper. . . . .	તાંખુ.
તાખે, <i>adv.</i> Under subjection... . . . .	તાખે.
<i>prep.</i> Under subjection to. . . . .	"
„ કરવું, To subdue. . . . .	તાખે કરવું.
„ થવું, To be under subjection. . . . .	તાખે થવું.
તામણુંટોલું, <i>n.</i> A rain-bow. . . . .	*
તાર, <i>m.</i> Wire. . . . .	તાર.
- તારનાર or તારવાવાળા, <i>m.</i> A redeemer, a saviour . . . . .	તારનાર.
તારવું, <i>v. t.</i> To save, to rescue. . . . .	તારવું.
તારામાં, તારાહું, તારં. [See Gr. § 14]. . . . .	તારં.
તારો, <i>m.</i> A star. . . . .	તારો.
તાવ, <i>m.</i> Fever ... . . . . .	તાવ.
તાવડી, <i>f.</i> A shallow copper or iron vessel with two handles. . . . .	તાવડી.
તાળી, <i>f.</i> Clapping the hands.... . . . .	તાળી.
„ પાડવી, To clap the hands. . . . .	"

## Guj. Equiv.

તાંગુ, <i>n.</i> A padlock.	તાંગુ દીવું To lock.	તાંગુ.
તી, or તે, <i>pron.</i> That one.	Those. ...	તે.
તીજી, <i>f.</i> The third day of the moon...		તીજી.
તીમ or તેમ, <i>adv.</i> Thus, so.	... ...	તેમ.
તીર, <i>m.</i> An arrow.	... ...	તીર.
તીર કામણું, Bow and arrows.	... ...	"
તીરથ, <i>n.</i> A place of pilgrimage.	...	તીરથ.
તીવું or તેવું, <i>adj.</i> Such....	... ...	તેવું.
તું, <i>pron.</i> Thou.	... ...	તું.
તુંઘરણ, <i>n.</i> A long gourd.	... ...	તુંઘરણી.
તે. See તી.	... ...	તે.
તે or તો, <i>conj.</i> Then.	... ...	તો.
તેચાર, <i>adj.</i> Prepared, ready.	...	તેચાર.
તેનેત, Name of a Bhil clan at Ghudimandav.	...	...
તેડ, <i>f.</i> The bank of a river.	...	તેડ.
તેડવું, <i>v. t.</i> To send for, to invite.	...	તેડવું.
તેપણું, <i>conj.</i> Nevertheless.	...	તેપણું.
તેમ or તીમ, <i>adv.</i> Thus.	... ...	તેમ.
તેમ ને તેમ, Just so.	... ...	"
તેર or તેરે, <i>adv.</i> Then. Of course !	...	ખારે.
તેરેણું, <i>adv.</i> Of course ! Certainly !	...	ખારે શું ?
તેલ, <i>n.</i> Oil.	... ...	તેલ.
તેવાં, <i>adv.</i> Then....	... ...	તેવે.
તેવું, <i>adj.</i> Such....	... ...	તેવું.
તેણી or તેણું, <i>adv.</i> Thence.	... ...	તેણી.
તો or તે, <i>conj.</i> Then.	... ...	તો.
તોકારે બોલવું, To speak disrespectfully.		તું+કર+બોલવું.
તોડવું, <i>v. t.</i> To break.	... ...	તોડવું.

	Guj. Equiv.
તોડા, <i>m.</i> Anklets. ... ... ...	તોડા.
તોપ, <i>f.</i> A cannon. ... ... ...	તોપ.
„ સેડવી, To discharge a cannon. ...	„
તોષાન, <i>n.</i> Malicious mischief... ...	તોષાન.
„ કરવું, To make mischief. ...	„
તોખરો, <i>m.</i> A horse's mouth bag. ...	તોખરો.
તોરણું, <i>f.</i> A rope stretched across a road with wisps of hay fastened to it to ward off evil. ...	તોરણું.
થાં, <i>adv.</i> There... ... ...	થાં.

## થ.

	થઈરહેવું, થઈ ચુકું.
થાઈ રેવું or થાઈ સુકું, <i>v. i.</i> To be finished.	થાક.
થાક, <i>m.</i> Fatigue. થાક ખાવો, To rest.	*
થાકડી, <i>f.</i> A step (of a ladder &c.) ...	થાકડું.
થાકું, <i>v. i.</i> To be tired. ... ...	થાકું.
થાકું, <i>adj.</i> Tired. ... ... ...	થાતે.
થાતે થાતે, <i>adv.</i> Gradually, by degrees....	થાણુદાર.
થાણુદાર, <i>m.</i> A police officer in charge of a district. ... ...	...
થાણું, <i>n.</i> A police station. ... ...	થાણું.
થાન, <i>m.</i> A web of cloth. ... ...	થાન.
થામલો, <i>m.</i> A pillar. ... ...	થાંબલો.
થાવોર, <i>m.</i> Saturday. ... ...	*
થાળ or થાળી, <i>f.</i> A brass tray or dish.	થાળ, થાળી.
થુઅર, <i>n.</i> A kind of cactus. ... ...	થુવર.
થુકસો, <i>m.</i> Saliva. ... ... ...	થુંક.
થુરી, <i>A</i> gipsy caste. ... ... ...	...

	Guj. Equiv.
શડ, n. The trunk of a tree....	શડ.
શડમાં, Near. ....	"
શેણાણું, v. i. To be congealed. ....	સ્થાણુ.
શાકું, adj. A little (in quantity). plur. Few, a few. ....	શાકું.
, કરવું, To make less, to diminish. ....	શાકું કરવું.
શાકું ધણું, adj. or adv. A little. More or less. ....	શાકું ધણું.
શાખરજાયા, m. Influenza. ....	*
શાખળું, v. i. To be patient, to wait. ....	શાખળું.
E.	
દક્ષાળ, f. A famine. ....	દક્ષાળ.
દાખ or દાખ, n. Pain. ....	દાખ.
, કરવું or દીવું, To annoy, to oppress ,, વેદવું, To put oneself to great trouble. To suffer greatly. ....	"
દાખણુ, f. The South. ....	દક્ષિણ.
દાખણાતું, adv. Southwards. ....	"
દાખવું or દુખવું, v. i. To hurt, to be painful. ....	દુખવું.
દ્વારા, m. A noise. ....	? બ્લેર.
દગ્ધોર, adj. Deceitful. s. m. A trea- cherous person. ....	દગ્ધોર.
દગ્ધાત, m. A deceiver....	દગ્ધા.
દગો, m. Treachery, deceit. ....	"
, કરવો, To deceive. ....	"
દાઢું, v.t. To throw (chiefly used to form Intensive comp. verbs). ....	H. ડાઢના.

Guj. Equiv.	
દી દીવું, v.t. To throw down....	... દતુરો, m. The <i>datura</i> plant (the wild poppy).
દન, m. A day. દન ખાવસી, The sun. ...	દિન. દન ઉગે, At sunrise.... દન ઘુડે, At sunset....
દમ, m. Breath... ,, સડવેા, To be out of breath (with dat. of person). ...	દમ. દમ ચડવેા. ... દમકી, f. Threatening. ...
દમકી ખતાવણી, To threaten. ...	”
દરજ્ઞા, m. The sea. ...	દીર્ઘા.
દરસણું, n. A sight (of anything). Visit- ing an idol. ...	દરશણું. ... ,, કરું, To visit (an idol or a person of high rank). ...
,, દીવું, To grant a sight of oneself.	દરશણું કરું. ...
દરડયો, Name of the Manpur pass near Som. ...	દરો. ...
દરો, m. A chasm. A pool of water.	દરો.
દરોણો, m. The pole-star. ...	ધર્ઢ.
દલ, n. The heart. ...	દલ.
દલાહો, m. Comfort. ...	હિલાસો.
દસમણું, m. An enemy, an adversary...	દુશમન.
દહી, n. Curds. ...	દહો.
દળવું, v.t. To grind (fine). ...	દળવું.
દળેલી ભાંગ, f. Snuff (lit. ground tobacco).	”
દાખલો, m. An example, an illustration. ,, દીવો, To illustrate. ...	દાખલો. ”
દાગળા, m. A watch-house. ...	*

Guj. Equiv.	
દાત, <i>m.</i> A father. ....	દાટો.
દાટવું, <i>v.t.</i> To bury. ....	દારતું.
દાડી દીકું, <i>v.t.</i> To bury out of sight....	„
દાડી, <i>f.</i> A beard. ....	દાડી.
દાઢું or દાડે દાડે, <i>adv.</i> Always, constantly.	દાહાડે દાહાડે.
દાડો, <i>m.</i> A day. ....	દાહાડો.
દાડો યુદી ગીજોએ, Sunset ( <i>lit.</i> the day has sunk)....	„
દાંખુ, <i>n.</i> Import and export duties....	દાંખુ.
દાણો, <i>m.</i> Grain... ....	દાણો.
દાંત, <i>m.</i> A tooth. અગડા દાંત, Ugly. ...	દાંત.
દાંત ખાંદી, <i>f.</i> Lock-jaw (used with the verb બેહંતું).	*
દાતણુ, <i>n.</i> A tooth-brush. ....	...
„, કરવું, To brush one's teeth. ....	દાતણુ.
દાતડી, <i>f.</i> A sickle, a bill-hook. ....	”
દાદર, <i>f.</i> Ringworm. ....	દાદરી.
દાદરા, <i>m.</i> Stairs. ....	દાદર.
દાદા, <i>m.</i> A father. An elder brother....	દાદો.
દાન, <i>n.</i> A gift. ....	દાન.
દાનગી, <i>m.</i> A labourer. Labour, work.	*
દાયું, <i>n.</i> The amount paid for a bride.	દાયું.
„, ભરવું, <i>m.</i> To pay down money &c., for a bride....	„
દામ, <i>m.</i> Price....	દામ.
દાંખ્સો, <i>m.</i> A small watch-house. ....	ડામચીઓ.
દામા, Name of a Bhil clan near Kherwara.	...

## Guj. Equiv.

દારુ, <i>m.</i> Spirituous liquor. Gunpowder.	દારુ.
દારુયો, <i>m.</i> A drunkard. ... ...	દારુયો.
દાવતું, <i>v.i.</i> To please, to suit.... ...	ધાતવું.
દાવે તે કરો, Do whatever suits you... ...	...
દાવો, <i>m.</i> A claim, a demand.... ...	દાવો.
,, કરવો, To prosecute. ... ...	,,
દાળીદર, <i>adj.</i> Weak. ... ...	દરિદ્ર.
દીકરી, <i>f.</i> A daughter.... ...	દીકરી.
દીકરો, <i>m.</i> A son... ... ...	દીકરો.
દીગણું, <i>n.</i> A block of wood. ... ...	ડિંગલું.
દીટ, <i>prep.</i> Per : e.g. મનખદીટ, per head, જેરદીટ, per house.... ...	દીટ.
દીંગ, <i>v.</i> Saw, seen (Irreg. past of દેખનું).	દીંગ.
દીતવાર, <i>m.</i> Sunday. ... ...	આદિત્યવાર.
દીલ, <i>n.</i> The body. ... ...	ડીલ.
દીલે દુખ દીને કામ કરવું, To exert one-self beyond one's strength. ...	,,
દીવાહળાં, <i>f.</i> A match.. ... ...	દીવાસળા.
દીવું, <i>v.t.</i> To give. To shut. To allow.	દૈવું.
દીવું લીધું or દૈવું લેધું, <i>n.</i> Dealings, transactions. ... ...	દેખુદેખુ.
દીવો, <i>m.</i> A lamp. ... ...	દીવો.
,, લગાડવો, To light a lamp. ...	,,
દુકાંડા, <i>m.</i> A small copper coin, a pice.	દાકાંડા.
દુખ or દખ, <i>n.</i> Pain. ... ...	દુખ.
દુખી, <i>adj.</i> Unhappy, afflicted...	દુખી.
દુળળ, <i>f.</i> A milch-cow... ...	દુનણી.
દુઃ, <i>n.</i> Milk. ... ...	દુઃ.

	Guj. Equiv.
દુલો or દુડો, <i>m.</i> A leaf-cup. ...	દડિયો.
દ્વાયા, <i>f.</i> The world. ...	દૂનીઆ.
દુખું, <i>adj.</i> Thin, weak, lean....	દુખું.
દે, <i>m.</i> The body. ...	દેહ.
દેશોર, <i>m.</i> Husband's younger brother.	દિશેર.
દેખું, <i>v.t.</i> To see. ...	દેખું.
દેખાતું, <i>pres. part.</i> Being seen ; visible.	દેખાતું.
દેખાહેખી, <i>f.</i> Imitation. દેખાહેખી કરવી, To copy, to imitate. ...	દેખાહેખી. ...
દેર or દોર, <i>m.</i> A cave, a hole. ...	દર.
દેરાણી, <i>f.</i> Husband's younger brother's wife. ...	દરાણી. ...
દેરા, <i>m.</i> A temple. ...	દેરા.
દેવ, <i>m.</i> A god. દેવ જાણે, Perhaps ( <i>lit.</i> God knows !) ...	દેવ. ...
દેવતરજથો, <i>m.</i> The "brain fever" bird.	દેવતરસથો.
દેવતા, <i>m.</i> Fire. ...	દેવતા.
દેવી, <i>f.</i> A goddess ( <i>esp.</i> the goddess <i>Kali</i> ). Name of a certain bird. ..	દેવી. ...
દેવું, <i>n.</i> A debt. દેવું કરવું, To fall into debt.	દેવું.
દેવું લેણું or દીવું લીણું, <i>n.</i> Dealings, transactions. ...	દેણુદેણું. ...
દેસ, <i>m.</i> A country. ...	દેશ.
દેહ, The district round about Tanka-tunka. ...	...
દોકાન, <i>f.</i> A shop. ...	દુકાન.
દોઢ, <i>adj.</i> One and a half. ...	દોઢ.
દોમાર, <i>adj.</i> Sick. ...	? ધીમાર.
દોર, <i>m.</i> A cave, a hole. ...	દર.

## Guj. Equiv.

દોરવું, <i>v.t.</i> To lead. ...	...	...
દોરી, <i>f.</i> Fine cord, thread. ...	...	...
દોરા, <i>m.</i> Cord....	...	...
દોષ, <i>adj.</i> Ten....	...	...
દોશરા, <i>m.</i> The <i>Dasara</i> festival. ...		
દોળા કાકાળ, Name of a former Rao of Jawas. ...	...	...

દોરવું.

દોરી.

દોરા.

દોષ.

દોશરા.

...

...

## ધ.

ધગધગવું, <i>v.i.</i> To blaze up. ...	...	...
ધળ, <i>f.</i> A banner, a flag. ...	...	...
ધણું, <i>v.i.</i> To shake the head. To roll under a fit of frenzy....	...	...
ધણી, <i>m.</i> A master. A husband. ...	...	...
ધન, <i>n.</i> Riches, wealth...	...	...
ધનત્વતી, <i>adj.</i> Rich, wealthy. ...	...	...
ધનેડા, <i>m.</i> A weevil that eats grain...		?
ધમરી, <i>f.</i> An uproar (combined with the verb ઉંઘું, <i>to rise</i> ). ...	...	धમાચુરી.
ધરતી, <i>f.</i> The earth. ...	...	ધરતી.
,, તૃષ્ણે, The earth shakes (said of an earthquake)...	...	,,
ધરમ, <i>m.</i> Religion. Alms. ...	...	ધર્મ.
,, કરવો, To give alms. To perform good deeds... ...	...	,,
ધરમસાળા, <i>m.</i> An inn, a caravanserai...		ધર્મશાળા.
ધરાયો, <i>adj.</i> Satisfied....	...	ધરાયો.
ધરાવું, <i>v. pass.</i> To be satisfied...	...	ધરાવું.

ધગધગવું.

ધળ.

ધણું.

...

ધણી.

ધન.

ધનત્વતી.

? ધાન્ય.

ધમાચુરી.

...

ધરતી.

,,

...

ધર્મ.

,,

...

ધર્મશાળા.

ધરાયો.

ધરાવું.

## Guj. Equiv.

ધવાડવું, v.t. To suckle....	...	...	ધવાડવું.
ધાક, f. Threatening. ....	...	...	ધાક.
ધાક દીવી, To threaten....	...	...	”
ધાન, n. Corn in general. Rice in the husk. ....	...	...	ધાન.
ધામવું, or ધામતું જવું, v.i. To run. ....	...	...	”
ધામારોળ, f. A commotion. ....	..	..	ધામહુમ + રંગરોળ.
ધારવું, v.t. To think, to suppose. ધારો, Suppose that....	...	...	ધારવું.
ધાવવું, v.t. To suck. ....	...	...	”
ધીપડું, n. A wall of wattle and daub.			धીપડ.
ધીરત, f. Patience.			ধીરય.
ધીરત રાખવી, To be patient....	...	...	”
ધીરું, adj. Patient. ....	...	...	ধીર.
ધીસ, f. Ordeal by fire or water. ....	...	...	ধીષ.
,, કરવી, To put to the ordeal. ....	...	...	”
ધુષ્પાવું, v.i. To shake (as when under supposed demoniac possession)....			ধুষ্পা঵.
માયું ધુષ્પાવણું, v.t. To roll the head round and round when practising divination. ....			”
ધુણેવ, A name of the town of Ri- shabhnnath. ....	...	...	”
ધોાવું, v.t. To wash. ....	...	...	ধોાવ.
ધોઈદાવું, To wash out thoroughly...			ধোઈ নাওয়া.
ધોણી, f. A bow. ....	...	...	ধুণ্ড.
,, ઉતારવી, To unstring a bow. ....	...	...	”

Guj. Equiv.	
ધોણી સોડવી, To string a bow. ...	ધતુખ્ય.
„ હરન્દિ, Bow and arrows ...	„
ધોળું, adj. White. ધોળી ગાર, Chalk. ...	ધોળું.
ધ્યાન, n. Memory. ...	ધ્યાન.
„ રાખવું, To remember. ...	„
ધ્યાનમાં લીવું, To consider. ...	„
ન.	
નર્થ, f. A river... ... ...	નર્દી.
નક્કે, adj. Indecent, impudent.	નક્કે.
નક્સાથુ, f. Damage, loss, injury. ...	નુકસાન.
નક્સો, m. A map, a plan. ...	નક્શો.
નકારું, adj. Useless. ... ...	નકારું.
નકી, adj. Certain. adv. Certainly. ...	નકી.
„ કરવું, To make certain, to settle...	„
નાખ, m. A nail of the finger or toe...	નાખ.
નખોજ, m. The extinction of a family.	નખોજિયું.
નખોજયું, or નખોજ્યો માલ, The property of a man who has died without leaving a son.... ... ...	„ ... ... ...
નખોજયું ખાવું, To distribute among re- latives and Brahmans the pro- perty of a man who has died without leaving a son, giving a small portion to the widow.	નખોજિયું. ... ... ... ...
નખોરી, v. A nostril. ... ...	નરકારી.
નગદ, adj. Prime. Very good. Pretty...	નગદ.
નગુરી, f. A very small loin-cloth worn by the forest Bhils. ... ...	લગોરી. ...

Guj. Equiv.

નજર, <i>f.</i> Sight. ભાયે નજર રાખવી, To look after. To be kind to. ...	નજર.
એકનજર, <i>Intently. e. g.</i> એકનજર જોઈ શીવું, To look intently at. ...	” એક નજર.
નટઘર, <i>m.</i> A rascal. ...	નટઘર.
નકારા, <i>adj.</i> Bad, evil. ...	નકારા.
નષ્ટવું, <i>v.t.</i> To break off the ears of corn, to reap. ...	નષ્ટવું.
નષ્ટન્યું, <i>n.</i> Harvest. ...	લષ્ટવું.
નધી, <i>f.</i> A husband's sister. ...	નષ્ટન્દ.
નષ્ટદોષ, <i>m.</i> A husband's sister's husband.	નષ્ટદોષ.
નદી, <i>f.</i> A river... ...	નદી.
નનાંઆ, Name of a Bhil clan beyond Dhebar... ...	...
નક્કા, <i>m.</i> Advantage, gain. ...	નક્કા.
નખળાધ, <i>f.</i> Weakness, infirmity. ...	નખળાધ.
નખળું or નમળું, <i>adj.</i> Weak, faint. ...	નખળું.
,, વર, <i>adj.</i> A year of scarcity. ...	”
નમણું, <i>v.i.</i> To bend. નમતી રાત, About 1 a. m. (lit. the bending night)...	નમણું.
નમતો દાડો, About 1 p. m. (lit. the bending day). ...	”
નમાવળું, <i>v. t.</i> To cause to bend. ...	નમાવળું.
નમી જવું, <i>v. i.</i> To bend down. To be frail. ...	નમી જવું.
નમુનો, <i>m.</i> A pattern. ...	નમુનો.
નરકંડ, <i>m.</i> Hell... ...	નરકંડ.
નવટાંગ, <i>n.</i> An eighth of a seer. ...	નવટાંક.

	Guj.	Equiv.
નરમ, adj. Gentle, soft.	...	...
નરમાધ, f. Gentleness...	...	...
નવરાધ, f Leisure.	...	...
,, થાવી, To be at leisure (with dat. of person).	...	,,
નવરે, adj. Disengaged, at leisure.	...	નવરે.
નવાધ, f. A wonder.	...	નવાધ.
નવાધ જેવું, Strange.	...	,,
,, થાગવી, To be astonished (with dat. of person).	...	,,
નવું, adj. New...	...	નવું.
નસો, m. Intoxication...	...	નીશા.
નસોવખું or નસોવી દડવું, v. t. To wring out (clothes).	...	નિચોવવું.
નહાડવું, v. caus. To put to flight.	...	નસાડવું.
નહીં, adv. Not. નહીં તે, Otherwise...	...	નહીં,
નહું, adv. At all, wholly.	...	*
નહું નહીં, Not at all.	...	,,
ના, f. No.	...	ના.
ના કેવી, To say No, to deny, to refuse.	...	,,
નાકો, m. A pass between hills.	...	નાકું.
નાખવું, v. t. To throw...	...	નાખવું.
નાણું, adj. Naked.	...	નાણું.
નાડ, f. The pulse.	...	નાડ.
,, જેવી, To feel the pulse...	...	,,
નાડા, Name of a Bhil clan at Thur...	...	...
નાડું, n. Tape...	...	નાડું.

	Guj. Equiv.
નાડો, <i>m.</i> A thick rope. ... ...	નાડું.
નાણ્યાવટી, <i>m.</i> A banker, a money-dealer.	નાણ્યાવટી.
નાળું, <i>n.</i> Coin, money... ...	નાળું.
નાનડો, <i>m.</i> A piece of cloth for a petticoat... ...	*
નાનું, <i>adj.</i> Small, little. ... ...	નાનું.
નાનેક, <i>adj.</i> Very small. ... ...	"
નામ, <i>n.</i> A name. ... ...	નામ.
„ પાણું, To name, to give a name to.	"
„ લીનું, To mention the name of...	"
પડતે નામે, Of an inferior class. ...	"
સડતે નામે, Of a superior class. ...	"
નામણું, <i>v. t.</i> To pour out. ... ...	નામવું.
નાર, <i>m.</i> A male. ... ...	નર.
નારાં, <i>n. pl.</i> Honey-comb. ... ...	*
નારાજ, <i>adj.</i> Displeased. ... ...	નારાજ.
નારાજ કરવું, To displease. ... ...	"
નારી, <i>f.</i> A female. ... ...	નારી.
નારેળ, <i>n.</i> A cocoa-nut... ...	નારિયળ.
નાવ, <i>f.</i> A boat. ... ...	નાવ.
નાવું, <i>v. i.</i> To bathe. ... ...	નહાવું.
નાસવું, <i>v. i.</i> To dance.... ...	નાચવું.
નાહિંવું or નાહી જાવું, <i>v. i.</i> To run away, to escape. ... ...	નાસવું.
જવ લીને નાહી જાવું, To flee for one's life. ... ...	નાસવું.
નળી, <i>f.</i> A tile. ... ...	નળી.
નીક, <i>f.</i> A water-course for irrigation.	નીક.

	Guj. Equiv.
નીકળવું, v. i. To go out. ... ...	નિકળવું.
નીકળવું, v. t. To put out, to cast out.	નિકળવું.
નીથકું, adj. Lower. ... ...	નીથકું.
નીથલે હાય, To the left. Below. ...	“
નીદવું, v. t. To weed. ... ...	નીદવું.
નીદું, adj. Green, moist. ... ...	લીદું.
નીતુંમા, m. The famine of Samvat 1890 (A. D. 1833). ...	નેતું.
નીચું, adj. Low. ... ...	નીચું.
નીચું or નીસે, prep. Below. ... ...	“
નીફરવું, v.i. To start, to proceed. To turn out (good or bad). ...	નીસરવું.
નીહાન્યું or નીહાર, adj. Without spirit, faint-hearted ..	ન+હાન.
નીહાળ, f. A school. ... ...	નિશાળ.
ને, conj. And. ... ...	ને.
નેખ, or નેખડા, m. A nail (of a finger or toe). A claw. ... ...	નાખ.
નેદાર, adj. Slothful, indolent, indigent.	નાદાર.
નેમાન્યું, adj. Orphaned (lit. motherless, but used also for fatherless)...	ન+મા.
નેલાર, n. The forehead. Fate... ~	લાલટ.
નેહાહો, m. A sigh. નેહાહો દડવો, To sigh.	નિસાસો.
નેહ, m. A vein... ... ...	નસ.
નોકર, m. A servant. નોકર રાખવો, To en- gage a servant.... ... ...	નોકર.
નોકરી, f. Service. ... ... ...	નોકરી.

		Guj. Equiv.
નોતરું, <i>v.</i> An invitation. ....	....	નોતરું.
„ મેલવું, To invite. ....	....	”
નોવ, <i>adj.</i> Nine....	....	નવ.
નોળા, <i>m</i> or નોળ્યું, <i>n.</i> A mongoose. ....	....	નોળિયો.
ન્યાત, <i>f.</i> A caste feast....	....	ન્યાત.
„ જમાડવી, To give a caste feast....	....	”
ન્યાતભારતું, Excommunicated. ....	....	”
ન્યારું, <i>adj.</i> Distinct, separate....	....	ન્યારું.
ન્યાવ, <i>m.</i> A judicial decision. ....	....	ન્યાય.
ન્યાવ કરવો, To pass sentence, to judge.	....	”

## ૫.

પખવાણું, <i>n.</i> A fortnight. ....	....	પખવાણું.
પંખાળું, <i>adj.</i> Winged. ....	....	પંખાળું.
પંખી, <i>n.</i> A bird. ....	....	પંખી.
પંખીરી, <i>m.</i> A wild animal. ....	....	*
પગણું, <i>n.</i> A stirrup. ....	....	પાગણું.
પગસું, <i>adj.</i> Saffron-coloured. ....	....	? ભગતું.
પગમો લાખરો, Saffron-coloured material.	....	”
પગદું, <i>n.</i> A foot-step. ....	....	પગદું.
પગાર, <i>m.</i> Wages. ....	....	પગાર.
પર. <i>m.</i> A spot, a stain....	....	બઢો.
પટકાવણું, <i>v.t.</i> To throw down violently.	....	પટકણું
પટકાળયી, <i>f.</i> A bad woman. ....	....	”
પટકાળયો, <i>m.</i> A bad man. ....	....	”
પટાટ, <i>m.</i> A saddle-girth. ....	....	પટાટ.
પટાહણું, <i>n.</i> A box. ....	....	પટારો.
પરી, <i>f.</i> A poultice. ....	....	પરી.

	Guj. Equiv.
પદી ખાંદવી or માંદવી, To poultice. ...	પદી ખાંદવી.
પદો, <i>m.</i> Territory, a state. ...	પાઠ, as in રાજપાઠ.
પકું, <i>v. i.</i> To make a contract. To agree. ... ... ...	પકું. ... ...
પઢો, <i>m.</i> A contract for sale or purchase.	પઢો.
પડતેલ, <i>adj.</i> Fallow. ... ... ...	પડતર.
પડું, <i>v. i.</i> To fall. ... ... ...	પડું. "
પડતે નામે, Of an inferior class. ...	"
પડજયું ને પડજયું રેલું, See ખાટલો. ....	"
પડસાળા, <i>m.</i> A shadow. ... ...	પડછાયા.
પડહાળ or પડાળ, <i>f.</i> A verandah. ...	પરસાળ.
પડાવી લીલું, <i>v. t.</i> To charge an exorbitant price. ... ... ...	પડાવી લેલું. ..."
પડી રેલું, <i>v. i.</i> To remain lying. To be useless. ... ... ...	પડી રહેલું. ..."
પંડાણું, <i>n.</i> Selfishness. ... ... ...	પંડે.
પંકુપંક or પંકે, <i>pron.</i> Self, by oneself, alone. ... ... ...	" ..."
પડેળ, <i>f.</i> Eaves. ... ... ...	પડાળ.
પડોણી, <i>m.</i> A neighbour. ... ...	પડોસી.
પડોહેણુ, <i>f.</i> A neighbour. ... ...	પડોસેણુ.
પડચાલી, <i>f.</i> Friendship. ... ...	? પ્રતિ+યારી.
પડચાલો, <i>m.</i> A friend. ... ...	"
પણ, <i>conj.</i> But. <i>enclitic</i> , Also. ...	પણ.
પણુનવું or પણુણ જવું, To become rancid.	વણુસતું.
પણુંબ, <i>v. t.</i> To marry. પણુવા જવું, To go to be married. [The third stage in the marriage ceremony. See લાડી જેવી, and હરો ભરવો].	પરણુંબ. ..." ..."

	Guj. Equiv.
પણુવણું, <i>v. caus.</i> To give in marriage.	પરખુતું.
પણેલી, <i>f.</i> A married woman. ...	પરલોલી.
પણેલો, <i>m.</i> A married man. ...	પરલોલો.
પતંગ, <i>m</i> A kite. ... ...	અતંચ.
પતંગણણું, <i>n.</i> A butterfly... ...	પતંગીણ.
પતંગણણું, <i>adj.</i> Scarlet. ... ...	પતંગ.
પથરાવણું, <i>v. caus.</i> To spread. ...	પથરાવણું.
પધારવું, <i>v. i.</i> To condescend, or be pleased, to come or go (used when speaking to or of a superior). ... ...	પધારવું. ... ... ...
પનરવાડણું, <i>n.</i> A fortnight. ...	પંદરવાડિણું.
પનામાં, <i>adv.</i> Breadthways. In breadth.	પનામાં.
પને or પનો, <i>m.</i> Breadth. <i>adj.</i> Broad...	પને, પનો.
પને દાડે, <i>adv.</i> See પરમ દાડે. ...	પરમ દહાડે.
પભળવું, <i>v. i.</i> To emit a smell. ...	પિભળવું.
પમેલી, <i>f.</i> Dizziness. ... ...	જમરી.
પમેળી આવણી, To feel dizzy. ...	"
પરયા <i>f.</i> Care. કંઈ પરયા નહોં, It does not matter. ... ...	પરવા. ... ...
પરયાત, <i>f.</i> Dawn. ... ...	પ્રભાત.
પરયાતે, At break of dawn. ...	"
પરયાવના, Free from care. Independent.	પરવા.
પરમ દાડે, <i>adv.</i> The day before yesterday. The day after to-morrow.	પરમ દહાડે. ...
પરમ પેદે દાડે, <i>adv.</i> Three days ago. Three days hence. ... ...	પરમ+પેદે+દહાડે. ... ...
પરમાર, Name of a Bhil clan at Sarara.	

## Guj. Equiv.

પરમે, <i>adv.</i> Beyond. ...	...	...	*
પરવીણુ or પરવેણુ, <i>m.</i> Perspiration. ...			પરસોવે.
„ „ વળવેણુ, To perspire. ...			„
પરસુષ્ટી, <i>com.</i> Another person. Some one else. ...	...	...	પર+સુષ્ટુ.
પરાર, <i>adv.</i> The year before last. The year after next. ...	...	...	પરાર.
પરાસતા, <i>n.</i> Atonement. Penance. ...			પ્રાયધિત.
પરાળ, <i>f.</i> Straw. ...	...	...	પરાળ.
પરોદુ, <i>n.</i> or પરોડો, <i>m.</i> The Morning Star. નાતું પરોદુ, The Morning Star near setting—4 a. m. ...			પરોડ.
ઘેદું પરોદુ, The Morning Star high up in the sky—3 a.m....			ઘેદું+પરોડ.
પથ, <i>n.</i> A bridge. ...	...	...	પુથ.
પથક, <i>n.</i> A moment. ...	...	...	પથક.
પલદઢુ, <i>f.</i> A regiment, a corps. ...			પલદઢુ.
પલળતુ, <i>v. i.</i> To be wet. ...	...	...	પલળતુ.
પલળણુ, <i>past.part.</i> Wet, soaked through.			„
પલાંડી, <i>f.</i> A cross-legged position. ...			પલાંડી.
પલાંડી ચામણી, To sit cross-legged. ...			„
પલાણુ, <i>n.</i> A saddle ...	...	...	પલાણુ.
પલાણતુ, <i>v. t.</i> To saddle, to load (a camel, bullock &c.) ...	...	...	પલાણતુ.
પલાળતુ, <i>v. t.</i> To wet, to soak. ...			પલાળતુ.
પસ્તાણુ, <i>adj.</i> Penitent. ...	...	...	પસ્તાણુ.
પસ્તાતું or પસ્તાવો કરવો, To repent.			પસ્તાતું.
પસ્તાવો, <i>m.</i> Repentence, regret. ...			પસ્તાવો.

Guj. Equiv.

પસું, v. i. To digest, to be digested.	પદ્ધતુ.
પસાડી ઓર પસાડુ, <i>adv.</i> Behind. ... ..	પણડી.
અમાડી પસાડી, <i>f.</i> The head and heel ropes of a horse. ...	”
પસાડો, <i>m.</i> A waist-band, a <i>kamarband</i> .	પછેડીયા.
પસીત, <i>f.</i> The back-wall of a house ..	પછીત.
પરીહોં, <i>m.</i> The famine of Samvat 1925 (A. D. 1868). ... ..	પરીસ.
પોસે, <i>adv.</i> and <i>prep.</i> After. ... ..	પછે.
પરોડા, <i>m.</i> A coarse sheet. ... ..	પછેડા.
પરેલંઠું, v. t. To squeeze. ... ..	*
જળ, <i>n.</i> A moment. An auspicious moment. ... ..	જળ.
પળમાં, <i>prep.</i> By means of. ... ..	જળ.
જળ્યાં, <i>n. pl.</i> Grey hairs. ... ..	જળ્યાં.
પાછડી, <i>f.</i> or પાછકુ, <i>n.</i> A wheel. ...	જેણુ.
પાંઘેણુનાં, <i>n. pl.</i> Anything grown by irrigation. ... ..	જાણી.
પાંકડી, <i>f.</i> A side. ... ..	પાખતી.
પાંકંઠું, v. i. To ripen. ... ..	પાકંઠુ.
પાંકુ, <i>adj.</i> Ripe....	પાંકુ.
પાંખ, <i>f.</i> A wing. ... ..	પાંખ.
પાગેળ ઓર ભાગેળ, <i>f.</i> A cattle-shed. ...	*
પાથડી, <i>f.</i> A turban, ... ..	પાથડી.
પાંજરું, <i>n.</i> A cage. ... ..	પાંજરુ.
પાંનો, <i>m.</i> A foundation. ... ..	પાંયો.
,, દડવો or નાખવો, To lay a foundation.	”
પાંચ, <i>m.</i> A season. ... ..	પાંક.

	Guj. Equiv.
પાટલી, f. A step of a well. ...	પાટલી.
પાટલો, m. A bench. ...	પાટલો.
પાટવેલ, f. A joist. ...	પાટવેલ.
પાંટયુ, n, A board. ...	પાટિંગ.
પાડુ, f. A kick, પાડુ આખ્યી, To kick. ...	પાડુ.
પાટો, m. A bandage. ...	પાટો.
પાકળયુ, n. A chicken... ...	પાકો.
પાડવું, v. t. To let fall, to knock down.	પાડવું.
પાડા, m. A division of a Pal, a ward.	પાડા.
પાડેર, Name of a Bhil clan at Limada.	...
પાડો, m. A buffalo. ...	પાડો.
પાણી, n. Water. ...	પાણી.
પાણી બુદાણું, n. Ice. ...	પાણી+બાંધવું.
પાણો, m. A stone. ...	પાણો.
પાતકી, f. A side. ...	*
પાતકન્યે ફુઘ જવું, To go to sleep on one's side ...	„
પાતર, f. A bad woman. ...	પાતર.
પાતળું, adj. Thin, lean. ...	પાતળું.
પાતળન્યો, A thin man. ...	„
પાથરન્યો, m. Red rice... ...	*
પાથરવું, v. t. To spread. ...	પાથરવું.
પાથરલું, n. A mattress. ...	„
પાદરું, adj. Straight. ...	પાદર.
„ આવણું, To be done well. ...	„
પાદેર, adj. Level, flat... ...	પાધર.
પાતુ, n. A leaf. ...	પાતુ.
પાપ, n. Sin, a sin. ...	પાપ.

	Guj. Equiv.
પાંપણ્યું, <i>n.</i> An eye-brow, an eye-lash.	પાંપણ્ય.
પાપી or પાપેકું, <i>adj.</i> Sinful. <i>s.m.</i> A sinner.	પાપી.
પાંમણો, <i>m.</i> A guest, a visitor. ...	? પરેણો.
પાંમણું or પામતું, <i>v.t.</i> To obtain. ...	પામતું.
„ (with Infin) To manage, to receive permission, to be able. ...	„
પાથડો, <i>m.</i> An arrow-head. ...	...
પાખમું, <i>adj.</i> Sharp. ...	*
પાયલી, <i>f.</i> A four-anna piece....	*
પાર, <i>m.</i> End. <i>adj.</i> Finished. ...	પારલી.
„ કરવું, <i>v.t.</i> To finish... ...	પાર.
„ થવું, <i>v.i.</i> To be finished....	પાર કરવું.
„ વગર or પારવના, Endless... ...	પાર થવું.
પારકું, <i>adj.</i> Another's.... ...	પાર વગર.
પારખ or પારખા, <i>f.</i> A test, an examination. Temptation. ...	પારકું.
„ આલદી, To go in for an examination.	પારખ.
„ લેલી, To hold an examination....	...
પારખનું, or પારખા કરવી, To test. To tempt.	પારખનું.
ચારળી, Name of a Bhil clan at Chawand. ...	...
પારણું, <i>n.</i> A cradle. ...	...
ચારેવો, <i>m.</i> A pigeon. ...	પારેવો.
પાલ, <i>f.</i> A Bhil settlement in the midst of hills. ...	પાલ.
ચાલકી <i>f.</i> A palanquin....	...
ચાલો, <i>m.</i> Fodder for cattle. ...	પાલખો.

## Guj. Equiv.

પાંડો, <i>m.</i> A spade, a shovel. ...	...	પાંડો.
પાંતુ, <i>v.t.</i> To give to drink. To irrigate.		પાંતુ.
પાંચ, <i>adj.</i> Five. પાંચ વિંદે, A hundred.		પાંચ.
પાંસમેરી, <i>f.</i> A five-pound weight..	...	પાંસ+મેરી.
પાસથો, <i>m.</i> A razor.	...	*
પાસું, <i>adv.</i> Back. Again.	...	પાસું.
„ આવાસું, To restore.	...	પાસું આવાસું.
„ મળસું, To get back. To recover (a thing).	...	„ મળસું.
પાછ, <i>f.</i> Side (rarely used except in અધ્યુતીપાછ, on this side, and પેલીપાછ, on that side ).	...	...
પાહું, <i>n.</i> A kid.	...	*
પાહુંથી, <i>adj.</i> Last.	...	પાહુંથી.
પાહુંથી રેણા, <i>f.</i> The afternoon.	...	„
પાંદળું, <i>n.</i> A rib...	...	પાંસફું.
પાહે, <i>prep.</i> Near.	...	પાસે.
પાહે આઈને, By, near, past, through....		પાસે આઈને.
પાહેર જ પાહેરા, <i>m.</i> A quarter.	...	પા.
પાહેરા, <i>m.</i> A small earthen vessel for measuring ghee.	...	પારીસે.
પાળ, <i>f.</i> An edge, a margin.	...	...
પાળવું, <i>v.t.</i> To nourish, to bring up, to rear. To abstain.	...	પાળવું.
પાળી, <i>f.</i> A measure containing about two seers...	...	...
પાળનથો, <i>m.</i> A cairn indicating the place where a murder has been com- mitted....	...	પાળનથો.

	Guj. Equiv.
પાળણું, past part. Tamie. ... ...	પાળણું.
પીચેર, n. The house of a wife's parents.	પિયર.
પીચેથાં, n. pl. The relatives on the wife's side. ... ... ...	પિદેરીઓાં.
ખોજણાં, n. pl. Anklets... ...	...
પીડા, f. Pain, trouble... ...	*
પીડી, f. A generation. ... ...	પીડા.
પીતળ, n. Brass. ... ...	પીટળ.
પીદાણાં, n. pl. Sore feet caused by exposure to damp. ... ...	પિદાણ.
પીપળા, m. The pipal tree. ... ...	પીપળા.
પીવું, v.t. To drink. ... ...	પીવું.
પીળું, adj. Yellow. ... ...	પીળું.
પુષ્કા, n. or પુષ્કાણ, m. An ear of Indian corn. ... ... ...	? પોંખ.
પુગવું, v.i. To reach, to last....	પુગવું.
પુજવું, v.t. To worship... ...	પુજવું.
પુળ, f. Worship. ... ...	પુળ.
પુણ, f. Capital, treasure. ... ...	પુણ.
પુણવાળું adj. Rich. ... ...	"
પુઢે, prep. Behind, after. ... ...	પુડે.
પુષ્ય, n. Merit.... ...	પુષ્ય.
પતેમ, f. The day of the full moon. ...	પુનેમ.
પુરું, adj. Finished, perfect. ... ...	પુરું.
,, કરવું, To finish. ... ...	પુરું કરવું.
,, થવું, To be finished. ... ...	,, થવું.
,, પાપવું, To supply with, to procure.	,, પાપવું.
પુસ્કા, n. A tail... ...	પુષ્કા.

Guj. Equiv.	
પુસતું, v.t. To ask, to enquire... ...	પૂષ્ટં.
પુણી, f. A small bundle of grass. ...	પુણી.
પુગો, m. A large bundle of grass. ...	પુગો.
પુળ્યું, n. A small necklace. ... ...	*
પેનર, f. Old, mended shoes ..	પેનર.
પેણું, n. Brains. ... ...	બેણું.
પેટ, n. The stomach. ... ...	પેટ.
પેટ ચક્કાં, To be flatulent. ... ...	"
પેટનાંયું, n. Rations supplied free by villagers to a Raja and his retinue.	પેટ.
પેટું, v. Entered. <i>Irrey. Past of પેણું</i> ....	પેટું.
પેંક, n. A large frog. ... ...	*
પેણસણું f. Pension. ... ...	Pension.
પેદા, adj. Created, produced... ...	પેદા.
,, કરવું, To create, to produce. ...	પેદા કરવું.
,, થાવું, To be created. ... ...	,, થવું.
પેદાસ, f. Birth, produce. ... ...	પેદાશ.
,, ફરી, To earn ... ...	,,
પેરણું, n. A shirt. ... ...	પહેરણું.
પેરવું, v.t. To wear, to put on... ...	પહેરવું.
પેરાવણું, v. caus. To give to wear. ...	પહેરાવણું.
પેલાં, adv. & prep. Before. ... ...	પહેલાં.
પેલું, adj. First... ... ...	પહેલું.
પેલું, adj. That.... ... ...	પેલું.
પેલીઆડ or પેલીપાઠ or પેલેપાર, On the further side. Beyond. ...	,,
પેસક m. A skein of cotton. ... ...	પેચ.
પેહ, m. A handful. ... ...	પોસ.

	Guj. Equiv.
પેઠું, v.i. To enter. ... ... ...	પેસતું.
પેઢી આવણું, To come in. ... ...	પેસી આવવું.
પેઢી જવું, To go in.... ... ...	પેસી જવું.
ગો, m. December–January. ... ...	પોષ.
પો, v. Give to drink. Imperat. of પાવું.	પાઓ.
પોઅાડ, f. A certain weed (used as a vegetable). ... ... ...	પુઅાડ.
પોગા, m. The foot. The leg. ... ...	... પગ.
પોગડંડી, f. A foot-path. ... ...	” ”
પોગાહું કસરવું, To trample under foot.	” ”
પોગે, On foot. ... ... ...	પગે.
„ લાગવું, To fall at another's feet. To entreat. To worship. ...	પગે લાગવું. ... પોટખો.
પોટખો, m. A large bundle. ... ...	પોટલી.
પોટલી, f. or પોટયું, n. A small bundle, a parcel. ... ...	... પોટિયો.
પોઈ, m. A pack-bull.... ... ...	પોતે.
પોતે, pron. Self. ... ... ...	” *
પોતાનું કરવું, To be selfish. ... ...	પોપટ.
પોથવું, v.t. To wrap round, to envelop.	પોદો.
પોપટ, m. A parrot. ... ... ...	પોર.
પોયટો, m. Cow's dung... ... ...	પોરો.
પોર, adv. Last year. Next year. ...	” પોરો.
પોરાવાળા, m. A guard, a sentinel. ...	” પોરો.
પોરો, m. A watch, a guard. ...	” ... પોરું.
„ કરવો or દીવો, To watch, to keep guard. ... ... ...	” ... પોરું.
પોણું, adj. Hollow. ... ... ...	” ... પોરું.

Guj. Equiv.			
પોવન, <i>m.</i> The wind. ...	...	...	પવન.
પોસણું, <i>v.t.</i> To wipe. ...	...	...	ભુસણું.
પોસી ઢાણું, To wipe out. ...	...	...	”
પોચું, <i>adj.</i> Soft... ...	...	...	પોચું.
પોળખાંડ or પોળાંડ, <i>f.</i> Breadth, width...			પહોળાંડ.
પોણું, <i>adj.</i> Broad, wide... ...	...	...	પહોળું.
ખાંદું, <i>n.</i> A cup... ...	...	...	ખાંદું.
દ્વ.			
કૃકૃત, <i>adv.</i> Merely, only. ...	...	...	કૃકૃત.
કૃકર, <i>f.</i> Anxiety, perplexity....	...		કૃકરો.
કૃકોણું, <i>n.</i> A wooden ear-ring worn by women. ...	...	...	*
કૃટકદી, <i>f.</i> Alum...	...	...	કૃટકદી.
કૃકૃદ, <i>adj.</i> In a flutter. ...	...	...	કૃકૃદ.
,, થાંદું, To throb, to flutter... ...	...		”
કૃછેણ or કૃષુગોણ, <i>m.</i> A sprout....	...		કૃષુગોણ.
કૃપલું, <i>adj.</i> Damp. ...	...	...	*
કૃસું, <i>v.i.</i> To turn, to walk. ...	...		કૃસું.
કૃરવા જણું, To go for a walk... ...	...		”
કૃરી કૃરીને, Over and over again. ...	...		કૃરી કૃરીને.
કૃરીને, Again. ...	...	...	”
કૃરીઅણ, <i>f.</i> A complaint. ...	...	...	કૃરીઅણ.
કૃરીઅણાદી, <i>m.</i> A plaintiff. ...	...	...	કૃરીઅણાદી.
કૃળ, <i>n.</i> Fruit. Reward. Result. ...	...		કૃળ.
,, પામવું, To reap one's reward ...	...		”
કૃળોળ, Name of a Bhil clan at Khajuri. ...			...
કૃળા, <i>m.</i> A quarter in a Bhil settlement, a ward. ...	...	...	કૃળિયું.
			...

## Guj. Equiv.

હાઈ, <i>f.</i> An aunt—a father's sister...	હોઈ.
હાગણુ, <i>m.</i> February-March. ...	હોગણુ.
હાટવું or હાટી જવું, <i>v.i.</i> To crack, to split.	હોટવું.
હાસ, <i>f.</i> A split, a rent. ...	હોસ.
હાડવું, <i>v.t.</i> To tear, to split. ...	હોડવું.
હાર્ડો, <i>m.</i> The shoulder blade...	હોર્ડો.
હાબી, <i>f.</i> Father's elder brother's wife.	ભાબી.
હાયદો, <i>m.</i> Advantage, gain. ...	હોયદો.
હાવણુ, <i>v.i.</i> To be favourable... ...	હોવણુ.
હાંસી, <i>f.</i> A noose. હાંસી દીવી, To hang...	હાંસી.
હાળણુ, <i>n.</i> A small <i>pagri</i> . ..	હોળણુ.
હીકુ, <i>adj.</i> Pale. Insipid. ...	હીકુ.
હીકુઓ, <i>m.</i> A wooden arrow-head used in shooting birds ( <i>lit.</i> a joint of a bamboo or sugar-cane)...	? પેરીણ.
હીર or હેર, <i>adv.</i> Again. ...	હોરી.
હુઅા or ખુઅા, <i>f.</i> An aunt—father's sister. ... ... ...	હોઅા.
હુએા or ખુએા, <i>m.</i> An uncle—father's sister's husband. ...	હુએા.
હુટવું or હુટી જવું, <i>v. i.</i> To burst. ...	હુટવું.
હુટી, <i>f.</i> A butterfly. ... ...	હુટી.
હુટી, <i>f.</i> A cotton ornament worn on the wrist. ... ...	*
હુલુ, <i>n.</i> Cataract. ... ...	હુલુ.
હુલું, <i>n.</i> A flower. ... ...	હુલ.
હું, <i>m.</i> Dawn.. ...	પોહ.
હું હાટવાં, At break of dawn. ...	"

	Guj. Equiv.
ફથસો, <i>m.</i> A decision. ... ... ...	ફસસો.
„ કરવો, To decide, to settle. ...	„
ફર or ફીર, <i>adv.</i> Again... ... ...	ફરી.
ફર or ફરશાર, <i>m.</i> Change, difference...	ફર.
ફરવણું, <i>v. t.</i> To change. ... ...	ફરવતું.
ફલ, <i>m.</i> A difference of opinion. ...	ફલ.
ફલાખણું, <i>v. t.</i> To spread (news &c.) ...	ફલાવતું.
ફળ, <i>f.</i> A pod. ... ... ...	ફળી.
ફાઈ or ફુદ્ધ, <i>f.</i> An aunt—father's sister.	ફાઈ.
ફાળ, <i>f.</i> An army. ... ... ...	ફાળ.
ફાયદાર, <i>m.</i> A police-magistrate. ...	ફાયદાર.
ફાડવું, <i>v. t.</i> To break. ... ...	ફાડવું.
ફાડી ફાવું, To break into pieces. ...	„
ફાખું, <i>n.</i> A foot. ... ... ...	? પાય.
ફાતરાં, <i>n. pl.</i> Husks of grain... ...	ફાતરાં.
ફાકેન્યા, <i>n. pl.</i> Whispering. ... ...	*
„ કરવાં, To whisper (derivation possibly traceable to the sound made by whispering). ... ...	... ... ...
ફાર, <i>on.</i> The eight part of a day. ...	પહેલાર.
ઘફાર, Noon. ... ... ...	ઘરોર.
ફાડા ફાર or ટાડે ફાર, The afternoon...	ફાડા+પહેલાર.
ફાર સફળસો, The morning from 6-9 a.m.	પોર+ચક.
ફારી, <i>adj.</i> Light (not heavy). Nimble.	ફારી.
ફિલ ફારી, <i>adj.</i> Active, energetic. ...	ફિલ+ફારી.
ફારી, <i>n.</i> A large drop of rain... ...	ફારી.
ફારોં, <i>m.</i> A boil. ... ... ...	ફારોં.
ફાલવું, <i>v.t.</i> To peel rind or bark, to shell grain. ... ... ...	ફાલવું. ...

Guj. Equiv.**ખ.**

ખકું or ખકખક કરું, <i>v.t.</i> To chatter....	ખકું.
ખક્સીસ, <i>f.</i> A present....	ખક્ષીશ.
ખકવા, <i>m. pl.</i> Rubbish....	*
ખગડું, <i>v.t.</i> To be spoiled.	ખગડું.
ખગડું, <i>adj.</i> Spoiled. ખગડા દાંત, Ugly....	„
ખગલ, <i>f.</i> The arm-pit....	ખગલ.
ખગલમાં, Under the arm....	„
ખગાડ, <i>m.</i> Harm, injury.	ખગાડ.
ખગાડી, <i>f.</i> Yawning. ...	ખગાડું.
„ હેરવી, To yawn. ...	„
„ તાણવી, To yawn excessively. ...	„
ખગોા, <i>m.</i> A mouthful....	ખુકુ.
ખળર, <i>m.</i> A market. ...	ખળર.
ખળરમાં ભાવ, The market-price or rate.	„
ખટકી <i>f.</i> or ખટકું, <i>n.</i> A piece....	ખટકું.
„ ફરવી, To break into pieces. ...	„
ખતોળ, <i>f.</i> Enlarged spleen. ...	*
ખથું, <i>v.i.</i> To happen. To agree (with dative). ...	ખનવું.
ખથુાવણ્ણું, <i>v.t.</i> To make... ...	ખનાવવું.
ખતાવણ્ણું, <i>v.t.</i> To shew....	ખતાવવું.
ખતી, <i>f.</i> A lantern. ...	ખતી.
ખતેક, <i>m.</i> A duck. ...	ખતક.
ખંડ, <i>adj.</i> Closed. ...	ખંડ.
„ ફરવું, To close. To stop....	...
ખદલે, <i>prep.</i> Instead of... ...	ખદલે.

	Guj. Equiv.
બદ્લો, <i>m.</i> A substitute. ... ...	બદ્લો.
„ કરવો, To change. ... ...	...
બદ્વાર, <i>m.</i> Wednesday... ...	બુધવાર.
બંદાતું or બંદાઈ નાતું, To be congealed... ...	બંધાતું.
બદુ, <i>adj.</i> All, the whole. ... ...	બદુ.
બંડુક, <i>f.</i> A gun. ... ...	બંડુક.
બંડુક સેડવી, To fire off a gun... ...	„
બંદોખસ, <i>m.</i> Arrangement. ... ...	બંદોખસ્ત.
„ કરવો, To arrange. ... ...	„
બનો, <i>pron.</i> Both. ... ...	બને.
બહેાર, <i>m.</i> Noon. કુળા બહેાર, About 11a.m.	બપોાર.
બધોા, <i>m.</i> Earth with rubble in it. ...	*
બંધારકાર થાતું. See જળ બંધારકાર થાતું. ...	...
બમણ્ય, <i>m.</i> A Brahman. ... ...	આબ્ધણ્ય.
બમણું, <i>adj.</i> Double, twice as much...	બમણું.
બૂરસવાર, <i>m.</i> Thursday.... ...	બૂરસતવાર.
બરાખર, <i>adj.</i> Right. <i>adv.</i> Correctly....	બરાખર.
અલ or બોલ, <i>m.</i> A cave. ... ...	બોલ.
અસ્કો, <i>m.</i> A bundle. ... ...	અચ્કો.
અસન (or વસન), <i>n.</i> A promise, a word.	વચન.
અસતું, <i>v. i.</i> To escape. To be saved...	અચ્યતું.
અસાવણું, <i>v. t.</i> To protect, to preserve.	અચાવણું.
અષુ, <i>adj.</i> and <i>adv.</i> Many, much. ...	અષુ.
અળ, <i>n.</i> Strength. ... ...	અળ.
અળદ, <i>m.</i> An ox. .. ...	અળદ.
અળદમારા તારો, The Evening Star. ...	અળદ+માર+તારો.
અળવાન, <i>adj.</i> Strong, powerful. ...	અળવાન.
અળતું, <i>v. i.</i> To burn. To be scalded...	અળતું.

Guj. Equiv.

અગાડો, Name of a Bhil clan at Kan-tharia.	...	...	...	...
અળીત, n. Firewood.	...	...	...	અળતથ.
આઈ, f. A term of respect used in addressing a woman.	...	...	...	આઈ.
આઈડી; f. A woman. આઈડી કરવી, To marry.	...	...	...	આઈડી.
આકરી, f. A she-goat.	...	...	...	અકરી.
આકડું, n. A kid.	...	...	...	અકડું.
આકરો, m. A ram.	...	...	...	અકરો.
આકી, f. The remainder. adj. Remaining.	...	...	...	આકી.
આખડું or આખકું કેદું, n. A young heifer.	...	...	...	? વાષ્ટું.
આગ, m. A garden.	...	...	...	આગ.
આજુ, f. A side.	...	...	...	આજુ.
આટકો, m. A muscle.	...	...	...	*
આટકા હરકું, Tough (lit. like muscle)...	...	...	...	
આંકું, adj. Tailless. With the tail cut short. Squint-eyed.	...	...	...	આંકું.
આથાં પડવું, v. i. To wrestle.	...	...	...	આથ ભીડવી.
આદરવો, m. August-September.	...	...	...	આદરવો.
આંદવું, v. t. To bind, to fasten, to tether. To build.	...	...	...	આંધવું.
આધા, f. A vow.	...	...	...	આધા.
આતું, n. A sacred cord worn round the neck.	...	...	...	*
આતું, n. Earnest-money, an advance.	...	...	...	આહતું.
આપ, f. A father.	...	...	...	આપ.
આપડો, આપડી, A poor creature.	...	...	...	આપડો.
આપદાદા, m. Ancestors...	...	...	...	આપદાદા.

## Guj. Equiv.

ખાયત, <i>prep.</i> About, concerning. ...	ખાયત.
ખાયી, <i>f.</i> An aunt—Father's elder brother's wife. ... ...	* ...
ખાયો, <i>m.</i> An uncle—Father's elder brother. ... ... ...	* ...
ખાંભણુ, Name of a Bhil clan at Ubri.	... ...
ખાયે, <i>prep.</i> Outside of. ... ...	ખાર.
ખાર, <i>adj.</i> Twelve. ... ...	ખાર.
ખારણુ or ખાયણુ, <i>n.</i> A door. ...	ખારણુ.
ખારણુની હાક, A door-frame...	ખારસાખ.
ખારણું, <i>v.t.</i> To sweep. ... ...	ખારણું.
ખારી, <i>f.</i> A window. ... ...	ખારી.
ખારે પોર, <i>adv.</i> Always...	ખારે+પોર.
ખારો, <i>m.</i> A whisk for sweeping. ...	ખારારણું.
ખાવસી, <i>m.</i> Lord, Sir. ... ...	ખાવાજ.
ખાવાજ, <i>m.</i> A respectful term for a <i>guru</i> or teacher. ... ...	” ...
ખાસકું, <i>n.</i> A handful....	ખચકું.
ખાળક, <i>n.</i> A child, an infant....	ખાળક.
ખાળવું, <i>v.t.</i> To burn, to scorch...	ખાળવું.
ખાળી દડતુ, To burn up completely...	”
ખી or ખીઠ, <i>n.</i> Seed. ... ...	ખી.
ખી or ખીક, <i>f.</i> Fear. ... ...	ખિફીક.
„ „ લાગવી, To be afraid (with dat. of person). ...	„ ...
ખીઆડવું, <i>v.t.</i> To terrify... ...	ખિફીવાડવું.
ખીઆમણું, <i>adj.</i> Fearful, terrible. ...	ખિહામણું.
ખીકણુંનું, <i>adj.</i> Timid. ... ...	ખિહીકણું.

	Guj. Equiv.
ઘોર, <i>f.</i> The second day of the lunar month. ... ... ... ...	ઘોર. ...
ઘોર, <i>n.</i> A seed. ... ... ...	ઘોર. ઘોર.
ઘોર્ય, <i>adj.</i> Second. Another... ...	ઘોર્ય. ઘોર્ય.
ઘોર્ય ટીર્ય, Etcetera. ... ... ...	” ”
ઘીડી, <i>f.</i> A pipe. ઘીડી ઘીડી, To smoke... ...	ઘીડી. ઘીડી.
ઘીડચું, <i>n.</i> A fetter. ... ... ...	ઘીડચું. ઘીડચું.
ઘીડચાંમાં ધાલવું, To put into chains. ...	” ”
ઘીવું or ઘી જવું, <i>v.t.</i> To fear (with abl. of object feared). ...	ઘીષીવું. ...
જૂર, <i>f.</i> A cork. ... ... ...	જૂર. જૂર.
જુદી, <i>f.</i> The lobe of the ear... ...	જૂદી. ” ”
કાનની જુદી પકડવી, To acknowledge oneself in the wrong... ...	... ” ”
જુડન્યું, <i>n.</i> A lizard. ... ... ...	* *
જુગવું, <i>v.i.</i> To sink. ... ... ...	જુગવું. ” ”
જન or દાડો જુદી ગીજ્યો, The sun has set. ...	... ” ”
જુડી મરવું, <i>v.i.</i> To be drowned... ...	જુદી મરવું. ...
જુદું, <i>n.</i> The bottom of anything. ...	* * જુદું.
જુમ, <i>f.</i> A shout, a noise. ... ...	જુમ. ” ”
જુમ પાડવી, To shout. ... ...	જુમ પાડવી. ” ”
એ, <i>adj.</i> Two. એસારેક, A few. ...	એ. ” ”
એ આશ્ચર્યાંમાં, On both sides. ... ...	” ”
એઅંબાં કણ્ણ નહીં, Neither of two....	” ”
એકું, <i>n.</i> The pair of water-pots which women carry on their heads. ...	એકું. ...
એન, <i>f.</i> A sister. ... ... ...	એન. એન.

## Guj. Equiv.

બેરસું, <i>adj.</i> Confused. Stupefied. ...	*
„ ધારું, To lose one's head. ...	"
બેભાન, <i>adj.</i> Unconscious. ...	બેભાન.
બેમન, <i>n.</i> Indecision, doubt. ...	બે+મન.
બેમતું, <i>adj.</i> Doubtful, undecided, wavering....	"
બેરાળ, <i>adj.</i> Displeased, cross...	બે+રાળ.
બેરિ, <i>adj.</i> Deaf....	બહેરિ.
બેટું, <i>v.i.</i> To sit. ...	બેસતું.
બેઠી નતું, To sit down. ...	"
બો, <i>f.</i> Scent, smell. ...	બો.
„ આવણી, <i>v.i.</i> To smell, to emit a smell. ...	"
બોાકી, <i>f.</i> A kiss. બોાકી કરવી, To kiss.	બોાકી.
બોડાન, Name of a Bhil clan at Buri and Hamimali. ...	...
બોદ્ડી, <i>n.</i> Fever with a swelling arising from guinea-worm. ...	*
બોખું, <i>adj.</i> Stammering, stuttering....	બોખું.
બોર, <i>f.</i> The jujube tree. ...	બોરડી.
બોરિ, <i>n.</i> The fruit of the jujube tree.	બોર.
બોરિ <i>n.</i> An ornament for the forehead.	*
બોલ, <i>m.</i> A cave ( for large animals, such as tigers, bears &c. ). ...	બોલ.
બોલબોલ કરવું, To chatter incessantly...	...
બોલવું, <i>v.t.</i> To speak. બોલવુંસાલતું, Conduct.	બોલવું.
બોલી, <i>f.</i> One's mother tongue. A dialect. A promise... ...	બોલી.

			Guj. Equiv.
ઓલી કરવી, To promise.	...	...	ઓલી.
ઓછ, m. A noise.	...	...	? બકોર.
,, કરનો, To make a noise.	...	...	,,
<b>સ.</b>			
અકતાની, f. A bad woman.	...	...	અકતા.
અગત, m. A worshipper, a votary, a devotee.	...	...	અગત.
અગતી, f. Worship.	...	...	...
અગતી કરવી, To worship.	...	...	અગતી.
અગવાન, m. God.	...	...	અગવાન.
અગોરા, Name of a Bhil clan near Balwara...	...	...	...
અજન, n. Worship.	...	...	અજન.
,, કરવું, To worship.	...	...	,,
અડવું, v.t. To grind coarsely....	...	...	અડવું.
અણવું, v.t. To learn.	...	...	અણવું.
અણ્ણાવણ્ણ, v. caus. To teach.	...	...	અણ્ણાવણ્ણ.
અન્નીને, m. A nephew—a brother's son.			અન્નીને.
અમવું, v.i. or અમતું ઇરવું, To wander about.			અમવું.
અમેળી or પમેળી, f. Dizziness...	...	...	અમરી.
,, આવણી, To feel dizzy (with dat. of pers.).	...	...	,,
અરવું, v.t. To fill. To pay.	...	...	અરવું.
અરીને પાસું આપવું, To pay back, to refund.	...	...	,,
અરી ઢીવું, v.t. To fill up.	...	...	અરી ઢીવું,
અરેલું, past partic. Filled, full...	...	...	અરેલું.

		Guj. Equiv.
ભરોહેંા, <i>m.</i> Trust, confidence....	...	ભરોસે.
ભરોહાવાળું, <i>adj.</i> Trustworthy.	...	"
ભલાઈ, <i>f.</i> Kindness, goodness....	...	ભલાઈ.
,, કરીને, Kindly, please. ...	...	"
ભર્તું, <i>adj.</i> Good, kind....	...	ભર્તું.
ભહંતું, <i>v.i.</i> To bark. ...	...	ભસતું.
ભાઈ, <i>m.</i> A brother. A cousin. A term frequently used in addressing a friend. ...	...	ભાઈ.
ભાઈયું, <i>m.</i> A friend. ...	...	ભાઈય-ય.
ભાંગ, <i>f.</i> Tobacco. ...	...	ભાંગ.
,, પીવી, To smoke tobacco... ...	...	"
ભાગ, <i>m.</i> A share, a portion....	...	ભાગ.
ભાગયો, <i>m.</i> A colleague, an heir. ...	...	ભાગીયો.
ભાગેઠ or પાગેઠ, <i>f.</i> A cow-house. ...	...	*
ભાંજતું or ભાળ પાડતું, <i>v. t.</i> To break. ...	...	ભાંજતું.
ભાળ, <i>f.</i> Greens, vegetables....	...	ભાળ.
ભાણી, <i>f.</i> A still for brewing liquor. ...	...	ભણી.
ભાડો, <i>m.</i> A large stone. ...	...	*
મોટો ભાડો, A rock. ...	...	...
ભાડું, <i>n.</i> Hire. ભાડે રાખતું, To hire... ...	...	ભાડું.
ભાણેજ, <i>m.</i> A nephew—a sister's son ( who is supposed never to be refused anything ). ...	...	ભાણેજ.
ભાત, <i>n.</i> Boiled rice. ...	...	ભાત.
ભાથ, <i>n.</i> Food. ...	...	ભાથું.
ભાદરવો <sup>or</sup> ભાદરવો, <i>m.</i> August—September.	...	ભાદરવો.
ભાન, <i>n.</i> Consciousness... ...	...	ભાન.

Guj. Equiv.

ભાન આવણું, To revive (with dat. of pers.).	ભાન.
ભાંપણું or પાંપળું, n. An eyebrow or eyelash....	પાંપળું.
ભાબો, m. A husband. ...	...
ભાયગ, n. Fortune, luck, chance. ...	*
ભાયડો or પાયડો, m. An arrow-head ( used for fighting or for shooting big game)...	ભાયગ.
ભાર, m. A load. ...	ભાર.
ભારી or ભારે, adj. Heavy. ...	ભારે.
ભાવ, m. Rate, price. ...	ભાવ.
ભાવણું, v.i. To be liked, to be agreeable, to suit. ...	ભાવવું.
ભાળવું, v.t. To shew. ...	ભાળવું.
ભીખ, f. Alms. Begging. ...	ભીખ.
,, માગવી, To beg. ...	”
ભીખારી, m. A beggar....	ભીખારી.
ભીડા, m. A certain vegetable. ...	ભીડા.
ભીત or ભીતડો, m. A wall. ...	ભીત.
ભીલ, m. A forester, a robber, a <i>Bhil</i> . ...	ભીલ.
ભીલડી, f. A <i>Bhil</i> woman. ...	ભીલડી.
જુઈ or કુઈ, f. An aunt—a father's sister. ...	કુઈ.
જુએ or કુએ, m, An uncle—a father's sister's husband. ...	કુએ.
જુકો, m. Anything powdered... ...	...
જુખ, f. Hunger. જુખે ભરવું, To starve. ...	જુખ.
જુહણું, past part. Hungry. ...	જુહણું.
જુહુ, adj. Evil....	જુહુ.

## Guj. Equiv.

જૂત, <i>m.</i> A spirit. A whirlwind. ...	જૂત.
જૂત, Name of a Bhil clan at Buri and Hamamali. ... ... ...	...
જૂલ, <i>f.</i> A mistake. જૂલાં, By mistake. „ ખાવી, To make a mistake, to be mistaken. ... ... ...	જૂલ. „ ...
„ પાડવી, To mislead. ... ... ...	જૂલ પાડવી.
જુલકાંત, <i>f.</i> Trickery. ... ... ...	*
„ કરવી, To trick, to take in. ...	...
જુલસુષુપ્તિ, <i>f.</i> Mistakes. ... ... ...	જુલસુષુપ્તિ.
જુલી જાણું, <i>v.t.</i> To forget. ... ... ...	જુલીજાણું.
જુલેલા પડુન્યો, <i>adj.</i> (One) who has lost his way	જુલેલા પડુન્યો.
જુસતું or પોસતું, <i>v.t.</i> To wipe. ... ...	જુસતું.
જુસી દઢતું, To wipe out completely. ...	„
બેગું or બેળું, <i>adj.</i> United, collected. ...	બેગું.
બેગાં or બેળા થાઈને, Together. ...	„
બેગાં થાવાં, To meet together. ...	„
બેગું or બેળું કરવું, To gather together, to collect.... ...	...
બેદ, <i>m.</i> Separation. Secret. Mystery... „ લીનો, To spy, to find out a secret.	બેદ. „
બેદ, <i>m.</i> A spy... ... ... ...	બેદ.
બેળું. See બેગું. ... ... ...	બેળું.
બો, <i>m.</i> Risk, danger ... ... ...	બો.
બોાઈ, <i>m.</i> A <i>palki</i> -bearer. ... ...	બોાઈ.
બોન્યો, <i>m.</i> A guide. ... ... ...	બોન્યો.
બોયો, <i>m.</i> One who chants a magic formula over a sick person. ...	...
ભોણ્ય, <i>f.</i> The ground. Land. ... ...	ભોણ્ય.

## મ

મછો, <i>m.</i> A long piece of wood for levelling ploughed land....	...	...	*
, ફિવો, To level ploughed land.	..	..	..
મકલાધ, <i>f.</i> A joke.	...	...	મકલાદુ.
મકલાતું, <i>v. i.</i> To go about dressed in one's best clothes....	...	...	„
મકાધ or મકી, <i>f.</i> Indian corn....	...	...	મકાધ.
મકાન, <i>n.</i> A place, a residence.	...	...	મકાન.
મકુડી or મકોડી, <i>f.</i> A small black ant...	...	...	મકોડી.
મકુડો or મકોડો, <i>m.</i> A large black ant.	...	...	મકોડો.
મખવા, <i>n.</i> Meat.	...	...	*
મગર, <i>m.</i> An alligator.	...	...	મગર.
મગરસી, <i>adj.</i> Supercilious.	...	...	મગરસી.
મગરો, <i>m.</i> A hill.	...	...	*
મંગળવાર, <i>m.</i> Tuesday....	...	...	મંગળવાર.
મજૂત, <i>adj.</i> Strong, firm.	...	...	મજૂત.
મજરો, <i>m.</i> Salutation.	...	...	મુજરો.
મજલ, <i>f.</i> A stage, a day's journey.	...	...	મજલ.
મજા, <i>f.</i> Enjoyment, pleasure....	...	...	મજા.
મજુ, <i>f.</i> A box, a safe.	...	...	મજૂસ.
મણ્ય, <i>prep.</i> According to.	...	...	મુજાય.
મજુર, <i>m.</i> A labourer.	...	...	મજૂર.
મજુરી, <i>f.</i> Labour.	...	...	મજૂરી.
મઠ, <i>m.</i> A kind of pulse.	...	...	મઠ.
મટું, <i>v. i.</i> To become less (as pain, disease).	...	...	મટું.

	Guj. Equiv.
મહાત્માં, v.t, To lessen, to make less ( as pain, disease ) ...	મટાત્માં.
મડકુ, n. A corpse. ...	મડકુ.
મત, m. or મતુ, n. Opinion. ...	મત.
મતલખ, m. Object, meaning. ...	મતલખ.
મતલખી, adj. Opinionative, self-willed.	મતલખી.
મથતું, v. t. To twist. ...	મથતું.
મંદવાડ, m. Sickness, illness. ...	મંદવાડ.
મધ્યાળુ, adj. Kind-hearted. ...	માયાળું.
મન, n. Mind, will, inclination. ...	મન.
મનમાં આહતું, To smile....	મનમાં હસતું.
મનખ, n. A human being. ...	મનખ.
,, અપતાર, m. Transmigration. ...	મનખ+અવતાર.
મનખો, m. Life, existence. ...	મનખ.
મનસુષો, m. A plan, a plot. ...	મનસુષો.
મનહું, adv. Spontaneously, of one's own accord. ...	મન.
મના, f. Prohibition. મના કરવી,To forbid.	મના.
મય, pron. Me. See Gr. § 14. ...	મને.
મરકી, f. An ear-ring worn by men.'...	*
મરજાધ, f. A long coat. ...	*
મરજ, f. Will, pleasure. ...	મરજ.
મરતું or મરીનતું, v. i. To die. ...	મરતું.
મરસું,n. A chili. કાળાં મરસાં, Black pepper.	મરચું.
મરેલું, past. part. Dead. ...	મરેલું.
મલંક, m. A country. ...	મુલક.
મલકાવણું. See મેઢું મલકાવણું.	મલકાવણું.
મસકરી, f. A jest. મસકરી કરવી, To jest.	મસકરી.

	Guj. Equiv.
મસર, <i>m.</i> A mosquito. ....	મર્ગર.
મસવું or મસ્યારવું, <i>v.t.</i> To close (the eyes).	મિચવું.
આંખ મસતાભાં, In a twinkling.	”
મસી દીવું, <i>v.t.</i> To close tight (the eyes).	”
મસાલ, <i>f.</i> A torch. ....	મસાલ.
મસાલો, <i>m.</i> Condiments. ....	મસાલો.
મહળવું, <i>v.t.</i> To rub, to shampoo. ....	મસળવું.
મહિનો, <i>m.</i> A month. ....	મહિનો.
મહિને, Monthly, per month. ....	”
મળગાળું, <i>adj.</i> Dirty. ....	મળગાળ.
મળવું, <i>v.i.</i> To meet. To be got, to be found. To embrace (shoulder to shoulder). ....	મળવું. ... ...
મળવા જવું, To visit. ....	મળવા જવું.
મળતું આવણું, To be alike, to correspond. ....	મળતું આવકું. ... ...
મળિસ, <i>m.</i> A ghost, an evil spirit (esp. the spirit of a camel-owner who dies in the desert). ....	પલીત. ... ...
આ, <i>f.</i> A mother. ....	આ.
મા, <i>m.</i> January–February. ....	માહ.
માડુણું, <i>m.</i> A bug. ....	માકણુ.
માઘણું, <i>n.</i> Butter. ....	માઘણુ.
માખી, <i>f.</i> A bee. ....	અધ માખી.
માણું, <i>n.</i> A fly. ....	માણી.
માખાં મારવાં, To be unoccupied ( <i>lit.</i> to kill flies)....	માખી મારવી
માંગવું, <i>v.t.</i> To ask for....	માગવું. ...

	Guj. Equiv.
માગસર, <i>m.</i> November-December. ...	માગસર.
માંજરું, <i>v.t.</i> To polish. ... ...	માંજરું.
માટલો, <i>m.</i> An earthen vessel... ...	માટલો.
માટી, <i>f.</i> Earth. ... ... ...	માટી.
માંકું, <i>adj.</i> Less. માંકું કરવું, To lessen... ...	માંકું.
„ પડવું, To be insufficient. To become less ( of pain, disease ). ...	„ .
„ લાગવું, To feel slighted. To be displeased, to be grieved ( with dat. of pers. ). ... ...	„ .
માંકવું, <i>v.t.</i> To set, to place. To enter (a name). To begin (with Infin)....	માંકવું.
માંડો, <i>m.</i> A bee-hive. ... ... ...	માંડો.
માણ્ણ, <i>n.</i> A measure containing twelve seers. ... ... ... ...	*
માતલી, <i>f.</i> A fish. ... ... ...	માછલી.
માતા, <i>f.</i> The goddess <i>Mata</i> . Small-pox.	માતા.
આતાનું થાનક, A shrine to <i>Mata</i> under a tree where earthen horses are placed as offerings. ...	„
માણું, <i>n.</i> The head. ... ... ...	... .
„ ડેખાવણું, To shake the head ( to indicate denial or refusal ).	માણું ડેખાવવું.
„ નમાવણું, To bow the head ( to indicate assent or approval ).	„ નમાવવું.
„ ધુણાવણું. See ધુણાવણું. .. ...	„ ધુણાવવું.
માયે, <i>adv. and prep.</i> Above. On, upon.	માયે.

	Guj. Equiv.
આદૃં or ખાદૃં, v.t. To build. To fasten, to tether. ... ...	ખાદૃં.
ચાદરું, n. An earthen drum used by the vaitis. ... ...	*
માંડ, adj. Sick, ill. ... ...	માંડ.
માંડ પડું, To be taken ill... ...	"
માદ્યા, f. Love.... ... ...	માદ્યા.
માદ્યો, m. An inheritance. ... ...	*
માનતા, f. A vow. ... ...	માનતા.
„ કરવી or સપાવણી, To perform a vow.	"
„ માનવી or લીધી, To make a vow...	"
માનવી, n. Mankind. A human being...	માનવી.
માનવું, v.t. To believe. To heed. To obey.	માનવું.
માની લીતું,v.t. To accept. To acknowledge.	"
માપ, n. A measure. માપ કરવું, To measure.	માપ.
માપ, adj. Forgiven. માપ કરવું,To forgive.	માફ.
માપક, prep. Suitable to, like... ...	માફક.
માફી, f. Forgiveness. ... ...	માશી.
„ માગવી, To beg forgiveness. ...	"
મામા આઈ, f. A grand-mother—a mother's mother.... ...	મા+આઈ.
મામી, f. An aunt—a mother's brother's wife. ... ... ...	મામી.
મામો, m. An uncle—a mother's brother.	...
„ દાઢ, m. A grandfather—a mother's father. ... ... ...	મામો.
માયણો, m. A meaning... ...	માયણો.
માયનું, adj. Internal. ... ...	માહેનું.

## Guj. Equiv.

માર, <i>m.</i> A blow. ... ... ...	માર.
„ આવા, To be beaten or thrashed.	માર આવા.
„ આવો, To pass through trouble...	„ આવો.
મારગ, <i>m.</i> A road. .. ... ...	આર્ગ.
મારમાર, <i>adv.</i> Quickly.... ... ...	માર.
મારકૃતમાં, <i>prep.</i> By means of.... ...	મારકૃતે.
મારવું, <i>v.t.</i> To strike. ... ... ...	મારવું.
મારી દઢવું, To slay, to kill.... ...	„
મારામાં, મારાહુ, મારે. See Gr. § 14. ...	મારે.
માલ, <i>m.</i> A certain kind of inferior grain.	*
માલ, <i>m.</i> Property, goods. ... ...	માલ.
માલવાળું, <i>adj.</i> Rich. ... ...	„
„ હાટે માલ આલવો, To barter. ...	„
માલમતા, <i>f.</i> Possessions. ... ...	માલમતા.
માલવું, <i>v.i.</i> To boast, to brag. ...	*
માલીક, <i>m.</i> A lord, a master, an owner.	માલીક.
માવીત્રાં, <i>n. pl.</i> Parents.... ... ...	માવેતરા.
માંહણી, Name of a Bhil clan at Sadawara.	...
માંહણું, <i>n.</i> A burning-ground... ...	મસાખુ.
માહી, <i>f.</i> An aunt—a mother's sister...	માસી.
માહે, <i>m.</i> An uncle—a mother's sister's husband. ... ... ...	માસો.
માળી, <i>f.</i> The gums of the teeth. ...	પાળા.
મીઅંન or મેઅંન, <i>n.</i> A scabbard, a sheath.	મ્યાન.
મીજાજ, <i>m.</i> Temper, disposition. Pride.	મીજાજ.
„ કરવો, To boast, to brag. ...	„
મીઠાઈ, <i>f.</i> A sweet-meat. Sweet-meats.	મીઠાઈ.
મીંકું, <i>n.</i> Salt. <i>adj.</i> Sweet.... ...	મીંકું.

## Guj. Equiv.

ભીની, <i>f.</i> A cat....	...	...	...	ભીની.
ભીમી, <i>f.</i> A teat, a nipple.	...	...	...	*
મુંઝ, <i>adj.</i> Dead.	...	...	...	મુંઝ.
સુકામ, <i>m.</i> A halting-place.	...	...	...	સુકામ.
કુત્રા સુકામ થાએ? How long will you stay?	...	...	...	"
સુકાવલો, <i>m.</i> A comparison.	...	...	...	સુકાખલો.
„ કરવો, To arbitrate.	...	...	...	"
સુખી, <i>m.</i> A village chief in Gujarat....				સુખી.
સુંચું, <i>adj.</i> Dumb.	...	...	...	સૂંગું.
સુઠ, <i>f.</i> The closed fist.	...	...	...	સૂઠી.
સુટભર, A handful.	...	...	...	"
સુડ, <i>f.</i> The head.	...	...	...	સૂડી.
„ હડવી, To comb the hair....	...	...	...	"
સુંક or મોંક, <i>n.</i> The face, the mouth.				મહેંકું.
સુરખ, <i>adj.</i> Stupid, foolish, ignorant.				મૂર્ખે.
સુરખાધ, <i>f.</i> Folly, stupidity, ignorance.				સુરખાધ.
સુરતી, <i>f.</i> An idol,	...	...	...	મૂર્તિ.
સુરેત, <i>m.</i> A beginning...	...	...	...	? સુફુર્ત.
„ કરવો, To begin.	...	...	...	"
સુરેત્યા, <i>f.</i> Charcoal.	...	...	...	*
સુસ, <i>f.</i> The moustache...	...	...	...	મૂળ.
સુળ, <i>n.</i> Origin, root.	...	...	...	મૂળ.
સુણું, From the beginning.	...	...	...	"
સુળો, <i>m.</i> A white radish.	...	...	...	મૂળો.
મેઅંન or મીઅંન, <i>n.</i> A scabbard, a sheath.				મ્યાન.
મેજ, <i>f.</i> A table.	...	...	...	મેજ.

	Guj. Equiv.
મેળજ or મીળજ, <i>m.</i> Temper, disposition.	મિનજ.
Pride. ... ... ...	...
મેડો, <i>m.</i> A loft, an upper storey. ...	મેડો.
મેણુ, <i>n.</i> Wax. ... ... ...	મીણુ.
મેણુતા, Name of a Bhil clan at Jaran.	...
મેદ, <i>n.</i> Honey. ... .. ...	મધ.
મેનત, <i>f.</i> Toil, pains. Perseverance....	મહેનત.
„ કરવી, To try, to take pains. ...	”
મેર, <i>f.</i> A side, a direction. ... ...	મેર.
મેરે, <i>adv.</i> On one side, apart... ...	”
મેરેમેરે, <i>adv.</i> On all sides. ... ...	”
મેલ, <i>m.</i> Dirt.... ... ... ...	મેલ.
મેલ, <i>m.</i> A palace. ... ... ...	મહેલ.
મેલવું, <i>v.t.</i> To place, to put. ... ...	મેલવું.
મેલરેમેલ ! Leave off ! ... ...	”
મેલાવવું, <i>v. caus.</i> To make one put down (a thing). ... ... ... ...	”
મેલી દ્રિવું, <i>v. t.</i> To put or lay down....	મેલી દ્રિવું.
મેલું, <i>adj.</i> Soiled, dirty. ... ...	મેલું.
મેહ, <i>m.</i> Rain. મેહ ગાજવો, To thunder.	મેહ.
મેળાપ, <i>m.</i> Meeting. Concord.... ...	મેળાપ.
મો, <i>pron.</i> I. ... ... ... ...	H. મો.
મોકલવું, <i>v. t.</i> To send. ... ...	મોકલવું.
મોંયું, <i>adj.</i> Dear (not cheap). ... ...	મોંયું.
મોટમન્યું, <i>adj.</i> Proud. ... ... ...	મોંક.
મોટાઈ, <i>f.</i> Greatness. Pride. ... ...	મોટાઈ.
„ કરવી, To boast. ... ... ...	”
મોટી આઈ, <i>f.</i> A grand-mother—a father's mother. ... ... ... ...	મોટી આઈ.
	...

## Guj. Equiv.

મેટીઆર, <i>m.</i> A young man, an adult.	મોકું.
મોકું, <i>adj.</i> Big, great, fat. ...	"
મોટો બાપ, A grand-father—a father's father. ...	"
મોડ, <i>m.</i> The chaplet worn by the bride-groom at the marriage procession. ...	મોડ.
મોકું, <i>adj.</i> Late. ...	...
મોકું or મુકું, <i>n.</i> The face, the mouth..	મોકું.
મોકું કાળું કરવું, To blacken one's face. To hide oneself in shame. To bring disgrace upon another. ...	"
મોકું ભલકાવણું, To smack the lips.	મોકું ભલકાવવું.
મેડીઆ, Name of a Bhil clan at Limara. ...	...
મોની, <i>adj.</i> Silent. ...	...
મોકૃત, <i>adv.</i> Gratis, for nothing. ...	મુન્ય.
મોખાગેલ, <i>m.</i> A wooden beam. ...	મુકૃત.
મોર, <i>m.</i> The blossom of the mango tree.	મોભ.
મોર, <i>m.</i> A gold coin....	મોર.
મોર, <i>m.</i> or મોકું, <i>n.</i> A peacock. ...	મહોર..
મોરલું, <i>adj.</i> Previous, recent. In front.	મોરો.
મોરે, <i>adv.</i> and <i>prep.</i> In front. Before.	મોર.
મોરે આલવું, To advance (money). ...	"
મોરેહું, <i>adv.</i> Beforehand. ...	"
મોલ, <i>n.</i> Price. ...	"
મોવત, <i>m.</i> An elephant driver or keeper.	મૂલ.
મોસી, <i>m.</i> A shoe-maker. ...	મહાવત.
મોળું, <i>adj.</i> Tasteless, insipid. ..	મોચી.
	મોળું.

## ૨.

રકમ, <i>f.</i> An item, a particle. ...	રકમ.
રખણાથ, Name of a town ten miles from Kherwara where there is a famous temple to Rishabhnath.	જીખભ.
રખવાળી, <i>f.</i> Guarding, keeping. ...	રખવાળી.
“ કરેવી, To guard, to watch....	”
રખે, <i>adv.</i> Not (only) used with the Imperative). ...	રખે.
રખેરે, <i>conj.</i> Lest. ...	રખેતે.
રખોડા, <i>m.</i> Ashes. ...	રાખ.
રંગ, <i>m.</i> Colour... ...	રંગ.
રગત, <i>n.</i> A certain disease. ...	રગત.
રંગતું, <i>v. t.</i> To colour... ...	રંગતું.
રજવાડ, <i>f.</i> A Native State. ...	રજવાડા.
રજવાડી, <i>adj.</i> Belonging to a Native State. ...	”
રણ, <i>f.</i> Leave, permission to go. ...	રણ.
રતવા, <i>n.</i> Mumps. ...	રતવા.
રતાળુ, <i>m.</i> Yam... ...	રતાળુ.
રદ્દા, <i>m.</i> Intention, desire. ...	? ધરાદ્દા.
રપત, <i>m.</i> Hard labour. ...	રહત.
રમણું or રમતું, <i>v. i.</i> To play. ...	રમતું.
“ “, <i>v. t.</i> To play at. ...	”
રમત, <i>f.</i> A game. ...	રમત.
રમતુંદી, <i>adj.</i> Playful. ...	રમતિયાળ.
રમણું, <i>v. i.</i> To wander. ...	રવણું.

Guj. Equiv.

રવડતું ઇરવું, To wander about....	...	રવડવું.
રસતો, <i>m.</i> A cart-track.	...	રસ્તો.
રફુઓ, <i>m.</i> Broth, soup, essence.	...	રસો.
રળવું, <i>v. t.</i> To earn.	...	રળવું.
રળિને, <i>adv.</i> With great difficulty.	...	"
રાઈ, <i>f.</i> Mustard.	...	રાઈ.
રાખડી, <i>f.</i> The cotton band worn round the wrist during the festival of Balev.	...	રાખડી. ...
રાખવું, <i>v. t.</i> To keep.	...	રાખવું.
રાગ, <i>m.</i> A tune.	...	રાગ.
રાજ, <i>n.</i> A kingdom.	...	રાજ.
„ કરવું, To reign, to rule.	...	„
રાજતેજ, <i>n.</i> Majesty, splendour, glory.	...	રાજ+તેજ.
રાજ, <i>adj.</i> Content, willing.	...	રાજ.
„ કરવું, To satisfy, to please.	...	„
રાજ્યસીહુ, Of one's own accord, will- ingly.	...	રાજ્ય ઘુણી.
રાજ્યાળ, <i>f.</i> Peace, contentment.	...	રાજ્ય.
રાંડવું, <i>v. i.</i> To become a widow.	...	રાંડવું.
રાંડી, <i>f.</i> A widow.	...	રાંડી.
„ આધી રાખવી, To keep a widow as wife.	...	„
રાંડ, <i>n.</i> or રાડો, <i>m.</i> A general disturb- ance, a rising.	...	રાંડ.
રાણી, <i>f.</i> A queen.	...	રાણી.
રાત, <i>f.</i> Night...	...	રાત.
રાતે, At night, to-night.	...	„
રાતું, <i>adj.</i> Red.	...	રાતું.

## Guj. Equiv.

રાંદું, <i>v.t.</i> To cook, to roast. ...	રાંદું.
રાનરાનપાનપાન કરવું, To give intense trouble... ...	? હેરાન ... રાણ.
રાણ, <i>f.</i> Gruel. ... ... ...	*
રામણુન્યું, <i>n.</i> A small guitar of one wire.	રામરામ.
રામરામ, <i>interj.</i> A form of salutation.	રામ.
રાવક્ષો, <i>m.</i> A Thakor's house....	રાચ.
રાસાં, <i>n.pt.</i> Tools. ... ... ...	રાસ.
રાહ, <i>f.</i> A rope....	રાથ.
રાહેણું, <i>f.</i> Sunshine. ... ... ...	રાથની. *
રાળાટેણા કરવાં, To lead an unsettled life.	રિંગાણું.
રોગણું, <i>n.</i> Brinjal (a certain vegetable).	રીત.
રીત, <i>f.</i> A custom. A method. A way.	રીછ.
રીસ, <i>m.</i> A bear... ... ...	રીસ.
રીળ, <i>f.</i> Anger....	„
„ સરળી, To feel angry (with dat.)...	„
„ સડાવણી, To get into a passion. ...	„
રીહાણું, <i>adj.</i> Angry. ... ... ...	રિસામજું.
રૂ, <i>n.</i> Cotton. ... ... ...	રૂ.
રઘું, <i>n.</i> A tree. ... ... ...	રઘું.
રૂપ, <i>n.</i> Form, shape. ... ... ...	રૂપ.
રૂપાણું, <i>adj.</i> Beautiful, handsome. ...	રૂપાણું.
રૂપીએં, <i>m.</i> A rupee. ... ... ...	રૂપીએં.
રૂપું, <i>n.</i> Silver. ... ... ...	રૂપું.
રસતીણુસતી, <i>f.</i> A settlement (of a dispute). ... ... ...	*
„ „ કરવી, To make an amicable settlement... ...	... ... ...

## Guj. Equiv.

રેંધ જવું, v.i. To remain, to be left over. To be paralyzed (of limbs).	રષી જવું.
રેણ, f. A water-wheel... ... ...	રેણ.
રેઝવું, v.t. To pour. ... ... ...	રેઝવું.
રેખારી, m. A camel-breeder. ... ...	રેખારી.
રેલ, f. A flood... ... ...	રેલ.
રેણું, v.i. To remain. To give milk (with ટાંકી, a cow, as nom.). ...	રહેણું.
રેસમ, n. Silk. ... ... ...	રેસમ.
રેણ, m. Broth, soup. Essence... ...	રેણ.
રોકડું, adj. In hard cash, ready (money).	રોકડું.
રોકવું, v.t. To hinder. To block up. ...	રોકવું.
રોગ, m. Disease. ... ... ...	રોગ.
„ interj. Get out! ( to animals). ...	...
રોગી, f. A heap of funeral ashes. ...	*
રોગીજઘવી, f. A funeral pyre... ...	*
રોંગ, m. A nilgai. ... ... ...	રોંગ.
રોટદો. See રોટો.... ... ... ...	રોટદો.
રોટી, f. Bread. રોટી કરવાયો, A cook... „ કરવી, To make bread. To prepare a meal. ... ... ...	રોટી. „ ...
„ કુટ્ઠવી, To lose one's livelihood (with genit.)... ... ...	રોટી+કુટ્ઠવી. ...
રોટો, m. Coarse bread.... ... ...	રોટો.
રોપવું, v.t. To plant. To transplant. ...	રોપવું.
રોવું, v.i. To weep, to cry. ... ...	રોવું.

## શ.

શખું, <i>v.t.</i> To write. ...	...	...	શખું.
શગણું, <i>prep.</i> Till, until... ...	...	...	શગણું.
શગતું, <i>adj.</i> Adjoining. <i>adv.</i> Quickly, soon.			શગતું.
શગન, <i>n.</i> A wedding. ...	...	...	શગન.
શગભગ, <i>adv.</i> Nearly, almost....			શગભગ.
શગમ, <i>f.</i> A bridle. ...	...	...	શગમ.
શગાડવું, <i>v.t.</i> To fix. To light (a lamp)...			શગાડવું.
શગારકશગાર, <i>adv.</i> Very little. A small quantity. ...	...	...	શગાર.
શડવું or શડી જવું, <i>v.i.</i> To fight....	...		શડવું.
શડાઈ, <i>f.</i> A fight. War... ...	...	...	શડાઈ.
,, કરવી, To fight. ...	...	...	”
શથાખથી કુરવી, To wrestle. ...	...	...	શથાખથ.
શહેર, <i>m.</i> Profit... ...	...	...	નહેઠ.
શખરાં, <i>n. pl.</i> Clothes, apparel... ...	...		? લુગડાં.
શખરં, <i>n.</i> Cloth. Piece-goods....	...		? લુગડું.
શવવું, <i>v.i.</i> To be painful, to burn ( as a sore ). ...	...	...	શહારય.
...			...
શવાર્દિ, <i>n.</i> A calf under 16 days old....			શવાર્દિ.
શસકર, <i>n.</i> An army. ...	...	...	શસકર.
શહજું or શહી જતું; <i>v.i.</i> To slip....	...		શસતું.
શાકડી, <i>f.</i> A stick. ...	...	...	શાકડી.
શાકંદુ, <i>n.</i> Wood. ...	...	...	શાકંદુ.
શાખણું, <i>v.</i> A round iron arrow-head for shooting birds. ...	...	...	*
શાગ, <i>m.</i> An opportunity ( usu. foll. by શૂષ્પણું, to be favourable )... ...	...		શાગ.
...			...

	Guj. Equiv.
લાગતું, v.i. To come into contact with.	લાગતું.
To feel,to seem (with dat. of pers.)	...
To begin (foll. by Infin. )...	...
લાજ, f. Shame, shyness.	લાજ.
લાજતું, v.i. To be ashamed, to be shy.	લાજતું.
લાળતું, adj. Ashamed, shy.	લાળતું.
લાડ, n. Caressing.	લાડ.
,, લગાડતું, To caress, to fondle.	,,
લાડી, f. A bride...	લાડી.
,, જેવી, To inspect or see the bride.	,,
[The first stage in arranging for a marriage. See કરો ભરવો and પણવા જવું].	...
લાકુ, m. Name of a certain sweetmeat.	લાકુ.
લાડો, m. A bride-groom.	લાડો.
લાદ, f. The dung of horses and ele- phants.	લાદ.
...	...
લાંપ, m. A spire of grass.	લાંપિયો.
લાપટ, f. A slap, a smart blow.	લાપટ.
,, આખુફી, To strike with the hand...	,,
લાંબહેણું, f. Length, distance....	લાંબાણુ.
લાંબહેણું, From a distance....	,,
લાખરો, m. Cloth.	? કુગકું.
લાંખું, adj. Long.	લાંખું.
લાભ, m. Advantage, gain, profit.	લાભ.
લાય, f. Heat....	લાય.
,, ઉંફી, To suffer from gastric heat.	...

## Guj. Equiv.

લારે, prep. Along with ..	...	...	લારે.
લાલસ, f. Avarice.	...	...	લાલચ.
લાલસી or લાલસુ, adj. Covetous, avaricious....	...	...	લાલચુ.
લાવણ્ય or લાવવું, v.t. To bring....	...	...	લાવવું.
લાંસ, f. A bribe.	...	...	લાંચ.
લાસાર, adj. Helpless, powerless.	...	...	લાસાર.
લાસેકુઓ, m. One who takes bribes....	...	...	લાંચિયું.
લાહકું, n. A sob. લાહકાં ભરવાં, To sob...	?	લાહકું.	
લીપણ્ય, v.t. To plaster or smear with a mixture of cow-dung, earth and water. ...	...	...	લીપવું.
લીટું, v.t. To take.	...	...	લેવું.
લી જવું, v.t. To take away.	...	...	લઈ જવું.
લુ, f. A hot wind.	...	...	લૂ.
લુધ, n. Blood. લુધ નીકળવું, To bleed....	...	...	લોડી.
લુગડાં, n.pl. Clothes.	...	...	લુગડાં.
લુગડું, n. Cloth. Any article of dress.	...	...	લુગડું.
A sari.	...	...	...
લુંટ, f. Booty.	...	...	લૂટ.
લુંટણો, m. A rascal.	...	...	લુંટનારો.
લુંટવું or લુંટી ખાતું, v.t. To plunder.	...	...	લુંટવું.
લુંટારા, m. A robber, a dacoit...	...	...	લુંટારા.
લુલું, adj. Maimed, crippled.	...	...	લુલું.
લુસાઈ, f. Roguery, cheating....	...	...	લુંચાઈ.
લુસવું, v.t. To wipe.	...	...	લુષવું.
લુસી દાઢું, v.t. To wipe out well.	...	...	„

	Guj. Equiv.
લુસો, <i>m.</i> A rascal, a cheat. ... ...	લુચ્યો.
મેસણુ, <i>f.</i> A sign... ... ...	નિશાણી.
દેહણુ, <i>n.</i> Garlic... ... ...	લસણુ.
દેહાંણી, <i>f.</i> A ladder. ... ... ...	નિસરણી.
દોચાર, <i>m.</i> A blacksmith. ... ...	લુહાર.
દોક, <i>n.</i> People.... ... ...	દોક.
દોગાઈ, <i>f.</i> A woman. ... ...	H. લુગાઈ.
દોટ, <i>m.</i> Flour... ... ...	દોટ.
દોંડ, <i>n.</i> Iron. ... ... ...	દોંડ.
દોડી, <i>f.</i> Rubble... ... ...	*
દોડો, <i>m.</i> The youngest son. The young- est brother. ... ... ...	*
દોણ, <i>n.</i> Coarse salt. ... ... ...	દૂણ.
દોધ્યાન, <i>n.</i> A sacrifice.... ... ...	દોહી+દાન.
,, કરવું, To offer up a sacrifice. ...	"
દોભ, <i>m.</i> Avarice. ... ... ...	દોભ.
દોભી, <i>adj.</i> Avaricious.... ... ...	દોભી.

## ૭

જ followed by આ is pronounced like the letter *w*, and in all other cases like the letter *v*.

વકરાઈ, <i>f.</i> A jest, a joke. ... ...	વકરણ.
,, કરવી, To joke, to jest, to play... ...	"
વખ, <i>n.</i> Poison... ... ...	વિખ.
વખત, <i>m.</i> or <i>f.</i> Time.... ... ...	વખત.
,, વેઠવી, To work over time. To have seen better days. ... ...	"
	...

## Guj. Equiv.

વખાણુ, <i>n.</i> Praise. વખાણુ કરવાં, To praise.	વખાણુ.
વખાણું, <i>v.t.</i> To praise... ... ...	વખાણું.
વઘેડા, <i>m.</i> A quarrel. ... ... ...	વઘેડા.
વગડવું, <i>v.i.</i> To spoil, to be spoiled. ...	અગડવું.
વગડાઓ, <i>adj.</i> Wild ( <i>lit.</i> belonging to the forest). ... ... ... ...	વગડાઓ.
વગડું, <i>n.</i> A forest. ... ... ...	...
વગર, <i>prep.</i> Without, besides, except.	વગર.
વગરચાદીલું, <i>adj.</i> Indolent, careless. ...	વગર+આદર.
વગાડ, <i>m.</i> Loss, damage, injury. ...	અગાડ.
વગાડવું, <i>v.t.</i> or વગાડ કરવો, To spoil. ...	અગાડવું.
વળડવું, <i>v.t.</i> To play on an instrument. To beat a drum... ... ...	વળડવું. ...
વટલાવણું, <i>v.t.</i> To defile, to pollute. ...	વટલાવણું.
વટલાવું, <i>v.pass.</i> To be polluted... ...	વટલાવું.
વટાવણું, <i>v.t.</i> To change (money). ...	વટાવણું.
વળ, <i>f.</i> Assessment on the produce of land. ... ... ... ...	વન્ન.
વજુ, <i>prep.</i> Like. ... ... ...	...
વડાગર, <i>n.</i> Salt (of a superior quality).	? સુનાય.
વડાડવું, <i>v.caus.</i> To get cut. ... ...	વડાગર.
વડું, <i>adj.</i> Older, elder.... ... ...	વડું.
વણુકોર, <i>m.</i> A weaver.... ... ...	વણુકર.
વણુનરો, <i>m.</i> A man hired by merchants to convey grain on pack bullocks. ... ... ...	વણુનરો. ...
વણુવું, <i>v.t.</i> To weave. ... ... ...	...
વણુા, વણુાય, વણુામાં, વણુાહુ. See Gr. § 14.	વણુવું. H. વહ.

## Guj. Equir.

વણ્ણાઈ, <i>f.</i> Weaving. ...	...	...
વણ્ણાય ઓલે, On that account. ...	...	...
વણુ. See Gr. § 14. ...	...	...
વતાવણું, <i>v.t.</i> To shew. ...	...	...
વતુ, <i>n.</i> Shaving. વતુ કરું, To shave....		
વતુ, <i>adj.</i> and <i>adv.</i> More. ...	...	...
વદમણું or વદામણું, <i>n.</i> A propitiatory of- fering... ...	...	...
„ કરવું, To propitiate. ...	...	...
„ સોઝવું, To make a propitiatory of- fering... ...	...	...
વદારે, <i>adv.</i> More. ...	...	...
વદારો, <i>m.</i> Increase. ...	...	...
„ કરવો, To increase. ...	...	...
વન, <i>n.</i> A forest... ...	...	...
વના, <i>prep.</i> Besides, except, without... ...		
વિપત, <i>f.</i> Trouble. ...	...	...
„ પાડવી, To trouble, to bother. ...		
વર, <i>n.</i> A year... ...	...	...
વરણું, <i>v.i.</i> To rain. ...	...	...
વરણાત, <i>m.</i> Rain. The rains. ...	...	...
વરહેળી, <i>f.</i> A lump, a swelling. ...		
વરાજવું, <i>v.i.</i> To be seated (said of or to a superior). ...	...	...
વરાડ, <i>m.</i> An assessment on crops. ...		
વવળવું, <i>v.i.</i> To itch. ...	...	...
વસન, <i>n.</i> A promise. ...	...	...
„ આખવું, To promise... ...	...	...

વણુતર.

## H વહ.

”

વતુ.

વતું.

વધાવણું.

”

વધાવવું.

”

વધારે.

વધારો.

”

વન.

વિના.

વિપત.

”

વરસ.

વરસવું.

વરસાદ.

વરસોળી.

અરાજવું.

”

વેરા.

વવળવું.

વચન.

”

	Guj. Equiv.
વંસન વાળતું, To intercede. ... ...	વચન.
વસાર, <i>m.</i> Thought, reflection... ...	વિચાર.
„ કરવો, To think, to consider. ...	„
„ ખાવો, To be undecided, to hesitate. To fret. ... ...	„
વસારવું, <i>v.t.</i> To think. To repent. ...	વિચારવું.
વહૃતી, <i>f.</i> Population.... ...	વરતી.
„ કરવી, To dwell... ...	...
વહૃતું, <i>v.i.</i> To encamp, to dwell, to live.	વસનું.
વહાડવું, <i>v.t.</i> To people, to populate. ...	વસાડવું.
વજુ, <i>f.</i> A wife. A daughter-in-law. ...	વજુ.
વળગવું, <i>v.t.</i> To cling to. ... ...	વળગવું.
વળગવળગ કરયું, To persecute with words. ... ...	„
વળગેણું, <i>f.</i> A quarrel. ... ...	વળગવું.
વળતે, <i>adv.</i> and <i>conj.</i> Again, moreover.	વળતે.
વળવું, <i>v. i.</i> To bend. To be formed (as a meeting). ... ...	વળવું.
વળા, <i>f.</i> Time. Delay. ... ...	વળા.
„, કરવી, To procrastinate. To be late.	„
વળાપ, <i>m.</i> Mourning. ... ...	વિદ્ધાપ.
વળાવણું, <i>v.t.</i> To see a person off. ...	વળાવણું.
વળાવી, <i>f.</i> An escort. ... ...	વળાવિયા.
વળાંતું, <i>n.</i> Black-mail. ... ...	વળાંતું.
વળાવું, <i>v. pass.</i> To be bent. ... ...	વળાવું.
વળી, <i>f.</i> A rafter. ... ...	વળી.
વળી or વળી, <i>adv. and conj.</i> Again, moreover.	વળી.
વા, <i>pron. m. and n.</i> They. ... ...	H વે.

	Guj. Equiv.
વાં, <i>pron. f.</i> They ( respectful form )....	હા.
વાધ, <i>f.</i> Rheumatism. ... ... ...	વાયળ.
વાધતી, <i>m.</i> A minstrel, a bard... ...	વૈદ.
વાધણ, <i>m.</i> A doctor. ... ... ...	વાકણ.
વાન્દમ, <i>adj.</i> Experienced. ... ...	...
વાન્દલ, Name of the river which flows through the Ogna and Panarwar States. ... ... ... ...	...
વાંકુ, <i>adj.</i> Crooked. ... ... ...	વાંકુ.
વાગ, <i>m.</i> A bridle-bit. Reins.... ...	ખાગ.
વાગડ, The Dungarpur district. ...	...
વાગળી, <i>f.</i> A flying-fox... ...	વાગોળા.
વાગાત, Name of a Bhil clan at Balwada. ...	...
વાંય, <i>n.</i> A stream. ... ... ...	*
વાગોળતુ, <i>v.i.</i> To chew the cud, to ruminante. ... ... ...	વાગોળતુ.
વાધ, <i>m.</i> A tiger. ... ... ...	વાધ.
વાધેણુ, <i>f.</i> A tigress. ... ... ...	વાધેણુ.
વાજબી, <i>adj.</i> Fair, just... ...	જાજબી.
વાજતુ, <i>v.i.</i> To blow ( as the wind ). To sound ( as a gong ). ...	વાજતુ.
વાંકુછ, <i>f.</i> A childless woman. ... ...	વાંકણી.
વાંકુશો, <i>m.</i> A childless man. ... ...	વાંકણો.
વાટ, <i>f.</i> A way, a track, a foot-path. ...	વાટ.
,, જોવી, To expect ( with gen. ). ...	,,
વાટેવાટે આવણુ, To come straight....	,,
વાટમાર્ગુ, <i>m.</i> A traveller. ... ...	વાટમાર્ગ.
વાટલી, <i>f.</i> A brass saucer. ... ...	વાટલી.

	Guj. Equiv.
વાંદું or વાંડી આસવું, v.t. To divide. ...	વાંડો.
વાટવું, v.t. To pound. ... ... ..	વાટવું.
વાડ, m. Griping pains... ... ...	*
વાડ, f. A hedge. ... ... ...	વાડ.
વાડવું, v.t. To cut, to prune. ... ...	વાડવું.
વાડી; f. A garden. ... ... ...	વાડી.
વાડી, f. An earthen vessel like a tea-pot.	*
વાડો, m. Land near a house... ...	વાડો.
વાડોળ, f. Rheumatism. ... ...	વા.
વાણુ, m. An exorciser... ... ...	વાણુ.
વાણુ, n. Rope made of cocoa-nut fibre...	વાણુ.
વાણ્યો, m. A Bania. ... ... ...	વાણ્યો.
વાત, f. A word. A story, a history, a legend. Conversation. A matter, a thing. ... ... ... ...	વાત. ....
વાત કરવી, To describe, to mention, to tell about (with gen.). ...	વાત કરવી. ....
વાતસીત, f. Conversation. ... ...	વાતચિત.
" કરવી, To converse. ... ...	"
વાથરવું, v.t. To spread... ... ...	વાથરવું.
વાથરેણું, n. A quilt, a mattress. Bedding.	"
વાંદરો, m. A monkey, ... ... ...	વાંદરો.
વાદળું, v. or વાદળો, m. A cloud, ...	વાદળું.
વાઢી, m. A snake-charmer. ... ...	વાઢી.
વાંદો, m. A quarrel, a dispute. ...	વાંદો.
વાપરવું, v.t. To spend, to use... ...	વાપરવું.
વાયરો, m. Wind... ... ...	વાયરો.
વાર, f. Time. ... ... ...	વાર.

Guj. Equiv.	
વાર લગાડવી, To keep one waiting. ...	વાર.
„ લાગવી, To take a long time. ...	„
વારંવારં, <i>adv.</i> Alternately, ... ...	વારો.
વાર, <i>m.</i> A feather. ... ... ...	પર.
વાર, <i>interj.</i> Well! Yes! Very good!...	વાર.
વારવાર, <i>adv.</i> Often. ... ... ...	વારવાર.
વારે, <i>f.</i> A Bhil war-cry. ... ...	*
„ પાડવી, To sound the war-cry. ...	„
વારો, <i>m.</i> A turn, a time. ... ...	વારો.
અાગલાવારાદ્ય, Ancient. ... ...	„
વાલડો, <i>m.</i> Brushwood... ...	*
વાલાં, <i>n. pl.</i> Relatives... ...	વધાલાં.
વાખું, <i>adj.</i> Dear, beloved. ... ...	વધાખું.
વાવ, <i>f.</i> A masonry well with steps leading down to the water. ...	વાવ.
વાવણી, <i>f.</i> Sowing. ... ... ...	વાવણી.
વાવળું, <i>v.t.</i> To sow. ... ... ...	વાવળું.
વાંસતું, <i>v.t.</i> To read. ... ... ...	વાંસતું.
વાંકડી, <i>f.</i> A short bamboo. ... ...	વાંકડી.
વાંકડો, <i>m.</i> A long bamboo. ... ...	વાંકડો.
„ દાડો સફળ્યો, About 7 a. m. ( <i>lit.</i> the day has advanced the length of a bamboo). ...	” ... ... ”
એ વાંકડા દાડો સફળ્યો, About 8 a.m.	વાંકડો.
તણું „ „ „ „ 9 „	”
સ્થાર, „ „ „ „ 10 „	”
વાંકડો દાડો, About 5 p.m. ... ...	”
વાણણું, <i>n.</i> A cooking utensil. ... ...	વાણણ.

	Guj. Equiv.
વાહંકું, adj. Last. ... ... ...	વાંસે.
વાહવાળું, The town and State of Bans-wara... ... ...	...
વાહનું, v.i. To bellow. ... ... ...	*
વાહણી, f. A flute, ... ... ...	વાંસળી.
વાહું, adj. More. ... ... ...	? વધારે.
વાહે, adv. and prep. Behind, after, afterwards. ... ... ...	વાંસે.
,, મેરે, adv. Behind and before. ...	વાંસે+મેરા.
,, વાહે નાનું, To follow. ... ...	વાંસે.
,, ધાનું, To persecute... ...	"
વાહો, m. The back. ... ... ...	વાંસો.
વાહો, m. A dwelling, a resting place, a lodging. ... ... ...	વાસો.
વાહો કરવો, To put up for the night...	વાસો.
વાળ, m. The hair. ... ... ...	વાળ.
વાળનું, To bend. To sweep. ... ...	વાળનું.
વાળી ટીવું, To sweep away. To fold or roll up. ... ...	"
વાળી, f. A nose-ring. ... ...	વાળી.
વાળો, m. A guinea-worm. ... ...	વાળો.
વી, pron. He. It. That. f pl. They, those. See Gr. § 14. ...	H. વા.
વીઅન, m. Interest on money. ...	વ્યાજ.
વીઅણી, f. Calving. ... ...	વીઅણી.
વીઅતું, v.i. To calve. ... ...	વીઅતું.
વીજણી, f. Lightning. ... ...	વિજણી.
વીટણું or વીટાળણું, v.t. To roll up, to wind.	વિટકું.

	Guj. Equiv.
વીઠી, f. A finger-ring... ... ...	વિંઠી.
વીષુવું, v.t. To glean, to pick, to gather.	વિષુવું.
વીષી દડવું, To gather up. ...	”
વીન્તી, f. Entreaty. ... ... ...	વિનંતી.
,, કરવી, To beseech, to pray. ...	”
વીકોા, m. A creeper. ... ... ...	વેકોા.
વીવા, m. Marriage. ... ... ...	વિવાહ.
વીવું, adj. and adv. Such. So....	H વહ.
વીસ્વા, m. Trust, faith. ... ... ..	વિશ્વાસ.
,, રાખવો, To trust, to believe ...	”
વીસી, f. A scorpion. ... ... ...	વિધી.
વીસ્યું, n. A toe-ring. ... ... ...	*
વીહરવું, v. t. To forget. ... ...	વિસરવું.
વીહરી જવું, v.t. To forget entirely.	”
વીહાક, m. April-May.... ... ...	વેશાખ.
વીહાત, Name of a Bhil clan at Mori.	...
વીળુ, f. Sand. ... ... ...	વેળુ.
વે, pron. She. See Gr. § 14...	H વહ.
વે, v. May be. ... ... ...	H હોવે.
વેગળું, adj, Distant. વેગળું રેણુ, To abstain.	વેગળું.
વેઠ, f. Forced labour.... ...	વેઠ.
,, કરવી, To work without pay. ...	”
વેઠમાં, adv. On forced labour....	”
વેઠવું, v.t. To suffer. ... ... ...	વેઠવું.
વેષુવાં, adv. In the morning. Early. To-morrow morning. ... ...	વેષુકવાં.
વેંત, f. A span.... ... ...	વેંત.
વેદ, m. A barber. ... ... ...	વૈદ.

	Guj. Equiv.
વેનું, <i>pron.</i> His....	H વહ.
વેપાર, <i>m.</i> Trade....	વેપાર.
વેપારી, <i>m.</i> A tradesman.	વેપારી.
વેમ, <i>n.</i> Suspicion. Superstition. Accusation....	વહેમ.
„ ડવો, To accuse....	વહેમ.
„ રાખવો, To suspect.	”
વેમી, <i>adj.</i> Superstitious. Suspicious....	વહેમી.
વેર, <i>n.</i> Enmity. Hatred. Vengeance...	વેર.
„ રાખવું, To hate.	”
„ વાળવું, To take revenge.	”
વેરવું, <i>v.t.</i> To saw.	વહેરવું.
વેરવું, <i>v.t.</i> To scatter.	વેરતું.
વેરી જગ્યા, To disperse (as clouds).	”
વેલા, <i>f.</i> Distress, great trouble.	વેલા.
વેણું, <i>adj.</i> and <i>adv.</i> Early, soon.	વહેણું.
વેલાંવેલા, <i>adv..</i> Very early, very soon.	”
વેણું or વીવું, <i>adj.</i> Such....	H વહ.
વેસમાંય, <i>adv.</i> and <i>prep.</i> In the middle.	વચમાં.
„ પડવું or બોલવું, To interfere....	... વચમાં
„ વાત પાડી લીવી, To interrupt....	”
વેસહું, <i>adj.</i> Middle, central.	વચકે.
વેસહોં ભાગ, The centre.	”
વેસવું, <i>v.t.</i> To sell.	વેચવું.
વેસાવું, <i>pres. part.</i> Being sold. On sale.	વેચાતું.
„ આલવું, To sell.	”
„ લીવું, To buy.	”
વેસી or વેસે, <i>prep.</i> About, concerning...	વિષે.

	Guj. Equiv.
વેળા, <i>f.</i> Time. ... ... ...	વેળા.
વેણુ, <i>n.</i> A brook, a stream. ...	વહેળા.
વેર, <i>m.</i> A bride-groom. ...	વર.
વાં, <i>adv.</i> There, thither. ...	H. વહાં.
વાં ને વાં, In that very place. ...	„

## સ.

સધંત, <i>m.</i> A groom. ...	... ...	H. સાઈસ.
સંકટ, <i>f.</i> Distress. ...	... ...	સંકટ.
સકલી, <i>f.</i> A hen-sparrow. ...	... ...	ચકલી.
સકલો, <i>m.</i> A cock-sparrow. ...	... ...	ચકલો.
સકાર સડું, To go hunting. ...	... ...	શિકાર.
સકારી, <i>n.</i> An antelope....	... ...	H. ચિકારા.
સડુ, <i>m.</i> or <i>f.</i> A penknife. ...	... ...	ચાડુ.
સળ, <i>f.</i> Punishment. ...	... ...	સળ.
સળ દીવી, To punish...	... ...	„
સડઉતર, <i>adj.</i> Uneven, ...	... ...	ઉત્તરયડ.
સડક, <i>f.</i> A made road...	... ...	સડક.
સડપ, <i>f.</i> A bow-string....	... ...	? ચાપ.
સડવું, <i>v.i.</i> To rise, to ascend....	... ...	ચડવું.
કપાળ સડવું, To have a headache. ...	... ...	„
સડાઈ, <i>f.</i> A tumult. ...	... ...	ચડાઈ.
„ કરવી, To raise a tumult. ...	... ...	„
સડાઈની બોલી બોલવું, To speak angrily...	... ...	„
સડાઉ, <i>adj.</i> Insolent. ...	... ...	ચડાઉ.
સડાવણું, <i>v. caus.</i> To incite. ...	... ...	ચડાવવું.
સડીતું, <i>adj.</i> Chief. Highest. Superior. Prime. ...	... ...	ચડતું.

	Guj. Equiv.
સણું, <i>v. t.</i> To construct, to build. ...	ચણું.
સણા, <i>m. pl.</i> Gram. ... .. ...	ચણા.
સણી, <i>f.</i> The seed of a vegetable or plant.	*
સણીસણી, <i>adv.</i> Very little. ... ...	...
સતરી, <i>f.</i> An umbrella. A mausoleum.	છત્રી.
સતુર, <i>adj.</i> Clever. ... ... ...	ચતુર.
સતુ, <i>adj.</i> Existing. Present. Restored (as stolen property). ... ...	છતાં.
, કરું, To restore. ... ... ...	છતાં.
, થાવું, To restore. ... ... ...	„
સંદરમાં, <i>m.</i> The moon...	ચંદ્રમા.
સદા, <i>adv.</i> Always. ... ... ...	સદા.
સદાણી, <i>f.</i> The moon-light. ... ...	ચંદ્રાષ્ટ્ર.
સંદાવર, Name of a Bhil clan beyond the Dhebar lake. ... ...	...
સપટ, <i>adj.</i> Even, level. ... ...	સપાઠ.
સપટ કરું, To level. ... ... ...	„
સપાંક, <i>n.</i> A journey. ... ... ...	*
, કરું, To travel. ... ... ...	„
સંપો, <i>m.</i> Jessamine. ... ... ...	ચંપો.
સખ્ય, <i>m.</i> Cause, reason. ... ...	સખ્ય.
સખાવ, <i>m.</i> Temperament. ... ...	સ્વભાવ.
સમકંઠ, <i>v. i.</i> To start. ... ...	ચમકંઠું.
સમકી પડવું, To shy (as a horse). ...	„
સમકાવણું, <i>v. t.</i> To startle. ... ...	ચમકાવવું.
સમકેર, <i>adv.</i> and <i>prep.</i> On all sides. Around. ... ... ...	સમકેર.
સમરો, <i>m.</i> A whisk, a fly-flapper. ...	ચમનર.
, ટેળવો, To whisk away flies. ...	„

		Guj. Equiv.
સમાર, <i>m.</i> A tanner. ... ...	... ...	ચ્યામાર.
સમાસું or સમાં, <i>n.</i> The rainy season.	... ...	ચેંમાસું.
સરકાર, <i>f.</i> The Supreme Government.	... ...	સરકાર.
સરત, <i>f.</i> Recollection, thought. ...	... ...	સરત.
સરતમાં આવે તી, Whatever you choose. ... ...	... ...	” ... ...
સરવાળો, <i>m.</i> Addition....	... ...	સરવાળો.
સરવાળે, <i>adv.</i> Lastly. ...	... ...	”
સરવુ, <i>v. i.</i> or <i>v. t.</i> To graze....	... ...	ચરવું.
સરાં, <i>n. pl.</i> Small shot. ...	... ...	છરાં.
સરચાત, <i>f.</i> A beginning. ...	... ...	શરચાત.
„ કરવી, To begin. ...	... ...	”
સલાહ, <i>f.</i> Advice. ...	... ...	સલાહ.
„ દીવી, To advise. ...	... ...	”
„ દીવી, To consult. ...	... ...	”
સસુદરી, <i>f.</i> A mouse. ...	... ...	છષુદરી.
સહુ, <i>adj.</i> All. ...	... ...	સહુ.
સહુકાર લોક, Hindus and Muhammadans as distinguished from Bhils.	... ...	સહુકાર. ... ...
સા, <i>f.</i> Butter-milk. ...	... ...	છાસ.
સાઈતર, <i>m.</i> March-April. ...	... ...	ચૈતર.
સાઇદો, <i>m.</i> Shade. ...	... ...	છાંડો.
સાઉં, <i>adj.</i> Fourteen. ...	... ...	ચૈંડ.
સાક, <i>m.</i> The two hands full of liquor.	... ...	છાક.
સાંજયું, <i>adj.</i> Drunk....	... ...	છાકં.
સાકવું, <i>v.t.</i> To taste. ...	... ...	ચાખવું.
સાકર, <i>f.</i> Sugar-candy....	... ...	શાકર.
સાકર, <i>m.</i> A servant. ...	... ...	ચાકર.

Guj. Equiv.

સાકરી, f. Service.	સાકરી કરવી,	To serve.	ચાકરી.
સાનેર, n. Thatch.	...	...	છાજદી.
સાટવું, v.t. To lick.	...	...	ચાટવું.
સાંટવું v.t. To sprinkle....	...	...	છાંટવું.
સાડુઓ, m. A ladle.	...	...	ચારવો.
સાંટો, m. A drop of rain.	...	...	છાંટો.
સાંટા સાંટા પડવા, To drizzle....	...	...	"
સાડી, f. Back-biting, slander...	...	...	ચાડી.
,, કરવી, To slander....	...	...	"
સાડુઓ, m. A back-biter.	...	...	ચાડિયો.
સાંખુ, f. Fresh cow-dung.	...	...	છાણુ.
સાતી, f. The bosom, the chest. Courage.	...	...	છાતી.
સાતીવાળું, adj. Brave.	...	...	"
સાદ્ડી, f. A mat made of palm leaves.	...	...	સાદ્ડી.
સાંધી, f. A sore, an ulcer. Purified silver.	...	...	ચાંદી.
સાંદો or સાંદોભાવસી, m. The moon.	...	...	...
સાનાંસાનાં or સાનેસાને, adv. Secretly. Stealthily. Privately.	...	...	છાનામાનાં.
સાનેસાને કાનમાં વાત કેવી, To whisper.	...	...	છાનામાના.
સાતું, adj. Quiet. Still. Secret. Private.	...	...	છાતું.
,, રાખવું, To keep secret.	...	...	"
,, રૈવું, To be quiet.	...	...	"
સાપરે, n. A hut.	સાપરી, f. A small hut.	...	કુંપડું, કુંપડી.
સાષ્ટ, adj. Clean. Pure. Holy...	...	...	સાષ્ટ.
સાખુ, m. A European...	...	...	સાહેખ.
સાંખડી, f. A small bamboo-basket.	...	...	છાંખડી.
સાંખડી, f. The human skin.	...	...	ચામડી.

## Guj. Equiv.

સાંખું, <i>n.</i> Skin, hide, leather...	...	ચામડુ.
સામાન, <i>m.</i> Goods, luggage. ...	...	સામન.
સામીસેળણ્યું, <i>n.</i> A bat... ...	...	ચામાચિદિયું.
સાર, <i>m.</i> Grass, hay. ...	...	ચારો.
સારો, <i>m.</i> Fodder. ...	...	"
સાલ, <i>n.</i> A year... ...	...	સાલ.
સાલ, <i>m.</i> Habit, custom. <i>f.</i> Conduct...		ચાલ.
સાલવાળું, <i>adj.</i> Well-behaved. ...	...	"
સાલવું, <i>v.i.</i> To go, to walk. To suit...		ચાલવું.
સાલવું કરવું, To begin... ...	...	"
સાદે લાં લગણું, As far as possible. ...		"
સાવકાર. See સહુકાર. ...	...	સહુકાર.
સાવણી, <i>f.</i> A cantonment. ...	...	છાવણી.
સાવવું, <i>v.i.</i> To be agreeable. To suit...		ચહાવવું
સાવેતી...સાવેતી, <i>conj.</i> Either...or. ...		"
સાંસ, <i>f.</i> A beak. ...	...	ચાંચ.
સાવળ or સાવળ, <i>m.</i> Rice. ...	...	ચાવળ.
સાહુડી, <i>f.</i> A porcupine. ...	...	સાહુડી.
સાહેદી, <i>f.</i> A witness. ...	...	શાહેદી.
,, આલવી, To testify. ...	...	"
સાળણી, <i>f.</i> A sieve. ...	...	ચાળણી.
સાળવું, <i>v.t.</i> To sift. ...	...	ચાળવું
સાળી, <i>f.</i> A she-goat. ...	...	છાળી.
સાળું, <i>n.</i> A kid....	...	છાળું.
સાળો, <i>m.</i> A ram. ...	...	છાળો.
સાળો, <i>m.</i> Shade... ...	...	છાંયડો.
સીકવું, <i>v.i.</i> To sneeze. ...	...	છિંકવું.
સીજ, <i>f.</i> A thing. ...	...	ચીજ.

	Guj. Equiv.
સીટી, <i>f.</i> A note. A letter of recommendation. ... ... ...	ચિટ્ઠી. ...
સીકું, <i>n.</i> An entrance.... ... ...	છીકું.
સીડ્રોણ્યું, <i>n.</i> A bead. ... ... ...	? કિડિણ્યું.
સીત, <i>n.</i> The mind. ... ... ...	ચિત્ત.
સીતરો, <i>m.</i> A leopard. ... ... ...	ચિતરો.
સીતાળ, <i>m.</i> A slab. ... ... ...	*
સીતું, <i>adj.</i> On one's back. ... ... ...	ચતું.
„ પડીને હુતું, To sleep on one's back.	”
સીથરે or સીદું, <i>v.</i> A rag... ... ...	ચિથરે.
સીદું, <i>adj.</i> Straight. ... ... ...	સીધું.
સીનાળું, <i>n.</i> Adultery. ... ... ...	છિનાળું.
સીપડી, <i>f.</i> A pinch. ... ... ...	ચપડી.
„ લીવી, To pinch.... ... ...	”
સીપાઈ, <i>m.</i> A policeman, a soldier. ...	સિપાઈ.
સીપીઓ, <i>m.</i> Pincers, tongs, tweezers...	ચિપિયો.
સીખડી, <i>f.</i> or સીખું, <i>n.</i> A long gourd...	ચિખડી.
સીખરી, <i>f.</i> A small owl.... ... ...	ચિખડી.
સીખું or સીખુંનાક, <i>adj.</i> Flat-nosed. Ugly.	ચીખું.
સીરવું, <i>v. t.</i> To split. ... ... ...	ચીરવું.
સીલ, <i>f.</i> A kite, a hawk. ... ... ...	ચીલ.
સીસી, <i>f.</i> Carrion. ... ... ...	છીછું.
સીહે, <i>f.</i> A scream. ... ... ...	ચીસ.
„ કરવી, To scream. ... ... ...	”
સુક, <i>n.</i> Happiness. Salvation...	સુખ.
„ આલવું, To save. ... ... ...	”
„ આલવાવાળો, The Saviour...	”

Guj. Equiv.

સુકૃતું. <i>v.i.</i> To finish (only used in forming compleutive compound verbs.	સુકૃતું.
See Gr. § 41). ... ... ...	... ... ...
સુકલી, <i>f.</i> Slander, backbiting....	ચુગલી.
સુકાળ, <i>m.</i> A time of plenty. ...	સુકાળ.
સુક્રી, <i>adj.</i> Happy, blessed. ...	સુખી.
સુટકી, <i>f.</i> A pinch. સુટકી લીવી, To pinch.	*
સુરકોણ, <i>m.</i> Release. સુરકોણ કરવો, To release.	જુરકોણ.
સુટું or સુરી જતું, <i>v.i.</i> To become free, to be released....	જુરતું. ... ...
સુફી, <i>f.</i> Freedom, release. Leave. ...	જુફી.
„ આલવી, To grant leave....	...
સુફ, <i>adj.</i> Free....	જુહું.
સુફ કરવું, To set free. ...	...
સુડલી, <i>f.</i> A bracelet worn on the fore-arm by women...	ચુડલી.
સુડલો, <i>m.</i> A bracelet worn on the upper part of the arm. ...	ચુડલો. ...
સુડવેલ, <i>f.</i> A she-devil, a female goblin.	ચુડલે.
સુનડી, <i>f.</i> A spotted sari. ...	ચુંડડી.
સુતસુન, <i>n.</i> Powder, anything powdered.	*
„ કરવું, To pulverize... ...	,,
સુનો, <i>m.</i> Lime. ...	ચૂનો.
સુલો, <i>m.</i> A fire-place. ...	ચૂલો.
સુટું, <i>v.i.</i> To leak... ...	ચુટું.
સેન્યું ગેર, <i>m.</i> A thatched house. ...	છાંયું ધર.
સેદું, <i>adj.</i> Far off, distant. ...	છેદું.
સેડો, <i>m.</i> A border, an edge, an end...	છેડો.

## Guj. Equiv.

સેડા છાડવો, To separate. To divorce. ...	છડો.
સેતરણું, <i>v.t.</i> To cheat. ... ...	છેતરણું.
સેતરું, or સેતી રૈતું, <i>v.i.</i> To be warned... ...	ચેતરું.
સેતાવણી, <i>f.</i> Warning. ... ...	ચેતવણી.
સેતાવણું, <i>v.t.</i> To warn. ... ...	ચેતાવણું.
સેર, <i>m.</i> A seer. કાસો સેર, One pound. પાકો „ Two pounds.	સેર. ... શહેર.
સેર, <i>n.</i> A city.... ... ...	અહેરો.
સેરો, <i>m.</i> A face. A picture. ... ...	છેલ્ખણ.
સેલુ, <i>adj.</i> Last.... ... ...	” સેલ્ખો.
સેલ્ખે સરવાળે, At length, finally. ...	સેવા.
સેલો, <i>m.</i> A disciple. ... ...	” સેવા.
સેવા, or સેવા સાકરી, <i>f.</i> Service. ... ” ” કરવી, To serve. ...	સેવા. ... ષાં.
સેવું, <i>v.t.</i> To thatch. ... ...	ષ.
સો, <i>adj.</i> Six. ... ... ...	ચુંચો.
સોચ્ચો, <i>m.</i> The sap of trees and plants.	*
સોકદી, <i>f.</i> A memorial stone erected to female ancestors. ... ...	... ? ચોખ્યું.
સોકદો, <i>m.</i> A Bhil who does not eat cow's flesh. ... ... ..	... મોકી.
સોકી, <i>f.</i> A watch-house. A watch-place on the road. A small looking- glass worn by women. ...	... ... ... મોકી.
સોકા, <i>m. pl.</i> Rice. ... ... ...	ચોખા.
સોકીદાર or સોકીવાળો, <i>m.</i> A watch-man.	ચોકીદાર.
સોકું, <i>adj.</i> Pure, clean.... ... ...	ચોખ્યું.
સોટલી, <i>f.</i> The tuft of hair worn on the crown of the head as a dis- tinctive mark of a Hindu. ...	ચોટલી. ... ...

## Guj. Equiv.

સોટલો, <i>m.</i> A woman's hair. ...	ચોટલો.
„ શુંખ્લો, To plait the hair. ...	„
સોટવું, <i>v. t.</i> To bite (as a dog or snake). To sting. To cast a spell over.	*
ડાકેખુંસોટવું, <i>n.</i> Witch-craft. ...	...
સોંટવું, <i>v. i.</i> To stick, to cling, to adhere.	ચોંટવું.
સોંટાડવું, <i>v. t.</i> To stick. ...	ચોંટાડવું.
સોદું, <i>n.</i> Infection, contagion (gen. fol- lowed by the verb આવણું). ...	ચોંટવું.
સોડવું, <i>v. t.</i> To offer up (as a sacrifice).	? ચડાવતવું.
સોડવું or સોડી દીવું, <i>v.t.</i> To abandon. To let go. To acquit. ...	છાડવું.
સોડું, <i>n.</i> The bark of a tree. The rind of fruit. ...	છાડું.
સોનીહોં, <i>m.</i> The famine of Samvat 1934 (A. D. 1877). ...	ચોત્રીસ.
સોથું, <i>adj.</i> Fourth. ...	...
સોથીઓ તાવ, Quartan, or fourth day, ague.	ચોથું.
સોપડવું, <i>v.t.</i> To rub, to anoint. ...	ચોપડવું.
સોપડી, <i>f.</i> A book. ...	ચોપડી.
સોપાં or સોપાંટાં, <i>n. pl.</i> Cattle... ...	ચોપગું.
સોપાડ, <i>f.</i> A cattle-shed. ...	? ચોપગું+આડ.
સોયું, <i>adj.</i> Four-footed... ...	ચોપગું.
સોમાહું, <i>n.</i> The rainy season.... ...	ચોમાસું.
સોર, <i>m.</i> A thief. A hypocrite, an evil- doer. ...	ચોર.
સેરલોક, Predatory tribes.... ...	...
સોરી, <i>f.</i> Theft. સોરી કરવી, To steal. ...	ચોરલોક.
24	ચાંરી.

			Guj. Equiv.
સોરી, <i>f.</i> A girl.	...	...	ઓડી.
સોરું, <i>n.</i> A child.	...	...	ઓરું.
સોરો, <i>m.</i> A boy.	...	...	ઓકરો.
સોલ, <i>f.</i> The bark of a tree....	....	....	ઓલ.
સોલવું, <i>v.t.</i> To peel.	...	...	ઓલવું.
સોળવીઓ, Name of a Bhil clan at Dhanhor...	...	...	...
સ્યાર, <i>adj.</i> Four...	...	...	ચાર,

## ૬.

હેઠ, <i>m.</i> A tailor.	...	...	સધ.
હેત, <i>m.</i> Right. Power....	...	...	હેત.
હેત, <i>n.</i> Happiness. Salvation. See સુહેત.	...	...	સુખ.
હેતન, <i>m.</i> An omen.	...	...	સુકન.
હેતમ, <i>m.</i> An order, a command.	...	...	હૃકમ.
હુક્રવાર, <i>m.</i> Friday.	...	...	શુક્રવાર.
હુકી, <i>adj.</i> Happy.	...	...	સુખી.
હુક્લવું, <i>v.t.</i> To gather together.	...	...	સંક્લવું.
હંગ, <i>m.</i> A body of pilgrims...	...	...	સંધ.
હંગવાળો, <i>m.</i> A pilgrim.	...	...	"
હંગડી, <i>f.</i> A stove.	...	...	સંગડી.
હંગરો, <i>m.</i> A store, a collection.	...	...	સંધરો.
„ ફરવો, To store up.	...	...	"
હંગણું, <i>adj.</i> All, the whole.	...	...	સથળું.
હંગામ, <i>f.</i> Relationship. Betrothal.	...	...	સગામ.
હંગામણું, <i>f.</i> Diarrhoea.	...	...	હંગણું.
હંગું, <i>n.</i> A relative. <i>adj.</i> Closely related.	...	...	સંગું.
હોંગો ભાઈ, A full-brother...	...	...	"

## Guj. Equiv.

કાર, <i>adj.</i> A thousand. . . . .	... ...	ગુજર.
હણુર, <i>Sir.</i> Your Honour. The Presence.		હણુર.
હણેણી, <i>f.</i> A tailor's wife. ( <i>fem.</i> of હણ)		સઈ.
હણું, <i>v.t.</i> To fix split bamboos on a roof. . . . .	... ...	સણું.
હણું, <i>v.t.</i> To comb. . . . .	... ...	? હોળણું.
મુડ હણવી, To comb the hair. . . . .	...	"
હોઠ, <i>m.</i> A flea.... . . . .	... ...	*
હણુસો, <i>m.</i> A brick mould. . . . .	...	*
હતરા, <i>m.</i> The famine of Samvat 1917 (A. D. 1860). . . . .	... ...	ખતરા.
હંતાડણું, <i>v.t.</i> To conceal... . . . .	... ...	ખંતાડણું.
હેઠ or હેતુ, <i>adj.</i> All. . . . .	... ...	*
હ્યોડો or અધ્યોડો, <i>m.</i> A hammer. . . . .	...	હ્યોડો.
હેદ, <i>f.</i> A boundary, a limit. . . . .	...	હેદ.
હેદરણું or હુદરણું, <i>v. i.</i> To improve. . . . .	...	સુધરણું.
હેદાંહે or હેદેહણું, <i>adv.</i> Finally. . . . .	...	હેદ.
હેદરણું or હુદરણું, <i>v. t.</i> To improve, to repair. . . . .	... ...	સુધારણું.
હેદરો or હુદરો, <i>m.</i> Improvement. Repairs. Progress. . . . .	... ...	સુધારો.
હેદેહો, <i>m.</i> News. . . . .	... ...	સંહેરો.
હનકુનર્દ, <i>m.</i> or <i>n.</i> <del>A hyena.</del> A wild dog. <small>Kuon d.</small>		*
હનણી, <i>adj.</i> or <i>adv.</i> Under protection.		? શરર્ણો.
„ જવું, Te seek protection. . . . .	...	"
„ રાખવું, To protect. . . . .	...	"
હેપ, <i>m.</i> Agreement. Concord... . . . .	...	સંપ.
હેપણું or હેપણું, <i>v. i.</i> To be concealed... . . . .		જુપણું.

	Guj. Equiv.
હૃતું, <i>n.</i> A dream. ... ... ...	સ્વમે.
હૃપાતું or હૃપાડી દીતું, <i>v. t.</i> To conceal...	હૃપાવતું.
હૃપિનતું, <i>v. i.</i> To be concealed... ...	હૃપી જતું.
હૃપિને, <i>a lv.</i> Secretly, stealthily. ...	હૃપીને.
હૃપી રૈતું, <i>v. i.</i> To lie in ambush. ...	હૃપી રહેતું.
હૃપુત, <i>adj.</i> Honest. ... ... ...	? સપુત.
હૃપાળતું, <i>v. t.</i> To take care. ... ...	સંભાળતું.
હમ, <i>m.</i> An oath. ... ... ..	સમ.
„ ખાવા, To swear. ... ... ...	„
ઓટા હમ ખાવા, To swear falsely...	„
હમજણું, <i>f.</i> Understanding. ... ...	સમજણું.
„ પડવી, To take in, to understand (with dat. of pers.). ... ...	„ ...
હમજતું, <i>v. t.</i> To understand. ... ...	સમજતું.
હમજવણું, <i>v. t.</i> To explain. To persuade.	સમજવતું.
હમજુ, <i>adj.</i> Intelligent. ... ...	સમજુ.
હમાતું, <i>v. i.</i> To be contained, to go into. અણ્ણા હુંગામાં કટરા રોટલા હમાય ? How many loaves go into this basket ?	સમાતું. ... ...
હમીસાર, <i>m.</i> News. ... ... ...	સમાચાર.
હમું, <i>adj.</i> Right, correct. ... ...	સમું.
„ કરતું, To mend. ... ... ...	„
હમુંતમું or હમુરમું, <i>adj.</i> Level, straight.	„
હમેઠતું or હમેરી દાતું, <i>v. t.</i> To collect. ...	સમેઠતું.
હરક, <i>m.</i> Joy, delight. ... ... ...	હરખ.
હરકાવણું, <i>v. t.</i> To compare. ... ...	સરખાવવણું.
હરકું, <i>adj.</i> Suitable, fit, like. ... ...	સરખું.
હરગ, <i>m.</i> Heaven. ... ... ...	સ્વર্গ.

	Guj. Equiv.
હરણ્યું, <i>n.</i> An arrow. ...	...
હરણ્યો, <i>m.</i> An arrow-shaft. ...	...
હરતું, <i>adj.</i> Rich, well-off. ...	...
હરખો, <i>m.</i> Rape-seed. ...	...
હરમ. <i>f.</i> Shame. ...	...
હરમાવું, <i>v. i.</i> To be ashamed... ...	...
હરવા, <i>m.</i> A spring of water... ...	...
હરા, <i>m.</i> A crop. ...	...
હરાડું, <i>adj.</i> Stray. Wandering away in search of food. ...	...
હરાન or એરાન, <i>adj.</i> Perplexed, dismayed.	હરાન.
હરાપ, <i>m.</i> A curse. હરાપ દીનો, To curse.	આપ.
હરામણી, <i>m.</i> A rascal. <i>adj.</i> Ill-bred.	હરામણી.
હરામણું, <i>m.</i> July-August. ...	આવણું.
હરાભી, <i>m.</i> A sinner. <i>adj.</i> Wicked. ...	હરાભી.
હરાવવું or હરાવી દક્કું, <i>v. t.</i> To defeat. ...	હરાવવું.
હોચાત, Name of a Bhil clan at Mathugamra. ...	...
હોડુંયો or હોળદ્યો. A drunkard. ...	?
હોરા, <i>m.</i> Liquor. ...	સુરા.
„ ભરવો, To betroth. (The second stage in arranging for a marriage. See લાડી નેવી and પણવા જવું)...	સુરા.
હોળો, <i>m.</i> A flea. ...	...
હોલું, <i>adj.</i> Light (not heavy). ...	*
„ ગણું, To despise....	હોલું
„ વર, A year of scarcity. ...	”
હોવણું, <i>v. t.</i> To shake. ...	હોવણું

		Guj. Equiv.
કુવાદ, <i>m.</i> Flavour, taste.	... ...	સન્દાદ.
કુવાર, <i>f.</i> The morning.	... ...	સવાર.
કુવારે, <i>adv.</i> In the morning. To-mor-		"
row morning.	... ... ...	..."
કુવાસો, <i>m.</i> Possession, charge...	...	કુવાસો.
કુવાસે કરતું. To hand over.	...	"
,, રાખતું, To take charge of.		"
કુહલો, <i>m.</i> A hare.	... ... ...	સસલો.
કુલેણે <i>adv.</i> Slowly. Gently....	...	હળવેહળવે.
કા, <i>f.</i> Consent, <i>adv.</i> Yes.	... ...	કા.
, કહેવી, To say Yes. To agree. To		કા કહેવી.
consent....	... ... ...	..."
કાઈ લી લતું, <i>v. t.</i> To take away.	...	સહાતું.
કાઉ, <i>adj.</i> and <i>adv.</i> Good. Pretty. Well.		સાર્ચ.
, કરતું, To do'good. To cure, to heal.		"
To bless.	... ... ...	..."
, થાતું, To recover, to get well.	...	સાર્ચ થતું.
કાક, <i>f.</i> The frame (of a door).	...	સાખ.
કાંકડુ, <i>adj.</i> Narrow.	... ... ...	સાંકડું.
કાકડો, <i>m.</i> Teak-wood....	...	સાગ.
કાકર, <i>f.</i> Sugar-candy....	...	સાકર.
કાંકડુ, <i>v.t.</i> To drive.	... ... ...	કાંકડું.
કાંકળી, <i>f.</i> A chain.	... ... ...	સાંકળી.
, અખડાવણી, To rattle the chain = to knock at the door.		" ..."
કાકી, <i>m.</i> A witness.	... ... ...	સાક્ષી.
કાખ, <i>f.</i> A clan.	... ... ...	શાખા.
કાંગ, <i>f.</i> A large crow-bar.	... ...	સાંગ.

	Guj. Equiv.
હાગ or હાગડો, <i>m.</i> Teak-wood...	સાગ.
હાગરી, <i>m.</i> A farm-labourer. ...	*
હાજર, <i>adj.</i> Present. ...	હાજર.
હાળું, <i>adj.</i> Fresh, well. ...	સાન્ધું.
„ કરું, To heal. ...	„
હાનુંતાનું, <i>adj.</i> Happy. Safe and sound.	„
હાંણે, <i>m.</i> Rubbish. ...	સાંણે.
હાટ, <i>f.</i> A shop. A market. ...	હાટ.
હાટ માલ આવવો, To barter. ...	સાંકે.
હાટકી, <i>f.</i> A thin teak-wood rafter. ...	સાકી.
હાટકી, <i>f.</i> A bazaar, a market. ...	હાટ.
હાટ, <i>prep.</i> In exchange for. ...	સાટે.
હાંડો, <i>m.</i> Sugar-cane (large and dark).	સાંડો.
હાડકી, <i>f.</i> or હાડકો, <i>m.</i> A bone. ...	હાડકું.
હાડકી, <i>f.</i> A she-camel. ...	સાંડથી.
હાડકાડ, <i>interj.</i> Get away ! ( said to animals). ...	હાડકાડ.
હાત, <i>m.</i> Company. ...	સાથી.
„ કરવો, To travel together...	„
હાત, <i>adj.</i> Seven. ...	સાત.
હાતવું, <i>v. t.</i> To hide. ...	સાંતવું.
હાતી દીવું, To cover up. ...	„
હાતાહાતિ, <i>adv.</i> Slowly... ...	? આસ્તે.
હાતી, <i>m.</i> A companion. ...	સાથી.
હાંકું, <i>v.</i> A compound round a house...	*
હાતે, <i>prep.</i> With. ...	સાથે.
હાતેહાતે, <i>adv</i> and <i>prep.</i> Along side, along with. ...	„
હાતેળ, <i>f.</i> The thigh. ...	સાથળ.

## Guj. Equiv.

હાથ, <i>m.</i> The hand. A cubit....	...	હાથ.
હાથકડી, <i>f.</i> Hand-cuffs. ...	...	”
હાથી, <i>m.</i> An elephant. ...	...	હાથી.
હાદ, <i>m.</i> A voice. હાદ દીવો, To shout.		સાદ.
હાદડી, <i>f.</i> A mat made of palm leaves.		સાદડી.
હાદવું, <i>v. t.</i> , To call. ...	...	સાદ.
હાદવું, <i>v. t.</i> To join. ...	...	સાંધવું.
હાંડો, <i>m.</i> A joint. ...	...	સાંધો.
„ દીવરાવણો, To join....	...	”
હાંડો, <i>m.</i> A boundary....	...	શે.
„ વતાવણો, To walk the boundary....		”
હાન, <i>f.</i> Sense. Experience. ...	...	સાન.
હાનવાળું, <i>adj.</i> Sensible. Experienced...		”
હાનણું, <i>n.</i> A stew of vegetables or meat.		*
હાનેવાળો, <i>m.</i> A driver of oxen. ...	...	હાંકવું.
હાન્યાં, <i>n. pl.</i> Signing. Beckoning. ...	...	નિશાણી.
„ કરવાં, To beckon. To sign. ...	...	”
હાપ, <i>m.</i> A large snake, a cobra. ...	...	સાપ.
હાંખરું, <i>n.</i> A sort of elk or stag. ...	...	સાંખર.
હાંખળવું, <i>v. t.</i> To hear... ...	...	સાંખળવું.
હાયું, <i>f.</i> Soap. ...	...	સાયું.
હાયુની રોડી, A tablet of soap. ...		”
હામલી, <i>f.</i> A certain wild seed of which bread is made... ...	...	*
...		....
હામાંહામાં, <i>adv.</i> Against one another.		સામસામા.
હામું or હામે, <i>prep.</i> Opposed to. ...	...	સામું.
„ થાતું, To resist. ...	...	”

## Guj. Equiv.

હાયહાય ! interj. Alas ! Alas ! ...	...	હાયહાય.
હારતું, v. i. To be defeated. ...	...	હારતું.
હારવો, m. Stubble. ...	...	*
હારી પેટો, adv. Thoroughly. ...	...	સારી પેટો.
હાર, prep. For the sake of. ...	...	સાર.
હાર, interj. Very well ! All right ! ...	...	સારે.
હાલ, f. Condition. State. ...	...	હાલ.
હાલતું, v. i. To move, to stir... .	...	હાલતું.
હાલેડ, f. Name of a certain tree. " ...	...	*
હાલેડો, m. The women's dance at the <i>Holi</i> ... ...	...	હાલરકું.
„ હીવો, To dance the <i>Holi</i> dance.	...	હાલરકું.
હાવકું, adj. Step-(in relationship). ...	...	સાવકું.
હાવકી સોારી, A step-daughter. ...	...	"
હાવકો સોારો, A step-son. ...	...	"
હાવું, v.t. To catch, to seize. ...	...	સહાવું.
હાસું, n. Truth. adj. True. ...	...	સાચું.
„ થાધને જવું, To be acquitted. ...	...	I.,,
„ થાવું, Acquittal. ...	...	"
„ મનાવણ્ણા કુઠવું, To torture. ...	...	"
હાંસે or હાંસેહાંસ, adv. Truly. ...	...	"
હાહ, m. Breath. ...	...	શાસ.
„ ખાવો, To rest, to pause. ...	...	"
„ દાવણો, To breathe freely... .	...	"
„ સડવો, To breathe with difficulty (with dat. of pers.)...	...	"
હાહડવું, v.i. To neigh. ...	...	દણુદણું.
હાહરી, f. The <i>saras</i> bird. ...	...	સારસ.

	Guj.	Equiv.
હાડરો or હાહો, <i>m.</i> A father-in-law.	...	સસ્તરો.
હાહુ, <i>f.</i> A mother-in-law.	...	સાસુ.
હાહો or હહલો, <i>m.</i> A hare.	...	સસલો.
હાળ, <i>n.</i> A coarse kind of rice.	...	સાળ.
હાળાએડી, <i>f.</i> A wife's brother's wife.	...	સારાએલી.
હાળી, <i>f.</i> A wife's sister.	...	સાળી.
હાળો, <i>m.</i> A wife's brother.	...	સાળો.
હાળોત્રી, <i>m.</i> A wife's sister's husband.	...	? આઢુ.
હીઆણી, <i>f.</i> A midwife.	...	સોઘઆણી.
હીઆરો, <i>m.</i> A partner.	...	સહિયારો.
હીઆળ, <i>m.</i> A jackal.	...	શિયાળ.
હીઓઠો, <i>m.</i> Winter.	...	શિયાગો.
હીક, <i>f.</i> Instruction.	...	સીખ.
„ વતાવણી, To instruct.	...	”
હીક, <i>f.</i> Dismissal.	...	*
„ દીવી, To dismiss.	...	”
હીકવણું, <i>v.t.</i> To teach.	...	શીખવણું.
હીકવું, <i>v.t.</i> To learn.	...	શીખવું.
હીગડો, <i>m.</i> A horn.	...	શીંગડો.
હીડવું, <i>v.i.</i> To walk, to go.	...	હીડવું.
હીમ, <i>f.</i> A district.	...	સીમ.
હીમ, <i>n.</i> Frost.	...	હિમ.
હીમત, <i>f.</i> Courage. હીમતવાળું, Brave.	...	હિમત.
„ આલવી, To encourage.	...	”
„ રાખવી, To have courage, to be brave.	...	”
હીમાળું, <i>adj.</i> Frosty.	...	હિમ.
હીર, <i>n.</i> Silk.	...	હીર.

	Guj. Equiv.
શીવડી, <i>f.</i> Sugar-cane (small and light in colour). ... ... ...	શેરડી. ...
શીવનણું, <i>v.t.</i> To swing.... ... ...	હિલણું.
શીવડાવણું, <i>v. caus.</i> To get sewn. ...	સિવડાવણું.
શીવતું, <i>v.t.</i> To sew. ... ... ...	સિવવું.
શીવાડવું, <i>v.t.</i> To get sewn, ... ...	સિવાડવું.
શીસવું, <i>v.t.</i> To sprinkle... ... ...	સિંચવું.
શીસતું, <i>v.i.</i> To swing. ... ... ...	હિંચવું.
શીસાંખો, <i>m.</i> A hawk. ... ... ...	સિચાણો.
શીર્ષો, <i>m.</i> Swinging. શીર્ષો દીવો, To swing.	હીંચવું.
શીઠી, <i>f.</i> A small bottle. ... ...	સીસી.
શીંહ, <i>n.</i> Lead. ... ... ...	સીસું.
શીંહો, <i>m.</i> A large bottle. ... ...	સીસોા.
હું, <i>pron.</i> I. ... ... ...	હું.
હું? <i>inter. pron.</i> What? હું કરીને? Why?	શું.
હુઅણું, <i>adj.</i> Soft. Smooth. ... ...	સુવાળું.
હુઘ જતું, <i>v.i.</i> To go to sleep. ... ...	સુઘ જતું.
હુએડ, <i>m.</i> A pig... ... ...	સુપર.
હુક. See હક. ... ... ...	સુખ.
હુકતું or હુકાતું, <i>v. i.</i> To dry, to wither.	સુકતું.
હુકાઈજતું, <i>v.i.</i> To wither, to rot. ...	"
હુકાવણું, <i>v.t.</i> To dry. ... ... ...	"
હુગ or હેઠાગ, <i>m.</i> Regret, sorrow. ...	શોક.
હુંગવું, <i>v.t.</i> To smell. ... ... ...	સુંધરવું.
હુંગું, <i>adj.</i> Cheap... ... ...	સોંધું.
હુજ, <i>f.</i> Perception. ... ... ...	સુઝ.
,, પડવી, To perceive (with dat. of pers.).	"

	Guj. Equiv.
કુજવું, v.i. To be perceived (with dat. of pers.)...	સુઅતું.
કુણ, f. An elephant's trunk....	સુણ.
કુડળી, f. or કુડલો, m. A basket.	કુડલો.
કુરો, m. A green pigeon.	કુરા.
કુણું, v.i. To swell.	સુણું.
કુતળી, f. String.	સુતળી.
કુતાર, m. A carpenter...	સુતાર.
કુદરં. See કેરં.	સુધરં.
કુટી, prep. Until.	સુખી.
કુદ્દ, adj. Reformed, civilized....	શુદ્દ.
કુની, m. A goldsmith....	સોની.
કુદુ, n. Gold.	સોનું.
કુતુ, adj. Deserted.	સુતું.
કુપતું or કુપી દીતું, v.t. To hand over.	સૌંપવું.
કુરણ, m. The sun.	સૂરણ.
કુરાત, Name of a Bhil clan at Od.	...
કુલ, f. A dagger. કુલ મારવી, To stab...	સુજી.
કુલો or હોલો, m. A ring-dove....	હોલો.
કુવાડતું, v. caus. To put to sleep.	સુવાડતું.
કુંબ, v.i. To go to sleep.	સુંબ.
કુસ, m. Activity. Cleverness. Skill....	હેંસ.
કુસકારી, f. A whistle....	*
,, કરવી, To whistle.	...
કુળી, f. Gallows, an impaling stake....	સુળી.
કુળન્યે સંગવણું, To impale.	"
કે, v. Is. હે કે નહીં? Is it not so?	કે.

## Guj. Equiv.

હેંડા, <i>adj.</i> Hundreds of. ....	સેકડા.
હેં, <i>f.</i> A strap.... ...	*
હેં, <i>f.</i> A stream, a flow ( of milk &c.).	સેર.
„ પાડવી, To milk (with genit. of cow).	"
હેંડા, <i>m.</i> An edge, a border. ....	છડા.
પેદે હેંડે, On the farther side. Beyond.	"
હેન, <i>n.</i> Love. હેત રાખું, To love. ....	હેત.
હેત, <i>prep.</i> Along with.... ...	સમેત.
હેતુ, <i>m.</i> An object, a motive....	હેતુ.
હેઠ, <i>adj.</i> All, the whole. ....	*
હેર, <i>f.</i> A spring of water. ....	સેર.
અનીની હેર જોવી, To feel the pulse.	"
હેરવું, <i>v.t.</i> To search for... ....	હેરવું.
હેરાજ, <i>n.</i> An auction. ....	હરાજ.
„ કરવું or કરી દાવું, To sell by auction.	"
હેરાન, <i>adj.</i> Perplexed, dismayed. ....	હેરાન.
હેરી, <i>f.</i> A lane.... ...	શરી.
હેલ or હેણું, <i>adj.</i> Easy. હેલાં, Easily...	સહેલ.
હેલણું, <i>n.</i> A sign, a mark, a proof. ....	? નિશાણી.
„ આલવું, To prove. ....	"
„ માંડવું, To make a note, to mark.	"
હેલા, <i>interj.</i> Ho! I say! ....	આલ્યા,
હેલા, Name of a Bhil clan at Thur....	...
હેલાણી, <i>f.</i> A trace, a proof. ....	? નિશાણી.
હેળ, <i>n.</i> A plough. હેળ હાંકવું, To plough.	હળ.
હેં, <i>adj.</i> A hundred. ....	સોં.
હો, <i>v.</i> Be thou! <i>interj.</i> Mind! ....	હો.
હોંક, <i>f.</i> A needle. ....	સાઈ.

Guj. Equiv.	
હોકારો, <i>m.</i> Assent. હોકારો ભરવો, To assent.	હોકારો.
હોક, <i>f.</i> A co-wife. ... ... ...	રોક.
હોગ or ફુગ, <i>m.</i> Regret, sorrow. ...	રોક.
હોગન, <i>m.</i> An oath. હોગન ખાવા, To swear.	સોગન.
હોજ, <i>adj.</i> Right, tidy... ... ...	? સ્વચ્છ.
„ કરવું, To set right, to tidy up. ...	...
હોજવું or હોજ કાઢવું, <i>v.t.</i> To search for...	? શોખવું.
હોણું, <i>n.</i> Flax. ... ... ...	શાણું.
હોણું, <i>n.</i> A dream. ... ... ...	સાણું.
હોતે રાખવું, To keep in remembrance...	? સરત.
હોપવું. See ફુપવું... ... ...	સાંપતું.
હોપો, <i>m.</i> The time for dreams. ...	સ્વમું.
„ પ્રજયો, The early part of the night.	„
હોમવાર, <i>m.</i> Monday. ... ... ...	સોમવાર.
હોર, <i>m.</i> Gun-powder. ... ... ...	સુરંગ.
„ ઉડાડવો, To blast.... ... ...	„
હોર, <i>f.</i> Leisure.... ... ...	*
હોકોં or ફુકોં, <i>m.</i> A ring-dove.... ...	હોકો.
હોવે, <i>adv.</i> Yes. ... ... ...	હોવે.
હોસ, <i>m.</i> Reflection, deep thought. ...	સોચ.
„ કરવો, To reflect.... ... ...	„





## ENGLISH-BHILI.

### A.

- Abandon**, *v. t.* સોડી દીનું.  
**Abide**, *v. i.* રેણું, વાસો કરવો.  
**Able**, *to be, v.i.* કુચિં. See also § 37.  
**Aboriginal**, *adj.* આગજમાતરું.  
**Aborigines**, *n.* આગજમાતરનાં, *n. pl.*  
**About**, *adv.* અટકેળમાં, આસરેમાં. *prep.* Around,  
આહેપાહે. Concerning, વેસી, વેસે.  
**Above**, *adv. and prep.* માથે, ઉપર.  
**Abscess**, *n.* શુખ્ફું, *n.*  
**Absent**, *adj.* જેરહાજર, નહીં સતું.  
**Absolute**, *adj.* પુરુષ, નકી.  
**Absolutely**, *adv.* નહીં.  
**Absolution**, *n.* ભાપી, *f.*; સુટકો, *m.*  
**Absolve**, *v.t.* ભાપ કરવું,—ની ભાપી કરવી,—નો સુટકો કરવો.  
**Abstain**, *v. i.* કેગળું રેણું.  
**Abundant**, *adj.* ખૂખું, ખણ્ણું, ખણ્ણું.  
**Abuse**, *n.* ગાળ or ગાળી, *f.*  
**Abuse**, *v. t.* ગાળ or ગાળી દીવી.  
**Accept**, *v. t.* (a thing) લીનું; (a statement) માનવું, માની લીનું.  
**Accompany**, *v.t.* હાતે આવણું or જાતું.  
**Accomplish**, *v.t.* કરવું, પાર કરવું.  
**Accomplished**, *to be*, થાવું, પાર થાવું.  
**Accord**, *of one's own*, રાજ ખુસીહું, મનહું.  
**According to**, *prep.* ભાપક, હરકું, અણુ, પ્રમાણે.  
**Account**, *n.* અસાધ, *m.* On account of, હાર, ઓલે, મારે.

- Accumulate, v.t.** બેળું, બેળું or એકદ્વારા કરવું, -નો ઉંગરો કરવો.
- Accurate, adj.** ખરી, ટીકી, ખરાખર or ખરાખર.
- Accurately, adv.** ખરાખર or ખરાખર.
- Accusation, n.** ફરીઆડ, f.
- Accuse of, v.t.** માયે...દરવું,
- Accuser, n.** ફરીઆડી, m.
- Accustom, v.t.** ટેવ પાડવી.
- Ache,** n. દખ or દુખ, n. v.i. દખવું or દુખવું, ફળવું.
- Acid,** adj. કઢવું ભીડું.
- Acknowledge, v.t.** આનવું, આની લીવું. To acknowledge oneself in the wrong, આનની જુદી પહૃતી. (lit. To seize the lobe of the ear).
- Acquaintance, n.** (a person) ઓળખીતો, ભાઈઓ; (knowledge) ઓળખેણું or ઓળખેણું પાળખેણું. f.
- Acquire, v.t.** પામણું, કમાતું.
- Acquit, v.t.** સેડી દીવું, -નો સુટકો કરવો.
- Across, adv.** આડું. To or on the other side, પેસેપાર.
- Active, adj.** ડીલેફેઝીં.
- Adhere, v.i.** વળગવું, સોંટવું.
- Adjoining, adj.** લગતું, પાહેતું.
- Admit, v.t.** માંહે આવણ્ણા દીકું.
- Adopt, v.t.** ઐગેતર લીવું.
- Adopted, adj.** ઐગેતર.
- Adult, n.** મોટીઆર, m.
- Adultery, n.** સીનાળું, n.
- Advance, n.** (of money) ખાતું. v.t. મોરે જવું.  
v.t. મોરે આલવું.
- Advancement, n.** ઉદારો or ફુદારો, m.
- Advantage, n.** નાફી, m.; લાભ, m.; લાભ, m.; ફાયદો, m.

- Adversary, n.** વેરી, m.; દસમન, m.  
**Adverse, adj.** ઉદ્દુ. Adverse to, હાયું or હામે.  
**Adversity, n.** વપત, f.; વેલા, f.  
**Advice, n.** સલાહ, f.; હીકામણુ, f.  
**Advise, v. t.** સલાહ or હીકામણુ દીવી.  
**Afoot, adv.** પોગે.  
**Afraid, to be,** ખીંબું, ખી or ખીક લાગવી (with dat. of pers).  
**After, adv. and prep.** વાંછે, પસે, પુટે.  
**Afternoon, n.** પાહલી વેળા, ટાડે ફેર.  
**Afterwards, adv.** વાંછે, તથાપુટે, પસે.  
**Again, adv.** શીર or ફેર. conj. વળતે, વળી.  
**Against, prep.** હાયું, હાનાં or હામે. Against one another, હામાંહામાં.  
**Age, n.** ઉભર, f. Of what age? કત્રાં વરતુ?  
**Aged, adj.** ધડું.  
**Agitate, v. t.** ઉસકાવણું, સડાવણું.  
**Ago, adv.** પાજ્યું. Three days ago, તથુ હાડા થાજ્યા. Long ago, કન્યાતું. How long ago? કન્યાતું?  
**Agree, v. i.** મળતું આવણું. To get on with, ખણું. To agree to, હા કેવી, હોકારો ભરનો.  
**Agreeable, to be,** હાઉ લાગવું, ગમવું, સાવવું, દાવતું.  
**Agreement, n.** કોલ, m.; કરાર, m.; કાવ, m. Concord, ઉપ, m.; મેળાપ, m.  
**Agriculture, n.** એતી, f.  
**Ague, n.** ટાડો તાવ.  
**Ailing, adj.** માંદું, હોમાર.  
**Air, n.** વાપરો, m.  
**Alas!** interj. હાયહાય! અરે! બાપરે!  
**Alight, v. i.** ઉતરવું.

- Alike,** *adj.* હરદું, એકદરકું, મળતું, ખરાયર. To be alike, મળતું આવણ્ણું.
- Alive,** *adj.* જીવતું, જીવી.
- All,** *adj.* હગળું, હેતું, આખું, બદું. Not at all, મૂળ નથી.
- Alligator,** *n.* મગર, *m.*
- Almost,** *adv.* આસરેમાં, લગભગ.
- Alms,** *n.* ધરમ, *m.* To give alms, ધરમ કરવો.
- Alone,** *adj.* એકદું.
- Along with,** *prep.* હાતે, હાતે હાતે, લારે.
- Aloud,** *adv.* જોરદારું.
- Also,** *adv.* - વળે, વળી, વળતે.
- Alter,** *v. t.* બદલો કરવો.
- Alternately,** *adv.* વારાંવારાં.
- Altogether,** *adv.* હગળું મળીને, હેતું મળીને.
- Alum,** *n.* ઇટકડી, *f.*
- Always,** *adv.* હાડું, હાડે હાડે, નીત, ખારેપોર, સદા.
- Ambush,** to lie in, ઓછામાં પેઢી રહું, હુંપી રહું.
- Amid,** among, *prep.* માંય, વેસમાંય.
- Ancestors,** *n.* ખાપદાદા, *m. pl.*
- Ancient,** *adj.* આગામાવારાતું.
- And,** *conj.* ને.
- Angel of death,** *n.* જરમ or જોમ, *m.*
- Anger,** *n.* રીંદ, *f.*
- Angrily,to speak,** સંગ્રહની ઘોલી ઘોલતું.
- Angry,** *adj.* રીંદાણું, નારાજ. To be angry, રીંદ સંગ્રહી, રીંદ સરવી (with dat. of pers.).
- Anguish,** *n.* પીડા, *f.*
- Animal,** *n.* જનાયર, *n.*

- Anklets, n.** તોડા, *m.pl.* Wedding-anklets, કામૂજવા, *m.pl.*  
Anklets with bells attached, સ્વિજરા, *m.pl.*
- Annoy, v. t.** દખ or દુખ કરતું or દીવું.
- Anoint, v. t.** સોપણવું.
- Another, adj.** બીજું. One another, એક બીજું.
- Another's, adj.** પારકું.
- Answer, n.** જવાય, *m.* **v. t.** જવાય દીવો.
- Ant, n.** કીડી, *f.* (red); મદુડો or મડુડો, *m.* (black);  
ઉદેચ, *f.* (white).
- Anxiety, n.** દુઃકર, *f.*
- Anxious, to be,** દુઃકર થાયી (with dat. of pers.).
- Any, pron.** કંઈ, કંણું, કોઈ.
- Anyhow, adv.** ગમે તીમ હરીને.
- Anyone, pron.** કંણુંક, કોક, કોઈ.
- Anything, pron.** કંઈ, કંઈ. Anything at all, કંઈજો.
- Anywhere, adv.** કંણે ઢેકાણે.
- Apart, adj.** જુઓ, ન્યાં, અલગું. **adv.** મેરમેર.
- Aperient, n.** જખાય, *m.*
- Apparel, n.** લઘરાં, *n. pl.*
- Appear, v. i.** દેખાયું, નજરે પડ્યું.
- Apply, v.t.(ointment)** સોપણવું. To apply oneself, ખણુણો રાખવો.
- April, n.** વીહાક—નેદ. See § 62.
- Arable, adj.** ખડવાહરકું.
- Arbitrate, v. i.** ન્યાવ કરવો, સુકાયલો કરવો. **v.t.** —નો ન્યાવ કરવો.
- Arise, v. i.** ઉઠતું, ઉણું થાતું.
- Arm, n.** હાથ, *m.*; દુટ્યો, *m.* Under the arm, ખગલમાં.
- Armlet, n.** સુડલો, *m.* (made of lacquer and worn on  
the upper arm by mothers only); સુડલી,  
*f.* (worn on the fore-arm); કામળી, *f.*  
(glass bangle worn on the fore-arm).

- Armpit,** *n.* કાય, *f.*; ખગથ, *f.*
- Arms,** *n.* અધ્યાર, *m.* Bows and arrows, ધોળી હરન્યા, *m. pl.*
- Army,** *n.* ફોર્સ, *f.*; લસ્ટર, *n.*
- Around, *adv.* and *prep.*** આહેપાહે, સમકેર.
- Arouse,** *v. t.* જગાડવું. To agitate, સડાવણું.
- Arrange,** *v. t.* —નો બંદોખસ કરવો,—નો કાચ કરવો. To make tidy, હોજ or હાઉં or ઠીક કરવું.
- Arrangement,** *n.* બંદોખસ, *m.*
- Arrive,** *v. i.* આવણું.
- Arrow,** *n.* હરન્યું, *n.*; તીર, *m.* Arrow-feather, કાપદો, *m.* Arrow-head for shooting fish, ઓલ, *f.* Arrow-head like a spear-head used in fighting and for shooting big game, વાપડો, *m.* Wooden arrow-head for shooting birds, શીદુઓ, *m.* Round iron arrow-head, લાખણું *n.* Arrow-shaft, હરન્યો, *m.*
- As,** *adv.* જામ or જેમ; કરીને (introducing noun in apposition). Such as, જતું. As much as, એતાં.
- Ascend,** *v. i.* સડવું, સડી જવું.
- Ascetic,** *n.* તપસી, *m.*
- Asceticism,** *n.* તપ, *m.*
- Ashamed,** *adj.* લાજતું. To be ashamed, લાજવું, હરમાતું.
- Ashes,** *n.* રઘોડો, *m.* Heap of funeral ashes, રાગી, *f.*
- Aside,** *adv.* મેરેમેરે.
- Ask,** *v. t.* પુસવું. To ask for, માગવું.
- Ass,** *n.* ગદેડો-ડી-ડું; ખોલો-લું.
- Assemble,** *v. i.* ભેળા, ભેગા or એકઢા થાવા; *v. t.* ભેળા, ભેગા or એકઢા કરવા.

- Assent,** *n.* હોકારો, *m.*; હા, *f.* *v.i.* હોકારો ભરવો, હા કેવી.
- Assessment** (on the produce of land), *n.* કુતું, *n.*; વળ, *f.*
- Assist,** *v.t.* લાગવું (combined with an Infinitive);  
ટકો કરવો.
- Assistance,** *n.* ટકો, *m.*
- Assurance,** *n.* ખાતરી, *f.*
- Assure,** *v.t.* ખાતરીંદું કરું.
- Asthma**, to suffer from, *દમ* or હાહ સડવો (with dat. of pers.).
- Astonished**, to be, નવાઈ લાગવી (with dat. of pers.);  
ચેરાન પામી રહ્યું.
- Astonishment,** *n.* નવાઈ, *f.*
- At,** *prep.* એ (loc. case-ending); કને or કેને. At  
once, જટપણ.
- Atonement,** *n.* પરાસત, *n.*
- Attachment,** *n.* માદ્યા, *f.* Attachment of property,  
જપતી, *f.* Attachment officer, જપતીદાર, *m.*
- Attack,** *v.t.* માથે આવી સડવું.
- Attend,** *v.i.* —માં હાજર થાવું. To attend to one's busi-  
ness, ગેર કરીને કામ કરવું.
- Attention,** *n.* ખણુઢો, *m.* To pay attention, ખણુઢો રાખવો.
- Auction,** *n.* હેરાજ, *n.* To hold an auction, હેરાજ કરી દડવું.
- August,** *n.* હુરાવણું—બાદરવો. See § 62.
- Aunt,** *n.* Father's sister, કુઠ, કોઈ or જુઈ. Father's  
elder brother's wife, ભાણી. Father's  
younger brother's wife, કાકી. Mother's  
sister, માણી. Mother's brother's wife, મામી.
- Auspicious,** *adj.* હાઉં. Auspicious moment, *n.* પળ, *n.*
- Austerities (religious),** *n.* તપ, *m.*

**Authority, n.** કંગ, *m.*

**Avarice, n.** લાખસ, *f.*

**Avaricious, adj.** લાખરી or લાખસુ.

**Await, v. t.** —ની વાટ નેવી.

**Awake, v. i.** જગવું; **v. t.** જગાડવું.

**Axe, n.** કડાડો, *m.*

## B.

**Babble, v. i.** ઘડણક કરવું.

**Babe, n.** બાળીક, *n.*

**Bachelor, n.** કુઅરો, અગન કુઅરો.

**Back, n.** વાહો. On one's back, સીતુ. *adv.* પાયું.

**Backbite, v. i.** સાડી કરવી, ચુકલી આવી.

**Backbiter, n.** સાડુંઘો, *m.*

**Backbiting, n.** સાડી, *f.*; ચુકલી, *f.*

**Backbone, n.** ગરગેડ, *f.*

**Back-room, n.** ઓલીભો', *n.*

**Back-wall, n.** પસીત, *f.*

**Bad, adj.** ઝોડું, નાદારું. Bad fellow, ગમાર, નકરો, પટકાંજો.

Bad woman, બદતાની, પટકાંજી, પાતર.

**Bag, n.** ડોથલી, *f.*

**Baggage, n.** સામાન, *m.*

**Bake (bread),** રોટી કરવી.

**Balance, n.** તાજવાં, *n. pl.* Remainder, *n.* ખાકી, *f.*

**Baldness, n.** રાશ, *f.*

**Bale,** *n.* પોટસો, *m.*

**Bale out, v.t.** અળીસવું.

**Ball,** *n.* ગોળી, *f.*; ડોટ, *m.*; તોટડી, *f.* To play at ball, ડોટ રમવો.

- Bamboo, n. વાંડો, m.; વાંડી, f. Thin bamboo, કેળું, n.  
 Split bamboo, (thin) કાંઘડી, f.; (thick)  
 કાંઘડો, m. Bamboo-matting, કડો, m.
- Bandage, n. પાટો, m.
- Bangle, n. કાંખળી, f. (made of glass and worn on the  
 fore-arm); કાતરજ્યું, n. (worn between  
 the કાંખળી); ખલેજ્યું, n. (worn near the  
 elbow); થાર, n. (worn on the wrist).
- Bania, n. વાણ્યો, m.
- Bank, of a river, n. કાંડો, m.; તેડ, f.; કનારો, m.
- Banker, n. નાણુલતી, m.
- Bankrupt, adj. જનાણું.
- Banner, n. ધળ, f.
- Barb, n. See arrow-head.
- Barber, n. કાંયને, m.; વેદ, m.
- Bard, n. વાઈતી, m.
- Bark, n. સોંકું, n.; સોલ, f.
- Bark, v. i. બહારું.
- Barley, n. જોવ, m.
- Barren (land), adj. ઉખીલ, પડતે.
- Barter, v. t. હાટે આલવું.
- Basin, n. કુંકું.
- Basket, n. ફુંદી, f.; ટેપલી, f.; સાખડી, f.
- Bat, n. સામીસોણદ્યું, n.
- Bathe, v. i. અલવું, નાવું.
- Be, v. i. હોવું, થાવું.
- Bead, n. સીડજ્યું, n.
- Beak, n. સાંસ, f.
- Beam, n. પાઠવેલ, f.; મેળજ્યો, m.

- |                                   |                |   |
|-----------------------------------|----------------|---|
| Bear,                             | v.             | રીસ, m.   |
| Bear,                             | v.t.           | (of a woman) જણું ; (of animals) વીચારું.<br>To bear fruit, કણ લાગવાં (with dat. of tree).              |
| Beard,                            | n.             | દાડી, f.  |
| Beat,                             | v.t.           | મારવું. To win, જતવું. To beat the breast<br>in token of mourning, કુટવું.                              |
| Beaten, to be,                    |                | માર ખાનો.   |
| Beautiful, adj.                   |                | સ્પાળું.  |
| Because, conj.                    |                | કીમકે ; તથે (at the end of clause).   |
| Beckon,                           | v.i.           | હાન્યાં કરવાં.  |
| Become,                           | v.i.           | થાંયું, થાઈન્યું, ખણું.   |
| Bed,                              | n.             | See Bed-stead. To go to bed, ફૂઝ જવું.<br>To be confined to bed, આટલામાં પડન્યું ને<br>પડ્યન્યું રેખું. |
| Bedding,                          | n.             | પાથરેલું or વાંધરેલું.  |
| Bee,                              | n.             | માણી, f.  |
| Beetle,                           | n.             | કંદળમારી, f.  |
| Before, adv. and prep. (of place) |                | મોરે, અગાડી or અગાડું;  |
| (of time)                         | adv.           | મોરે, આગે. adv. મોરેહું.  |
| Beg,                              | v.i.           | ભીખ માગવી.  |
| Beget,                            | v.t.           | પેદા કરવું.   |
| Beggar,                           | n.             | ભીખારી, m.  |
| Begging,                          | n.             | ભીખ, f.   |
| Begin,                            | v.t.           | સર કરવું, સાથતું કરવું, આદરવું, -ની સરાયાત<br>કરવી, -નો સુરેત કરવો.                                     |
| Beginning,                        | n.             | સરાયાત, f.; સુરેત, m.; સુલા, n. From the<br>beginning, ઠેઠું, ઠેઠાંઠું, સુલાંઠું.                       |
| Behind,                           | adv. and prep. | વાંદે, પુઠે, પસાડી or પસાડું. Behind<br>and before, વાંદે મોરે.   |

- Belch, *v.i.* ઓટકાર કરવો.
- Believe, *v.t.* માનવું, ખરું માનવું.
- Bell, *n.* કુંગરો, *m.*; જાયું, *n.* ( worn at the back by women and girls ); કંહેણ, *f.* ( hung on the neck of cattle ).
- Bell-metal, *n.* કાંઠું, *n.*
- Bellow, *v.i.* વાહવું.
- Beloved, *adj.* વાદ્યા.
- Below, *adv.* and *prep.* નીચું or નીસે, એટો, તળે.
- Bench, *n.* પાટળો, *m.*
- Bend, *v.i.* નમણું, વળવું. To bend down, નમી જવું.  
*v.t.* વાળવું.
- Beseech, *v.t.* —ની વીન્તી કરવી.
- Beside, *prep.* કને or કેને, પાછે.
- Besides, *prep.* વગર, વના, સવાખ.
- Besiege, *v.t.* ધેરવું, ધેરી લીવું.
- Besmear, *v.t.* સોપડવું.
- Besom, *n.* ખારો, *m.*
- Best, *adj.* હગળા કરતાં હાડ.
- Betroth, *v.t.* —ને હાર હરો ભરવો ( lit. To fill up the liquor—the second stage in arranging for a marriage ).
- Betrothal, *n.* હગાધ, *f.*
- Better than, —કરતાં હાઉ.
- Between, *prep.* વસે, વેસમાંય.
- Beware, *interj.* ખખરદાર ! *v.i.* ગમ રાખવી, સેતવું, સેતી રૈવું.
- Bewilder, *v.t.* એરાન or હરાન કરવું.
- Bewildered, to be, હરાન થાવું.

Bewitch,	v. t.	સોટવું (agreeing with ડાકેણું, a witch).
Beyond,	adv.	પેલીપાછ, પેલીઆડ, પેલે હેઠે, પરમે. On the right side, ઉપકે હાય. On the left side, નીચકે હાય.
Bid,	v.t.	કેવું, હકમ દીવેં.
Bier,	n.	તરકદી, f.
Big,	adj.	મોદું.
Bill,	n.	અસાચ, m.
Bind,	v. t.	ખાંદવું, માંદવું. To bind tightly, તાણુંને ખાંદવું.
Bird,	n.	પંખી, n.
Birth,	n.	જલઅ, m.; પેદાસ, f. To give birth to, (of a woman) જખુંબ ; (of animals) વીચાંબ.
Bit,	n.	ખટકું, n. Bit of bridle, વાગ, m.
Bitch,	n.	કુતરી.
Bite,	v. t.	કડવું, કદી ખાવું. To sting, ઝંકું.
Bitter,	adj.	કડવું.
Black,	adj.	કાળું. Black-mail વળાંબ, n. Black pheasant, કાગોડો મોર, m.
Blacksmith,	n.	લોચાર, m.
Blacken,	v. t.	કાણું કરવું.
Blame,	n.	ઝોડ, f.; v. t. —ની ઝોડ કાડવી.
Blanket,	n.	કામગોલ, m.
Blast,	v. t.	(a mine) ઉકાડવી (always governing the object, હોરેંગ).
Blaze,	v. i.	ધગધગવું.
Bleed,	v. i.	લુધ નીહરવું.
Blemish,	n.	ઝોડ, f.; અખ, f. Blemished, અખીલું.
Bless,	v. t.	હાઉ કરવું.
Blessed,	adj	સુકી, હુકી, હકી.

Blight,	<i>n.</i>	(on corn) ગીંદ, <i>n.</i>
Blind,	<i>adj.</i>	આંદળું.
Blister,	<i>n.</i>	જરેલો, <i>m.</i>
Block (of wood),	<i>n.</i>	ટીંગળું, <i>n.</i> To block up, રોકવું.
Blood,	<i>n.</i>	લુધ, <i>n.</i>
Blossom,	<i>n.</i>	મેર, <i>m.</i>
Blot,	<i>n.</i>	ડાગ, <i>m.</i> Small blot, ટીપ્કી, <i>f.</i>
Blow,	<i>n.</i>	માર, <i>m.</i> To receive a blow, માર આવે.
Blow,	<i>v. i.</i>	ઝુકવું; (as wind) વાજણું. To blow (an instrument), <i>v. t.</i> પણકવું.
Blunder,	<i>n.</i>	ભુલ, <i>f.</i> ; ભુલસુક, <i>f.</i> ; સુક, <i>f.</i> ; ઘોટ, <i>f.</i>
Blunt,	<i>adj.</i>	કોળું.
Boa-constrictor,	<i>n.</i>	આંધેર, <i>m.</i>
Boar,	<i>n.</i>	હુંશેડ, <i>m.</i>
Board,	<i>n.</i>	પારીઓ, <i>n.</i>
Boast,	<i>n.</i>	મોટાઈ; <i>v. i.</i> મોટાઈ કરવી.
Boat,	<i>n.</i>	નાવ, <i>f.</i>
Bodice,	<i>n.</i>	કાપડું, <i>n.</i>
Body,	<i>n.</i>	ડીલ, <i>n.</i> ; દે, <i>m.</i> ; કાયા, <i>f.</i> ; ખોળદ્યું, <i>n.</i> ; સરીર, <i>n.</i>
Boil,	<i>n.</i>	ગુઝરું, <i>n.</i> ; ઉમરું, <i>n.</i> ; <i>v. i.</i> ઉકળવું, ઉકળું આવ- ણું; <i>v. t.</i> ઉકળવું.
Bold,	<i>adj.</i>	સાતીવાળું, શીખતવાળું.
Bone,	<i>n.</i>	હાડકો, <i>m.</i> ; હાડકી, <i>f.</i>
Book,	<i>n.</i>	સોચી, <i>f.</i>
Booty,	<i>n.</i>	હુંટ, <i>f.</i>
Border,	<i>n.</i>	(of material) કોઠર, <i>f.</i> ; (of a tank, &c.) પાળ, <i>f.</i> ; (of a river) કનારો, <i>m.</i> ; કાઠો, <i>m.</i> ; તેડ, <i>f.</i> See Boundary.
Bore,	<i>v. t.</i>	કારવું.

Born, to be,	ਪੇਦ ਥਾਂ.
Borrow, v. t.	ਲਈਨ੍ਹ ਹਾਂ. Borrowed, ਲਈਨ੍ਹ.
Bosom, n.	ਖੱਬੀ, f.
Both, pron.	ਧਨੇ. On both sides, ਨੇ ਆਇਆਂਮਾਂ.
Bother, n.	ਦਾਖ, n.; v. t. ਦਾਖ ਕਰਵੁੰ.
Bottle, n.	ਲੀਡੋ, m.; ਲੀਡੀ, f.; ਤੁਪੋ, m. A bottle-bird, ਅੜੀ, f.
Bottom, n.	ਫੂੰਡੀ, n.
Bough, n.	ਗਣੀ, f.
Boundary, n.	ਛਾਡੀ, m.; ਛੇ, f.; ਹੀਮਾ, f. To walk the boundary, ਹੱਦੇ ਭਤਾਵਵੇਂ.
Bow, n.	ਬੋਲ੍ਹੀ, f.; ਕਾਂਘਡੀ, f. Bow and arrows, ਪੋਲ੍ਹੀ ਦੁਰਜਾਂ, ਤੀਰ ਕਾਂਘਡੀ. To unstring the bow, ਪੋਲ੍ਹੀ ਉਤਾਰਵੀ. To string the bow, ਪੋਲ੍ਹੀ ਸੋਡਵੀ. Bow-string, ਸਤ੍ਤਾ, f.
Box, n.	ਪਟਾਕਣ੍ਹ, n.; ਮੁੜ੍ਹ, f.
Boy, n.	ਚੌਰੋ, m.
Bracelet, n.	See armlet.
Brahman, n.	ਖਮਲ੍ਹ, m.
Brains, n.	ਪੇਨੇ, m.
Branch, n.	ਗਣੀ, f.
Brand, n.	ਝਾਮ, n.; v. t. ਝਾਮ ਢੀਵੁੰ.
Brass, n.	ਪੀਤਾਣ, n.
Brave, adj.	ਸਾਤੀਵਾਣੇ, ਝੀਮਤਵਾਣੇ। To be brave, ਝੀਮਤ ਰਾਖਵੀ.
Brawl, n.	ਅਲੋ, m.
Bread, n.	ਰੋਟੀ, f.; ਰੋਟੇਂ, m.; ਰੋਟਲੀ, f.; ਰੋਟਲੋਂ, m. To bake bread, ਰੋਟੀ ਕਰਵੀ.
Breadth, n.	ਪਨੇ or ਪਨੋ, m.; ਪੋਣਯਾਈ, f.; ਪੋਣਾਈ, f. In breadth, ਪਨਾਮਾਂ.

Break, v. i.	કુટવું, કુરી જવું, ભાંજ જવું; v. t. ભાંજવું, ભાંજ પાડવું, તોપવું, ફેંગવું. To break to pieces,—ની ખટકી કરવી.
Breath, n.	દમ, m.; હાહ, m.
Breathe, v. i.	હાહ લીધો. To breathe with difficulty, હાહ or દમ સડવો (with dat. of pers.).
Bribe, n.	લાંસ, f. One who takes a bribe, લાસેકુઓ, m.
Brick, n.	ઢૂંદ, f.
Bride, n.	લાડી, f.
Bride-groom, n.	લાડો, m.; વોર, m. Companions of bride- groom, જાંયા, m.; જાંનડી, f. Procession accompanying bride-groom, માન, f.
Bridge, n.	પથ, n.
Bridle, n.	લગમ, f.
Bright, adj.	દિનળું.
Brim, n.	કાનો. To fill to the brim, કાનાટુંદી ભરવું.
Bring, v. t.	આખવું, લાવણું.
Broad, adj.	પોળું, પને.
Broken, adj.	ખાંડું, કુંડું.
Brook, n.	વાંશું, n.; વેળું, n.
Broth, n.	રફુઓ, m.; રેણ, m.
Brother, n.	ભાઈ, m.; (elder) દાદા, m. Brother-in-law, (elder) જેઠ; (younger) દેઝોર.
Brow, n.	કપાળ, n.; નેલાર, n. Brow of a hill, કુસ, f.
Bruised, adj.	ખાંડું.
Brushwood, n.	વાલડો, m.
Bucket, n.	(of iron) તોલસો, m.; (of leather) કોંઠ, f.

Bud,	<i>n.</i>	મોર, <i>m.</i>
Buffalo,	<i>n.</i>	પાડો, <i>m.</i> ; તોળી, <i>f.</i>
Bug,	<i>n.</i>	મારુણું, <i>m.</i>
Build,	<i>v.t.</i>	બાંદું, માંદું, સખું.
Bulb,	<i>n.</i>	કાંદો, <i>m.</i>
Bull,	<i>n.</i>	ટાહો, <i>m.</i> Pack-bull, પોઈ, <i>m.</i>
Bullet,	<i>n.</i>	ગોળી, <i>f.</i>
Bullock,	<i>n.</i>	ખળદ, <i>m.</i>
Bundle,	<i>n.</i>	ગાંઠિ, <i>f.</i> ; ચોરથો, <i>m.</i> (carried on the head); ઘસકો, <i>m.</i> (carried on the back). Bundle of grass, પુલો, <i>m.</i> ; પુળી, <i>f.</i>
Burglar,	<i>n.</i>	ખાતર પાડવાનાળો, <i>m.</i>
Burglary,	<i>n.</i>	ખાતર પાડવી(lit.to make a breach in a wall).
Burn,	<i>v.i.</i>	અળવું. To smart, લચવું; <i>v.t.</i> આળવું, ખાળી દીવું.
Burning-ground,	<i>n.</i>	માંહણું, <i>n.</i>
Burst,	<i>v.i.</i>	કૂશવું, કૂઠી જવું, ફાટવું, ફાટી જવું; <i>v.t.</i> ફાડવું.
Bury,	<i>v.i.</i>	દાટવું. To bury out of a sight, દાટી દીવું.
Bush,	<i>n.</i>	ઝડપ, <i>n.</i>
Business,	<i>n.</i>	કામ, <i>n.</i> To attend to one's business, જેર કરીને કામ કરવું.
Busy, to be,		કામમાં હોવું.
But,	<i>conj.</i>	પણ.
Butt,	<i>v.i.</i>	ઓટ મેલવી.
Butter,	<i>n.</i>	માખણું, <i>n.</i> Butter-milk, સા, <i>f.</i>
Butterfly,	<i>n.</i>	કુદી, <i>f.</i> ; પતંગણું, <i>n.</i>
Buy,	<i>v.t.</i>	વેસાતું લીવું.
By,	<i>prep.</i>	કને or કને, થાઈને, પાહે થાઈને.

## C.

- Cage, n. પાંજરું, n.
- Cairn, n. પાગેજનો, m. (indicating the place where a murder has been committed).
- Calamity, n. આકૃત, f.; વપત, f.
- Calculate, v.t. ગણું, —ની ગણુતરી કરવી.
- Calculation, n. ગણુતરી, f.
- Calf, n. ખાખું or ખાખું કું, n.; દનાડું, n. (under 16 days old).
- Calico, n. માદરપાટ, n.
- Call, v.t. હાદું, ઐલાવણું. To give a name to, નામ પાડવું.
- Called (by name), કરીને.
- Calm, adj. ટાંકું. v.t. ટાંકું પાછવું, ટાંકું કરવું.
- Calve, v.i. વીઆવું.
- Calving, n. વીઆણી, f.
- Camel, n. ઉદ્ડુ, m.; હાડડી, f. Camel-keeper, ઉદ્ડો જોવાળ.
- Camp, n. તેરા, m.; v.i. તેરા કરવો.
- Cannon, n. તોપ, f. To discharge a cannon, તોપ સેડવી.
- Cantonment, n. સત્વણી, f.
- Cap, n. ટેપી, f.
- Capital, n. પુણી, f.
- Care, n. અનર, f.; ઘણુહો, m.; હંબાળ, f.; ગમ, f. To take care, હંબાળવું, અનર રાખવી, ઘણુહો રાખો, હંબાળ રાખવી, ગમ રાખવી.
- Careful, adj. ઘણુહો રાખવાચાળું.
- Careless, adj. આકૃષ.
- Caress, n. લાડ, n.; v.t. લાડ લડાવણું.

<b>Carpenter,</b>	<b>n.</b>	કુતાર, <i>m.</i>
<b>Carpet,</b>	<b>n.</b>	ડરી, <i>f.</i>
<b>Carrion,</b>	<b>n.</b>	સીસી, <i>f.</i> ; ટંદર્યુ, <i>n.</i>
<b>Carrot,</b>	<b>n.</b>	ખુબો, <i>m.</i>
<b>Carry,</b>	<b>v.t.</b>	લી ઊં, ઉસુ કરીને લી ઊં. To carry a child on the hip, કેરે હાથ.
<b>Cart,</b>	<b>n.</b>	ગાડું, <i>n.</i> ; ગાડી, <i>f.</i> Cart-track, રસ્તો, <i>m.</i>
<b>Carve,</b>	<b>v.t.</b>	કોરવું.
<b>Cash,</b>	<b>n.</b>	દુષ્પો, <i>m.</i> ; પાછસા, <i>n.</i> ; રોકોં, <i>m.</i> ; નાણું, <i>n.</i>
<b>Cast,</b>	<b>v.t.</b>	દર્દું.
<b>Caste,</b>	<b>n.</b>	જાત, <i>f.</i>
<b>Cat,</b>	<b>n.</b>	મીની, <i>f.</i>
<b>Catarrh,</b>	<b>n.</b>	કસરો, <i>m.</i> (accompanied with burning fever).
<b>Catch,</b>	<b>v.t.</b>	પકડવું, ઢાંચું.
<b>Cause,</b>	<b>n.</b>	સખા, <i>m.</i>
<b>Cattle,</b>	<b>n.</b>	સોપાં, <i>n. pl.</i> ; ડાંબ, <i>n. pl.</i> ; સોપાંડાં, <i>n. pl.</i>
<b>Cauterize,</b>	<b>v.t.</b>	ડામ દીવું.
<b>Cave,</b>	<b>n.</b>	(large) ઘણ or ખોલ, <i>m.</i> ; (smaller) ઓદર્દું, <i>n.</i> ; (very small) દેર or ધેર, <i>m.</i>
<b>Cease,</b>	<b>v.i.</b>	ઉંઘું રેવું, ચોઅવું; <b>v.t.</b> બંદ કરવું.
<b>Censure,</b>	<b>n.</b>	ફિકો, <i>m.</i> ; <b>v.t.</b> ફિકો દીવો.
<b>Centipede,</b>	<b>n.</b>	કાનાહારવેલ, <i>m.</i> ; ખજુરો, <i>m.</i>
<b>Centre,</b>	<b>n.</b>	વેસદો ભાગ. <i>adj.</i> વેસદું. In the centre, વેસમાંથ.
<b>Certain,</b>	<b>adj.</b>	નક્કી. To make certain, નક્કી કરવું.
<b>Certainly,</b>	<b>adv.</b>	ખરેખરું, નક્કી, હાંસેહાંસ.
<b>Chafe,</b>	<b>v.i.</b>	દ્વાળવું.
<b>Chaff,</b>	<b>n.</b>	કુંગઠા, <i>m. pl.</i>

Chain,	v.	ટોણી, f.; (a fetter) ખીડું, n. To put into chains, ખીડચાગા પાલવું.
Chalk,	n.	ઘાળી ગાર, f.
Chance,	n.	ભાવ્યા, n.
Change,	v.	કર, m.; કેરકાર, m.; v.t. કેરવણી.
Channel,	v.	નીક, f. (for irrigating purposes).
Chaplet,	n.	મેડ, n. (worn by the bride-groom).
Character,	n.	સભાવ, m.
Charcoal,	n.	કોયલા, m.; ચુરેલા, f.
Charge,	n.	કણને, m. To give into one's charge, ફૂપવું, ફૂપી દીવું. To charge, v.t. મોખ દીવે. To charge exorbitantly, પડાવી કીવું. To charge with, માય...દાવું.
Charm,	n.	ઉતાનણી, n.; v.t. રાજ કરવું. To charm away (disease, &c.), -નું ઉતાનણી કરવું.
Chase,	n.	આપડો, m.; v.t. -નો આપડો કરવે.
Chatter,	v.i.	ખાદું, ખકાદ કરવું.
Cheap,	adj.	હુંબું or હેંબું.
Cheat,	n.	છુસું.; v.t. સેતરવું.
Cheek,	n.	ગાલ, m.
Cheerful,	adj.	રાજ.
Chest,	n.	સાતી, f.
Chew,	v.t.	સાવવું.
Chicken,	n.	પાઠરણું, n. Chicken-pox, અસખરી માતા, f.
Chief,	adj.	સરીતું, n.; કાકોર, m.; રાજુ m. Chief's house, રાવદો, m.
Chiefly,		ખાંડું કરીને.
Child,	n.	ખાળક, n.; સોરી, n. Childless man, વાંકુઓ, નાખો. Childless woman, વાંકુઈ.

Chin,	<i>n.</i>	કાડથું, <i>n.</i>
Choke,	<i>v.t.</i>	—નો હાથ રહી નાવો; <i>v.t.</i> ડ્રાગળા અથી દડવો.
Cholera,	<i>n.</i>	ક્રાગળીઓ, <i>n.</i>
Choose,	<i>v.t.</i>	સરતમાં આવે તી લીધું, અમે તી લીધું.
Circle,	<i>n.</i>	કુંડાળું, <i>n.</i>
Circular,	<i>adj.</i>	ગોળ.
City,	<i>n.</i>	સેર, <i>n.</i>
Civilize,	<i>v.t.</i>	હદારથું. Civilized, ફુંદું, હદરેથું.
Claim,	<i>n.</i>	દાવો, <i>m.</i> ; <i>v.t.</i> —નો દાવો કરવો.
Clan,	<i>n.</i>	ઓડેઅખ, <i>f.</i> ; હાય, <i>f.</i>
Clap (hands),		તાળી પાડવી. Clapping, તાળી, <i>f.</i>
Class,	<i>n.</i>	નાત, <i>f.</i> Of an inferior class, પડતે નામે. Of a superior class, સડતે નામે, મોટે નામે.
Claw,	<i>n.</i>	નાખ or નેખ, <i>m.</i> ; નેખરા, <i>m.</i>
Clay,	<i>n.</i>	ભારી, <i>f.</i>
Clean,	<i>adj.</i>	સાદ, ચોકું.
Clever,	<i>adj.</i>	અકલવાળું, સતુર.
Cling,	<i>v.i.</i>	સોંટથું, વળગથું, વગાળી રેવું.
Clod,	<i>n.</i>	ટેકું, <i>n.</i>
Close-weather,	<i>n.</i>	ઉભાણો, <i>m.</i>
Close,	<i>v.t.</i>	ટાંકથું, ટાંકવું, ટાંકી દીવું, દીવું. To close a door, કમાડ દીવું, કડી દીવી. To close the eye, આંખ મસવી, આંખ મરી દીવી.
Cloth,	<i>n.</i>	લાઘરાં, <i>n.</i> Coloured cloth worn by women, લુગું <i>n.</i> Very coarse cloth, ખાડી, <i>f.</i> A piece of cloth, કરું. <i>n.</i> A piece of cloth for a petticoat, નાનાડો, <i>m.</i>
Clothe,	<i>v.t.</i>	પેરાનથું, ઓડથું.
Clothes,	<i>n.</i>	લાઘરાં, <i>n. pl.</i>

Cloud,	n.	વાદળું, n.; વાદળો, m. Banks of clouds, કળાંમેણું, f.
Club,	n.	ગહેડો, m.
Clumsy,	adj.	અનાડી.
Coal-tar,	n.	કારંટ, n.
Coarse,	adj.	ભડું. Coarseness, જાડાઈ, f.
Coat,	n.	આંગડી, f.; આંગડું, n.; કોલ, f. Small-coat, અલડી, f. Long coat, મરજાઈ, f.
Cobra,	n.	છાપ, m.
Cobweb,	n.	ઓળા, f.
Cock,	n.	કુકડો, m. The cock crows, કુકડો બોલે.
Cockroach,	n.	કહણયારી, f.
Cocoa-nut,	n.	નારેળ, n. Cocoa-nut shell, કાથલી, f. A piece of cocoa-nut, કાંસલી, f.
Coin,	n.	દુકાંડો, m.; પાઠસો, m.; નાણું, n. Imperial copper coins, કાવડુંન્યાં, n.pl.
Coir,	n.	કુસો, m.
Cold,	n.	શાઢ, f. To tremble with cold, શાડ સહવી (with dat. of pers.). adj. શાડું. To feel cold, શાડ લાગવી (with dat. of pers.).
Collapse,	v.i.	ખખલતું, ખખલી જતું, ખરેલતું, ખરેલી પણું.
Colleague,	n.	ભાજયો, m.; હાતી, m.
Collect,	v.i.	બેળું, બેણું or એકદું થાવું; v.t. બેળું, બેણું or એકદું કરવું, હમેઠવું, હમેઠી દડવું, હંગદો કરવો.
Collection,	n.	હંગરો, m.
Colonize,	v.t.	વહાડવું.
Colony,	n.	પાલ, f.
Colour,	n.	રંગ, m.; v.t. રંગતું, રંગ દીવો.
Comb,	n.	કાંગડી, f. v.t. કડવું.

Born, to be,	પેદ થતું.
Borrow, v. t.	ઉસીનું હોય. Borrowed, ઉસીનું.
Bosom, n.	સાતી, f.
Both, pron.	ઘને. On both sides, એ આડુણાંમાં.
Bother, n.	દખ, n.; v. t. દખ કરતું.
Bottle, n.	ધીણા, m.; ધીણી, f.; કુપો, m. A bottle-bird, આરી, f.
Bottom, n.	ફૂલ, n.
Bough, n.	ડાળી, f.
Boundary, n.	હાંદો, m.; હદ, f.; ધીમા, f. To walk the boundary, હાંદો પતાવણે.
Bow, n.	ધોણ્ણી, f.; કાંભડી, f. Bow and arrows, ધોણ્ણી હરજ્યાં, તીર કાંભડી. To unstring the bow, ધોણ્ણી ઉતારવી. To string the bow, ધોણ્ણી સેંગવી. Bow-string, સડપ, f.
Box, n.	પઢાણું, n.; મર્ગ, f.
Boy, n.	સેરો, m.
Bracelet, n.	See armlet.
Brahman, n.	બ્રહ્મણું, m.
Brains, n.	પેને, m.
Branch, n.	ડાળી, f.
Brand, n.	ડામ, n.; v. t. ડામ દીનું.
Brass, n.	પીતળ, n.
Brave, adj.	સાતીવાળો, ધીમતવાળો. To be brave, ધીમત રાખવી.
Brawl, n.	આલો, m.
Bread, n.	રોટી, f.; રોટો, m.; રોટલી, f.; રોટસો, m. To bake bread, રોટી કરવી.
Breadth, n.	પને or પનો, m.; પોળખાઈ, f.; પોળાઈ, f. In breadth, પનામાં.

Break, v. i.	કુશું, કુદી જવું, ભાંજું જવું; v. t. ભાંજવું, ભાંજું પાડવું, તોડવું, ફેરવું. To break to pieces, —ની ખટકી કરવી.
Breath, n.	દમ, m.; દાદ, m.
Breathe, v. i.	હાથ લીધો. To breathe with difficulty, દાદ or દમ સડવો (with dat. of pers.).
Bribe, n.	લાંસ, f. One who takes a bribe, લાસેડુઓ, m.
Brick, n.	ચિંદ, f.
Bride, n.	લાડી, f.
Bride-groom, n.	લાડો, m.; વોર, m. Companions of bride-groom, જાંયા, m.; જાંનડી, f. Procession accompanying bride-groom, જાંન, f.
Bridge, n.	પથ, n.
Bridle, n.	લગમ, f.
Bright, adj.	ઝનળું.
Brim, n.	કાતો. To fill to the brim, કાતાફુદી ભરવું.
Bring, v. t.	આખુશું, લાવણું.
Broad, adj.	પોળું, પને.
Broken, adj.	ખાંડું, ફુંકું.
Brook, n.	વાંગું, n.; વેળું, n..
Broth, n.	રફુઓ, m.; રેણ, m.
Brother, n.	ભાઈ, m.; (elder) દાદા, m. Brother-in-law, (elder) જેઠ; (younger) ડેંબોર.
Brow, n.	કપાળ, n.; નેલાર, n. Brow of a hill, કુસ, f.
Bruised, adj.	ખાંડું.
Brushwood, n.	વાલડો, m.
Bucket, n.	(of iron) તોલસો, m.; (of leather) કાદ, f.

Bud,	<i>n.</i>	મોર, <i>m.</i>
Buffalo,	<i>n.</i>	પાડો, <i>m.</i> ; તેણી, <i>f.</i>
Bug,	<i>n.</i>	મારુણુ, <i>m.</i>
Build,	<i>v.t.</i>	બાંદવું, માંદવું, સખવું.
Bulb,	<i>n.</i>	કાંદો, <i>m.</i>
Bull,	<i>n.</i>	ટાહો, <i>m.</i> Pack-bull, પોઠી, <i>m.</i>
Bullet,	<i>n.</i>	ગોળી, <i>f.</i>
Bullock,	<i>n.</i>	બળદ, <i>m.</i>
Bundle,	<i>n.</i>	ગાંડી, <i>f.</i> ; પોરસો, <i>m.</i> (carried on the head); ઘસ્કો, <i>m.</i> (carried on the back). Bundle of grass, પુળો, <i>m.</i> ; પુળી, <i>f.</i>
Burglar,	<i>n.</i>	ખાતર પાડવાવાળો, <i>m.</i>
Burglary,	<i>n.</i>	ખાતર પાડવી ( <i>lit.</i> to make a breach in a wall).
Burn,	<i>v.i.</i>	ખગવું. To smart, લવવું; <i>v.t.</i> ખાળવું, ખાળી દીવું.
Burning-ground,	<i>n.</i>	માંહણું, <i>n.</i>
Burst,	<i>v.i.</i>	કુટવું, કુટી જવું, ફારવું, ફારી જવું; <i>v.t.</i> ફાડવું.
Bury,	<i>v.i.</i>	દાટવું. To bury out of a sight, દાઢી દીવું.
Bush,	<i>n.</i>	કામ, <i>n.</i>
Business,	<i>n.</i>	કામ, <i>n.</i> To attend to one's business, જર કરીને કામ કરવું.
Busy, to be,		કામમાં હેઠું.
But,	<i>conj.</i>	પણ.
Butt,	<i>v.i.</i>	ઓષ્ઠ મેલવી.
Butter,	<i>n.</i>	માખણુ, <i>n.</i> Butter-milk, સા, <i>f.</i>
Butterfly,	<i>n.</i>	કુદી, <i>f.</i> ; પતંગણું, <i>n.</i>
Buy,	<i>v.t.</i>	વેસાઈ લીવું.
By,	<i>prep.</i>	કને or કને, થાઈને, પાહે થાઈને.

## C.

- Cage, n. પંજરું, n.
- Cairn, n. પાળાંગેલા, m. (indicating the place where a murder has been committed).
- Calamity, n. આકૃત, f.; વપત, f.
- Calculate, v.t. ગણું, —ની ગણુતરી કરવી.
- Calculation, n. ગણુતરી, f.
- Calf, n. બાખું or બાખું કેદું, n.; લાંબાં, n. (under 16 days old).
- Calico, n. માદરપાટ, n.
- Call, v.t. હાદવું, એલાનવણું. To give a name to, નામ પાડવું.
- Called (by name), કરીને.
- Calm, adj. ટાકું. v.t. ટાકું પાડવું, ટાકું કરવું.
- Calve, v.i. વીઆવું.
- Calving, n. વીઆણી, f.
- Camel, n. હંડુ, m.; હંડડી, f. Camel-keeper, હંડુનો ગોવાળ.
- Camp, n. તેરો, m.; v.i. તેરો કરવો.
- Cannon, n. તોપ, f. To discharge a cannon, તોપ સોાંધી.
- Cantonment, n. સાવણી, f.
- Cap, n. ટેપી, f.
- Capital, n. પુણી, f.
- Care, n. અનર, f.; અણુહો, m.; હંબાળ, f.; ગમ, f. To take care, હંબાળવું, અનર રાખવી, અણુહો રાખવો, હંબાળ રાખવી, ગમ રાખવી.
- Careful, adj. અણુહો રાખવાવાળું.
- Careless, adj. આકળ.
- Caress, n. લાડ, n.; v.t. લાડ લડાવવણું.

Bud,	<i>n.</i>	મેર, <i>m.</i>
Buffalo,	<i>n.</i>	પાડો, <i>m.</i> ; પોઈ, <i>f.</i>
Bug,	<i>n.</i>	માંકણું, <i>m.</i>
Build,	<i>v.t.</i>	બાંદવું, માંદવું, સચુવું.
Bulb,	<i>n.</i>	કંદો, <i>m.</i>
Bull,	<i>n.</i>	ટાહો, <i>m.</i> Pack-bull, પોડી, <i>m.</i>
Bullet,	<i>n.</i>	ગોળી, <i>f.</i>
Bullock,	<i>n.</i>	ઘળદ, <i>m.</i>
Bundle,	<i>n.</i>	ગાંડા, <i>f.</i> ; પોછો, <i>m.</i> (carried on the head); ઘસકો, <i>m.</i> (carried on the back). Bundle of grass, પુળો, <i>m.</i> ; પુળી, <i>f.</i>
Burglar,	<i>n.</i>	ખાતર પાડવાવાળો, <i>m.</i>
Burglary,	<i>n.</i>	ખાતર પાડવી(lit.to make a breach in a wall).
Burn,	<i>v.i.</i>	ખગવું. To smart, લવવું; <i>v.t.</i> ખાળવું, ખાળી દીવું.
Burning-ground,	<i>n.</i>	માંહણું, <i>n.</i>
Burst,	<i>v.i.</i>	કુટવું, કુદી જવું, ફાટવું, ફાટી જવું; <i>v.t.</i> ફાડવું.
Bury,	<i>v.i.</i>	દાટવું. To bury out of a sight, દાટી દીવું.
Bush,	<i>n.</i>	ઝડપ, <i>n.</i>
Business,	<i>n.</i>	કામ, <i>n.</i> To attend to one's business, જેર કરીને કામ કરવું.
Busy, to be,		કામમાં હોવું.
But,	<i>conj.</i>	પણ.
Butt,	<i>v.i.</i>	ઓટ મેલવી.
Butter,	<i>n.</i>	માખણું, <i>n.</i> Butter-milk, સા, <i>f.</i>
Butterfly,	<i>n.</i>	કુદી, <i>f.</i> ; પતંગણું, <i>n.</i>
Buy,	<i>v.t.</i>	વેસાતું લીવું.
By,	<i>prep.</i>	કને or કને, થાઇને, પાહે થાઇને.

## C.

- Cage, n. પંજરું, n.
- Cairn, n. પાળનો, m. (indicating the place where a murder has been committed).
- Calamity, n. આડત, f.; વપત, f.
- Calculate, v.t. ગણું, —ની ગણુતરી કરવી.
- Calculation, n. ગણુતરી, f.
- Calf, n. બાખું or બાખું કેકું, n.; ધરાડું, n. (under 16 days old).
- Calico, n. માદરપાટ, n.
- Call, v.t. હાદું, એલાવણું. To give a name to, નામ પાડવું.
- Called (by name), કરીને.
- Calm, adj. રાંકું. v.t. રાંકું પાડવું, રાંકું કરવું.
- Calve, v.i. વીઆવું.
- Calving, n. વીઆણું, f.
- Camel, n. ઉદુ, m.; હાડડી, f. Camel-keeper, ઉદુનો ગોવાળ.
- Camp, n. તેરો, m.; v.i. તેરો કરવો.
- Cannon, n. તોપ, f. To discharge a cannon, તોપ સોણવી.
- Cantonment, n. સાવણી, f.
- Cap, n. ટેપી, f.
- Capital, n. મુશ્ય, f.
- Care, n. અનર, f.; ઘણુહો, m.; હંબાળ, f.; ગમ, f. To take care, હંબાળવું, અનર રાખવી, ઘણુહો રાખવો, હંબાળ રાખવી, ગમ રાખવી.
- Careful, adj. ઘણુહો રાખવાચાળું.
- Careless, adj. આડળ.
- Caress, n. લાડ, n.; v.t. લાડ લડાવણું.

Carpenter,	<i>n.</i>	કુતાર, <i>m.</i>
Carpet,	<i>v.</i>	ડરી, <i>f.</i>
Carrion,	<i>v.</i>	સીરી, <i>f.</i> ; ટાંગું, <i>n.</i>
Carrot,	<i>n.</i>	મુખો, <i>m.</i>
Carry,	<i>v.t.</i>	લી જવું, ઉચ્ચુ કરને લી જવું. To carry a child on the hip, કેરે હાજુ.
Cart,	<i>n.</i>	ગાડું, <i>n.</i> ; ગાડી, <i>f.</i> Cart-track, રસતો, <i>m.</i>
Carve,	<i>v.t.</i>	કોરવું.
Cash,	<i>n.</i>	દુકાંઓ, <i>m.</i> ; પાખરા, <i>n.</i> ; રોકડો, <i>m.</i> ; નાણું, <i>n.</i>
Cast,	<i>v.t.</i>	હરવું.
Caste,	<i>n.</i>	જાત, <i>f.</i>
Cat,	<i>n.</i>	મૌની, <i>f.</i>
Catarrh,	<i>n.</i>	કસરો, <i>m.</i> (accompanied with burning fever).
Catch,	<i>v.t.</i>	પકડવું, હાજું.
Cause,	<i>n.</i>	સખ્ય, <i>m.</i>
Cattle,	<i>n.</i>	સોપાં, <i>v. pl.</i> ; ટેંબાં, <i>n. pl.</i> ; સોપાંટાંબાં, <i>n. pl.</i>
Cauterize,	<i>v.t.</i>	ડામ દિવું.
Cave,	<i>n.</i>	(large) ઘથ or ઘોથ, <i>m.</i> ; (smaller) ઘોદંદ, <i>n.</i> ; (very small) ટેર or ધેર, <i>m.</i>
Cease,	<i>v.i.</i>	ઉચ્ચુ રેખું, થોખવું; <i>v.t.</i> બંદ કરવું.
Censure,	<i>n.</i>	કપડો, <i>m.</i> ; <i>v.t.</i> કપડો દીવો.
Centipede,	<i>n.</i>	કાનાંડારવેલ, <i>m.</i> ; ઘજુરો, <i>m.</i>
Centre,	<i>n.</i>	વેસદો ભાગ. <i>adj.</i> વેસલું. In the centre, વેસમાંય.
Certain,	<i>adj.</i>	નકી. To make certain, નકી કરવું.
Certainly,	<i>adv.</i>	ખરેખરું, નકી, હાંસેહાંસ.
Chafe,	<i>v.i.</i>	શ્વળવું.
Chaff,	<i>n.</i>	કુંગઠા, <i>m. pl.</i>

<b>Chain,</b>	<b>n.</b> કાંડળી, <i>f.</i> ; (a fetter) ખીડવું, <i>n.</i> To put into chains, ખીડયાંના ધાસવું.
<b>Chalk,</b>	<b>n.</b> ઘોળી ગાર, <i>f.</i>
<b>Chance,</b>	<b>n.</b> ભાગ, <i>n.</i>
<b>Change,</b>	<b>n.</b> ફેર, <i>m.</i> ; ફેરફાર, <i>m.</i> ; v.t. ફેરવણી.
<b>Channel,</b>	<b>n.</b> નીક, <i>f.</i> (for irrigating purposes).
<b>Chaplet,</b>	<b>n.</b> મોડ, <i>n.</i> (worn by the bride-groom).
<b>Character,</b>	<b>n.</b> સભાવ, <i>m.</i>
<b>Charcoal,</b>	<b>n.</b> કાપલા, <i>m.</i> ; ચુરેલા, <i>f.</i>
<b>Charge,</b>	<b>n.</b> કણનો, <i>m.</i> To give into one's charge, ફુપવું, ફુપી દીવું. To charge, v.t. મોશ લીધે. To charge exorbitantly, પડાવી લીવું. To charge with, આયે...ફડવું.
<b>Charm,</b>	<b>n.</b> ઉતાનણી, <i>n.</i> ; v.t. રાજ કરવું. To charm away (disease, &c.), -નું ઉતાનણી કરવું.
<b>Chase,</b>	<b>n.</b> આપડો, <i>m.</i> ; v.t. -નો આપડો કરવે.
<b>Chatter,</b>	v.i. ખાટવું, ખાટખાટ કરવું.
<b>Cheap,</b>	<i>adj.</i> ફુંગું or હેંગું.
<b>Cheat,</b>	<b>n.</b> લુણું; v.t. સેતરવું.
<b>Cheek,</b>	<b>n.</b> ગાલ, <i>m.</i>
<b>Cheerful,</b>	<i>adj.</i> રાજ.
<b>Chest,</b>	<b>n.</b> સાતી, <i>f.</i>
<b>Chew,</b>	v.t. સાવવું.
<b>Chicken,</b>	<b>n.</b> પાકરણયું, <i>n.</i> Chicken-pox, અસખરી માતા, <i>f.</i>
<b>Chief,</b>	<i>adj.</i> સરીતું, <i>n.</i> ; ઢાકોર, <i>m.</i> ; રાજી <i>m.</i> Chief's house, રાવદો, <i>m.</i>
<b>Chiefly,</b>	ખાલ્સું કરીને.
<b>Child,</b>	<i>n.</i> બાળક, <i>n.</i> ; સોંદર, <i>n.</i> Childless man, વાંઝુઓ, નખોંદર. Childless woman, વાંઝુછ.

Chin,	<i>n.</i>	કાડણું, <i>n.</i>
Choke,	<i>v.i.</i>	—નો હાહ રહી નવો; <i>v.t.</i> ડ્રાગળા મથી દડવો.
Cholera,	<i>n.</i>	ક્રાગળીઉં, <i>n.</i>
Choose,	<i>v.t.</i>	સરતમાં આવે તી લીવું, અગે તી લીવું.
Circle,	<i>n.</i>	કુંડાળું, <i>n.</i>
Circular,	<i>adj.</i>	ગોળ.
City,	<i>n.</i>	સેર, <i>n.</i>
Civilize,	<i>v.t.</i>	હદારવું. Civilized, હુદું, હદરેણું.
Claim,	<i>n.</i>	દાવો, <i>m.</i> ; <i>v.t.</i> —નો દાવો કરવો.
Clan,	<i>n.</i>	ઓડેઅખ, <i>f.</i> ; હાય, <i>f.</i>
Clap (hands),		તાળી પાડવી. Clapping, તાળી, <i>f.</i>
Class,	<i>n.</i>	નાત, <i>f.</i> Of an inferior class, પડતે નામે. Of a superior class, સહતે નામે, મોટે નામે.
Claw,	<i>n.</i>	નાખ or નેખ, <i>m.</i> ; નેખરો, <i>m.</i>
Clay,	<i>n.</i>	ભાડી, <i>f.</i>
Clean,	<i>adj.</i>	સાદ, સોંકું.
Clever,	<i>adj.</i>	અકલવાળું, સતુર.
Cling,	<i>v.i.</i>	સેંટવું, વળગવું, વાગવી જેવું.
Clod,	<i>n.</i>	ટેણું, <i>n.</i>
Close-weather,	<i>n.</i>	ઉન્મારો, <i>m.</i>
Close,	<i>v.t.</i>	ટાંકવું, કાંકવું, ટાંકી દીવું, દીવું. To close a door, કમાડ દીવું, કડી દીવી. To close the eye, આંખ મસવી, આંખ મસી દીવી.
Cloth,	<i>n.</i>	લાઘરું, <i>n.</i> Coloured cloth worn by women, લુગકું <i>n.</i> Very coarse cloth, ખાડી, <i>f.</i> A piece of cloth, કરું. <i>n.</i> A piece of cloth for a petticoat, નાનડો, <i>m.</i>
Clothe,	<i>v.t.</i>	પેરાવણું, ચોડવું.
Clothes,	<i>n.</i>	લાઘરાં, <i>n. pl.</i>

Cloud,	n.	વાદળું, n.; વાદળો, m. Banks of clouds, કળાંમેણું, f.
Club,	n.	ગહેરો, m.
Clumsy,	adj.	અનાડી.
Coal-tar,	n.	કારણ, n.
Coarse,	adj.	જડું. Coarseness, જડાઈ, f.
Coat,	n.	આંગડી, f.; આંગડું, n.; કોલ, f. Small-coat, અલડી, f. Long coat, મરળાઈ, f.
Cobra,	n.	કાપ, m.
Cobweb,	n.	ઓળ, f.
Cock,	n.	કુકડો, m. The cock crows, કુકડો બોલે.
Cockroach,	n.	કાળયારી, f.
Cocoa-nut,	n.	નારેળ, n. Cocoa-nut shell, કાથલી, f. A piece of cocoa-nut, કાંસલી, f.
Coin,	n.	દુકાંડો, m.; પાધસો, m.; નાણું, n. Imperial copper coins, કાવડુંયાં, n.pl.
Coir,	n.	કુસો, m.
Cold,	n.	ટાંડ, f. To tremble with cold, ટાંડ સડવી (with dat. of pers.). adj. ટાંડું. To feel cold, ટાંડ લાગવી (with dat. of pers.).
Collapse,	v.i.	ખખલતું, ખખલી જાવું, ખરેલતું, ખરેલી પડવું.
Colleague,	n.	ભાગ્યો, m.; હાતી, m.
Collect,	v.i.	બેળું, બેણું or એકદું થાવું; v.t. બેળું, બેણું or એકદું કરવું, હમેઠવું, હમેરી દરવું, હંગાંડો કરવો.
Collection,	n.	હંગરો, m.
Colonize,	v.t.	વહાડવું.
Colony,	n.	પાલ, f.
Colour,	n.	રંગ, m.; v.t. રંગવું, રંગ દીવો.
Comb,	n.	કાંગડી, f. v.t. કાંગડું.

- Come,** v.i. આવણું, પારવું (respectful form). To come straight, વાટે વાટે આવણું. Coming and going, આવજા, f.
- Comfort,** n. દલાહો, m.; આરામ m.; v.t. દલાહો દીવો.
- Command,** n. હકમ, m.; v.t. હકમ દીવો.
- Common,** adj. હારું.
- Commotion,** n. ખામારોળ, f.
- Companion,** n. હાતી, m. Companionship, n. હાત, m.
- Company,** n. ટેળું, n. A company of pilgrims, હંગ, m.
- Compare,** v.t. હરકાવણું.
- Compel,** v.t. See § 38.
- Complain,** v.i. ફરીઆદ કરવી.
- Complainant,** n. ફરીઆદી, m.
- Complaint,** n. ફરીઆદ, f.
- Complete,** adj. પૂર્ણ, પાર.; v.t. પૂર્ણ or પાર કરવું, કરી પુરવું.
- Completed,** to be, પૂર્ણ or પાર થાવું, થાઈ રેવું, થાઈ ચકવું.
- Compound,** n. (enclosure) હાંડુ, n.
- Compulsion,** n. નેરાવરી, f.
- Conceal,** v.t. હાંતવું, હાંતી મેલબું, હંતાડવું, હપાડવું, હપાડી દીવું.
- Concealed,** to be, હપણું. હપી નવું.
- Concern,** n. પરથા, f.; v.t. થાગવું.
- Concerning,** prep. વેસી or વેસે.
- Concord,** n. મેળાપ, m.; હંપ, m.
- Condemn,** v.t. ડંડ કરવો. To condemn to death, હંચી દીવાનું હકમ દીવું, હૃળજ્યે સરપણું.
- Condition,** n. હાલ, f.; અનાલ, m.
- Conduct,** n. ઘોલંસાલવું, n.; સાલ, f.
- Confectioner,** n. હંદુધ, m.
- Confess,** v.t. માનવું, હાસું માનવું,

**Confidence, n.** ભરોણો, m.

**Confident,to be,** નકી જાણવું.

**Confiscate, v. t.** —ની જપતી કર્યા. **Confiscating officer,** જપતીદાર, m.

**Confiscation, n.** જપતી, f.

**Confusedly, adv.** અખડાખલા.

**Confusion, n.** ગડાયા, f.

**Congeal, v.i.** ઘેણું.

**Conjecture, n.** અટકળ or અટકેળ, f.

**Conquer, v.t.** અતવું.

**Consciousness,n.** ભાંન, n.

**Consent, n.** હા, f.; v.i. હા કેવી, માયું નમાવણું.

**Consider, v.i.** વસાર કરવો, હોસ કરવો, ધ્યાનમાં લીવું.

**Consist of,v.i.** —નું હોયું, —નું થાયું.

**Consult, v.t.** —ની સલાહ લીની.

**Contagion, n.** સોંદ, n. (followed by the verb, આવણું).

**Contain, v.t.** —માં હોયું, ઉમાવણું. To be contained, ઉમાયું.

**Content, adj.** રાજી, ખુસી; v.t. રાજી કરવું.

**Contention, n.** દગરાઠ, f.

**Continent, n.** ઘંડ, m.

**Continually,adv.** દાઢું, દાડે દાડે, બારેપોર, સદા.

**Contract, n.** પઢા, m.; v. i. પછું. v.t. ( to lessen ) હાંડું કરવું.

**Contradict, v.t.** આડી વાત કર્યી. To contradict flatly, ઉત્તરી પાડવું, જુહું પાડવું.

**Conversation, n.** વાત, f.; વાતસીત, f.

**Converse, v.i.** વાત or વાતસીત કરવી.

**Cook, v.t.** રાંદવું. n.; રાંદવાનાળો, m.; રોટી કરવાનાળો, m.

Copper,	n.	તાંચુ, n. Coppersmith, કંદારો. Copper coins. See Coins.
Cord,	n.	દોરો, m.; દોરી, f. Sacred cord, આંતુ, n. Cord worn round the waist by men, કંડોરો, m.
Corinda,	n.	કમદું, n. Corinda-tree, કમદી, f.
Cork,	n.	(a stopper for a bottle) ચૂજ, f.
Corn,	n.	અનાંજ, n.; ખાંન, n. Indian corn, ભકી or મકાઈ, f.; જુઘાર, f. Ear of corn, તોડો, m.; કષુદું, n. Ear of Indian corn, ગાખો, m.; પુખું, n.; પુખ્યો, m.
Corner,	n.	ઝુંચો, m.
Corpse,	n.	મડું, ઝ.
Correct,	adj.	ખરું, ટીક, ખરોખર, હમું. v.t. ખરોખર or હમું કરું.
Correctly,	adv.	ટીક, ખરોખર,
Cost,	n.	કીમત, f.; દાય, m.; મોલ, n. v.i. બેદું, (agreeing with the price, the article bought being in the genitive).
Cotton,	n.	રૂ, n.
Cough,	n.	ઉદ્રથ, f.; થોળ્યાન્યો, m.
Count,	v. t.	ગણું, ગણુતરી કરવી.
Country,	n.	મન્ડક, m.; દેસ, m.
Couple,	n.	નોડો, m.; જુડી, f.
Courage,	n.	સાતી, f.; ધીમત, f. To keep up one's courage, ધીમત or સાતી રાખવી.
Courageous,	adj.	સાતીવાળું, ધીમતવાળું.
Court-yard,	n.	આંગણું, n.
Cousin,	n.	ભાઈ, m.; એન, f.
Cover,	n.	ટાંકણી, f.; v.t. ટાંકું, ટાંકી દીનું. To cover up, હાંતી દીનું. To cover the body, એડવું.

- Covet, *v. t.* —ની લાભસ રાખવી.  
 Covetous, *adj.* લાભસી, લાભસુ, લોભી.  
 Covetousness, *n.* લાભસ, *f.*; લોભ, *m.*  
 Cow, *n.* ગાય, ટાણી, ડાઢી, *f.* Cowdung, પોષણ, *m.*; સાથુ, *f.*  
 Coward, *n.* ઘીરદૂધો, *m.*  
 Cowherd, *n.* ગવાળ, ગોઆળ or ગોવાળ, *m.* Cowherdess, ગોઆળણુ, *f.*  
 Cow-house, *n.* ખાગેળ or ભાગેળ, *f.*; સોપાણ, *f.*  
 Co-wife, *n.* હોક, *f.*  
 Crab, *n.* કથદો, *m.*  
 Crack, *n.* છાટ, *f.*; *v.t.* છાટવું, છાડી જવું. *v.t.* છાડવું.  
 Cradle, *n.* પારણું, *n.*  
 Crawl, *v. i.* શુડજને શુડજને હોડતું.  
 Crazy, *adj.* ગાંદું.  
 Cream, *n.* તરી, *f.*  
 Create, *v.t.* ચેદા કરવું. Created, ચેદા.  
 Creature, *n.* (human) મન્ય, *n.*; જીવ જનાવર, *n.*  
 Credit, on, ઉસીનું.  
 Creep, *v.i.* શુડજને શુડજને હોડવું,  
 Creeper, *n.* વીલો, *m.*  
 Cremate, *v.t.* ઘાણવું.  
 Cricket, *n.* કણજારી, *f.*  
 Cripple, *adj.* લુલું.  
 Crime, *n.* ગનો or શુનો, *m.*  
 Crocodile, *n.* મગર, *m.*  
 Crooked, *adj.* વાંકું.  
 Crop, *n.* ઉષું અનાજ, *n.*; હરા, *m. pl.* Summer-crop, ઉનાળો પાઠ, *m.*

- Cross,** *adj.* બેગળ. *v.t.*, અળાડવું, અળાડી દાવું, અળાડી જતું,  
ઉત્તરવું. *Cross-ways*, આવું. *Cross-legged posture*, પથાંઠી, *f.* To sit cross-legged,  
પથાંઠી વાળવી.
- Crow,** *n.* કાગડો, *m.*; *v.i.* બોલવું.
- Crow-bar,** *n.* (small) કોણ, *f.*; (large) હાંચ, *f.*
- Crowd,** *n.* ટાળું, *n.*
- Crown,** *n.* (of head) મુડ, *f.*
- Cruel,** *adj.* કાન્ફ્રેન્યાળું.
- Crumble,** *v.i.* ખખલવું, ખખલી જતું, ખરેખવું, ખરેખી પડવું.
- Crush,** *v.t.* કસરવું. To squeeze, પસેલવું.
- Cry,** *n.* ઝુમ, *f.*; *v.i.* રેવું. To cry out, ઝુમ પાડવી.
- Cubit,** *n.* હાથ, *m.*
- Cuckoo,** *n.* દેવતરણો, *m.*
- Cucumber,** *n.* કાકડી, *f.*
- Cudgel,** *n.* કહેળા, *m.*
- Cultivate,** *v.t.* ખેડવું.
- Cultivation,** *n.* ખેતી, *f.*
- Cultivator,** *n.* કભાણ્યો, *m.*; ખેતી કરવાવાળા, *m.*
- Cunning,** *adj.* લુસું.
- Cup,** *n.* કાંપારી, *f.* Leaf-cup, દુંદ્દો or દુંદો, *m.*
- Curds,** *n.* દાઢી, *n.*
- Cure,** *v.t.* હાઉ or હાંજું કરવું.
- Curlew,** *n.* રટેડી, *f.*
- Current,** *adj.* સાલવું. Current year, ઓછું.
- Curry-comb,** *n.* ખરેરો, *m.*
- Curse,** *n.* હરાખ, *m.*; *v.t.* હરાખ દીનો.
- Custom,** *n.* ટેવ, *f.*; રીત, *f.*; સાલથ, *m.*

**Cut,** v. t. કાપવું. To cut off, કાપી દરવું. To prune, વાડવું, વડાવણું.

**Cyclone,** n. કોરણું, f.

## D.

**Dacoit,** n. હુંગરો, m.

**Dagger,** n. કટારી, f.; ફલ, f.

**Daily,** adv. દાદેદાદે.

**Damage,** n. નકસણ, f.

**Damp,** adj. ઝિપત્યું, લીધું.

**Dance,** v.i. નાસવું.

**Dandruff,** n. રાટ, f.

**Danger,** n. બો, m.

**Dark,** adj. અંદારું.

**Darkness,** n. અંદારી, f.

**Date,** n. (fresh) ખજૂરી, n.; (dry) ખારેક, f. Date-palm, ખજુરી, f.

**Daughter,** n. સોારી, દીકરી. Daughter-in-law, વડુ, સોચાની વડુ.

**Dawn,** n. પરાયાત, f.; હે, m. At break of dawn, હેકાટાં, પરાયાતે.

**Day,** n. દાડેા, m.; દન, m. At day-break, એવાય શાટાં, ઉગતી કીરણયાંમાં. Day before yesterday, or day after to-morrow, પભને દાડે, પરમ દાડે. Three days ago, પરમ પેલે દાડે, તથા દાડા થાજ્યા. Day-labourer, દાનગી, m.

**Dead,** adj. મરેદું, મુર્દ.

**Deaf,** adj. એર્દું.

**Dealings,** n. દીવુલીણું or દેવુલેણું, n.

- Dear,** *adj.* (in price) મેઘ. Beloved, વાણી. Term of endearment to a child, કાઉ or કાઉણા.
- Dearth,** *n.* કાળ, *m.*; દુકાળ, *m.*
- Death,** *n.* મરણ, *n.*
- Debt,** *n.* કરજ, *n.*; દેવું, *n.* To fall in debt, કરજ or દેવું કરવું. To discharge a debt, કરજ or દેવું ભરવું.
- Debtor,** *n.* કરજદાર, *m.*
- Decay,** *v. t.* ફૂકાઈ જવું.
- Deceit,** *n.* દોષ, *m.*; કપટ, *n.* To practise deceit, દોષ કરવો.
- Deceitful,** *adj.* ખુલ્લું.
- Deceive,** *v.t.* સેતરવું.
- Deceiver,** *n.* દ્વાર્ગાર, *m.*; દ્વારી, *m.*; ખુસો, *m.*
- December,** *n.* માગસર-પોઠ, *m.* See § 62.
- Deception,** *n.* દોષ, *m.*; કપટ, *n.*
- Decide,** *v.t.* ફરાવ or દાણો or ફેથલો કરવો.
- Decision,** *n.* ફરાવ, *m.*; દાણો, *m.*; ફેથલો, *m.* Decision in a court, ન્યાય, *m.*
- Declivity,** *n.* અધારી, *n.*
- Deed,** *n.* કામ, *n.*
- Deep,** *adj.* ઉંડું.
- Deer,** *n.* અનણો, *m.*; ચકારી, *n.*
- Defeat,** *v.t.* જતવું, હરાવણી, હરાવી દડવું. To be defeated, હારવું, હારી જવું.
- Defect,** *n.* એડ, *f.*; એથ, *f.*
- Defend,** *v. t.* અસાવણી.
- Defile,** *v. t.* વરલાવણી. To be defiled, વરલાવવું.

- Delay,** n. બોટી, f.; વળા, f.; v. i. વાર લાગવી (with dat. of pers.); વળા કરવી. v.t. બોટી કરવી, વાર લગાડવી.
- Delight,** n. હરક, m.; હક, હુક or સુક, n.
- Deliver,** v. t. ખસાવણું. To deliver up, અવાલે કરવું or દીવું, હુપી દીવું, હુપણું.
- Delivered, to be, (of child)** નાંયો થાનો (with dat. of mother).
- Demand,** n. દાનો, m.; v.t. —નો દાનો કરવો.
- Deny,** v.t. —ની ના કેની.
- Depopulate,** v.t. ઉલડ કરવું.
- Depressed, to feel,** ઉસાઠમાં પડવું.
- Depression,** n. ઉસાઠ, f.
- Depth,** n. ઉડાઈ, f.
- Descend,** v.i. ઉત્તરવું.
- Describe,** v.t. —ની વાત કરવી.
- Desert,** n. વન, n.; જગાલ, n; adj. ઉલડ.
- Desert,** v.t. સોડી દીવું. To desert a *Pal*, પાલ ઉઠાવણી.
- Deserted,** ફુન્ઝ.
- Desire,** n. રહો, m.; મરળ, f.
- Despicable,** adj. અળવું.
- Despise,** v.t. અળવું માનવું, હલકું ગણું.
- Destitute,** adj. કંગાલ or ગંગાલ, ગરીબ.
- Destroy,** v.t. —નો વગાડ કરવો.
- Devil,** n. (evil spirit) શ્રુત, m.
- Devotee,** n. તપસી, m.
- Devotion,** n. ભગતી, f.; સેવા, f.
- Dew,** n. છાર, m.
- Dialect,** n. બોલી, f.

- Diarrhoea, n.** અડો, *m.*; હાંગથુ, *f.* To have diarrhoea, ખુશ અડો થાવો.
- Die, v. i.** મરતું, મરી જતું, મુદરતું.
- Difference, n.** ફેર or ફેરાર, *m.* Difference of opinion, ફેલ, *m.*
- Different, adj.** જુઓ, ન્યાંદે.
- Difficult, adj.** આકર્ષિ, કટણું.
- Difficulty, with, રળોને (lit. having earned).** With great difficulty, તાણી તોડીને.
- Dig, v.t.** ઘણતું.
- Digest, v.i.** પસતું. *v.t.* પસાવણું.
- Diligence, n.** ઘણહો, *m.*
- Diligent, adj.** મેનતવાળું. To be diligent, ઘણહો રાખવો.
- Dim, adj.** જાંખું. Dimmess, જાંખ, *f.*
- Diminish, v.t.** અહું કરતું, આહું કરતું.
- Dine, v.i.** જમતું, રોઠી આવી.
- Direction, n.** આડી, *f.*; મેર, *f.*
- Dirt, n.** મેલ, *m.*
- Dirty, adj.** મળમાળું, મેલું.
- Disappear, v.i.** અલપ થાતું.
- Disciple, n.** સેલો, *m.*
- Discontented, adj.** બેરાળ, નારાળ.
- Disease, n.** રોગ, *m.*; મંદવાડ, *f.* Foot and mouth disease, ખરણાડ, *f.*
- Disengaged, adj.** નવર્દી. To be disengaged, નવર્દ થાતું, નવર્દ રાઈ થાવી, હોર થાવી (with dat. of pers.).
- Disgrace, n.** લાજ, *f.*; હરમ, *f.*; *v.t.* -તુ મોહું કાળું કરતું.
- Dish,** *n.* થાળ or થાળી, *f.*
- Dismayed, adj.** એરાન or હરાન.

- Dismiss, *v.t.* દીક or રણ દીવી. Dismissal, દીક, *f.*; રણ, *f.*
- Disobedient, *adj.* કુટેલ.
- Disobey, *v.t.* નહીં માનવું, —ના કેળવામાં નહીં રેવું.
- Disorder, in a state of, અલગઅલગ, કસાપસા.
- Disperse, *v.t.* વેરવું; *v.i.* વેરાધ જવું.
- Displeased, *adj.* નારાજ, બેરાજ.
- Disposition, *n.* ગોળજ or મેળજ, *m.*; સખાવ, *m.*
- Dispute, *n.* રાગરાટ, *f.*; જધડો, *m.*; વાંદો, *m.* To settle a dispute, દાળો કરવો, ફેથોડો કરવો.
- Disrespect, to show, આયકન નહીં રાખવું.
- Disrespectfully, to speak, તોકારે બોલવું.
- Distance, *n.* દૂરો, *m.*; લાંઘહેણુ, *f.*
- Distant, *adj.* વેગળું, સેદું.
- Distinct, *adj.* જુદીં, ન્યારીં,
- Distribute, *v.t.* વાંદવું, વાંદી આલવું, અલાંવું.
- District, *n.* પટો, *m.*
- Distill, *v.t.* આળવું.
- Distress, *n.* દુખ or દુખ, *f.*; પીડા, *f.*; વપત, *f.*; *v.t.* દુખ or એરાન કરવું, વપત પાડવી. Distressed, દુખી, એરાન.
- Disturbance, *n.* અલો, *m.*; (a rising) રાડો, *m.*
- Dive, *v.i.* કુખું.
- Divide, *v.t.* વાઠવું, વાઠી આલવું or દીવું.
- Division, *n.* ભાગ, *m.* Division of the globe, ખિડ, *m.* Division of a *Pal*, ખાડા, *m.*; દળો, *m.*
- Divorce, *v.t.* —નો સેડો ફાડવો (*lit.* to tear the end of a *sari*).
- Dizziness, *n.* પમેળી or ભમેળી, *f.*; આધેડ, *f.*
- Dizzy, to be, પમેળી or આધેડ આવણી (with dat. of pers.).

<b>Do,</b>	<b>v. t.</b>	<b>કરવું.</b>
<b>Doctor,</b>	<b>n.</b>	<b>વાઈદ, m.; ડાક્ટર, m.</b>
<b>Dog,</b>	<b>n.</b>	<b>કુતરા, m.</b>
<b>Donkey,</b>	<b>n.</b>	<b>ખાલો, m.; અડો, m.</b>
<b>Door,</b>	<b>n.</b>	<b>બારણી, n. Door-frame, ટાક, f. Leaf of a door, કમાડ, n.</b>
<b>Double,</b>	<b>adj.</b>	<b>બ્રમણી.</b>
<b>Doubt,</b>	<b>v.</b>	<b>બેમન, n. Doubtful, adj. બેમનતું.</b>
<b>Dove,</b>	<b>n.</b>	<b>ઓલો, કુલો or હોલો, m. Turtle-dove, ટોલો, m.</b>
<b>Dowry,</b>	<b>n.</b>	<b>દાખણ, n. To give a dowry, દાખણ ભરવું.</b>
<b>Draw,</b>	<b>v. t.</b>	<b>તાણવું.</b>
<b>Dream,</b>	<b>n.</b>	<b>ધ્રતું, n.; હોળું, n.; v. i. હોળું આવણું (with dat. of pers.).</b>
<b>Drink,</b>	<b>v. t.</b>	<b>પીવું. To drink spirits, દાઢ ખાવો or પીવો. To give to drink, પાવું.</b>
<b>Drinking-vessel,</b>	<b>n.</b>	<b>દાંખડી, f.</b>
<b>Drive,</b>	<b>v. t.</b>	<b>ઢાંકવું.</b>
<b>Driver,</b>	<b>n.</b>	<b>હાનાવાળો, m.</b>
<b>Drizzle,</b>	<b>v. i.</b>	<b>સાંચા પડવા. Drizzling rain, સાંચા, m. pl.</b>
<b>Drop,</b>	<b>n.</b>	<b>દીપું, n.; (small) દીપકી, f. Drop of rain, (small) સાંટો, m.; (large) દોરં, n.</b>
<b>Dropsy,</b>	<b>n.</b>	<b>જળાંડરો, m.</b>
<b>Drown,</b>	<b>v. i.</b>	<b>ખુદી મરવું, કુણી મરવું. v. t. ખુંડાડવું.</b>
<b>Drudge,</b>	<b>v. i.</b>	<b>દીલે દુખ દીને કામ કરવું.</b>
<b>Drum,</b>	<b>n.</b>	<b>ઢોથ or ટોથ, n. Drum-stick, ખાણી, f.</b>
<b>Drunkard,</b>	<b>n.</b>	<b>સાંજયો, દારડયો, હરેકુંયો, હરેળદયો.</b>
<b>Drunkenness,</b>	<b>n.</b>	<b>નસા, f.</b>
<b>Dry,</b>	<b>adj.</b>	<b>કોણી, ફૂકું; v. i. ફૂકવું. v. t. ફૂકાવણું, કોણ કરવું.</b>
<b>Duck,</b>	<b>n.</b>	<b>ઘતેક, n.</b>

Dumb,	<i>adj.</i>	સુણું.
Dun,	<i>v. t.</i>	ટાપો કરાવણો.
Dung,	<i>n.</i>	(of a cow) પોયટો, <i>m.</i> ; સાખું, <i>f.</i> ; (of a horse) લાદ, <i>f.</i>
Dusk,	<i>v.</i>	આપકી, <i>f.</i>
Dust,	<i>n.</i>	ઘેણ, <i>f.</i>
Duty,	<i>n.</i>	કામ, <i>n.</i> Import and export duty, દાખાં, <i>n.</i>
Dwarf,	<i>n.</i>	ગટુજોયો, <i>m.</i>
Dwell,	<i>v.i.</i>	વાહો કરવો, વહુતી કરવી, વહું. Dwelling, વાહો, <i>m.</i>

## E.

Each,	<i>pron.</i>	એકેક.
Ear,	<i>n.</i>	કાન, <i>n.</i> Ear of corn, ડોડો, <i>m.</i> ; કણુફુ, <i>n.</i> Ear of Indian corn, ગાળો, <i>m.</i> ; પુષ્પડો, <i>m.</i>
Ear-ring,	<i>n.</i>	મરકી, <i>f.</i> (worn by men); એઠાન્યા, <i>n.pl.</i> (worn on the upper part of the ear); ટાણી, <i>f.</i> (of silver or gold); ફેંકાની. <i>n.pl.</i> (wooden).
Early,	<i>adj.</i>	વેલ્સ. <i>adv.</i> વેલાંવેલાં, વેષુમાં, પરબાતે, જાક ઝાટતાં.
Earn,	<i>v.t.</i>	કમાવું, રાગતું, —ની કમાઈ or મેદાસ કરવી.
Earth,	<i>n.</i>	મારી, <i>f.</i> The ground, ભૌંય, <i>f.</i> The earth, ધરતી, <i>f.</i> The world, કળગસ, <i>f.</i>
Earthquake,	<i>n.</i>	તરણેણ, <i>f.</i>
Earthen,	<i>adj.</i>	ગારતું, મારીનું.
Ease,	<i>n.</i>	આરામ, <i>m.</i> ; કહોળખેમ, <i>m.</i> ; સુક or ફુક, <i>n.</i>
Easily,	<i>adv.</i>	હેલમાં.
East,	<i>n.</i>	ઉગમણ્ણા દેસ. Eastern or Eastward, ઉગમણ્ણું.
Easy,	<i>adj.</i>	હેલ, હેલણ.
Eat,	<i>v.t.</i>	ખાતું. To eat up, ખાઈ જવું.

Eaves,	n.	પડેલ, f.
Eclipse,	n.	ગણ્ય, n.
Edge,	n.	કાર, f. Margin, પાળ, f.
Effect,	n.	કાગ, n.
Effort,	n.	એપ, f.; મેનત, f.
Egg,	n.	ઉંદું, n.
Either...or, conj.		સાવેતી...સાવેતી, કેતી...કેતી.
Elbow,	n.	કાંશી, f.
Elder,	adj.	વડો. Elder brother, વડો ભાઈ, દાદા. Elder sister, વડી બેન. Husband's elder brother, વેદ. Husband's elder brother's wife, જેદાંશી
Eldest,	adj.	વડો, હગળાં કરતાં ધડો.
Elephant,	n.	હાતી, m. Elephant-driver. મોવત, m.
Elope,	v.i.	કઢારી નાઢી જગું.
Embrace,	v.t.	(shoulder to shoulder) મળવું.
Empty,	adj.	છાંદું, ખાલી. Empty-handed, છાંદંખાં.
Encamp,	v.i.	વહવું, તેરો કરવો.
Enchant,	v.i.	મંત્ર કરવું, ઉતાનણું કરવું.
Enchanter,	n.	વાંશ, m.
Enchantment,	n.	મંત્ર, n.
Encourage,	v.t.	ફીભત આકાશી.
End,	n.	પાર, m.; સેડો or હેડો, m.; v.t. પાર કરવું.
Endeavour,	n.	એપ, f.; મેનત, f.
Endless,	adj.	પારવગર.
Enemy,	n.	વેરી, m.; દસમન, m.
Energetic,	adj.	ફૈરી or ડીલફૈરી, મેનત કરવાવાળું.
Enjoyment,	n.	મજા, f.
Enmity,	n.	વેર, n.; અદાવત, f.; ખાર, m.

- Enough, *adj.* ધણું, અસ, અફુ.
- Enquire, *v.i.* તપાસ or તપાહ કરવી, પુસણું. To enquire after, -ની ખખર પુસવી or લીવી.
- Enter, *v.i.* પેહણું, પેહી આવણું, પેહી જવું.
- Entrails, *n.* આંતરી, *n.*
- Entrance, *n.* (into a field) સીડું, *n.*
- Entrap, *v.t.* દોષ કરીને હાજું; (to deceive) સેતસણું.
- Entreat, *v.t.* -ની વીન્તી કરવી.
- Entreaty, *n.* વીન્તી, *f.*
- Entrust, *v.t.* અવાકે કરવું or દીનું, ફુપું, ફુપી દીનું.
- Envoy, *n.* અદાવત, *f.*; *v.t.* માયે અદાવત રાખવી.
- Epilepsy, *n.* ઉમાર, *m.*
- Equal, *adj.* બરોખર, હરસું. Equal to, બરોખર, હરસું.
- Err, *v.i.* લુક ખાવી, લુલસુક કરવી.
- Eruption, *n.* એટકાર, *m.*
- Escape, *v.i.* નાહણું. નાહી જવું, સુટવું, સુટી જવું.
- Escort, *n.* વળાપી, *f.*
- Especially, *adv.* ધણૂ કરીને.
- Essence, *n.* રહુઓ, *m.*; રેહ, *m.*
- Establish, *v.t.* માંદવું. To establish a station, જગા કરવી.
- Estimate, *n.* ગણુતરી, *f.*; *v.t.* જોખવું, -ની ગણુતરી કરવી.
- Etcetera, *n.* પીળુ તીળનું.
- Eternal, *adj.* અમેર.
- Even, *adj.* સપટ, હસું, પાદસ.
- Evening, *n.* આથમતું, *n*; આથમન્યું, *n.* In the evening, આથમતે, આથમન્યે. See § 64.
- Ever, *adv.* દાડુ, દાડેદાડે. Ever so long ago, કણાંતું.
- Everlasting, *adj.* અમેર.
- Every, *adj.* હરેક.

**Everywhere, *adv.*** ફરજે ટેકાણે, હેઠે ટેકાણે, આપે.

**Evidence, *n.*** સાહેદી, *f.*

**Evident, *adj.*** જાનેલું, જાર. To be evident, —ની ફૂજ પડવી.

**Evil, *adj.*** ખાંડું. નાઃાંડું, કુંડું. Evil spirit, ભૂત, *m.*; ચુંગવેલ, *f.* To cast the evil eye, સોટાં ( agreeing with some such word as ડાંકેણું, a witch ).

**Exaggerate, *v.i.*** ગાપ આકવી.

**Examination, *n.*** પારખ or પારખા, *f.* To go in for an examination, પારખ આલવી. To hold an examination, પારખ લીવી.

**Examine, *v.t.*** પારખતું, —ની તપાસ or તપાછ કરવી.

**Example, *n.*** દાખલો, *m.*

**Except, *prep.*** વગર, વના, સવાય.

**Exchange, *v.*** બદલ્યો, *m.*; *v.t.* બદલતું, —નો બદલ્યો કરવો. In exchange for, હાટે.

**Excite, *v.t.*** ઉસકાવવણું, સહાવવણું.

**Excommunicate, *v.t.*** ન્યાત બાયરં નીકાળતું. Excommunicated, ન્યાત બાયરતું.

**Exert oneself, *v.e.*** એપ કરવી, મેનત કરવી. To exert oneself beyond one's strength, દીકે ફુખ દીને કામ કરતું.

**Exhale, *v.i.*** હાહ દરવો.

**Exist, *v.i.*** હોતું. Existing, સતું.

**Existence, *n.*** મન્યો, *m.*; જી, *m.*

**Exorcise, *v.t.*** કાડતું (governing some such word as શુન); —નું ઉતાનણું કરતું.

**Exorciser, *n.*** વાંખુ, *m.*

**Expect, *v.t.*** —ની વાટ જેવી.

**Expend, *v.t.*** ખરસ કરવો. To be expended, ખટતું.

- Expenditure, *n.* ખરચ, *m.*  
 Experience, *n.* આવાગેત, *f.*; હાંન, *n.*  
 Experienced, *adj.* હાંનવાળું, દાવકું.  
 Explain, *v.t.* હમભલવણું, —નો ખુલાસો કરવો.  
 Explanation, *n.* ખુલાસો, *m.*  
 Export, *v.t.* વી જવું.  
 Extinguish, *v.t.* એલનવણું, એલની દીવું.  
 Extort, *v.t.* પડાવી લીવું, ખમણું લીવું.  
 Extravagance, *n.* ઉડાવણુસ, *n.*  
 Extravagant, *adj.* ઉડાવસ. To be extravagant, ઉડાવણુસ કરવું.  
 Eye, *n.* આંખ, *f.* To have sore eyes, આંખ આવણી.  
 Eyeball, *n.* તેણો, *m.*  
 Eyebrow, *n.* ઉપછું પાંપણુંનું or ભાંપણુંનું, *n.*  
 Eyelash, *n.* નીથલું પાંપણુંનું or ભાંપણુંનું, *n.*  
 Eyelid, *n.* આંખ માધે સંખડી.

## F.

- Face, *n.* મુદું or મોહું, *n.*  
 Faint, *v.i.* બેદરસું or બેભાન થાઈ જવું.  
 Fair, *adj.* નગદ, હાઉ. Fair weather, ઉગાડ, *f.*  
     Just, વાજણી.  
 Faith, *n.* એમન, *n.*; ભરોણો, *m.*; વીસ્વા, *m.*  
 Faithful, *adj.* એમાની. To be faithful, એમન રાખવું.  
 Fall, *v.i.* પડવું, ગરી પડવું. To let fall, પાડવું.  
 Fallow, *adj.* ઉખીલ, પડતેલ.  
 False, *adj.* ઘોડું, જુદું.  
 Famine, *n.* કાળ, *m.*; દકાળ, *m.*  
 Famous, *adj.* જાણ્ણીતું.  
 Fan, *n.* સમરો, *m.*; *v.i.* સમરો ટેલવો.

- Far,**      *adj.* વેગળું, દુર, સેકું. As far as possible, સાદે લાં લગણું.
- Farewell !**      આરને !
- Farm,**      *n.* ખેતર, *n.* Farm-labourer, કાંહણી, આણી, હાગરી.
- Farmer,**      *n.* ખેતરવાળો, *m.*
- Fashion,**      *v.t.* એકસરું, ધડતું. Fashioned, ધડતેલ.
- Fast,**      *n.* (from morning till evening) અપાણ, *m.*; (on the 11th day) એકાંદળું, *n.*; *adj.* કાંદું. To make fast, કાંદું કરતું, ખાંદતું, માંદતું.
- Fasten,**      *v.t.* ખાંદતું, માંદતું. To shut, દીનું. To shut the door, કમાડ દીનું, કરી દીની.
- Fat,**      *adj.* જાંદું, મેંદું.
- Fate,**      *n.* કપાળ, *n.*; નેલાર, *n.*; તગાઈર, *f.*
- Father,**      *n.* આતા, પાપ, દાજુ, દાદ. Father-in-law, હાડરો or હાંદો.
- Fatigue,**      *n.* થાક, *m.*
- Fault,**      *n.* ગનો or ચુનો, *m.*
- Fear,**      *n.* ડા, *m.*; ધાક, *f.*; ખી or ખીક, *f.*; (risk) બો, *m.*; *v.t.* ડરતું, ખીનું, ખી ઊં (with ablative).
- Feast,**      *n.* જોઠ, *f.* Caste-feast, ન્યાત, *f.* Feast after death, કાંદું, *n.* To give a feast, જોઠ કરતી. ન્યાત જમાડવી, કાંદું કરતું.
- Feather,**      *n.* વારિ, *m.*
- February,**      *n.* મા—દ્રાગણું. See § 62.
- Feed,**      *v.t.* ખવડાવણું, જમાડતું.
- Feel,**      *v.i.* લાગતું (agreeing with the thing felt).
- Feet, sores on,**      પીદુઅં, *n. pl.*
- Female,**      *n.* નારી.

Festival, *n.* ઉહોં, *m.* The Bhil festivals are ;—

દીવાળી, New year's eve (about end of October).

કાર્તકી, Fourteen days after the *Divali*.

ઉત્તરાષ્ટ્ય, First day of the winter solstice.

હેણી, From the 11th to the 15th of the month *Fagan*.

દસરા, The 10th of the month *Aso*.

Fetch, *v.t.* આણું, લાવણું.

Fetter, *n.* ખીડનણું, *n.*

Fever, *n.* તાવ, *m.* Fourth day fever, સોથીઓ તાવ.  
Intermittent fever, કાંચો તાવ. Ague,  
દાડો તાવ.

Few, *adj.* થોડાં. A few, એસારેક.

Field, *n.* ઘેતર, *n.* Field-gate, આંપો, *m.*

Fight, *n.* લડાઈ, *f.; c. t.*, *m.* A quarrel, વધેડો, *m.* An  
uproar, રાડો, *m.*; *v.i.* લડણું, લડી જાણું, લડાઈ  
કરવી. To prepare to fight, રાટો લગાડવો.

Fill, *v.t.* ભરણું, ભરી દીણું.

Final, *adj.* સેહું. Finally, સેથે સરવાળે, હદ્દેસેહું, હદ્દેવાંહે.

Find, *v.t.* જરણું, મળણું (agreeing with thing found).  
To find out, કાંચું કરવું, તપાસ or તપાછ કરવી.

Fine, *n.* ઠંડ, *m.*; *v.t.* ઠંડ કરવો. *adj.* અસલ, નગદ, ઢિક,  
હાઉ; (not coarse) અણું.

Finish, *v.t.* કરી પુગણું, પાર કરવું, પુરી કરવું.

Finished, to be, ચાધ રૈવું, ચાધ સુકતું, પાર ચાવું, પુરી ચાવું.

Finger, *n.* અંગળી, *f.* Finger-ring, વીઠી, *f.*

Fire, *n.* આગ, *f.*; દેવતા, *m.* Fire-place, સુખો, *m.*  
Fire-wood, ઘળીત, *n.*

Firm, *adj.* કાંકું, મજબૂત.

- Firmament, *n.* આંગારી, *f.*; આખું, *n.*
- First, *adj.* પેદું.
- Fish, *n.* માતલી, *f.*
- Fist, *n.* ઝુઠ, *f.*
- Fit, *adj.* હરકું.
- Five, *adj.* પાંચ.
- Fix, *v.t.* જડતું, લગાડતું.
- Flag, *n.* ધૂળ, *f.*
- Flat, *adj.* પાદેર, સપટ, હમું.
- Flatulent, to be, —તુ પેટ સડતું.
- Flavour, *n.* છવાદ, *m.*
- Flaw, *n.* એચ, *f.*; ઘોડ, *f.*
- Flax, *n.* હોણું, *n.*
- Flea, *n.* હોંદા, *m.*; હરોળો, *m.*
- Flee, *v.i.* નાહતું, નાછી જતું. To flee for one's life, અવ લીને નાછી જતું.
- Flight, to put to, *v.t.* નહાડતું, કણારતું.
- Float, *v.i.* તરવું.
- Flog, *v.t.* જેરથાંદ મારવો.
- Flood, *n.* રેખ, *f.*
- Flour, *n.* લોટ, *m.*; વાટો, *m.*
- Flow, *v.i.* વેવું.
- Flower, *n.* ફુલું, *n.*
- Flute, *n.* વાંદળી, *f.*
- Flutter, in a, ફુડ્ફુડ, To be in a flutter, ફુડ્ફુડ થાયું.
- Fly, *n.* માખું, *n.*; *v.i.* ઉડતું.
- Flying-fox, *n.* વાગળી, *f.*
- Fodder, *n.* પાલો, *m.*; સારો, *m.*
- Fold, *v.t.* વાળતું. Fold up, વાળી ઢીવું.

Follow,	v.t.	વાંદે જવું, વાંદે આવણું.
Folly,	n.	સુરખાઈ, f.
Food,	n.	અન, n.; પોરાક, m. Rations, ભાય, n.
Fool,	n.	ગમાર, m.; ટોક, m.
Foolish,	adj.	આનાડી.
Foot,	n.	પોગ, m.; ફોલ્ચ, n. On foot, પોગે. Foot-path, પોગડાઈ, f.; ગેલો, m. By or along a foot-path, ગેલેગેલે. Foot-step, પગણું, n.
Forbid,	v.t.	મના કરવી, ના કેવી.
Force,	n.	જોર, n.; જરૂરાઈ, f.; જોરાવરી, f. By force, જોરણું or જોરેજોરું, જરૂરાઈજોરું, જોરાવરીજોરું.
Ford,	n.	આરોં, m.
Forehead,	n.	કપાળ, n.; નેલાર, n.
Forget,	v.t.	વીદસ્યું. To forget entirely, વીદરી જવું.
Forgive,	v.t.	આપ કરવું. Forgiven, માપ.
Forgiveness,	n.	આપી, f. To ask forgiveness, માપી માખવી.
Form,	n.	ધાર, m.
Fornication,	n.	સીનાળું, n.
Fort,	n.	કોટ, f.; ગાડ, m.
Fortnight,	n.	પનરવાડણું, n.; પખવાઈ, n.
Fortune,	n.	કુલ, f.; (luck) ભાયમ, n.
Found, to be,		જડવું.
Foundation,	n.	પાને, m. To lay a foundation, ધાન્ય દાયો or નાંખ્યો.
Four,	adj.	સ્થાર. Four-footed, સોધું.
Fowl,	n.	કુકું, n. Water-fowl, જળકુકું, n.
Fox (silver),	n.	ઘેખી, f.
Frame,	n.	(of a door) ટોક, f.
Free,	adj.	સુકું. To become free, ચુટવું; સુરી જવું.

- To set free, सोडवुं, सोडी दीवुं, खडं करवुं.
- Freedom, n. सुटी, f.
- Freeze, v.i. हरवुं, घेण्वावुं, अंदावुं, अंदाई जवुं.
- Frequently, adv. दाढ़, दाडेदाढ़े, वाढवार.
- Fresh, adj. ताज्जूं, टाज्जूं.
- Fret, v.i. —नो अब खण्वें, वसार खावें.
- Friday, n. उक्रवार, m.
- Friend, n. जाहीरो, m.; पक्यालो, m.; भाईयंदे.
- Friendship, n. पड़याक्षी, f.
- Frighten, v.t. हरावल्छ, थीमाइवुं.
- Frog, n. डेडो, m.; चेढ़, n.
- From, prep. कनेहुं, आहुं.
- Front, adj. मोरद्धुं. n. मोरद्धे भाग.
- In front, adv. मोरे, आगे, आगाम, आगाडी.
- In front of, prep. आगे, मोरे.
- Frost, n. फ्रिअ, n. Frost-bite, डाग, f. Frosty, adj. फ्रिमाणुं.
- Frown, v.i. काणुं काणुं थावुं.
- Fruit, n. फण, n.
- Fry, v.t. तणवुं. Frying-pan, क्रेप, f.
- Full, adj. भरज्युं, भरेल्युं. Full to the brim, काना झुटी भरज्युं or भरेल्युं.
- Fume, v.i. —नो अब खण्वें.
- Funeral pyre, n. रोगीजभवी, f.

## G.

- Gain, n. नदो or लदो, m.; लापदो, m.; लाल, m.
- Gallop, v.i. तक्षपवुं, तक्षपतुं जवुं.
- Gallows, n. फुणी, f.

Game,	<i>n.</i>	રમત, <i>f.</i>
Garden,	<i>n.</i>	ઘાગ, <i>m.</i> ; વાડી, <i>f.</i>
Gargle,	<i>v.i.</i>	કોઅયો કરવો.
Garlic,	<i>n.</i>	લેણદુ, <i>n.</i>
Gate,	<i>n.</i>	(of a town) દરવાજો, <i>m.</i> ; (of a field) આપો, <i>m.</i>
Gather,	<i>v.t.</i>	વીણું. To gather up, વીણી દડવું. To gather together, એકનું or બેચુ or બેળું કરવું; -નો હંગરો કરવો, હમેટવું, હમેઠી દડવું. To gather together and look after, હકેલવું.
Generally, <i>adv.</i>		ધાર્યું કરીને.
Generation, <i>n.</i>		પીડી, <i>f.</i>
Gentle, <i>adj.</i>		નરમ સખાવતું, નરમાસી.
Gently, <i>adv.</i>		કળેકળો, હળેહળો,
Get,	<i>v.t.</i>	પાંમણું; મળવું or જડવું (with dat. of pers.). To earn, કમાવું, -ની પેદાસ કરવી.
Get away !		નો ! ! (said to people); ફુખ ! રેંગ ! હાડહાડ ! (said to animals).
Ghost,	<i>n.</i>	શુત, <i>m.</i> ; ભળીસ, <i>m.</i> ; સુડનેલ, <i>f.</i>
Gift,	<i>n.</i>	અલભ, <i>m.</i> ; દાન, <i>n.</i> ; અક્સીસ, <i>f.</i>
Ginger,	<i>n.</i>	આદું, <i>n.</i>
Gipsy,	<i>n.</i>	થુરી.
Girder,	<i>n.</i>	પાછવેલ, <i>f.</i>
Girl,	<i>n.</i>	સોરી, <i>f.</i>
Girth,	<i>n.</i>	પટાઈ, <i>m.</i> ; તંગ, <i>m.</i>
Give,	<i>v.t.</i>	આલવું, દીવું, અલાડવું.
Ghee,	<i>n.</i>	ધી, <i>n.</i>
Glare,	<i>v.i.</i>	ઢાળા કાડવા, આંખ દેખાડવી. Glaring at, ટેગુંડ or ટેગંડ.
Glass,	<i>n.</i>	ઢાસ, <i>m.</i>

Glean,	v.t.	વીષુવું, કરી વીષુવી. Gleanings of corn, કઢી, f.
Go,	v.i.	નાચું. To go out, નીકરું, નીકળવું ; (speaking to or of a superior) પધારતું.
Goat,	n	બાકરો, m.; બાકરી, f.; સાળો, m.; સાળી, f.
Goblin,	n.	જૂત, m.; મળીસ, m.; ચુડવેલ, f.
God,	n.	ભગવાન, m.; દેવ, m. Goddess, દેવી, f.
Gold,	n.	કુંઠ, n. Goldsmith, કુની, m.
Gong,	n.	પંટ or પંટો, m.; આલેર, f.
Good,	adj.	અસલ, એકાજત, નમદ, હાઉ; (kind) ભક્તિ; interj. વાર ! હાર ! Good-bye, આવજો ! Good- ness, ભલાઈ, f.
Goods,	n.	ખટલો, m.; માલ, m.; માલમતા, f.; સામાન, m.
Gossip,	n.	ગપ, f.; v. i. ગપ આણવી.
Gourd,	n.	સીથું, n.; (white and long) તુખું, n.
Govern,	v.t.	-માયે રાજ કરતું. Government (supreme), સરકાર, f.
Gradually, adv.	કળેકળે, થાતે થાતે.	
Grain,	n.	દાઢો, m. Grain-jar, કોઠી, f.
Gram,	n.	સણ્ણા, m. Roasted gram, ઓલાં, m. pl.
Granary,	n.	કોકાર, m. Keeper of a granary, કોકારી, m.
Grand,	adj.	હાઉ. Grandchild, સોરાનું સોંદ, સોરીનું સોંદ.
Grand-father, n. (paternal)	મોટો બાપ; (maternal) મામો દાજ.	
Grand-mother, n. (paternal)	મોટી આઈ; (maternal) મામા આઈ.	
Grass,	n.	સાર, m. Spire of grass, લાંઘ, m.
Grateful, to be,	શુણું માનવે.	
Gratis,	adv.	મોક્કત.
Grave,	n.	ધોર, m.
Gravel,	n.	કંગડી, f.
Graze,	v.i.	સરવું.

- Great, adj. મોહું, જાહેર. Greatness, મોહાઈ, f.
- Greed, n. લાલસ, f.; લોભ, m.
- Greedy, adj. લાલસી or લાલસુ, લોભી.
- Green, adj. નીલું. Greens, બાજ, f.
- Grey, adj. કાખરું. Grey hairs, પલ્યાં, n. pl.
- Grieve, v.i. જીવ ઘળવો; v.t. દખ or દુખ દીવું.
- Grieved, to be, દુખી થાવું, જોહું or માહું લાગવું (with dat.).
- Grind, v.t. (fine) દળવું, (coarse) ભડવું.
- Griping pains, n. વાડ, m.
- Groan, v.i. આડી કરવી.
- Groom, n. ધોડાવાળો, સધત.
- Grope, v.i. ડકુએવું, ડકુએતું હીંડવું.
- Ground, n. જમી, f.; જાગા, f.; ભોંય, f.
- Grow, v.i. ઉગવું.
- Gruel, n. રાય, f.
- Grumble, v. i. કકળવું, —નો જીવ કકળવો.
- Guard, n. સોકીદાર, રખવાળી કરવાવાળો. v.t. —ની રખવાળી કરવી.
- Guess, n. અટકળ or અટકેળ, f.; v.t. અટકળ કરવી. By guess, અટકળમાં.
- Guest, n. પાંખજો, m.
- Guide, n. આગુઞ્ચો, m.; ભોન્ચો, m. Spiritual guide, શુરૂ. v.t. દોરવું, દોરી લી જવું.
- Guinea-worm, n. વાળો, m.
- Guitar, n. તંયુરો, m.; (of one wire) રામણુન્યું, n.
- Gum, n. ખડા, f.; સોઓ, m.
- Gums, n. ભાણી, f.
- Gun, n. ખંડક, f. Gun-shot, સરાં, n. pl.; ગોળી, f. To fire off a gun, ખંડક or ગોળી સોઢવી.
- Gunpowder, હોર, m.

## H.

- Habit, *n.* આવડેત, *f.*; ટેચ, *f.*
- Habitually, *adv.* દાકુ, દાઢેદાઢે, વાણવર.
- Hail, *n.* કરોં, *n. pl.*
- Hair, *n.* વાળ, *m.* Matted hair, અટા, *f.* Grey hair, પલ્યાં, *n. pl.*
- Half, *adj.* અદું. Half a rupee, અદેલી, *f.* Half maund અદમણું, *m.* Half way, અદવેસમાં.
- Halt, *v. i.* ઝુકામ કરવો. Halting place, ઝુકામ, *m.*
- Hammer, *n.* અથોડી or હ્યોડી, *f.*; અથોડો or હ્યોડો, *m.* To hammer out, *v.t.* ટીપણું, ટીપાવણું.
- Hand, *n.* હાય, *m.* Hand-cuffs, હાયકડી, *f.* Hand-made, ધડતેથ.
- Handful, *n.* આસંકું, *n.* The two hands full, ખોબો, *m.*; (of liquor) સાંક, *m.*
- Hand over, *v.t.* અવાદે or હવાદે કરવું or દીવું, ફૂપવું or ફૂફી દીવું.
- Handkerchief, *n.* અંગુસો, *m.*
- Handle, *n.* આધો or હાધો, *m.*
- Handsome, *adj.* રૂપાળું.
- Hang, *v.t.* ટાંગવું, તતુલવું, તતુભતું મેલવું. To put to death, ટાંસી દીવી.
- Happen, *v.i.* ઘણુવું, થાવું, શુદ્ધરવું.
- Happiness, *n.* સુક, *n.*; છુક, *n.*; ઉક, *n.*
- Happy, *adj.* સુકી, હકી, રાજ.
- Hard, *adj.* કડણું, કાહું,
- Hare, *n.* હણો or હાણો, *m.*
- Harm, *n.* અગાડ or વગાડ, *m.*; નકસણ, *f.*
- Harrow, *n.* મછડો. *v. t.* મછડો દીવો.

Harvest,	<i>n.</i>	નષ્ટન્યું, <i>n.</i>
Haste,	<i>n.</i>	ઉત્ત્વળ, <i>f.</i> ; તાકીદ, <i>f.</i>
Hastily,	<i>adv.</i>	ઉત્તાવળું, જરૂર, જરૂરપણ, તરત, તાકીદકું.
Hasty,	<i>adj.</i>	ઉત્તાવળું.
Hate,	<i>v.t.</i>	-માયે અદાવત રાખવી, -માયે વેર રાખજું.
Hatred.	<i>n.</i>	વેર, <i>n.</i> ; અદાવત, <i>f.</i> ; ખાર, <i>m.</i>
Hawk,	<i>v.</i>	ધીસાણો, <i>m.</i>
Hay,	<i>n.</i>	સાર, <i>f.</i> Hay-stack, ક્રીડુલ્યો, <i>m.</i>
He,	<i>pron.</i>	વી, વણે, વો, એ, તી. See § 14, 16, 17.
Head,	<i>n.</i>	માથું, <i>n.</i> Crown of the head, મુડ, <i>f.</i> Head and heel ropes for a horse, અગાડીપસાડી, <i>f.</i>
Headache,	to have a, -નું કપાળ સડવું or સડી જતું.	
Headman,	<i>v.</i>	ગમેતી, મુખી.
Heal,	<i>v.t.</i>	હાઉ or હાંજું કરવું.
Healthy,	<i>adj.</i>	હાજુંતાજું.
Heap,	<i>n.</i>	ધગદો, <i>m.</i> A heap of grain, બોરો, <i>m.</i>
Hear,	<i>v.t.</i>	શંખળવું.
Heart,	<i>n.</i>	દથ, <i>n.</i>
Heat,	<i>n.</i>	તાપ, <i>m.</i> Heat of the sun, તરઢો, <i>m.</i> Gastric heat, લાય, <i>f.</i> To suffer from gastric heat, લાય ઉડવી (with dat. of pers.); <i>v.t.</i> તાપવું.
Heaven,	<i>n.</i>	અંગાહી, <i>f.</i> ; હરગ, <i>m.</i>
Heavy,	<i>adj.</i>	ભારી or ભારે.
Hedge,	<i>n.</i>	વાડ, <i>f.</i>
Heel,	<i>n.</i>	ધૂઠી, <i>f.</i>
Heifer,	<i>n.</i>	ખાખું, ખાખુંકેદું, <i>v.</i> ; (under 16 days) ખવારું, <i>n.</i>

- Height,** *n.* ઉસાઈ, *f.*
- Heir,** *n.* બાળયો, *m.* Heirless, *adj.* નકુડયો, નખોજ.
- Hell,** *n.* નરકુંડ, *m.*
- Help,** *n.* અસારો, *m.*; આસરો, *m.* [The verb લાગવું combined with an infinitive conveys the idea of helping].
- Helpless,** *adj.* કાપર or કાપણ, લાસાર.
- Hen,** *n.* કુકડી, *f.*
- Hence,** *adv.* અણાહું. See § 17. Henceforth, એવાંહું, આજાહું.
- Herd,** *n.* જોએડ, *f.*; ટેણું, *n.*
- Her,** *pron.* See § 14, 16, 17.
- Here,** *adv.* અહીં, ઈથાં. Hereafter, એવાંહું, આજાહું.
- Hesitate,** *v.t.* વસાર ખાને.
- Hide,** *n.* ખાલ, *f.*; સાંખું, *n.*; *v.t.* હંતાડવું, હપાડવું, હાંતવું, હાંતી દીકું.
- Hidden, to be,** હપણું, હપી જવું.
- High,** *adj.* ઉચ્ચ.
- Hill,** *n.* ટેકરો, *m.*; કુંગરો, *m.*; મગરો, *m.* Hillock, ટેકરી, *f.*
- Hilly,** *adj.* કુંગરાણું.
- Him,** *pron.* See § 14, 16, 17.
- Hinder,** *v.t.* અટકાવણું, હપકાવણું, રોકું.
- Hindus and Muhammadans** (as distinguished from Bhils), સફુકાર or સાવફાર લેાગ.
- Hindrance,** *n.* અહસન, *f.*
- Hire,** *n.* ભાડું. *v.t.* ભાડે રાખવું.
- Hiring cattle,** *n.* અડેકું, *n.*; ખડેડો, *m.*

<b>His,</b>	<i>pron.</i>	See §§ 14, 16, 17.
<b>History,</b>	<i>n.</i>	વાત, <i>f.</i>
<b>Hither,</b>	<i>adv.</i>	ધ્રાં, અહો. Hither and thither, ધ્રાંબાં, એહુંબાં ને વેહુંબાં.
<b>Hive,</b>	<i>n.</i>	માંડો, <i>m.</i>
<b>Ho !</b>	<i>interj.</i>	અલા ! લા ! અરે !
<b>Hoard,</b>	<i>n.</i>	હંગરો. <i>v.t.</i> હંગરો કરવો, એકું or બેગું or બેળું કરતું, હકેલતું, હમેટતું, હમેઠતું.
<b>Hog,</b>	<i>n.</i>	હુચ્છેડ, <i>m.</i>
<b>Hold,</b>	<i>v.t.</i>	હાતું, હાઈલીતું. To contain, હમાવણું, —માં હોતું.
<b>Hole,</b>	<i>n.</i>	કાણું, <i>n.</i> ; (of an animal) દેર or દોર, <i>m.</i> See Cave, Den.
<b>Hollow,</b>	<i>adj.</i>	પોળું. <i>n.</i> દરો, <i>m.</i>
<b>Holy,</b>	<i>adj.</i>	હાઉ, નગદ, સોકું.
<b>Home,</b>	<i>n.</i>	ગેર; <i>adv.</i> ગેરે.
<b>Honest,</b>	<i>adj.</i>	હુપુત.
<b>Honey,</b>	<i>n.</i>	મેદ, <i>v.</i> Honey-comb, નારાં, <i>n. pl.</i>
<b>Honour,</b>	<i>n.</i>	આયકન, <i>n.</i> ; આખરિ, <i>f.</i> ; <i>v.t.</i> —તુ આયકન રાખવું.
<b>Hoof,</b>	<i>n.</i>	ખરી, <i>f.</i>
<b>Hook,</b>	<i>n.</i>	કડી, <i>f.</i>
<b>Hope,</b>	<i>n.</i>	આયસા, <i>f.</i> ; <i>v. i.</i> આયસા રાખવી.
<b>Horn,</b>	<i>n.</i>	હીંગડો, <i>m.</i>
<b>Horse,</b>	<i>n.</i>	ઘેડો, <i>m.</i> Horseman, અસ્વાર, <i>m.</i> Horse-shoe, ખરતાળું, <i>n.</i>
<b>Hot,</b>	<i>adj.</i>	ઉંઠું, ગરમ.
<b>Hour,</b>	<i>n.</i>	ઘઢી, <i>f.</i>
<b>House,</b>	<i>n.</i>	ગેર, <i>n.</i> Chief's house, રાવસો, <i>m.</i> Thatched house, સેજયું ગેર, <i>n.</i> ; સાપું, <i>n.</i> To break into a house, ખાતર ખાડવી.

- How?** *adv.* કીમ or કેમ? How much? કાંતું? How long ago? કાન્યાવાંતું?
- Howl,** *v.i.* રોણું.
- Huff,** *v.* રીંદ, *f.* To get into a huff, રીંદ સડાવણી. To go away in a huff, આંગણું સોડી દીવું.
- Human being, n.** મનુષ, *n.*
- Humble, adj.** ગરીબ, નરમ સખાવાંતું.
- Hump (on the back of an ox), n.** ઘાંદું, *n.*
- Hundred, adj.** પાંસ વીંદ, હેંડી. Hundreds, ફેંકડા.
- Hunger, n.** જુખ, *f.* To die of hunger, જુખે મરવું.
- Hungry, adj.** જુખજુંયું. To be hungry, જુખ લાગવી.
- Hunt, v. i.** આપડો કરવો, સકાર સરવું.
- Hunting, n.** આપડો, *m.*; A-hunting, સકાર.
- Hurricane, n.** કોરેણું, *f.*
- Hurry, n.** ઉતાવળ, *f.*; v. i. ઉતાવળ કરવી; v.t. તાકીદહું કરાવણું.
- Hurt, v.i. or v.t.** દખવું, દખવું, દખ દીવું.
- Husband, n.** ધ્યા.
- Hush! interj.** સહ!
- Husks,** *n.* કુંગઢા. *m. pl.*; હોતરાં, *n. pl.*
- Hut,** *n.* છુંપડી, *f.*; કુઠી, *f.*; સાપરી, *f.*; સાપરી, *n.*; ખોલ્દી, *n.*; સેનયું ગેર, *n.* Watch-hut, ડાગળો, *m.*; ડામસું, *n.*
- Hyena,** *n.* હનકુવરૂ, *m. or n.* [A wild dog] એવું નથી.
- Hyprocrisy, n.** કપટ, *n.*; દગ્દો, *m.*
- Hypocrite, n.** સોર, *m.*; હરાથી, *m.*

**I.**

- I,** *pron.* હું, મૈ.
- Ice,** *n.* પાણીયંદાણું, *n.*

- Idle, *adj.* આગેહન્યું. Idleness, *n.* આગેહ, *f.*
- Idol, *n.* સુરતી, *f.* To visit an idol, દરસણું કરવું.
- If, *conj.* જે, જે. If...then, જે...તે, જે...તો.
- Ignorance, *n.* સુરખાધ, *f.*
- Ignorant, *adj.* સુરખ, ટોકો.
- Ill, *adj.* દોમાર, માંડું. To become ill, માંડું પડવું.
- Illustrate, *v.t.* -નો દાખલો કરવો. Illustration, દાખલો, *m.*
- Imagination, *n.* ઘ્યાથ, *m.*
- Imitate, *v.t.* દેખાહેખી કરવી. Imitation, દેખાહેખી, *f.*
- Immediately, *adv.* ઉજુંઉણું, જટ, જટપટ, તરત.
- Immortal, *adj.* અમોર.
- Impale, *v.t.* કુળન્યે સડાવણું. Impaling-stake, કુળી, *f.*
- Imperfect, *adj.* અફુરું, કાણું.
- Implements, *n.* અયુઆર, *m.*; રાસાં, *n.* *pl.*
- Import duties, દાંખું, *n.*
- Imprison, *v.t.* કેદમાં નાંખવું, કેદ કરવું. To sentence to long imprisonment, દીપમાં નાંખવું, દીપમાં દડવું.
- Imprisonment, *n.* દીપ, *f.*
- Improve, *v.i.* દૃદરું or ફુદરું. *v.t.* દૃદરું or ફુદરું.
- Improvement, *n.* ફુદારો, *m.*
- Improvident, *adj.* પરખાવના.
- In, *prep.* માં or માંય.
- Incantation, *n.* જાપ, *m.*; ઉતાનણું, *n.*
- Incarnation, *n.* અપતાર, *m.*
- Inch, *n.* તહુ, *m.*
- Inclination, *n.* અન, *n.*
- Incline, *n.* અલાણું, *n.*; ગોડ, *m.*
- Income, *n.* આવેત, *f.*; ઉપેજ, *f.*

Incomplete, *adj.* અફૂરું, કાસ્યુ.

Inconvenience, *n.* અડસન, *f.*

Increase, *v.* વદારો, *m.*; *v.t.* —નો વદારો કરવો.

Indecision, *v.* બેમન, *v.*

Indeed, *adv.* ખરું, ખરેખરું, હાંસે, હાંસેહાંસ.

Indian corn, *v.* મકી, *f.*; મકાઈ, *f.*; જુઆર, *f.* Ear of Indian corn, ગાંધો, *m.*; પુખું, *v.*

Indian fig-tree, વડ, *m.*

Indigent, *adj.* અરીય, નેદાર.

Indigestion, *n.* ડકારી, *f.* To suffer from indigestion, ડમી પડવી (with dat. of pers.).

Indolence, *v.* આગેણ, *f.*

Indolent, *adj.* આગેણયું, કોચાદીલું, નેદાર, પરખાવના.

Infection, *n.* સોઢું, *v.* To catch infection, સોઢું આવણું (with dat. of pers.).

Inferior, *adj.* અખંતું, હલ્દું, પડતે નામે.

Infirm, *adj.* નખંણું or નમંણું. Infirmity, નખળાઈ, *f.*

Influenza, *n.* થાયરન્ઝો, *m.*

Inform, *v.t.* ખખર દીવી, ખખર આલની.

Information, *n.* ખખર, *f.*; દંદેહો, *m.*; દોસાર, *m. pl.*

Inheritance, *n.* માટ્ઠો, *m.*

Ink, *n.* સાઢી, *f.*

Inn, *n.* ખરમસાળા, *f.*

Inquire, *v.i.* તપાસ or તપાણ કરવી; *v.t.* પુસ્તું.

Inquiry, *n.* તપાસ or તપાણ, *f.*

Insane, *adj.* ગાંડું.

Insect, *v.* ક્રીડી, *f.*

Inside, *prep.* ભા or ભાંય. Inside out, અવળું.

Insipid, *adj.* શીદું, મોળું.

- Insolent, adj.** સડાઉ.
- Inspect, v.t.** —ની તપાસ or તપાછ કરવી.
- Instant, n.** પલક, n.; પળ, n.
- Instantly, adv.** આંખ ભરતામાં, એક ધીમાં, તરત.
- Instead of, prep.** હાટે, બદલે.
- Instruct, v.t.** હીક ખતાવણી.
- Instruction, n.** હીક, f.
- Insufficient, adj.** એસું, ઉણ્ણું, એણ્ણું, ખુંદું. To be insufficient, ખરજ.
- Insult, n.** એચાયકન, n.
- Insurrection, n.** રાડો, m.
- Intelligence, n.** કમનજ્ઞુ, f.; જેઆન, n.
- Intelligent, adj.** કમનજ્ઞ, હોસીઆર, વાકમ.
- Intend, v.t.** Expressed by the Intentional Participle.
- Intention, n.** રહેણ, m.; મન, n.
- Intently, adv.** એકનજર. To look at intently, એકનજર નોઈ લીણું, એકનજર નોઈ રેણું.
- Intercede, v.t.** વસણ વાળનું.
- Intercessor, n.** તરહાઢી, m.
- Interest, n.** વીઆજ, m.
- Interfere, v.t.** વેસમાંય પડવું, વેસમાંય બોલવું.
- Intermittent fever, n.** કાંતો તાવ, m.
- Internal, adj.** માંયતું.
- Interrupt, v.t.** વેસમાં પાડી લીણું ( agreeing with some such word as વાત ).
- Into, prep.** આં or આંય.
- Intoxicated, adj.** દાડડયું, કરેળદયું, સાકદયું.
- Intoxication, n.** નસો, m.
- Intrigue, n.** ખટપથ, f.
- Invade, v.t.** આવી સડવું.

Inverse, *adj.* ઇંવું, અવળું.

Investigate, *v.t.* —ની તપાછ કરવી.

Invitation, *n.* નોતરી, *n.*

Invite, *v.t.* નોતરી મેલવું.

Iron, *n.* લોડું, *n.*

Irrigate, *v.t.* પાણું.

Irritate, *v.t.* ઘીજનાણું, નેર ચડાવણું.

Is, *v.* હે. Is it not so? હે કે નથી?

Island, *n.* દ્વાર્પા, *m.*

It, *pron.* See § § 14, 17.

Itch, *n.* ખેદ or ખેદો, *m.*; *v.i.* વચળવું.

Item, *n.* રકમ, *f.*

Itinerate, *v.i.* ગામેગામો ફરવું.

### J.

Jackal, *n.* હીઆળ, *m.*

Jaconet, *n.* જગનાયી, *f.*

Jar, *n.* See Vessel.

Jail, *n.* કેદ, *m.*; કેદખાતું, *n.*

January, *n.* ચો—મા, *m.* See § 62.

Jaws, *n.* ડાડલાં, *n. pl.*

Jay, *n.* ટેન્ઝે, *n.*

Jeer, *v.i.* —ની ખોમણી પાડવી.

Jeering, *n.* ખોમણી, *f.*

Jessamine, *n.* સંપોદા, *m.*

Jest, *n.* મહલાઈ, *f.*; મસ્કરી, *f.*; વકરાઈ, *f.*; *v.i.* મહલાઈ, મસ્કરી or વકરાઈ કરવી.

Jewelry, *n.* (of gold or silver) ગણુણું or અનણું, *n.*; (common) એખર, *m.*

Join,	v.t.	જડતું, હાંદું, હાંડો દીવરાવણો.
Joint,	n.	હાંડો, m.
Joist,	n.	પાટવેલ, f.
Joke,	n.	See Jest.
Journey,	v.	સપાંડું, n.; v.i. સપાંડું કરતું.
Joy,	n.	સુક, n.; હુક, n.; હરક, m.
Judge,	n.	ન્યાય કરવાવાળો. v.t. —નો ન્યાય કરવો.
Jujube,	n.	(tree) બેચ, f.; (fruit) બેચાં, n.
July,	n.	અહાડ-હરાંમણું, m. See § 62.
Jump,	n.	ડાકડો, m.; v.i. ડાકડો ભરવો, ટેકતું, ટેકતું જવું.
June,	n.	નેટ-અહાડ, m. See § 62.
Jungle,	n.	જ'ગલ, n.; તોળ, n.
Jurisdiction, n.	હક, m.	
Just,	adj.	(of a person) ઢિક, હાઉ; (of a thing) વાજખી; particle, ઓ, e.g. Just so much, અતેંજ. Just so, એમજ, એમજ, એજુન, તીવુંજ, તીમ ને તીમ.
Justice,	n.	ન્યાય, m.

## K.

Keep,	v.t.	રાખતું.
Key,	n.	કુરી, f.
Kick,	n.	પાદુ, f.; v.t. પાદુ આખુવી.
Kid,	n.	થાકરું, n.; પાછં, n.; સાળું, n.
Kill,	v.t.	મારી ઢતું.
Kiln,	n.	ભાડી, f.
Kind,	n.	ભાત, f. Of what kind? કીવું? કેવું?
	adj.	ભંડું, મધ્યાળું. To be kind to, —માયે નજર રાખવી. Kindly, ભલાઈ કરીને.
Kindness,	n.	શુણું, m.; ભલાઈ, f.

King,	<i>n.</i> રાજ, <i>m.</i> Kingdom, રાજ, <i>n.</i> ; રાજ્યાદ, <i>f.</i>
Kiss,	<i>n.</i> બોકી, <i>f.</i> ; <i>v.t.</i> બોકી કરવી.
Knee,	<i>n.</i> શુદી, <i>f.</i>
Kneel,	<i>v.i.</i> શુદી વાળવી.
Knife,	<i>n.</i> સરી, <i>f.</i> Pen-knife, સંકુ, <i>m.</i>
Knock,	<i>v.i.</i> કુકુતું. To knock at the door, ડાંડણી ઘઘડા- વણી ( <i>lit.</i> to rattle the chain). To knock down, પાડતું, નીસે પાડતું. To knock into, ઢિંગ.
Knot,	<i>n.</i> ગાંડ, <i>f.</i> ; <i>v.t.</i> ગાંડ વાળવી.
Know,	<i>v.t.</i> (a person) ઓળખતું, (a thing) જાણતું. Known, જાણ્યું, જર, ડાંગ. To make known, જર કરવું. To be known, આપડતું (usually accompanied by Inf. in <i>cl.</i> , e.g. અણ્યાય વાંસતાં આપડે, reading is known to him, <i>i.e.</i> , he knows how to read).
Knowledge, <i>n.</i>	જ્ઞાન, <i>f.</i> ; જેઆન, <i>n.</i>

**L.**

Labour,	<i>n.</i> કામ, <i>n.</i> ; દાનગી, <i>f.</i> ; મજુરી, <i>f.</i> ; મેનત, <i>f.</i> Hard labour, રૂપત, <i>m.</i> Forced labour, વેદ, <i>f.</i> On forced labour, વેદમાં. To labour, કામ કરવું, મજુરી કરવી, મેનત કરવી.
Labourer,	<i>n.</i> મજુર, <i>m.</i> Day labourer, દાનગી, <i>m.</i> Farm labourer, કાંકણી, <i>m.</i>
Lacking, <i>adj.</i>	ઉણ્ણ, ઓણ્ણ, ઉણ્ણ, ઝુંક. To be lacking, ઝુંક, ઝુરી જવું.
Ladder,	<i>n.</i> લેંધણી, <i>f.</i>
Ladle,	<i>n.</i> સાડુઓ, <i>m.</i>
Lake,	<i>n.</i> તળાવ, <i>m.</i>

Lame,	<i>adj.</i>	ઘોડું.
Lamp,	<i>n.</i>	દીવો, <i>m.</i> To light a lamp, દીવો લગાડવો. Lamp-black, કાજળ, <i>f.</i>
Land,	<i>n.</i>	જમી, <i>f.</i> ; જયગ, <i>f.</i> ; બોંધ, <i>f.</i> Land held direct from Government, ખાલેલ, <i>f.</i>
Lane,	<i>n.</i>	હેરી, <i>f.</i>
Language,	<i>n.</i>	ભાષા, <i>f.</i>
Lantern,	<i>n.</i>	અતી, <i>f.</i>
Lap,	<i>n.</i>	ઘોળા, <i>m.</i>
Large,	<i>adj.</i>	મોડું, જાણું.
Last,	<i>adj.</i>	વાહણું, પાહણું, સેણું; <i>v. i.</i> પુગવું. Last year, ચોર. The year before last, ચરાર. At last, સેલે સરવાળે, હદવાંછે, હદસેણું.
Lasting,	<i>adj.</i>	જમારી.
Lastly,	<i>adv.</i>	સેલે સરવાળે, હદવાંછે, હદસેણું.
Late,	<i>adj.</i>	મોડું.
Laugh,	<i>v. i.</i>	આહવું.
Law,	<i>n.</i>	કાયદો, <i>m.</i>
Lay,	<i>v.t.</i>	મેલવું. To lay down, મેલી દીવું. To lay eggs, ઢાં મેલવા.
Laziness,	<i>n.</i>	આગેઠ, <i>f.</i>
Lazy,	<i>adj.</i>	આગેઠન્યું.
Lead,	<i>n.</i>	ણીં, <i>n.</i>
Lead,	<i>v.t.</i>	દોરવું, દોરી લીનવું. To lead astray અડુઓડે લીનવું.
Leaf,	<i>n.</i>	પાતું, <i>n.</i> Leaf of a door, કમાડ, <i>n.</i>
Leak,	<i>v. i.</i>	ચુલું.
Lean,	<i>adj.</i>	ફાળું, પાતળું; <i>v.i.</i> અંડ દીવું (with dat. of the thing leaned against).

Leap,	<i>n.</i>	ઝાકડો, <i>m.</i> ; તલપ, <i>f.</i> ; <i>v. i.</i> ઝાકડો ભરવો, તલપં, ટેકું, ટેકું જતું.
Learn,	<i>v.t.</i>	ભણું, છીકતું.
Leather,	<i>n.</i>	સાંખું, <i>n.</i> Leather worker, ચમાર, <i>m.</i>
Leave,	<i>v.t.</i>	મેલતું, મેલી દીવું, સોઅતું, સોડી દીવું. Leave off ! મેલરેમેલ !
Leech,	<i>n.</i>	જળધી, <i>f.</i>
Left,	<i>adj.</i>	(opposed to right) ડાયુ. To the left, ડાયે દાય, નીથલે દાય. Remaining, જીકી.
Leg,	<i>n.</i>	ઘોગ, <i>m.</i> ; ટાંટરો, <i>m.</i>
Legend,	<i>v.</i>	વાત, <i>f.</i>
Leisure,	<i>n.</i>	નવરાઈ, <i>f.</i> ; હોર, <i>f.</i> At leisure, નવરાઈ. To be at leisure, નવરાઈ થાની (with dat. of person).
Lend,	<i>v.t.</i>	ઉસીતું આલવું, ઉસીતું દીવું.
Length,	<i>n.</i>	લાંબદેશ્ય, <i>f.</i> At length, સેલે સરવાળે, હુદવાંહે, હુદસેલું.
Leopard,	<i>n.</i>	ઝીતરો, <i>m.</i>
Leper,	<i>n.</i>	કોડયો, <i>m.</i> White leper, કોષારો, <i>m.</i>
Leprosy,	<i>n.</i>	કોડ, <i>f.</i>
Leprous,	<i>adj.</i>	કોડયાળું.
Less,	<i>adj.</i>	ઉછું, ઓછું, ઓસું, કમતી, માદું.
Lessen,	<i>v. i.</i>	ધરતું, માદું પડતું, મઠતું'; <i>v. t.</i> અદૂં કરતું, કમતી કરતું, થોડું કરતું, મઠાડતું, માદું કરતું.
Lest,	<i>conj.</i>	રખેરે.
Let,	<i>v.t.</i>	દીવું (with oblique Infinitive). To let go, જવા દીવું, સોઅતું, સોડી દીવું.
Letter,	<i>n.</i>	કાગદ, <i>m.</i> To write a letter, કાગદ કરવો.

Level,	adj.	સપટ, હસુંતસું, હસુંરખું; ( of country ) પાદેર;
	v.t.	સપટ કરવું. To level ploughed land, મછડો દીવો.
Liar,	n.	જુડો, m.; જુહું બોધવાવાળો, m.
Liberty,	n.	સુદી, f.; ચુટકો, m.
Lice,	n.	જુ, f.
Lick,	v.t.	સાટવું.
Lid,	n.	ટાંકણી, f.
Lie,	n.	જુહું, n.
Life,	n.	જીવ, m.; મનખો, m.
Lift,	v.t.	અસકતું, અસક્તી લીતું, અસક્તાવણું, ઉદ્ઘાવણું, ઉસુ કરવું. To be lifted, ઉપડવું.
Light,	n.	અજવાળું, n.; adj. અલકું or હલકું, અણતું, ઝોરિ.
Lightning,	n.	વીજળી, f.
Like,	adj.	હરકું, ખરાખર; prep. વજુ, માપક. To be like મળતું આવણું; v.t. ગમતું, દાવતું, ભાવણું (with dat. of person).
Lime,	n.	સુનો, m. Lime-mill, ધંઢ, m.
Limit,	n.	પાર, m.; હેઠ, f.
Limp,	v.i.	ઘોડાવું.
Line,	n.	ઓણ, f.
Linseed,	n.	ઈલાયસી, f.
Lip,	n.	ઓઠ, m.
Liquor,	n.	દાડ, m.; હરો, m. Liquor-seller, કલાલ, m.
Little,	adj.	( size ) નાનું; ( quantity ) થાંકું, થોડુંખણું. Very little, અતીક, અસીક, લગારલગાર.
Live,	v.i.	જવવું.
Live,	adj.	જવતું. Live-coal, અંગારો, m.
Livelihood, n.		શુનરો, m. To lose one's livelihood, —ની રોટી દુટવી.

Liver,	n.	કાળજીં, n.
Lizard,	n.	ઝુડુણું, n.; કરોડો, m.
Load,	n.	ભાર, m.; v.t. To load a camel &c. પલાણું.
Loan, on,		ઉસીનું.
Lobe, of the ear,	n.	કાનની ઝુટી, f.
Lock,	n.	તાણું, n.
Lock-jaw,	n.	દાંત ખાંદી.
Locust,	n.	દીડ, m.
Lodge,	v.i.	વહેં, વાહે કરવો.
Loft,	n.	મેડો, n.
Lofty,	adj.	ઉસું.
Log,	n.	ડીગઢું, n.
Loin,	n.	કેડ, f.
Loiter,	v.i.	વળા કરવી.
Lonely,	adj.	અએકદ્ધિં.
Long,	adj.	લાંબું. Long-suffering, ધીરત રાખવાવાળું.
Look,	v.i.	નોચું, દેખું.
Looking-glass, n.	સોાકી, f.	
Loose,	adj.	દીલું. v.t. સોડી દીલું.
Lord,	n.	ધર્મશીલ, માલીક.
Lose,	v.t.	ખાતું.
Loss,	n.	નકસણ, f.; ખગડા or વગડા, m.
Lot (share),	n.	ભાગ, m.
Loud,	adj.	મોદું. Loudly, નોરેહું.
Louse,	n.	જી, f.
Love,	n.	માદ્યા, f.
Lovely,	adj.	હૃપાળું.
Low,	adj.	નીચું.
Lower,	adj.	નીચાલું. v.t. ઉતારવું.

- Luck, n. તગદીર, f.; ભાયગ, n.  
 Luggage, n. સામાન, m.  
 Lute, n. વાંહળી, f.  
 Lump (swelling), n. વરલોળી, f.

## M.

- Mad, adj. ગાંધું.  
 Magician, n. કુરાડ, m.; બોપો, m.  
 Magistrate (police), n. ફેજફાર, m.  
 Mail, n. ડાક, f.  
 Maimed, adj. લુલ્હા.  
 Maina-bird, n. કાખ્યારી, n.  
 Maintenance, n. શુનારા, m.  
 Maiden, n. કુચારી.  
 Maize, n. મકી, f.; મકાઈ, f.  
 Majesty, n. રાજતેજ, n.  
 Make, v.t. કરવું, બણાવવણું.  
 Male, n. નાર.  
 Malice, n. અદાવત, f.; ખાર, m.; વેર, n. To show malice, ખાર કરવો, અદાવત રાખવી.  
 Malleate, v.t. ટીપણું, ટીપાવણું.  
 Man, n. આદમી. Old man, તેકરો, તેસો, તેઢો. Bad man, પટકાંન્યો, પાપેડો.  
 Manage (to be able), v.t. પાંખણું.  
 Manager, n. કારભારી, m.  
 Mane, n. કાતરો, m.  
 Mango, n. કરી, f. Mango tree, આંધો, m.  
 Mankind, n. માનવી, m.  
 Manner, n. રીત, f.; સાથ, m.

- Manure, *n.* ખાતર, *n.* Manure in a heap, ઉપેડો, *m.*
- Many, *adj.* ધણ્યા, જુદી. So many, અતિરા.
- Map, *n.* નક્સો, *m.*
- March (month of), *n.* ફાગણું-સાઈટર, *m.* See § 62.
- Margin, *n.* પાળ, *f.* See Edge.
- Mark, *n.* હેલણું, *n.*; *v. t.* હેલણું મંડવું. Sectarian mark on the fore-head, રીતું, *n.*
- Market, *n.* બજાર; *m.*; હાટડી, *f.* Market rate, બજારમાં ભાવ.
- Marriage, *n.* લગન, *n.*; વીવા, *m.* Marriage company, જાંન, *f.* The male friends in the marriage procession, જાંના. The female friends in the marriage procession, જાંનડી. Marriage settlement, દાયું, *n.* To give in marriage, પણુવણું.
- Marry, *v.i.* ઘાયડી કરવી; *th.t.* પણું. To go to marry, પણવા જાતું. [ પણવા જાતું is the third and last stage in connection with marriage. The first is દાડી જોવી, to see the bride ; the second is હરો ભરવેા, to drink liquor together over the betrothal ].
- Mason, *n.* કડજયો, *m.*
- Master, *n.* ધર્ષી, આલીક.
- Mat, *n.* સાદડી or સાદરી, *f.*; હાદડી or હાદરી, *f.*
- Match (lucifer), *n.* દીવાહળાઈ, *f.*
- Matter, *n.* વાત, *f.* No matter! એર! કંઈ શીકર નથી। કંઈ પરણા નથી! What is the matter? હું ધાજણું?
- Mattress, *n.* ગ્રાદું, *n.*; પાથરેલું, *n.*; વાથરેલું, *n.*
- Maul (as a tiger), *v.t.* ડાસાં ભરવાં.

- May, n. વીહાક-જેઠ, m. See § 62.
- Me, pron. મય. See § 14.
- Meal, n. લોટ, m.; આટો, m.
- Mean, adj. અતિકું or હલકું, અળવું; v. t. —નો અરથ થાનો,  
—નો અતિથ થાનો. ‘It means’ (in the  
sense of ‘to wit’), તણે.
- Meaning, n. અતિથ, m.; અરથ, m.
- Meddle, v.i. વસે આવણ્ણું, વસે પડવું.
- Means, n. See Money. By all means, ખરખરં, નક્કી.  
By no means, નહું નહીં. By some means  
or other, ગમે તીમ કરીને. By means of,  
પળમાં, મારફત, જેરે.
- Meanwhile, adv. અતરાફમાં.
- Measles, n. એચી ભાતા, f.
- Measure, n. માપ, n.; (containing about 2 lbs.)  
પાળી, f.; (containing about 12 lbs.)  
માંણું, n.; v. t. માપ કરવું.
- Meat, n. મખવા, n.
- Medicine, n. એખદ, f. To give medicine, એખદ કરવી.
- Meek, adj. ગરીબ, નરમ સખાવતું.
- Meekness, n. ગરીબાઈ, f.
- Meet, v.i. અળવું, બેળું થાવું.
- Meeting, n. મેળાપ, m.
- Melon, n. (water) કડળુલો.; (long gourd) સીખંડ, n.
- Melt, v.i. એંગણવું; v. t. એંગણવું, માળવું.
- Memorial stone, n. (to males) અગાઠ, m.; (to females)  
સેક્સી, f.
- Memory, n. ધ્યાન, n.; સરત, f. To keep in memory,  
હેતે રાખવું, સરતમાં રાખવું.

<b>Men,</b>	<i>n.</i>	આદમી. See § 5 (d).
<b>Mend,</b>	<i>v.t.</i>	હદારવું or હુદારવું, હમું કરવું.
<b>Mention,</b>	<i>v.t.</i>	-તું નામ લીવું, -ની વાત કરવી.
<b>Merciful,</b>	<i>adj.</i>	ગદ્યાળું.
<b>Mercy,</b>	<i>n.</i>	માદ્યાળા, <i>f.</i>
<b>Merely,</b>	<i>adv.</i>	ફક્ત. Expressed also by the particle એ.
<b>Merit,</b>	<i>n.</i>	પુણ્ય, ઊ.; આધુર, <i>f.</i>
<b>Middle,</b>	<i>n.</i>	વેસલો ભાગ. In the middle, વેસમાં or વેસમાંથી; <i>adj.</i> વેસલું.
<b>Midday,</b>	<i>n.</i>	બજોર, <i>m.</i>
<b>Midnight,</b>	<i>n.</i>	અદરાત, <i>f.</i>
<b>Midway,</b>	<i>adv.</i>	અદરેસમાં.
<b>Midwife,</b>	<i>n.</i>	હીચાણી, <i>f.</i>
<b>Milch-cow,</b>	<i>n.</i>	ફળળ, <i>f.</i>
<b>Mile,</b>	<i>n.</i>	( one and a half ) ગાડ, <i>f.</i> ; ( two to three ) કોડ, <i>f.</i>
<b>Milk,</b>	<i>n.</i>	હેડ, <i>n.</i> Stream of milk, હેડ, <i>f.</i> To milk, હેડ પાડવી.
<b>Mill,</b>	<i>n.</i>	ધંટી, <i>f.</i> Lime mill, ધંટ, <i>m.</i>
<b>Mind,</b>	<i>n.</i>	મન, <i>n.</i> ; સીત, <i>n.</i> To bear in mind, ધ્યાનમાં લીવું. Mind ! હો !
<b>Minstrel,</b>	<i>n.</i>	વાઈઠી, <i>m.</i>
<b>Minute,</b> in a,		અસીક વારમાં, એક પળમાં, એક ધડીમાં.
<b>Mischief (harm),</b>	<i>n.</i>	અગાડ or વગાડ, <i>f.</i> ; (devilry) તોદ્દાન, <i>m.</i> To create mischief, તોદ્દાન કરવું.
<b>Miser,</b>	<i>n.</i>	કહેટેબોઠો, <i>m.</i> ; કાઠો, <i>m.</i> Miserly, કાંઠું.
<b>Misinform,</b>	<i>v.t.</i>	ડમાડવું, સેતરવું, ભુલ પાડવી.
<b>Mislead,</b>	<i>v.</i>	અકુચેઠ લી જવું, ભુલકાંત કરવી.
<b>Mist,</b>	<i>n.</i>	નાક, <i>f.</i>

- Mistake, n. ઓટ, f.; ભુલ, f.; ભુલસુક, f.; સુક, f. To make a mistake, સુકવું, ભુલ આવી, ભુલસુક કરવી. By mistake, ભુલમાં, ભુલહું.
- Misunderstand, v.t. અવગું હમજવું, ઉદ્દું હમજવું.
- Mix, v.t. બેળું કરવું.
- Moan, n. ડાડી, f.; v.i. ડાડી કરવી.
- Mock, v.t. —ની મસકરી કરવી, —ની ખોમણી પાડવી.
- Model, n. નમુનો, m.; v.t. ધડવું, ખોરવું.
- Moist, adj. નીછું.
- Molasses, n. ગોળ, m.
- Moment, n. પવક, n.; પળ, n. Auspicious moment, પળ, n.
- Monday, n. હોમવાર, m.
- Money, n. દુકાં, m.pl.; પાઈસા, m.pl.; તાણું, n.; મરથ, m. Earnest money, વાન્ય, n. Ready money, રોકડું, adj. Money-changer, નાણુાણી, m.
- Mongoose, n. નોળા, m.; નોળું, n.
- Monkey, n. વાદરો, m.
- Monogamist, n. એક ખાપડીવાળા.
- Monsoon, n. સમાષું or સમાઢું or સોમાઢું, n.
- Month, n. અણીનો, m. Per month, અણીનો.
- Moon, n. સંદરભા, m; સાંદો, m.; સાંદોણવસી, m. Moon-light, સંદાણી, f. New moon ( 30th day of lunar month ), અમેઠ, m. Full moon, પુતેમ, f. First day of the moon, એકમ, f.; second day, બીજ, f.; third day, તીજ, f.
- More, adj.& adv. વધું, જાંદું, વાહું, વદારે.
- Moreover, adv. & conj. વળતે, વળી, વળે.
- Morning, n. હવાર, f. Early morning, પરાયાત, f. In the morning, હવારે, પરાયાતે, વેણુમાં, નક શાયતાં.

- Morrow, n. છાળનો દાદો, m. To-morrow, કાશ or કાલે.
- Morsel, n. બટકી, f.
- Mosquito, n. મસર, m.
- Most, adj. હગળા કરતાં ધણ્ણા, ધણ્ણામાં ધણ્ણા, ધણ્ણાખરા.
- Mostly, adv. ધણ્ણનું કરીને.
- Moth, n. કુદી, f.
- Mother, n. આઈ, મા. Mother-in-law, હાડુ. Mother tongue, પોલી, f. Grand-mother, મોટી આઈ, મામા આઈ.
- Motive, n. ભતલણ, m.; હેઠુ, m.
- Mound, n. રેકરી, f.
- Mount, v.i. સડકું. Mounted policeman, ચાર્સમાર, m.
- Mountain, n. કુંગરો, m.; મગરો, m. Mountain-pass, બાંટો, m.; ગંટી, f.
- Mourn, v.i. વળાપુ કરવો, હોગ or ફુગ કરવો. Mourning, વળાપુ, m.; હોગ or ફુગ, m.
- Mouse, n. સસુદરી, f.
- Moustache, n. મુસ, f.
- Mouth, n. મુદુ or મેદુ, n. Mouth-bag, તોાંગરો, m. Mouthful, ઘોણા, m.
- Move, v.t. ઘેહવણું, ડેખવું.
- Much, adj. & adv. ધણ્ણું, ખુઅ, અહુ. So much, અતરે. As much...so much, જતરે...તતરે.
- Mud, n. કાદ્વ, f.; કેળ, m.
- Muffler, n. ડાડેયું, n. To muffle up, ડાડેયું લીડવું.
- Multiply, v.t. ગણુવું.
- Mumps, n. રતવા, m.
- Murder, n. ઝુન, n. Murderer, ઝુની. v.t. ઝુન કરવું.
- Murmur, v.i. મનમાં ગણુગણુવું, નંદવું, નંદ્યા કરવું.

Muscle, n. ખાડકો, m.

Mushroom, n. કુતરીનો જલો, m.

Music, n. રાગ, m.

Musical instrument, n. (small guitar of one wire)

રામણુંયું, n.; (guitar with four wires)  
તંયુરો, m.

Must, v. જુને. See § 45.

Mustard, n. રાઈ, f.

Muzzle, n. કુછડી or કુઝેડી, f.; v.t. કુછડી or કુઝેડી બાંદવી.

My, pron. મારું. Myself, હું પણ. See §§ 14, 15.

## N.

Nail, n. ખીલો, m.; (of finger or toe) નખ or નેખ  
or નેખરો, m.

Naked, adj. નાખું.

Name, n. નામ, n.; v.t.—તું નામ લીવું. To give a name,  
નામ પાડવું. By name, નામે, કરીને.  
Namely, તણે.

Narrow, adj. હાંકડું.

Nature (temperament), n. સખાન, m.

Near, adj. આહતું, પાહેતું. adv. પાહે, થેડમાં. prep. કને,  
કેને, પાહે. Nearly, આસરેમાં.

Neat, adj. ઢીક, હાઉ. Neatly, ઢીકડાક.

Necessary, it is, જુને. See § 45.

Necessity, n. ગરજ, f.

Neck, n. આખેડ, f. Necklace, (long) આઘડો, m.;  
(short) પુલ્યું, n.

Need, n. ગરજ, f. Needful, ગરજ. Needy, કંગાખ.

Needle, n. હોઠ, f.

- Neglect, v.t.** વીદારી મેલવું.  
**Negligent, adj.** ગાડેગા. **Negligence, n.** ગડળાઈ, f.
- Neigh, v.i.** હાહડતું.  
**Neighbour, n.** પડાણી, m.; પડોહેણું, f. In the neighbourhood, પાહે, થેડમાં, આહેપાહે.
- Neither, pron.** એઆંમાં કણું નહીં. Neither...nor, નહીં...ને...નહીં.
- Nephew, n.** (brother's son) ભાત્રીને; (sister's son) ભાણ્યો.
- Nest, n.** ગોખ્લો, m.; ગોહળો, m.
- Net, n.** જળ, f.
- Never, adv.** કરે નહીં; કરે રખે (with imperative).
- Nevertheless, conj.** તેપણું or તોપણું.
- New, adj.** નવું.
- News, n.** ખમર, f.; હંદેહોા, m.; હમીસાર, m. pl.
- Next, adj.** પાહેનું. Next year, ચોર. Year after next, પરાર.
- Nice, adj.** નગદ, હાઉ; (to the taste) ગીતું.
- Niche, n.** આદ્યો, m.; ગોખળો, m.
- Niece, n.** (brother's daughter) ભાત્રીજ; (sister's daughter) ભાણ્યોજ or ભાણ્યજ.
- Niggard, n.** કાડો આદમી, કહેટવેઠો. **adj.** કાઢું.
- Night, n.** રાત, f. At night, To-night, રાતે.
- Nilgai, n.** રૈઠ, m.
- Nimble, adj.** ડીલફારું.
- Nine, adj.** નોંધ. See § 9.
- Nip, n.** સુરક્ષા, f.; સીપણી, f.; v.t. શુકકી લીવી, સીપણી લીવી.
- Nipple, n.** મીમી, f.
- No, adv.** અંદા, ઉંદું, ના. To say No, ના કેવી. No matter! એર ! No one, કણું નહીં, કોઈ નહીં.

- Noble, *adj.* અસલ. Nobleman, ઉખરાવ.  
 Nod, *v.i.* માણું નમાવણું. To nod from sleep, ઓખાં ખાવા.  
 Noise, *n.* દ્રોષારો, *m.*; ઝુમ, *f.*; બોઢ, *m.*  
 None, *pron.* See No one.  
 Nonsense, *n.* ઢાલી વાત. To talk nonsense, ઢાલી વાત કરવી,  
     બકું, બકબક કરવું.  
 Noon, *n.* બદ્ધિર, *m. pl.*  
 Noose, *n.* ફુંસી, *f.*  
 North, *n.* એતર, *f.* Northward, એતરાતું.  
 Nose, *n.* નાક, *n.* Nose-ring, વાળી, *f.*  
 Nostril, *n.* નાખાં, *n.*  
 Not, *adv.* નહીં; રખે (with imperative). Not at all,  
     નહું નહીં.  
 Nothing, *pron.* કાંઈ નહીં. For nothing, મોહત.  
 Note, *n.* (letter of recommendation) સીટી, *f.*  
 Nourish, *v.t.* પાળવું, ધાંન આલવું.  
 November, *n.* કાઠી-માગસર, *m.* See § 62.  
 Now, *adv.* એવાં. Now and then, કૃદેકર, કરેકરેક,  
     નેરેતેરે.  
 Now-a-days, *adv.* આજકાલ.  
 Nowhere, *adv.* કષે કેકષે નહીં.  
 Number, *v.t.* ગણું, —ની ગણુતરી કરવી. Numbering,  
     ગણુતરી, *f.*  
 Nurse (midwife), *n.* હીઆણી.  
 Nutmeg, *n.* નયુકળ, *n.*

## ①.

- Oath, *n.* હમ, *m.*; હોગન, *m.* (usually used in plural).  
 Obedient, *adj.* કેળ્યાગંડી. To be obedient, કેળ્યામાં રેતું.

- Obeisance, to do, પોગે લાગતું.
- Obey, v.t. કેળવું કામ કરવું, કેળવામાં રેતું, માનવું.
- Object, n. હેતુ, m.; ભતલાય, m.
- Object, v.i. ના કેવી.
- Oblation, n. ઉમ, m.; લોધ્યાન, n.; વદમણું or વદામણું, n.
- Obstinate, adj. અાણ્ણી, કુટેલ.
- Obtain, v.t. પામણું.
- Obvious, adj. ઉગાંસું, ખુલ્સું, ઓલેસું, નર.
- Occasion, n. લાગ, m. On all occasions, ઉઠતે બેહતે.
- October, n. આહો-કાતી, m. See § 62.
- Of, prep. -નો-ની-નું. Of course ! તેર or તેર ! તેરહું ! or તેરહું !
- Offence, n. ગનો or શુનો, m. To take offence and go away in a huff, આંગણું સોડી દીતું.
- Offer, v.t. આલવાનું કેવું. To offer up (a sacrifice), સોપવું.
- Often, adv. વારવાર, ધણીવાર, ધણીવેણા. How often ? કતરા ફેરા ? So often, અતરા ફેરા.
- Oil, n. તેલ, n. Oilman, ધાંસી, m.
- Ointment, n. એષિદ, f.
- Old, adj. (of a thing) જુનું; (of a person) ધું. Old man, તોકરો, તોસો, તોહો. Old woman, તોકરી, તોસી, તોહી. How old ? કતરા વરતું ?
- Omen, n. હકન, m.
- Omission, n. કસર, f.
- On, prep. માથે, ઉપર.
- Once, adv. એકવાર, એકદેરો. At once, આંખ મસતામાં, ઉપરપાટ, એક સપાદુ, એકદાયે, જરપદ.
- One, adj. એક. One only, એકજ. One and a half, તોડ or દોડ.

- Oneself, *pron.* પંડે, પંકુપંડ, પોતે.
- Onion, *n.* કુગલી, *f.*
- Only, *adj.* એકલું. [*Only* is often expressed by the enclitic એ].
- Open, *adj.* ઉગાડું, ખુલ્યું. *v.i.* ઉગાડવું. *v.t.* ઉગાડવું, ખોલવું.
- Opening, *adj.* (of plants &c.) કુળું.
- Openly, *adv.* જાણીતું.
- Ophthalmia, to have, આંખ આવણી (with dat. of pers.).
- Opinion, *n.* મત, *m.*; ભતું, *n.*
- Opium, *n.* અમલ, *m.*
- Opportunity, *n.* લાગ, *m.* To have a favourable opportunity, લાગ ક્રાવણો (with dat. of pers.).
- Opposed, *adj.* હાયું. Opposed to, હામે or હાયું.
- Oppress, *v.t.* દખ or દુખ કરવું, દખ or દુખ દીવું.
- Oppression, *n.* દખ, *n.*; જલમ, *m.*; જોરાવરી, *f.*; ગજખ, *m.*
- Or, *conj.* કે, સાચે. Either...or, સાચેતી...સાચેતી, કેતી...કેતી.
- Ordeal (by fire or water), *n.* ધીસ, *f.* To put to the ordeal, ધીસ કરવી.
- Order, *n.* હકમ, *m.* In order that, તે, તણે. See § 59.
- Origin, *n.* મૂળ, *n.*
- Original, *adj.* આગમતું.
- Ornament, *n.* (of silver or gold) ગનણું, *n.*; (common) ઓખર, *m.*
- Orphan, *n.* નેમાન્યો સેરોા, નેમાન્યો સોરી; *adj.* નેમાન્યું.
- Other, *adj.* બીજું. Otherwise, નહીં તે.
- Ought, *v.* જુલે. See § 45.
- Our, *pron.* અમારં. Your and our, આપદું, આપડાતું. Ourselves, અમાં પંડે, આપડાં પંડે.
- Out, Outside, *adv.* બાયદું. Out of, Outside of, બાયદું.

Over,	<i>prep.</i>	આથે, ઉપર. Over and over again, દરીકર્ણિને.
Overcome,	<i>v.t.</i>	જીતવું.
Overseer,	<i>n.</i>	ફાવડો આદમી, ઉપરી.
Owe,	<i>v.t.</i>	પાહે...ના...હોયં, e.g. આદમી પાહે વાણ્યાના રૂપાર હોયાં હું. The man owes the <i>bania</i> , Rs.4.
Owl,	<i>n.</i>	(large) કુચેડ, <i>m.</i> ; (small) સીખરી, <i>f.</i>
Own,	<i>v.t.</i>	—ની પાહે હોયં. One's own, આપચાપદું. See § 15.
Ox,	<i>n.</i>	ટાહો, <i>m.</i> ; બુણદ, <i>m.</i> Oxen-driver, હાનેવાળા. String of oxen for treading out corn, ડામણું, <i>f.</i>

**P.**

Pace (step),	<i>n.</i>	ડગલો, <i>m.</i>
Pacify,	<i>v.t.</i>	શક્કું પાડવું, —ની આગ એલાવણી. Pacified, શક્કું.
Pack,	<i>v.t.</i>	પટાહણુભાં મેલવું. Pack-bull, પોડી, <i>m.</i>
Pad-cloth (put under saddles),	<i>n.</i>	ડાળી, <i>f.</i>
Padlock,	<i>n.</i>	તાળું, <i>n.</i>
Pagri,	<i>n.</i>	પાધડી, <i>f.</i> ; (small) કણણું, <i>n.</i>
Pain,	<i>n.</i>	દખ or દુખ, <i>n.</i> ; પીડા, <i>f.</i> Griping pain, વડ, <i>m.</i> Shooting pains, છક્કા, <i>f.</i> To feel shooting pains, છક્કા કુટ્ઠી (with dat. of pers.).
Painful, to be,		કળવું, લવવું, દુખવું; <i>v.i.</i> દુખ લાગવું (with dat. of pers.).
Paint,	<i>n.</i>	રંગ, <i>m.</i> ; <i>v.t.</i> રંગવું, રંગ દીવો.
Pair,	<i>n.</i>	જ્ઞાદી, <i>f.</i> ; જોડો, <i>m.</i>
Palace,	<i>n.</i>	મેલ, <i>f.</i>
Palanquin,	<i>n.</i>	પાલકી, <i>f.</i> Palanquin-bearer, બોઈ, <i>m.</i>
Pale,	<i>adj.</i>	શીકું.

- Palm (of the hand), *n.* અથેકી, *f.* Palmful, અથેલી, *f.*
- Palm-tree, *n.* ખજુરી, *f.*
- Palpitate, *v.i.* અભકડાયક કરવું. Palpitatingly, અભકડાયક.
- Panther, *n.* ટીઅસ્ટમો સીતરો, *m.*
- Paper, *n.* કાગદ, *m.*
- Paralytic, *adj.* ટાંટ્રાદુરધા રહી ગીજયું. To be paralyzed, (in the legs) —ના ટાંટ્રા રહી જવા; (in the arms) —ના દુરધા રહી જવા.
- Parcel, *n.* ગંડઠી, *f.*
- Pardon, *n.* માપી, *f.*; *v.t.* માપ કરવું. Pardoned, માપ.
- Parents, *n.* માવીતાં, *n. pl.*
- Parrot, *n.* પોપટ, *m.*
- Part, *n.* ભાગ, *m.*
- Particle, *n.* રકમ, *f.*
- Partly, *adv.* હોઢું.
- Partner, *n.* હીઆરો, *m.*
- Partridge, *n.* કલડો, *m.*
- Pass, *n.* (between hills) નાડો, *m.* Mountain pass, ગંડી, *f.*; ગંડો, *m.* To pass by, પાહે થાઇને જતું.
- Passion, *n.* રીખ, *f.* To get into a passion, રીખ સગવણી, આકર્ષ ઉદ્દું. Passionate, આકર્ષી.
- Past (*via*), *prep.* પાહે થાઇને. A thing that is past, શુદ્ધરેલી વાત.
- Patch, *n.* થીગઢું; *v.t.* થીગઢું દીવું.
- Path, *n.* વાટ, *f.*; ગેતો, *m.*; પોગડાંડી, *f.*; રસતો, *m.*
- Patience, *n.* ધીરત, *f.* To have patience, ધીરત રાખવી, થોખણું. Patient, ધીરી.
- Pattern, *n.* નમુનો, *m.*

Pause,	v. i.	ધોઅણું, દાઢ ખાનેં.
Paw,	n.	પોગ, m.
Pay,	v. t.	મોલ આલવું, દામ આલનેં, ભરવું. To pay back, ભરીને પાસું આલવું.
Peace,	v.	મેળાપ, m.; રાજ્યાભ, f.; ઇસ્તીઝુસતી, f. To make peace, ઇસ્તીઝુસતી કરવી, મેળાપ કરવો.
Peacock,	n.	મોર, m.; મોરી, n.
Peahen,	n.	ફેલ, f.
Peculate,	v.i.	દુકડા ખાઈ જવું.
Peel,	v.t.	ફાલવું, સેલવું.
Peep,	v.i.	ટોકલ્યાં કરવાં. Peeping, ટોકલ્યાં, n. pl.
Peg (stake),	n.	ખુંફી, f.
Pell-mell,	adv.	ટેલાટેલ કરીને.
Pen,	n.	પેન, f.
Penalty,	n.	કંડ, m.
Penance,	n.	પરાસત, n.
Penitence,	n.	પરતાવો, m.
Penitent,	adj.	પરતાણું. To be penitent, પરતાવું, પરતાવો કરવો.
Penknife,	n.	સડક, m. or f.
Pension,	n.	પેણુસણુ, f.; ઈગલીસ, f.
People,	n.	લોક or લોગ, n. pl.
Pepper,	n.	(black) કાળાં ભરસાં, n. pl.; (chilli) ઝુંગરી ભરસું, n.
Perceive,	v. t.	હમજવું. To be perceived, ગમ પડવી, હજ પડવી, હજાણું (with dat. of pers.).
Percentage,	n.	વીઆજ, m.
Perception,	n.	ગમ, f.; હમજથી, f.; હજ, f.
Perforate,	v.t.	-માં કાણું પાડવું.
Perhaps,	adv.	કદાક, કદાસ, જણીએક, દેવ જણે.

- Peril,** *n.* બોા, *m.*
- Perish,** *v.i.* મરી જાવું.
- Perjury,** to commit, ખોટા હમ ખાવા.
- Perpetually,** *adv.* દાકુ, દાઢેદાડે, સતા.
- Perplexed,** *adj.* એરાન, હરાન, હેરાન. To be perplexed, એરાન થાવું.
- Persecute,** *v.t.* દખ or દુખ કરવું, વાંહે લાગવું, પુઠે લાગવું. To persecute with words, વળગવળગ કરવું.
- Perseverance,** *n.* ઐપ, *f.* To persevere, *v.i.* ઐપ કરવી.
- Person,** *n.* જથુ, મનખ, *n.* Another person, પરસ્યુણી.
- Perspiration,** *n.* પરવીહોા or પરવેહોા, *m.*
- Perspire,** *v.i.* પરવીહોા or પરવેહોા વળવો (with dat of pers.).
- Persuade,** *v.t.* હમજવણું.
- Pet (darling),** *n.* કાઉ, કાઉડા.
- Petition,** *n.* અરજી, *f.*; *v.t.* અરજી કરવી. Petitioner, અરજી કરવાવાળો.
- Petticoat,** *n.* ધારણા, *m.* Piece of cloth for a petticoat, નાનડો, *m.*
- Pheasant (black),** *n.* કોગોડા ભોર, *m.*
- Pice (money),** *n.* દુકકો, *m.*
- Pick,** *v.t.* વીષું, વીષ્ટી લીનું. To pick up, અસકાવી લીનું.
- Pick-axe,** *n.* કોંદળો, *m.*
- Picture,** *n.* સેરો, *m.*
- Pie (money),** *n.* પાઈ, *f.*
- Piece,** *n.* ઘટકી, *f.* A piece of cloth, કટું, *n.* To break into pieces, ફેડી દડવું. To tear into pieces, —ની ઘટકી કરવી.
- Pig,** *n.* ફુંઘડ, *m.*
- Pigeon,** *n.* પારવો, *m.* Green pigeon, ફૂડો, *m.*

File,	n.	ફેલો, m. To pile up, -નો ફેલો કરવો.
Pilgrim,	n.	ભત્રાવાળો, હંગવાળું. Body of pilgrims, હંગ, m.
Pilgrimage,	n.	ભત્રા, f. Place of pilgrimage, તીરય, n.
Pill,	n.	પોણી, f.
Pillar,	n.	કુદ્દી, f.; ધામલો, m.
Pillow,	n.	ઉલ્લિંક, n.
Pimple,	n.	ખીલ, m.
Pin,	n.	ટાંકણી, f.
Pincers,	n.	સીપીઓ, m.
Pinch,	v.	સીપડી, f.; સુટકી, f.; v.t. સીપડી લીવી, સુટકી લીવી.
Pink,	adj.	ગુલાબજું.
Pipe,	n.	ખીડી, f. To smoke a pipe, ખીડી ખીવી.
Pit,	n.	ખાડો, m.
Pity,	n.	માધ્યા, f. Pitiful, adj. મધ્યાળું.
Place,	n.	જગ્યા, f.; ટેકાણું, n.; ટોડ, f. In the same place, ટોડની ટોડ. In that very place, બાં ને બાં. To place, ગેખવું.
Plague,	n.	રોગ, m.
Plaintiff,	n.	દરીઆડી, m.
Plait,	n.	અમુડો, m.; સોટસો, m. To plait the hair, અમુડો વાળવો, સોટસો ગુંઘવો.
Plan,	n.	મનસ્ઝો, m.; નકસો, m.
Plank,	n.	પાટયું, n.
Plantain,	n.	કેળું, n. Plantain-tree, કેળ, n.
Plate,	n.	(copper or brass) પાણ or આળી, f.; (iron) તવી, f.
Play, v.i. or v.t.	રમણું.	To play on an instrument, વણણું.
Playful,	adj.	રમતું. To be playful (of kids, dogs, &c.), ડાક્કું પડું.

Please,	v.i.	ગમતું, ધ્યાનતું, ભાવણું. Please (be pleased to), ભલાઈ કરીને.
Pleasure,	n.	કહોળખેમ, m.; મજા, f.
Pledge,	v.t.	ગનણે મેલતું. Pledged (in pawn), ગનણે.
Plot,	n.	મનસુષેલા, m.; (of ground) ફાડી, f.
Plough,	n.	હેળ, n.; v.i. હેળ હાંકતું. Plough tax, હેળનો વરાડ, m. Ploughman, n. આળી. Plough-share, n. ઢાંડ, f.
Plunder,	n.	કુટ, f.; સોરીનેા માલ, m.; v.t. કુટતું, કુંઠી આતું.
Pocket,	n.	ચુણું, n.
Pod,	n.	કૃદિ, f.
Point,	n.	આણી, f.
Poison,	n.	નેર, n; વાય, n. Poisonous, નેરી.
Pole,	n.	ઢાંડો, m.; વળી, f.
Police-magistrate,	n.	ફોજદાર. Policeman, સીપાઈ. Police-station, થાણું, n.
Polish,	v.t.	ઉટકતું, ઉટકી દાખલું, માંગવું.
Pollute,	v.t.	વટલાવણું. To be polluted, વટલતું.
Polygamist,	n.	ધણી બાઈદીયાળો.
Pomp,	n.	ધામારોળ, f.; રાજતોળ, n.
Pool,	n.	દરો, m.
Poor,	adj.	કંગાલ, ગંગાલ, ગરીય, ડાળીદર. Cherisher of the poor, ગરીપદ્ધર.
Poppy,	n.	અમલ, m. Wild poppy, દતુરો, m. Poppy-seed, ખેણ, f.
Population,	n.	વદતી, f.
Porcupine,	n.	સાડુદી, f.
Portion,	n.	ભાગ, m.
Possess,	v.t.	કને હેઠાતું, પાહે હેઠાતું (agreeing with the thing possessed).

- Possession, n.** અવારો, o. હવારો, m; કાળો, m. Possessions, n. આલમતા, f.
- Post (mail), n.** પ્રક, f.
- Pot,** n. See Vessel.
- Potter,** n. કુંઘાર, m.
- Poultice,** n. પટી, f.; v.t. પટી ખાંદવી or માંદવી.
- Pound,** n. કાસો સેર, m; v.t. કુટણું, ધોટણું, વાટણું.
- Pour,** v.t. નાંગણું, રેખણું, દુખણું. To pour out, દુલી દીણું. To pour in torrents, કેંધે મારણું, જળ બંનારકાર થાણું.
- Poverty,** n. અરીનાધ, f.
- Powder,** n. શૂકો, m.; ચુનસુન, n. Gunpowder, હોર, m.
- Power,** n. જોર, n.; જળ, n. Powerful, જરાવર, જર્યાં. Powerless, adj. લાસાર.
- Practice, n. (experience)**આવડેત, f.; (habit) ટેન, f.; (custom) સાથ, m. To practise, v.t. —ની ટેન પાડવી.
- Praise,** n. વખાણું, n.; v.t. વખાણું, વખાણું કરેવાં.
- Pray,** v.i. વીન્તી કરવી, અરજ કરવી.
- Preach,** v.i. જેખાન દીક્ષવણું.
- Precious, adj.** પણ્ણા મેલણું.
- Predatory people,** સોર લોક.
- Pregnant, adj.** ઓદાન.
- Prepare,** v.t. તેઅાર કરવું. Prepared, તેઅાર.
- Presence, In the presence of,** —ના જોડા આગળ.
- Present, adj.** આજર or હાજર, સતુ. At present, એવાં. Presently, એક ઘડીમાં.
- Present,** n. એદામ, m.; પૃષ્ઠસીસ, f.; જોઠ, f. (given at the Holi festival).
- Preserve,** v.t. ખસાનણું.

- Press, v.t. દાખણું, દાવણું.
- Pressing, adj. તરતનું.
- Pretend, v.t. કદર કરવું. નોંધી કરવી, ધમેજ કરવું.
- Pretty, adj. રૂપાળું, નગદ, હાઉં.
- Prevail, v.i. જીતવું.
- Previous, adj. મેરલું.
- Price, n. ચીલ, n.; કીભત, f.; દાખ, m.
- Pride, n. એકરાઈ, f.; એકાર, m.; મોટાઈ, f.
- Priest, m. (for the Bhils) નોંધી; (for the weaver caste) ગરૂડો.
- Prime, adj. નમદ, સરીતું.
- Prince, n. કુઅરે, m.
- Prison, n. કેદ, m.; દેદખાનું, n.
- Prisoner, n. કેદી, m.
- Private, adj. જેરતું, સાંજ. Privately, adv. સાનાંસાનાં, સાનેસાને.
- Prize, n. અલખમ, m.
- Probably, adv. કદાક, કદાસ.
- Proceed, v.i. મોરે હીડવું, નીહરવું.
- Procrastinate, v.i. વખા કરવી.
- Produce, n. ઉપેજ, f.; પેદાસ, f.; v.t. પેદાસ કરવી.
- Profit, n. નહોં, m.; લહોં, m.; છાયહોં, m.; લાભ, m.
- Progress, n. કદારો or ફદારો, m.
- Prohibit, v.t. મના કરવી. Prohibition, મના, f.
- Promise, n. ક્રાલ, m.; બોલી, f.; વસન or વસન, n.; v.i. ક્રાલ કરવો, વસન દીવું, બોલી કરવી. To promise faithfully, ખાતરીહું વસન દીવું.
- Promotion, n. વદારો, m.
- Proof, n. હેખણું, n.; હેખાંણું, f.; સાહેદી, f.

- Prop, n. ટકા, m.; ધામદો, m.; v.t. ટકા દીવો.
- Property, n. માલમતા, f.; ખરદો, m.; માલ, m.
- Propitiate, v.t. કોદ્યાન or વદામણું કરવું or સોડવું. Propitiatory offering, n. કોદ્યાન, n.; વદામણું, n.
- Prosecute, v.t. —ની ફરીઆદ કરવી, —નો દાવો કરવો.
- Prosecution, n. ફરીઆદ, f.
- Prosper, v.i. —નો દન હમે હુંબો, ધનવતી હોવું.
- Prostrate oneself, v.i. પોગે લાગવું.
- Protect, v.t. હનથી રાખવું.
- Protection, n. આસરો, m. To seek protection, આસરે ચેવું, હનથી જાવું. Under protection, હનથી.
- Proud, adj. મોટમન્યું.
- Prove, v.t. હેઠળું આલવું, સાહેદી આલવી.
- Proverb, n. ક્રવત, f.
- Provide, v.t. પુરી પાડવું, આલવું.
- Provision, n. અદોભસ, m. Provisions, ભાથ, n.
- Provoke, v.t. ઘીજવણું, નેર સડવણું. To be provoked, ઘીજવું, રીહ સડવી (with dat. of pers.).
- Prune, v.t. વાડવું, વડાવણું.
- Public, adj. જાર. Publish, v.t. જાર કરવું.
- Pull, v.t. તાણવું.
- Pulley, n. મરેડી, f.
- Pulse, n. નાડ, f. To feel the pulse, નાડ જોવી, જીવીની હેર જોવી; (grain) દાળ, f.; મદ, m.
- Pulverize, v.t. ચુનચુન કરવું.
- Pumpkin, n. (red) કોળું, n.
- Punctually, adv. વખતસર.
- Punish, v.t. સણ દીર્ઘી; (to fine) ડંડ કરવો.
- Punishment, n. સણ, f.; (fine) ડંડ, m.

Pure,	<i>adj.</i>	સોંકું, શારુ.
Purgative,	<i>n.</i>	જલધાર, <i>m.</i>
Pursue,	<i>v.t.</i>	વાંछે જતું.
Push,	<i>v.t.</i>	ઘેણ્યાણું, ટેલ્યાણું.
Put,	<i>v.t.</i>	મેલવું. To put down, મેળી દીનું, ડાલવું. To put out, કાઢવું, નીકાળવું. To put up for the night, વાહો કરવો.
Pyre,	<i>n.</i>	રૂપગીજખવી, <i>f.</i>

**Q.**

Quarrel,	<i>n.</i>	(brawl) અસોા, <i>m.</i> ; (contention in words) કળાઓા, <i>m.</i> ; જાખડોા, <i>m.</i> ; વખેડોા, <i>m.</i> ; વળગેથા, <i>f.</i> ; વાંદોા, <i>m.</i> ; દમરાટ, <i>f.</i> ; (difference of opinion) દેખ, <i>m.</i> ; (fight) કર્દોા, <i>m.</i> ; લડાઈ, <i>f.</i> . To quarrel is expressed by any of the above nouns combined with કરવું.
----------	-----------	---

Quarrelsome, *adj.* ટગરાટ કરવાવાળું. To be quarrelsome, વળગતું.

Quartan (fever), *n.* કાંનો લાવ, *m.*

Quarter, *n.* પાછેરો, *m.*; (of a town) પાડા, *m.*; કોણો, *m.*

Quarry, *n.* ખાંથા, *f.*

Queen, *n.* રાણી, *f.* Queen Victoria, કુચારી સંપત્તિ.

Question, *n.* હવાલ, *m.*

Quickly, *adv.* ઉતાવળું, ઉભુંઉભું, જઈ, જટપદ, મારમાર, વેલાવેલાં, વેલું, તાકીદફૂલ.

Quiet, *adj.* સાંનું. To be quiet, સાંનું રેણું.

Quilt, *n.* ગોદંદું, *n.*; પાથરેદું, *n.*; વાથરેદું, *n.*; કામળું, *n.*

Quite, *adv.* નહું.

Quiver, *n.* (small) કેળી, *f.*; (large) તરગેઠ, *n.*

## R.

Radish,	v.	મુળા, m.
Rag,	n.	માણો, m.; સીધેં or સીદું, n.
Rain,	v.	મેઠ, m.; વરહાત, m. Rain-bow, તામથુતોલ્લિ, n. Drop of rain, (large) ફોરો, m.; (small) સાંટો, m.; v.i. વરહણું. To rain heavily, જળ બંબારકાર થાવું, કંધે મારવું.
Rainy season,	n.	સમાસું or સમાહું or સોમાહું, n.
Raise,	v.t.	અસકું, અસકી લીવું, અસકાવણું, ઉસું કરવું, ઉપાડવું.
Rake,	n.	ખોડી, f.; v.t. ખોડવું.
Ram,	n.	ગાયરો, ગેટો, બાકરો, સાળો.
Ramble,	v.i.	ભમવું, ભમતું રચવું.
Rancid, to be,		પણજવું, પણજળ જવું.
Rape-seed,	n.	દરઘો, m.
Rascal,	n.	નરખટ, કુટણો, લુસો, દરામણદી, દરાભી.
Rat,	n.	ઉદરો, m.
Rate,	n.	ભાવ, m.
Rattle,	v.i.	ખખડવું. v.t. ખખડાવણું.
Raw,	adj.	કાસું.
Ray (of the sun),	n.	કીરણું, n.
Razor,	n.	પાસણો, m.
Reach,	v.t.	હૃદી પુખવું.
Read,	v.t.	વાંસવું.
Ready,	adj.	તેઆર. Ready money, રોકું. To get ready, કેડ ખાંદવી or માંદવી, તેઆર કરવું.
Real,	adj.	ખરી, ખરેખરી, કાસું.
Reap,	v.t.	નથવું, To reap one's reward, ઇન પાંખણ.
Rear,	v.i.	(as a horse) ઉણું પાણું; v.t. (nourish) પાળવું.

- Reason,** n. (understanding) જગ્યા, f.; (cause) કારણ, n.  
 For what reason? કેને આપે? હાય? હું આપે?  
 For that reason. વને આપે. વધ્યાય.
- Receive,** v.t. પાંખું; મળવું (with dat. of pers.).
- Recognize,** v.t. ઓળખવું.
- Reckon,** v.t. ગણવું, ગણતરી કરવી.
- Recollection,** n. સરત, f.; છ્યાદ, f.
- Recover,** v.t. પાસું મળવું (with dat. of pers.). v.i. To recover after an illness, હાઉં થાવું. To recover, after being at the point of death, કલાંતરો વળવેા. Recovery, after being at the point of death, કલાંતરો, m.
- Red,** adj. રાદું.
- Redeemer,** n. જીતાડનાર, તારનાર, હુક આલવાવાળો.
- Redemption,** n. સુક or હુક or હુક, n.
- Reduce,** v.t. અહું કરવું, થોહું કરવું, કમતી કરવું.
- Reference,** In reference to, વેરી or વેરો, બાધત.
- Reflect,** v.t. વસાર કરવો, હોસ કરવો. Reflection, n. (shadow) આખ, f.; (thought) વસાર, m.; હોસ, m.
- Reform,** n. હદારો or હુદારો, m.; v.t. હદારવું, હુદારવું.
- Reformed,** adj. હુદું. To be reformed, હુદરવું or હદરવું.
- Refuge,** n. આસરો, m. To seek refuge, આસરે પેવું, હનણી જવું.
- Refund,** v.t. ભરીને પાસું આપવું.
- Refuse,** v.i. ના કેવી. v.t. —ની ના કેવી.
- Regarding,** prep. વેરી or વેરો, બાધત.
- Regiment,** n. પલટણું, f.
- Regret,** v. ફુગ or હોગ, m.

- Reign, n. રાજ, n.; v.i. રાજ કરું.
- Reins, n. વાખ, m.
- Reject, v.t. સોડી દીવું, —ની ના કેવી.
- Rejoice, v.i. રાજ રેવું.
- Relate, v.t. —ની વાત કરવી, કરું.
- Related (closely), હળું. Relationship; n. હગાઈ, f.
- Relative, n. હગો, m.; હગી, f. Relatives and friends, હગાંવાલાં, n. pl.
- Release, n. સુટકો, m.; સુટી, f.; v.t. સોડવું, સોડી દીવું, —નો સુટકો કરવો. To be released, સુધ્યાં, સુટી જગ્યા.
- Religion, n. ધરમ, m.; ભગતી, f.
- Relief, n. આરામ, m.
- Remain, v.i. રેવું. To remain for the night, વાહો કરવો. Remaining, બાકી; Remainder, બાકી, f.
- Remedy, n. ઔદ્ધબ, f.
- Remember, v.t. છેતે રાખવું. Remembrance, સરત, f.; કંપાદ, f.
- Remove, v.t. લી જગ્યા, કષ્ટ કરીને લી જગ્યા.
- Repair, v.t. કષ્ટ કરવું.
- Repay, v.t. ભરીને પાસું આપવું.
- Repent, v.i. પરતાવું, પરતાવો કરવો, વસાર કરવો.
- Repentance, n. પરતાવો, m.
- Reply, n. જબાબ, m.; v.t. જબાબ આપવો, જબાબ દીવો.
- Reproof, n. કપકો, m.
- Reprove, v.t. કપકો દીવો.
- Request, n. અરજી, f.; વીન્તી, f.; v.t. અરજી કરવી, વીન્તી કરવી.
- Rescue, n. સુટકો, m.; v.t. તારવું, ઘસાવણું, —નો સુટકો કરવો.
- Rezin, n. ઘડા, f.; સોઝો, m.
- Resist, v.t. લાખું ચાવું.
- Resolve, v.i. નકી કરવું.

Respect,	n.	આપકન, n. To show respect, આપકન રાખું. In another respect, પીળ વાતે. Respectful, adj. આપકનવાળું.
Rest,	n.	ઉહાણો, m.; આરામ, m.; v.i. ઉહાણો આવો, યાક આવો, હાથ આવો. Resting place, વાહો, m.
Restore,	v.t.	પાસું આખવું, સર્તું કરવું. To be restored, સર્તું થાવું.
Result,	n.	કણ, n.
Return,	v.i.	પાસું આવણું. v.t. પાસું આખવું.
Revenge,	n.	વેર, n.; v.t. —નું વેર વાળવું.
Revenue,	n.	આવેત, f.; ઉપેજ, f.
Reverse,	v.t.	અવળું કરવું. Reversed, અવળું.
Revive,	v.i.	ભાંન આવણું (with dat. of pers.).
Reward,	n.	એકામ, m.; કણ, n.
Rheumatism,	n.	વાઈફ, f.; કણતર, n.; વાડોળ, f.
Rib,	n.	પાંદળું, n.
Rice,	n.	સોડા, m.pl.; સાવળ, m.; (in husk) ખિન, n.; (coarse) હળ, n.; (boiled) ભાત, n.
Rich,	adj.	ધનવલી, પુણ્યવાળું, હરદુ.
Riches,	n.	ધન, m.; પુણ્ય, f.
Ride,	v.i.	થોડે બેઠીને જવું.
Ridgepole,	n.	પાટવેલ, f.
Right,	n.	અક or હક, m.; adj. ડીક, ખરાણર, હાઉસ, હસ્પિટ, હોન; (opposed to left) જમણું. To the right, જમણે હાથ, હપકે હાથ. To set right, હસ્પ કરવું, હોન કરવું. All right! ઐર! વાર! હારી! Right up to, ટેચ.
Righteous,	adj.	હાઉસ. Righteousness, પુણ્ય, n.
Rim,	n.	કાંચો, m.

Pile,	n.	ટગલો, m. To pile up, -નો ટગલો કરવો.
Pilgrim,	n.	ભત્રાવાળો, હંગવાળો. Body of pilgrims, હંગ, m.
Pilgrimage,	n.	ભત્રા, f. Place of pilgrimage, તીરથ, n.
Pill,	n.	ચેળી, f.
Pillar,	n.	કુણી, f.; ધામલો, m.
Pillow,	n.	ઉલ્લિંક, n.
Pimple,	n.	ખીલ, m.
Pin,	n.	ટાંકણી, f.
Pincers,	n.	સીપીઓ, m.
Pinch,	v.	સીપડી, f.; સુટકી, f.; v.t. સીપડી લીવી, સુટકી લીવી.
Pink,	adj.	ગુલાબજું.
Pipe,	n.	ખીડી, f. To smoke a pipe, ખીડી પીવી.
Pit,	n.	ખાડો, m.
Pity,	n.	માદ્યા, f. Pitiful, adj. માદ્યાળું.
Place,	n.	જગ્ગા, f.; ટેકાણું, n.; ટોડ, f. In the same place, ટોડની ટોડ. In that very place, બાં ને બાં. To place, મેલવું.
Plague,	n.	રોગ, m.
Plaintiff,	n.	કુરીઆદી, m.
Plait,	n.	અમુડો, m.; સોટલો, m. To plait the hair, અમુડો વાળવો, સોટલો શુંઘવો.
Plan,	n.	મનસુલો, m.; નકસો, m.
Plank,	n.	પાટણું, n.
Plantain,	n.	કેળું, n. Plantain-tree, કેળ, n.
Plate,	n.	(copper or brass) ધાળ or ધાળી, f.; (iron) તાવી, f.
Play, v.i. or v.t.		રમણું. To play on an instrument, રમણું.
Playful,	adj.	રમતું. To be playful (of kids, dogs, &c.), ડાક્કું પડવું.

- Please, v.i. ગમતું, ધ્યાનતું, ભાવણી. Please (be pleased to), ભર્તાઈ કરીને.
- Pleasure, n. કહોળખેમ, m.; મજા, f.
- Pledge, v.t. ગનણે મેલબંદું. Pledged (in pawn), ગનણે.
- Plot, n. મનસુષેષા, m.; (of ground) કાયડી, f.
- Plough, n. હેળ, n.; v.i. હેળ હાંકતું. Plough tax, હેળનો વચાડ, m. Ploughman, n. આળા. Plough-share, n. ડોઢ, f.
- Plunder, n. હુંદ, f.; સોરીનો માલ, m.; v.t. હુંટતું, હુંઠી આતું.
- Pocket, n. ચુણું, n.
- Pod, n. ફેળ, f.
- Point, n. આણી, f.
- Poison, n. જેર, n; વખ, n. Poisonous, જેરી.
- Pole, n. ડાંડા, m.; વળી, f.
- Police-magistrate, ફોજદાર. Policeman, સીપાઈ. Police-station, યાણું, n.
- Polish, v.t. ઉટકતું, ઉટકી હાથું, આંગતું.
- Pollute, v.t. વટલાવણું. To be polluted, વરલાવું.
- Polygamist, n. ધણી બાધીરાળો.
- Pomp, n. ધામારોળ, f.; રાજતોજ, n.
- Pool, n. દરો, m.
- Poor, adj. કંગાલ, ગંગાલ, ગરીઅ, ડાળીદર. Cherisher of the poor, ગરીપરવર.
- Poppy, n. અમલ, m. Wild poppy, દતુરો, m. Poppy-seed, ખેપેહ, f.
- Population, n. વદતી, f.
- Porcupine, n. સાડુડી, f.
- Portion, n. ભાગ, m.
- Possess, v.t. કને હેઠાં, પાહે હેઠાં (agreeing with the thing possessed).

- Possession, *n.* અવારો, or હવાયો, *m.*; કૃપણો, *m.* Possessions, *n.* માલમતા, *f.*
- Post (mail), *n.* ડાક, *f.*
- Pot, *n.* See Vessel.
- Potter, *n.* કુંઘાર, *m.*
- Poultice, *n.* પદી, *f.*; *v.t.* પડી બાંદવી or માંદવી.
- Pound, *n.* કાસો સેર, *m.*; *v.t.* કુટવું, ધોટવું, વાટવું.
- Pour, *v.t.* નાંમણું, રેડવું, દુલવું. To pour out, દુલી દીવું. To pour in torrents, કેંધે મારવું, જળ બંખારકાર થાવું.
- Poverty, *n.* ગરીબાઈ, *f.*
- Powder, *n.* શુકો, *m.*; સુનસુન, *n.* Gunpowder, હોર, *m.*
- Power, *n.* લોર. *n.*; બળ, *n.* Powerful, લેરાવર, જાહેર. બળવાન. Powerless, *adj.* લાસાર.
- Practice, *n.* (experience) આવડેત, *f.*; (habit) ટેવ, *f.*; (custom) સાલ, *m.* To practise, *v.t.* —ની ટેવ પાડવી.
- Praise, *n.* વખાણું, *n.*; *v.t.* વખાણું, વખાણું કરવાં.
- Pray, *v.i.* વીન્તી કરવી, અરજી કરવી.
- Preach, *v.i.* જેચાન હીકવણું.
- Precious, *adj.* ધથ્યા મોલનું.
- Predatory people, સેર લોક.
- Pregnant, *adj.* ઓદન.
- Prepare, *v.t.* તેઅાર કરવું. Prepared, તેઅાર.
- Presence, In the presence of, —ના મોડા આગળ.
- Present, *adj.* આજર or હાજર, સતું. At present, એવાં. Presently, એક ધરીમાં.
- Present, *n.* એકભ, *m.*; પછ્સીસ, *f.*; ગોક, *f.* (given at the Holi festival).
- Preserve, *v.t.* ખસાનણું.

- Press, *v.t.* દાયણું, દાયાવણું.
- Pressing, *adj.* તરતનું.
- Pretend, *v.t.* કદર કરવું. નોંગી કરવી, ધમેજ કરવું.
- Pretty, *adj.* રૂપાળું, નગદ, હાઉં.
- Prevail, *v.i.* જીતવું.
- Previous, *adj.* મોરલું.
- Price, *n.* ચીલ, *n.*; કીમત, *f.*; દાન, *m.*
- Pride, *n.* એકરાઈ, *f.*; એકાર, *m.*; મોટાઈ, *f.*
- Priest, *m.* (for the Bhils) નોંગી; (for the weaver caste) ગરૂડો.
- Prime, *adj.* નમદ, સરીતું.
- Prince, *n.* કુઅરે, *m.*
- Prison, *n.* કેદ, *m.*; કેદખાનું, *n.*
- Prisoner, *n.* કેદી, *m.*
- Private, *adj.* જેરતું, સાંજ. Privately, *adv.* સાનાંસાનાં, સાનેસાને.
- Prize, *n.* એલભ, *m.*
- Probably, *adv.* કદાક, કદાસ.
- Proceed, *v.i.* મોરે હીડવું, નીહરવું.
- Procrastinate, *v.i.* વખા કરવી.
- Produce, *n.* ઉપેજ, *f.*; પેદાસ, *f.*; *v.t.* પેદાસ કરવી.
- Profit, *n.* નક્કા, *m.*; લદ્દો, *n.*; છાયદ્દો, *m.*; લાભ, *m.*
- Progress, *n.* કદારો or ફદારો, *m.*
- Prohibit, *v.t.* મના કરવી. Prohibition, મના, *f.*
- Promise, *n.* ક્રાલ, *m.*; બોલી, *f.*; વસન or વસન, *n.*; *v.i.* ક્રાલ કરવો, વસન દીવું, બોલી કરવી. To promise faithfully, ખાતરીહું વસન દીવું.
- Promotion, *n.* વદારો, *m.*
- Proof, *n.* હેલણું, *n.*; હેલાંણું, *f.*; સાહેદી, *f.*

- Prop, n. ટકો, m.; ધામદો, m.; v.t. ટકો દીવો.
- Property, n. માલમતા, f.; ઘરદો, m.; માલ, m.
- Propitiate, v.t. લોઈયાન or વદામણું કરવું or સોડવું. Propitiatory offering, n. લોઈયાન, n.; વદામણું, n.
- Prosecute, v.t. —ની દરીઆદ કરવી, —નો દાવો કરવો.
- Prosecution, n. દરીઆદ, f.
- Prosper, v.i. —નો દન હમો હોવો, ધનવતી હોવું.
- Prostrate oneself, v.i. પોગે લાગવું.
- Protect, v.t. હનણી રાખવું.
- Protection, n. આસરો, m. To seek protection, આસરે પેવું, હનણી જાવું. Under protection, હનણી.
- Proud, adj. મોટભન્યું.
- Prove, v.t. હેઠથું આલવું, સાહેદી આલવી.
- Proverb, n. કેવત, f.
- Provide, v.t. પુરી પાડવું, આલવું.
- Provision, n. અંદોબસ, m. Provisions, ભાય, n.
- Provoke, v.t. ખીજવણું, જેર સરખણું. To be provoked, ખીજવું, રીહ સરવી (with dat. of pers.).
- Prune, v.t. વાડવું, વડાવણું.
- Public, adj. જર. Publish, v.t. જર કરવું.
- Pull, v.t. તાણવું.
- Pulley, n. ગરેડી, f.
- Pulse, n. નાડ, f. To feel the pulse, નાડ જેવી, શુવીની હેર જેવી; (grain) દાળ, f.; મદ, m.
- Pulverize, v.t. સુનસુન કરવું.
- Pumpkin, n. (red) કોળું, n.
- Punctually, adv. વખતસર.
- Punish, v.t. સણ દીરી; (to fine) ડાંડ કરવો.
- Punishment, n. સણ, f.; (fine) ડાંડ, m.

Pure,	<i>adj.</i>	સોંકું, હાઉ.
Purgative,	<i>n.</i>	જલાણ, <i>m.</i>
Pursue,	<i>v.t.</i>	વાંદે જતું.
Push,	<i>v.t.</i>	પેદવણું, ઠેલવું.
Put,	<i>v.t.</i>	મેલવું. To put down, મેળી દિતું, ડાલવું. To put out, કાડવું, નીકળવું. To put up for the night, વાહો કરવો.
Pyre,	<i>n.</i>	રૂગીજખવી, <i>f.</i>

**Q.**

Quarrel,	<i>n.</i>	(brawl) અસો, <i>m.</i> ; (contention in words) કળાઓ, <i>m.</i> ; જથડો, <i>m.</i> ; વખેડો, <i>m.</i> ; વળગેણું, <i>f.</i> ; વાંદો, <i>m.</i> ; દમરાટ, <i>f.</i> ; (difference of opinion) દેલ, <i>m.</i> ; (fight) કર્દો, <i>m.</i> ; લડાઈ, <i>f.</i> . To quarrel is expressed by any of the above nouns combined with કરું.
----------	-----------	--

Quarrelsome, *adj.* ટગરાટ કરવાવાળું. To be quarrelsome, વળગતું.

Quartan (fever), *n.* કાંચો તાવ, *m.*

Quarter, *n.* પાહેરો, *m.*; (of a town) પાડા, *m.*; કળો, *m.*

Quarry, *n.* ખાંચું, *f.*

Queen, *n.* રાણી, *f.* Queen Victoria, કુઅરી ડાયા.

Question, *n.* છવાલ, *m.*

Quickly, *adv.* ઉતાવળું, ઉણુંઉણું, જર, જરયદ, ભારમાર, વેલાવેલાં, વેલું, તાકીદફૂલ.

Quiet, *adj.* સાનું. To be quiet, સાનું રેણું.

Quilt, *n.* ગોદંદું, *n.*; પાથરેદું, *n.*; વાથરેદું, *n.*; કામળું, *n.*

Quite, *adv.* નહીં.

Quiver, *n.* (small) કેળી, *f.*; (large) તરબેલ, *n.*

## R.

<b>Radish,</b>	<b>v.</b>	ਮੁਣੋ, <i>m.</i>
<b>Rag,</b>	<b>n.</b>	ਮਾਣੋ, <i>m.</i> ; ਸੀਪਈ or ਸੀਫੁੰ, <i>n.</i>
<b>Rain,</b>	<b>v.</b>	ਮੇਹ, <i>m.</i> ; ਵਰਛਾਤ, <i>m.</i> Rain-bow, ਤਾਮਖੂਤੇਲੁੰ, <i>n.</i> Drop of rain, (large) ਫਿਟੋ, <i>m.</i> ; (small) ਸਾਂਟੋ, <i>m.</i> ; <i>v.t.</i> ਵਰਲਵੁੰ. To rain heavily, ਜਣ ਅੰਧਾਰਕਾਰ ਥਾਵੁੰ, ਝੋਂਥੇ ਮਾਰਵੁੰ.
<b>Rainy season,</b>	<b>n.</b>	ਸਮਾਂਸੁੰ or ਸਮਾਂਫੁੰ or ਸੋਮਾਂਫੁੰ, <i>n.</i>
<b>Raise,</b>	<b>v.t.</b>	ਅਸਕਵੁੰ, ਅਸਕੀ ਲੀਵੁੰ, ਅਸਕਾਵਣੁੰ, ਉਚੁੰ ਕਰਵੁੰ, ਉਪਾਡਵੁੰ.
<b>Rake,</b>	<b>v.</b>	ਯੋਡੀ, <i>f.</i> ; <i>v.t.</i> ਯੋਡਵੁੰ.
<b>Ram,</b>	<b>n.</b>	ਗਾਥਰੋ, ਜੇਟੋ, ਘਾਕਰੋ, ਸਾਗੋ.
<b>Ramble,</b>	<b>v.i.</b>	ਭਮਵੁੰ, ਭਮਤੁੰ ਇਰਵੁੰ.
<b>Rancid, to be,</b>		ਪਥਰਵੁੰ, ਪਥਰ ਜਵੁੰ.
<b>Rape-seed,</b>	<b>n.</b>	ਹਰਖੋ, <i>m.</i>
<b>Rascal,</b>	<b>n.</b>	ਨਟਖਟ, ਝੁਟ੍ਠੇਮੋ, ਲੁਸੋ, ਹਰਾਮਲਦੀ, ਹਰਾਮੀ.
<b>Rat,</b>	<b>n.</b>	ਛੁਫ਼ਰੋ, <i>m.</i>
<b>Rate,</b>	<b>n.</b>	ਆਪ, <i>m.</i>
<b>Rattle,</b>	<b>v.i.</b>	ਘਘਡਵੁੰ. <i>v.t.</i> ਘਘਡਾਵਣੁੰ.
<b>Raw,</b>	<b>adj.</b>	ਛਾਂਸੁੰ.
<b>Ray (of the sun),</b>	<b>n.</b>	ਕੀਰਥੁੰ, <i>n.</i>
<b>Razor,</b>	<b>n.</b>	ਪਾਸਥੋ, <i>m.</i>
<b>Reach,</b>	<b>v.t.</b>	ਛੁਟੀ ਪੁਅਵੁੰ.
<b>Read,</b>	<b>v.t.</b>	ਕਾਂਸਵੁੰ.
<b>Ready,</b>	<b>adj.</b>	ਤੇਅਾਰ. Ready money, ਰੋਕਵੁੰ. To get ready, ਕੇਵਾਂਵੀ or ਮਾਂਵੀ, ਤੇਅਾਰ ਕਰਵੁੰ.
<b>Real,</b>	<b>adj.</b>	ਖੱਬੇ, ਖਰੱਬੱਬੇ, ਛਾਂਸੁੰ.
<b>Reap,</b>	<b>v.t.</b>	ਨਥੁਵੁੰ, To reap one's reward, ਇਨ ਪਾਮਣੁੰ.
<b>Rear,</b>	<b>v.i.</b>	(as a horse) ਉਚੁੰ ਪਾਉੰ; <i>v.t.</i> (nourish) ਪਾਣਵੁੰ.

- Reason,** n. (understanding) હમજું, f. (cause) હારણું, n.  
 For what reason? કેને એલે? હાય? હું એલે?  
 For that reason. વને એલો. વણ્ણાય.
- Receive,** v.t. પાંખું; મળવું (with dat. of pers.).
- Recognize,** v.t. એણખું.
- Reckon,** v.t. ગણવું, ગણતરી કરવી.
- Recollection,** n. સરત, f.; ઈયાદ, f.
- Recover,** v.t. પાસું મળવું (with dat. of pers.). v.i. To recover after an illness, હાઉં થાવું. To recover, after being at the point of death, કલાંતરો વળવો. Recovery, after being at the point of death, કલાંતરો, m.
- Red,** adj. રાદું.
- Redeemer,** n. જીતાડનાર, તારનાર, હુક આલવાવાળો.
- Redemption,** n. સુક or હુક or હુક, n.
- Reduce,** v.t. અર્દું કરવું, ચોર્ડું કરવું, કમતી કરવું.
- Reference,** In reference to, વેસી or વેસે, બાધત.
- Reflect,** v.t. વસાર કરવો, હોસ કરવો. Reflection, n. (shadow) આખ, f.; (thought) વસાર, m.; હોસ, m.
- Reform,** n. હદારો or હુદારો, m.; v.t. હદારવું, હુદારવું.
- Reformed,** adj. હુદું. To be reformed, હુદરવું or હદરવું.
- Refuge,** n. આસરો, m. To seek refuge, આસરે પેવું, હનણી જવું.
- Refund,** v.t. ભરીને પાસું આલવું.
- Refuse,** v.i. ના કેવી. v.t. —ની ના કેવી.
- Regarding,** prep. વેસી or વેસે, બાધત.
- Regiment,** n. પલટણું, f.
- Regret,** v. ફુગ or હોગ, m.

Reign,	n.	રાજ, n.; v.i. રાજ કરવું.
Reins,	n.	વાખ, m.
Reject,	v.t.	સોડી દીવું, —ની ના કેવી.
Rejoice,	v.i.	રાજ રેવું.
Relate,	v.t.	—ની વાત કરવી, કરું.
Related (closely),	n.	કંગુ. Relationship, n. કાર્ડ, f.
Relative,	n.	હોં, m.; હોં, f. Relatives and friends, હગંવાલાં, n. pl.
Release,	n.	સુધકો, m.; સુધી, f.; v.t. સોડવું, સોડી દીવું, —નો સુધકો કરવો. To be released, સુધવું, સુધી જગું.
Religion,	n.	ધરમ, m.; ભગતી, f.
Relief,	n.	આરામ, m.
Remain,	v.i.	રેવું. To remain for the night, વાહો કરવો. Remaining, આકી; Remainder, આકી, f.
Remedy,	n.	ઓખદ, f.
Remember,	v.t.	હોતે રાખવું. Remembrance, સરત, f.; ઈપાદ, f.
Remove,	v.t.	થી જવું, કિંદુ કરીને થી જવું.
Repair,	v.t.	કંગુ કરવું.
Repay,	v.t.	બરીને પાસું આપવું.
Repent,	v.i.	પરતાવું, પરતાવો, વસાર કરવો.
Repentance,	n.	પરતાવો, m.
Reply,	n.	જબ્બાય, m.; v.t. જબ્બાય આપનો, જબ્બાય દીવો.
Reproof,	n.	કંપકો, m.
Reprove,	v.t.	કંપકો દીવો.
Request,	n.	અરાજ, f.; વીન્ટી, f.; v.t. અરાજ કરવી, વીન્ટી કરવી.
Rescue,	n.	સુધકો, m.; v.t. તારવું, અસાવણું, —નો સુધકો કરવો.
Rezin,	n.	ખડા, f.; સોએં, m.
Resist,	v.t.	દાખું યાવું.
Resolve,	v.i.	નકી કરવું.

Respect,	v.	આપકન; n. To show respect, આપકન રાખું. In another respect, પીળ વાતે. Respectful, adj. આપકનવાળું.
Rest,	n.	ઉહાહો, m.; આરામ, m.; v.i. ઉહાહો આવો, થાક આવો, હાદ આવો. Resting place, વાહો, m.
Restore,	v.t.	પાસું આલવું, સતુ કરવું. To be restored, સતુ થાવું.
Result,	n.	કણ, n.
Return,	v.i.	પાસું આવણું. v.t. પાસું આલવું.
Revenge,	n.	વેર, n.; v.t. -નું વેર વાળવું.
Revenue,	n.	આવેત, f.; ઉપેજ, f.
Reverse,	v.t.	અવળું કરવું. Reversed, અવળું.
Revive,	v.i.	ભાંન આવણું (with dat. of pers.).
Reward,	n.	એકામ, m.; કળ, n.
Rheumatism,	n.	વાઈફ, f.; કળતર, n.; વાડોળ, f.
Rib,	n.	પાંછળું, n.
Rice,	n.	સોડા, m.pl.; સાવળ, m.; (in husk) ધિન, n.; (coarse) હાળ, n.; (boiled) ભાત, n.
Rich,	adj.	ધનવતી, મુખ્યવાળું, હરદુ.
Riches,	n.	ધન, m.; મુખ્ય, f.
Ride,	v.i.	થાડે બેઢીને જવું.
Ridgepole,	n.	પારવેલ, f.
Right,	n.	અક or હક, m.; adj. ડીક, ઘરાખર, હાડ, હસુ, હોજ; (opposed to left) જમણું. To the right, જમણે હાય, ઉપરે હાય. To set right, હસુ કરવું, હોજ કરવું. All right! એર! વાર! હાર્ડ! Right up to, ટેક.
Righteous,	adj.	હાડ. Righteousness, પુણું, n.
Rim,	n.	કાંચો, m.

<b>Ring,</b>	<i>n.</i> કદી, <i>f.</i> Ear-ring, ગરભી, <i>f.</i> ; મેદી, <i>f.</i> ; કદેણું, <i>n.</i> ; ઓગ્ગી-યાં, <i>n. pl.</i> Finger-ring, વીડી, <i>f.</i> Nose-ring, વાળી, <i>f.</i> Toe-ring, વીસ્યુ, <i>n.</i> <i>v.i.</i> વાળવું; <i>v.t.</i> વળડવું.
<b>Ring-worm,</b> <i>n.</i>	દાદર, <i>f.</i>
<b>Ripe,</b> <i>adj.</i>	પાકું. Ripe, <i>v.i.</i> પાકતું.
<b>Rise,</b> <i>v.i.</i>	ઉંઘું; (to ascend) ઉંડતું; (of the sun) ઉંમવું. A general rising, રાડો, <i>m.</i>
<b>Risk,</b> <i>n.</i>	બોલ, <i>m.</i>
<b>River,</b> <i>n.</i>	નર્ધ or નદી, <i>f.</i>
<b>Road,</b> <i>n.</i>	મારમ, <i>m.</i> ; વાટ, <i>f.</i> ; રસતો, <i>m.</i> A made road, સાડક, <i>f.</i>
<b>Roam,</b> <i>v.i.</i>	ભાગતું or ભાગતું ફરજિયાં.
<b>Roar,</b> <i>v.i.</i>	(as a lion) અતુઆડી કરવી. Roaring, અતુઆડી, <i>f.</i>
<b>Roast,</b> <i>v.t.</i>	રાંદતું. Roasted green gram, ઓદ્ધા, <i>m. pl.</i>
<b>Rob,</b> <i>v.t.</i>	કુટતું, સોરી કરવી.
<b>Robber,</b> <i>n.</i>	સોર, <i>m.</i> ; કુટખો, <i>m.</i>
<b>Rock,</b> <i>n.</i>	મેટો બાઢો.
<b>Roll,</b> <i>v.i.</i>	(over and over) અગેખતું. To roll up, વાળી દીતું, વીંટતું, વીંટાળતું.
<b>Roof,</b> <i>n.</i>	પડેથ, <i>f.</i>
<b>Room,</b> <i>n.</i>	ઓપડી, <i>f.</i> Back-room, ઓલીં, <i>n.</i>
<b>Roost,</b> <i>v.i.</i>	ફુર્જ રેવું.
<b>Root,</b> <i>n.</i>	જડ, <i>f.</i> ; મુળ, <i>n.</i> To root up, ઉખેણું.
<b>Rope,</b> <i>n.</i>	નાડો, <i>m.</i> ; રાહ, <i>f.</i> Head and heel ropes for a horse, અગાડિપસાડી, <i>f.</i>
<b>Rose,</b> <i>n.</i>	ગુધ્યાણ, <i>m.</i>
<b>Rot,</b> <i>v.i.</i>	ફૂકાઈ જતું.

Rough,	<i>adj.</i>	ખુલ્લું. To roughen a grinding-stone, ખાડી ટાંકવી.
Round,	<i>adj.</i>	ગોળ. Round about, આહેપાહે.
Row,	<i>n.</i>	ઓળ, <i>f.</i>
Rub,	<i>v.t.</i>	રગડવું, મહળવું; (to smear) સોપડવું.
Rubbish,	<i>n.</i>	કસરો, <i>m.</i> ; બજવા, <i>m. pl.</i> ; કાંને, <i>m.</i>
Rubble,	<i>n.</i>	ખખડો, <i>m.</i>
Rude,	<i>adj.</i>	દરારી.
Rule,	<i>n.</i>	(law) કાયડો, <i>m.</i> ; (dominion) રાજ, <i>n.</i> ; <i>v.t.</i> રાજ કરવું.
Rumour,	<i>n.</i>	ગપ, <i>f.</i> To spread a rumour, ગપ આપવી.
Run,	<i>v.i.</i>	દોડવું, ધામતું, ધામતું જવું. To run away, નાહિંદું, નાહીં જવું.

## S.

Sack,	<i>n.</i>	કોષદો, <i>m.</i>
Sacred cord,	<i>n.</i>	ધાર્તુ, <i>n.</i>
Sacrifice,	<i>n.</i>	ઉમ, <i>m.</i> ; લોધ્યાન, <i>n.</i> ; વદમણું or વદામણું, <i>n.</i> ; <i>v.i.</i> લોધ્યાન કરવું, વદમણું or વદામણું કરવું or સોઝવું.
Sad,	<i>adj.</i>	દુખી. To be sad, હસાઈમાં પડવું, દુખી થાવું, છક સડવી (with dat. of pers.).
Saddle,	<i>n.</i>	પલાણું, <i>n.</i> ; <i>v.t.</i> પલાણું. Saddle-cloth, ડળ, <i>f.</i>
Safe,	<i>adj.</i>	દીક. Safe and sound, હાલુંતાળું. <i>n.</i> (box) મળું, <i>f.</i>
Saffron,	<i>n.</i>	કેસર or કેહાર, <i>m.</i> Saffron-coloured, પગચું.
Sake,	For the sake of,	અદે, હાર.
Sale,	<i>n.</i>	કરાજ, <i>n.</i> To hold a sale, કરાજ કરી દાવું. On sale, વેસાતું.
Saliva,	<i>n.</i>	યુકદો, <i>m.</i>

Salt,	n.	બીજું, n.; (inferior) ખારી, f.; (coarse) ખુણ or દોખું, n.; (of the best kind) વડાગકી, n.
Salutation, Forms of,	n.	રામરામ ! સભામ ! મજરો ! લેહાર !
Salvation,	n.	હક, હુક or સુક, n.
Sambhar,	n.	છાગકી, n.
Saint,	adj.	પ્રતું, એજ, એતું, લ્લતું કો તીવું.
Sample,	n.	નમુનો, m.
Sand,	n.	વીળું, n.
Sap,	n.	રૈણ, m.; (rezin) અડા, f.; સોઅઓ, m.
Saras (bird),	n.	છાહરી, f.
Sari,	n.	સાડી, f.; (small) ઉનથી, f.; (spotted) ચુનઠી, f.
Satisfy,	v.t.	રાજ કરવું. Satisfied, ખરાણું. To be satisfied, ખરાણું.
Saturday,	n.	ધારોર, m.
Savage,	adj.	જંગલી ; n. જંગલી મનથ.
Saucer,	n.	(brass) વાટશી, f.
Save,	v.t.	તારવું, ખસાવણું. To save from suffering, સુક or હક આખવું.
Saviour,	n.	સુક or હક આખવાવાળો, તારવાવાળો.
Saw,	n.	કરવત, f.; v.t. વેરવું.
Scab,	n.	રેણ, f.
Scabbard,	n.	મેઅંન, n.
Scald,	v.t.	ખાળવું. To be scalded, ખળવું, ખળી જાવું.
Scarcity,	n.	કફેટ, f.; તંગાઈ, f.; તંગાસ, f. Year of scarcity, લેખું વર.
Scarecrow,	n.	ઓડો, m.
Scarlet,	adj.	પતંગાણું.
Scatter,	v.t.	વેરવું. To be scattered, વેરાઈ જતું.

Scent,	n.	બો, f.; પમળ, f.
Scheme,	n.	ઘાલ, m.; મનસુઅં, m.
School,	n.	નીણાણ, f.
Scissors,	n.	કાતર, f.
Scoff,	v.i.	ઓમણી પાડવી. To scoff at, —ની ઓમણી પાડવી. Scoffing, ઓમણી, f.
Scold,	v.t.	કપડો દીવો.
Scorch,	v.t.	ખાળવું To be scorched, ખળવું.
Scorpion,	n.	વીરી, f.
Scowl,	v.i.	આંખ દેખાડવી, તોળા કાડવા.
Scratch,	v.i.	કનરવું.
Scream,	n.	સીંહ, f.; v.i. રીંહ કરવી.
Screw,	n.	પેસ, m.
Sea,	n.	દરજો, m.
Search,	v.t.	—ની તપાહ કરવી. To search for, હેરવું, હોજવું, હોળ કાડવું.
Season,	n.	પાઠ, m. Summer season, ઉનાળો પાઠ. Rainy season, સમાર્ચ or સમાઝ or સોમાઝ, n.
Second,	adj.	દીજું. Second day of the moon, દીજ, f.
Secret,	adj.	સાનું. To keep secret, સાનું રાખવું; n. બેદ, m. To find out a secret, બેદ લીવો.
Secretly,	adv.	સાનાંસાનાં, સાનેસાને, હાનુંમાનું.
Secure,	adj.	મજાયુત, કાંકું. v.t. કાંકું કરવું. Security, જમન or જમન્યો, m.
See,	v.t.	નોંધું, દેખવું. To see off, વળાવણું.
Seed,	n.	ભી or ભીન, n.; (of vegetables, plants, &c.) સણી, f.; (of the <i>Mowra</i> tree) ઝોળ, f.
Seek,	v.t.	હેરવું, હોજવું, હોળ કાડવું.
Seem,	v.i.	દેખાવું, લાગવું. Seemingly, દેખીતું.
Seize,	v.t.	હાવું, હાધ લીવું.

Seldom,	<i>adv.</i>	કણ્ણીક વાર, કણ્ણીક વેળા.
Self,	<i>pron.</i>	પંડે, પંડુપંડ, પોતે. Self-willed, અતખણી.
Selfish,	<i>to be,</i>	પંડણું કરવું, પોતાનું કરવું. Selfishness, પંડણું, <i>n.</i>
Sell,	<i>v.t.</i>	વેસવું, વેસાંતું આલવું. To sell by auction, હોઝ કરી દાવું.
Send,	<i>v.t.</i>	મોકલવું. To send away, મોકલી દીવું. To send for, તેઝું.
Sense,	<i>n.</i>	હમજણું, <i>f.</i> ; હાંન, <i>n.</i> ; આકલ, <i>f.</i>
Sentence,	<i>n.</i>	ન્યાય, <i>m.</i> To pass sentence, ન્યાય કરવો.
Sentinel,	<i>n.</i>	પોરાવાળા, <i>m.</i>
Separate,	<i>adj.</i>	અલગણું, જુઓ, ન્યારું. <i>v.t.</i> જુઓ પાડવું, અલગું કરવું. Separately, જુઓનુંએ.
Separation,	<i>n.</i>	બેદ, <i>m.</i> ; જુઓ થાવું.
September,	<i>n.</i>	આદરવો—આહેા, <i>m.</i> See § 62.
Serpent,	<i>n.</i>	હાય, <i>m.</i>
Servant,	<i>n.</i>	નોકર, <i>m.</i> ; સાકર, <i>m.</i> To engage a servant, નોકર રાખવો.
Serve,	<i>v.i.</i>	સાંકરી કરવી, સેવા કરવી, સેવાસાકરી કરવી. <i>v.t.</i> —ની સાંકરી કરવી.
Service,	<i>n.</i>	સાકરી, <i>f.</i> ; સેવા, <i>f.</i> ; સેવાસાકરી, <i>f.</i> ; નોકરી, <i>f.</i>
Sesame,	<i>n.</i>	તલી, <i>f.</i>
Set,	<i>v.i.</i>	(as the sun) આથમતું, ઝુડતું. <i>v.t.</i> મેલવું, માંડતું. To set right, હોઝ કરવું.
Settle,	<i>v.t.</i>	—નો કાન કરવો, —નો બંદોખસ કરવો; (to decide) —નો ન્યાય કરવો, —નો ટાળો કરવો. Settlement (of a dispute) દિગો, <i>m.</i> ; ઇસ્તીયુસ્તી, <i>f.</i>
Seven Sisters bird,	<i>n.</i>	કોણી, <i>n.</i>
Several,	<i>adj.</i>	કાતરાકો.
Severe,	<i>adj.</i>	આકર્ષ, કંકું.

Sew,	v.t.	શીવણું. To get sewn, શીવડાવણું, શીવાડવું.
Shade,	n.	સાઈલો, m.; સાગો, m.; ઓડો, m.
Shadow,	n.	અથ, f.; પડસાગો, m.
Shake,	v.i.	આલવું; (as when possessed) ધુખુલું; (as a tree) જખેળું; (as the earth) તોલવું, કંપણું; v.t. હશાવણું. To shake the head (to indicate denial or refusal) તોળાવણું.
Shame,	n.	લાજ, f.; હરમ, f. To put to shame, હરમાવણું, મેદું કાળું કરવું. Shameful, Shameless, નકદું.
Shampoo,	v.t.	મહણવું.
Shape,	n.	ધાર, m.; રૂપ, n.; v.t. પોરવું.
Share,	n.	ભાગ, m.; v.t. વાંટવું, વાંટી આલવું, વાંટી દીકું.
Sharp,	adj.	ખાયમું. To sharpen, ઉતરાવણું; (a pen or pencil) —ની આખી કાડની.
Shave,	v.t.	વટું કરવું. Shaving, વટુ, n.
Shawl (sari),	n.	ઉનણ્ણી, f.
She,	pron.	વે. See § 14.
Sheath,	n.	મીઅાંન or મેઅાંન, n.
Sheep,	n.	ગાડકું, n.; ગોડું, n.; ગાયરી, f.
Shed n. (for cattle)		પાગેળ or ભાગેળ, f. To shed tears, આંખું પાડવી. To be shed (as leaves) ખરવું, ખરી પડવું.
Sheet,	n.	અડીલીટો, m.; પસેડો, m.
Shelf,	n.	પાટયું, n.
Shell,	n.	(large) કોકું, n.; (small) કોડી, f.
Shelter,	n.	(refuge) આસરો, m.: (shade) સાઈલો, m.; સાગો, m.; (made of leaves) પોલું, n.
Shepherd,	n.	ગાયરી, m.
Shield,	n.	ટાળ, f.; v.t. બસાવણું, આંદું રેતું.

Shine,	v.i.	શાન્દુરું.
Ship,	n.	નાજ, n.
Shirt,	n.	પેરણ, n.
Shiver,	v.i.	કાપણું.
Shoe,	n.	ખાંડડી, f.; ખાંડકું, n. Shoes, નોડા, m. pl. Shoemaker, મોસી.
Shoot,	v.t.	બોળી સોડવી, બંદુક સોડવી. Shooting pain, ઈક, f. To feel a shooting pain, ઈક કુદવી (with dat. of pers.). To shoot forth, કુદતું.
Shop,	n.	દોકાન, f.; હાડ, f. Shop-keeper, દોકાનવાળો.
Short,	adj.	કુંકું. To fall short, ઝુટું, ઝુરી જવું, કમતી પડતું. To shorten, v.t. કુંકું કરવું.
Shot,	n.	ગ્રાણી, f. Small shot, સરાં, n. pl.
Shore,	n.	કનારો, m.
Shoulder,	n.	ખબો, m. Shoulder-blade, હાંડો, m,
Shout,	n.	ઝુમ, f.; v.i. ઝુમ પાડવી, હાડ દીવો.
Shove,	v.t.	ઘેઠવણું, ટેલવું.
Shovel,	n.	ખાવડો, m.
Show,	v.t.	ભાગવું, વતાવણું.
Shower,	n.	આપોટ, f.
Shrine,	n.	થાનાં, n.
Shut,	v.t.	ઢાંકવું, ઢાંકતું, ઢિવું, બંદ કરવું. To shut a door, કમાડ દીવું, કરી દીવી.
Shy,	adj.	લાળતું. v.i. સમક્ષી પછતું. Shyness, લાજ, f.
Sick,	adj.	દોમાર, માંડ. Sickness, દોમારી, f.; મંદવાડ, f.; (vomiting) ઉલેખ, f. To be sick, ઉલેખ થાવી,
Sickle,	n.	દાતડી, f.

Side,	n.	આડ or આડી, f.; ગમ, f.; પાકતી, f.; પાથ, f.; ખાજુ, f.; મેર, f. On this side, અણીઆડ, અણીપાઠ, અણીમેર. To one side, કોરે, મેરે. To the other side, ખીજુઆડ, ખીજ પાહે, ખીજ મેર, પેલે હેડે; (of a river) પેલે પાર. To the right side, જમણે હાથ, ઉપલે હાથ. To the left side, ડાને હાથ, નીથલે હાથ. On the farther side, પેલી આડ, પેલે હેડે. On both sides, એ આડૂલ્યાંમાં.
Sieve,	n.	સાળણી, f.
Sift,	v.t.	સાળવું.
Sigh,	n.	નેહાહે, m.; v.i. નેહાહે દાવો.
Sight,	n.	દરસણ, n.; નજર, f. To grant a sight of oneself, દરસણ દીવું.
Sign,	n.	લેસણ, f.; હેલણ, n.; હાન્યાં, n. pl.; v.i. હાન્યાં કરવાં.
Silent,	adj.	મોની.
Silly,	adj.	ગાંડું.
Silk,	n.	રૈસમ, n.; ઢીર, n.
Silver,	n.	( bullion ) રષ્યુ, n.; ( purified ) સાંશી, f. Silver fox, ઘેખી, f.
Similar,	adj.	એકહરંગ, ખરાખર. To be similar, મળતું આવણું.
Sin,	n.	પાપ, n.; ગતો or ચુનો, m. Sinful, પાપી, પાપેકું. Sinless, પાપવના. Sinner, n. પાપી મનખ, પાપેકું મનખ, હરાભી.
Sing,	v.i.	ગાવું.
Single,	adj.	એકલું. Not a single one, એકજ નહીં.
Sink,	v.i.	કુષ્ણવું, ચુડવું, ચુડી નવું. To sink and be drowned, ચુડી મરવું.

Sir,	n.	સાહેબ.
Sister,	n.	ભેન. Elder sister, વડી ભેન, વડી ખાઈ. Sister-in-law, નઃદી, જેણાણી, ડેરાણી, હાળી, હાળાઓડી. See § 65.
Sit,	v.i.	એહાંતું, વરાજાંતું ( speaking to or of a superior ).
Site,	n.	જગ્ગા, f.; ટેકાંણું, n.
Size,	n.	કદ, m. What size? કીંઠું મેટું?
Skin,	n.	( human ) સાંખ્યી, f.; ( of an animal ) સાંખ્યું, n.; ખાલ, f.; ( of fruit ) સોઢું, n.
Skull,	n.	કાંસથી, f.
Sky,	n.	અંગારી, f.; આંધું, n.
Slab,	n.	સીતાળ, m.
Slack,	adj.	દીક્ષિ. To slacken, દીક્ષિ કરવું.
Slander,	n.	સાડી, f.; સુકલી, f.; v.i. સાડી કરવી, સુકલી કરવી.
Slanderer,	n.	સાડુંઓ, m.
Slap,	n.	લાપટ, f.; v.t. લાપટ આણવી.
Slate,	n.	પાઠી, f.
Slave,	n.	ગોલો, m.; ગોલી, f.
Slay,	v.t.	મારી દડવું.
Sleep,	n.	ઉગ, f.; v.i. ઉગવું. To sleep on one's side, પાતકન્યે હુંઠું. To sleep on one's face, ઉંફું પડીને હુંઠું. To sleep on one's back, સીતું પડીને હુંઠું. To go to sleep, ફુલાંઠું. To put to sleep, ફુલાડવું.
Sleepy, to feel,	v.	ઉગ આવણી (with dat. of pers.).
Slide,	v.i.	ખદીનાંતું, લખસી નાંતું.
Sling,	n.	ગોદણું, f.; v.t. ગોદણુંબાંણું, ગોદણુંને દડવું.
Slipper,	n.	ખાંદી, f.; ખાંદું, n.

Slope,	<i>n.</i>	ગોડ, <i>m.</i> ; ટાળ, <i>m.</i>
Sloth,	<i>n.</i>	આગણ, <i>f.</i> Slothful, આગણયું, નેદાર.
Slow,	<i>adj.</i>	દીકું. Slowly, હળેણે, હંતાંહંતાં, દીમેદીમે.
Smack, the lips,	<i>n.</i>	મોઢું મલકાવણું.
Small,	<i>adj.</i>	નાચું. Very small, નાનેક. A small quantity of, લગાર લગાર, સણ્ણિસણ્ણી. Small-pox, માતા, <i>f.</i>
Smear,	<i>v.t.</i>	સોપડતું.
Smell,	<i>n.</i>	ઓ, <i>f.</i> ; પમળ, <i>f.</i> ; <i>v.i.</i> પમળતું; <i>v.t.</i> ફુગવું; ઓ આનણી (with dat. of pers.).
Smile,	<i>v. i.</i>	મનમાં આંહવું.
Smith,	<i>n.</i>	લોઆર, <i>m.</i>
Smoke,	<i>n.</i>	ગડ, <i>m.</i> To smoke a pipe, ડીડી પીવી, બાંગ પીવી.
Smooth,	<i>adj.</i>	કુચાળું.
Snake,	<i>n.</i>	ધાપ, <i>m.</i> ; (grey) કોટ, <i>m.</i> ; (small) ગડું, <i>n.</i> Snake-charmer, વાઢી, <i>m.</i>
Snatch,	<i>v.t.</i>	અસકી લીવું, આસકી લીવું, હાઈ લી જતું.
Sneeze,	<i>v.i.</i>	સીંકતું.
Snore,	<i>v.i.</i>	ગોર કરવો. Snoring, ગોર, <i>m.</i>
Snuff,	<i>n.</i>	દળેલી બાંગ, <i>f.</i>
So,	<i>adv.</i>	ઈમ, એમ, ઈવું, એવું, તીવું. Just so, ધમજ, એમજ. So many, અતરા. So much, અતરે. So big, છતું મોઢું. So often, અતરા હેરા. Is it so? એમ કે? Is it not so? હે કે નહીં?
Soak,	<i>v.i.</i>	પલણતું; <i>v.t.</i> પલાળતું.
Soap,	<i>n.</i>	હાણું, <i>f.</i> ; ઉણળ, <i>f.</i> A tablet of soap, હાણુની રોટી.
Sob,	<i>n.</i>	લાહકું, <i>n.</i> To sob, લાહકાં ભરવાં.
Soft,	<i>adj.</i>	પોસું. Softly, કોણે.

Sir,	n.	સાહેણ.
Sister,	n.	બેન. Elder sister, વડી બેન, વડી ખાઈ. Sister-in-law, નજીવી, જેઠાણી, દેરાણી, હાળી, હાળાઓડી. See § 65.
Sit,	v.i.	એહેથું, વરાજથું (speaking to or of a superior).
Site,	n.	જગ્યા, f.; ટેકાણું, n.
Size,	n.	કદ, m. What size? કોણું મોટું?
Skin,	n.	(human) સાંખ્યા, f.; (of an animal) સાંખ્યં, n.; ખાલ, f.; (of fruit) સોંખું, n.
Skull,	n.	કાંસથી, f.
Sky,	n.	આંગાડી, f.; આંધું, n.
Slab,	n.	સીતાળ, m.
Slack,	adj.	દીલ્ખું. To slacken, દીલ્ખ કરવું.
Slander,	n.	સાડી, f.; સુકલી, f.; v.i. સાડી ફરવી, સુકલી ફરવી.
Slanderer,	n.	સાડુઓ, m.
Slap,	n.	લાપટ, f.; v.t. લાપટ આણવી.
Slate,	n.	પાટી, f.
Slave,	n.	ગોલો, m.; ગોલી, f.
Slay,	v.t.	મારી દડતું.
Sleep,	n.	ઉગ, f.; v.i. ઉગતું. To sleep on one's side, પાતકંને ફુંટું. To sleep on one's face, ઉંદું પડીને ફુંટું. To sleep on one's back, સીંહ પડીને ફુંટું. To go to sleep, ફૂછનું. To put to sleep, ફૂઅડતું.
Sleepy, to feel,		ઉગ આવણી (with dat. of pers.).
Slide,	v.i.	ઘડીનારું, લખરી નારું.
Sling,	n.	ગોઝું, f.; v.t. ગોઝુાવણું, ગોઝુને દડતું.
Slipper,	n.	ખાંઠડી, f.; ખાંઠું, n.

Slope,	v.	શોડ, m.; ટાળ, m.
Sloth,	n.	આગેહ, f. Slothful, આગેહજ્યું, નેદાર.
Slow,	adj.	દીકું. Slowly, હગેહળે, હાંતાંહાંતાં, દીમેદીમે.
Smack, the lips,	mોડું	ભલકાવણું.
Small,	adj.	નાચું. Very small, નાનેક. A small quantity of, લગાર લગાર, સણ્ણિસણ્ણી. Small-pox, માતા, f.
Smear,	v.t.	સોપડતું.
Smell,	n.	ઓં, f.; પમળ, f.; v.i. પમળતું; v.t. ફુગવું; ઓં આનણ્ણી (with dat. of pers.).
Smile,	v. i.	મનમાં આઢતું.
Smith,	v.	શોઆર, m.
Smoke,	n.	ગડ, m. To smoke a pipe, પીવી પીવી, ભાંગ પીવી.
Smooth,	adj.	ફુઅળું.
Snake,	v.	શાપ, m.; (grey) કોટ, m.; (small) ગડહુ, n. Snake-charmer, વાઠી, m.
Snatch,	v.t.	અસકી લીતું, આસકી લીતું, હાઈ લી જતું.
Sneeze,	v.i.	સીંકતું.
Snore,	v.i.	ગોર કરવો. Snoring, ગોર, m.
Snuff,	n.	છેલી ભાંગ, f.
So,	adv.	ઇમ, એમ, ઈંવું, એવું, તીવું. Just so, ધમજ, અમજ. So many, અતરા. So much, અતરે. So big, છતું મોડું. So often, અતરા હેરા. Is it so? એમ કે? Is it not so? હે કે નહીં?
Soak,	v.i.	પલળતું; v.t. પલાળતું.
Soap,	n.	ટાયુ, f.; ઉનળ, f. A tablet of soap, ટાયુની રોટી.
Sob,	n.	લાહકું, n. To sob, લાહકાં ભરવાં.
Soft,	adj.	પોસું. Softly, કોણગે.

Soil,	<i>n.</i> માટી, <i>f.</i>
Soil,	<i>v.t.</i> મેલું કરવું. Soiled, મેલું, અણગાળું.
Sole,	<i>adj.</i> એકલું. Solely. એકલું, ઇકત.
Some,	<i>adj.</i> કોઈ, કણ્ણું, કંઈ, કંતરોક, કંતરીક, કંતરિક. Someone, કણ્ણું, કોઈ. Something, કંઈ, કાઈ, કંઈક. Some one else, ખરસુણી. Some how or other, અમતીમ કરીને, જમે તીમ કરીને. Sometimes, કણ્ણીક વેળા, કરેને કરે, કરેક કરેક. At some time or other, કન્યાંક. Somewhat, કંઈક. Somewhere, કણ્ણે ટેકાણે, કયાંક.
Son,	<i>n.</i> દીકરો, સોરો. Adopted son, બોળેતર સોરો. Son-in-law, જમાઈ.
Song,	<i>n.</i> ગાણ્ણું, <i>n.</i> The song sung at the <i>Dasara</i> festival, ગરભો, <i>m.</i>
Soon,	<i>adv.</i> વેલું, લગતું. Very soon, વેલાંવેલાં.
Soothsayer,	<i>n.</i> વાંશુ, <i>m.</i>
Sore, to be,	દુખતું, કળતું, લખતું. A sore, સાંદી, <i>f.</i>
Sorrow,	<i>n.</i> દુખ or દુષ્પ, <i>n.</i> ; ફુગ or હોગ, <i>m.</i>
Sort,	<i>n.</i> જાત, <i>f.</i> Of what sort! કીંદું! હેઠું!
Soul,	<i>n.</i> જીવ, <i>m.</i>
Sound,	<i>n.</i> બોલ, <i>m.</i> ; <i>v.i.</i> વાજતું; <i>v.t.</i> વળડતું. To sound the war-cry, વારે પાડવી, છીકલી કરવી.
Soup,	<i>n.</i> રેથ. <i>m.</i> ; રહુઓ, <i>m.</i>
Sour,	<i>adj.</i> ખાદું. ખાદુંપટ.
South,	<i>n.</i> દખણું, <i>f.</i> Southwards, દખણુંાં.
Sow,	<i>v.t.</i> વાવણું. Sowing, વાવણી, <i>f.</i>
Space,	<i>n.</i> ઠાલી જગા, <i>f.</i> ; ખાલી જગા, <i>f.</i>
Spade,	<i>n.</i> પાવડો, <i>m.</i>
Span,	<i>n.</i> વેત, <i>f.</i>

Sparrow, *n.* સકલો, *m.*; સકલી, *f.*

Speak, *v.i.* & *v.t.* બોલતું. To speak angrily, સાચની બોલતું.

Special, *adj.* Specially, *adv.* Expressed by enclitic એ.

Speech, *n.* બોલી, *f.*

Spell, to cast a, સેટતું.

Spend, *v.t.* ખરસ કરવો, વાપરતું. To spend time, વખત કાઢવી. Spendthrift, ઉગ્વસ આદમી.

Spider, *n.* કરોળ્યો, *m.*

Spill, *v.i.* ઢેળાઈ જતું; *v.t.* ઢેળતું.

Spire (of grass), *n.* લાંધ, *m.*

Spirit (evil), *n.* જુત, *m.*; મળીસ, *m.*; ચુડનેથ, *f.*

Spite, *n.* વેર, *n.*; અદાવત, *f.*; ખાર, *m.*; *v.t.* -તુ વેર વાળતું.

Spleen (enlarged), *n.* ઘડોળ, *f.*

Split, *n.* ઝડિ, *f.* *v.i.* ઝાટતું, ઝાડી જતું. *v.t.* ઝાડતું.

Spoil, *v.i.* વગડતું or વગડતું; *v.t.* વગડાતું or વગડતું.

Spontaneously, *adv.* અનહુ.

Spoon (ladle), *n.* સાડુઓ, *m.*

Spot, *n.* (place) ટેકાણું, *n.*; જગા, *f.*; (stain) ડાગ, *m.*; પદ, *m.*; (very small) ટીપુકી, *f.*

Spotted, *adj.* ટીપુકન્યાવાળું. Spotted sari, સુનદી, *f.*

Spread, *v.i.* (as news) ફેલી જતું; *v.t.* ફેલાવણું; (as a carpet, &c.), પાથરતું, વાથરણું.

Spring (of water), *n.* છેર, *m.*; હરવા, *m.*; *v.i.* તલસપતું, ગાકડો ભરવો.

Sprinkle, *v.t.* ખાંટતું, ટીસતું.

Sprout, *n.* ઝડપો, *m.*; ઝણગો, *m.*; *v.i.* ઉગતું, કુટતું.

Spy, *n.* બેદ, *m.*; *v.i.* બેદ લીનો. *v.t.* -નો બેદ લીનો.

Squander, *v.t.* બિડાવણું.

Square, *adj.* સ્થારપોથીનું. Square plot of ground, માડી, *f.*

- Squeeze, v.t. પસેલવું.
- Squint-eyed, adj. આંકું.
- Squirrel, n. ઘરી, f.
- Stab, v.t. હુદ્દ મારવી.
- Stable, n. કોરાડ, m.
- Stag, n. સારો, m.
- Stage (of a journey), n. અંગધ, f.
- Stagger, v.i. અયડાવું, અયડાતું જાવું, આયડાવું, આયડીઓ ખાવાં.
- Stain, n. ડાગ, m.; પટ, m.
- Stairs, n. દાદરો, m.
- Stake, n. ઝુટી, f. Impaling stake, ઝળી, f.
- Stammering, adj. બોણકું.
- Stand, v.i. ઉઘું થાવું. Standing, ઉઘું.
- Star, n. તારો, m. Morning Star, પૂરોડો, m.
- Stare, v.i. લોઇ રહું.
- Start, v.i. ઓસાડવું, ઓસાડી પડવું, સસકવું. To start on a journey, નીઢરખું, નીકળખું.
- Startle, v.t. સમકાવણું.
- Starve, v.i. જુઘે મરવું. v.t. જુઘે આરવું.
- State, n. હાથ, f. Native State, પોતા, m.; રજવાડી, f. Belonging to a Native State, રજવાડી.
- Stead, Instead of, ઘદલે, હાટે, ઠેકાણે.
- Steal, v.i. સોરી કરવી. v.t. —ની સોરી કરની.
- Steel, n. અજવેખ, f.
- Steep, adj. અધારું.
- Step, n. યાંકડી, f. Foot-step, રગલો, m. Step of a well, પારચી, f.; Step-son, સાવકો સોરો. Step-daughter, સાવકી સોરી.
- Stern, adj. આકર્ષિ.

<b>Stew,</b>	n. હાંનણું, n.
<b>Stick,</b>	n. લાકડી, f.; લાટો, m.; v.i. સોંઘરું; v.t. સોંઘડકું
<b>Stiff,</b>	adj. કાઢું.
<b>Stile,</b>	n. પોડીખાળણું, n.
<b>Still,</b>	v. (for distilling spirits) ભાડી, f.; adj. સાતું.
<b>Sting,</b>	n. (of a bee) ગાળી, f.; (of a scorpion) અંદરકો, n.; v.t. ગાળી ધારવી, અંદરકો ભારવો.
<b>Stir,</b>	v.i. કાલણું. v.t. હલાવણું. To stir up, ઉસકાનણું, સડાવણું.
<b>Stirrup,</b>	n. ખગડું, n.
<b>Stomach,</b>	n. એઝર્ચ, n.; પેટ, n.
<b>Stone,</b>	n. પાણે, m.; (large) ભાડો, m.
<b>Stool,</b>	n. પાટણું, n..
<b>Stoop,</b>	v.i. અંગરું પડતું.
<b>Store,</b>	n. હંગરો, m.; (granary) કોકાર, m. To store up, —નો હંગરો કરવો, હમેઠાં, હમેરી હાતું.
<b>Storey (upper),</b>	n. મેડો, m.
<b>Story,</b>	n. વાત, f.
<b>Stop,</b>	v.i. થોખણું. v.t. થોખાવણું, ઉષું રામતું : (a thing) અંદે કરતું.
<b>Storm,</b>	n. કોરણું, f.
<b>Stout,</b>	adj. બાઢું, મોઢું.
<b>Stove,</b>	n. હગડી, f.
<b>Straight,</b> adj.	ખાદર, સીડું; (right) હમુતમું, હોજ. To set straight, હોજ કરતું. To come straight, વાટેલાટ આવણું.
<b>Strain,</b>	v.t. ગાળતું, સાળતું. Strainer, n. સાળણી, f.
<b>Strait,</b>	adj. હાંકડું. Straits, તંગાછ, f.; તંગાસ, f.; સંકદ, f.
<b>Strange,</b> adj.	તંગાછ જેતું. Stranger, અણણ્યો, m.
<b>Strap,</b>	n. હેડ, f.

- Straw,** *n.* પરાળ, *f.*; (of chana) કાણજું, *n.*
- Stray,** *adj.* હરાડું.
- Stream,** *n.* વાંશું, *n.*; વેજું, *n.* Stream of milk, હેલ, *f.*
- Street,** *n.* અલી, *f.*
- Strength,** *n.* જોર, *n.*; ઘણ, *n.*
- Stretch,** *v.t.* તાખું. To stretch out, તાખ્યી થિતું.
- Strike,** *v.t.* મારવું.
- String,** *n.* દોરો, *m.*; વાંશું, *n.*; હુનળી, *f.* String of oxen for treading out corn, ડામેણું, *f.*
- Strive,** *v.i.* મેનત કરવી.
- Strong,** *adj.* જખાડું, જોરાવર; (stiff) કાઢું.
- Struggle,** *v.i.* ભયાખ્યી કરવી, બાચાં ખડતું.
- Strut about (in fine clothes),** મહલાતું.
- Stubble,** *n.* કડણ, *f.*; હારવો, *m.*
- Stubborn,** *adj.* આડાણી, કુટેલ.
- Stumble,** *n.* ટેપ, *f.*; *v.i.* ટેપ લાગવી.
- Stupefied,** *adj.* બેદ્રસું.
- Stupid,** *adj.* ગાંઠું, ટોડ, સુરાખ. Stupidity, મુરખાછ, *f.*
- Stuttering,** *adj.* બોધકાં.
- Subdue,** *v.t.* કંનામાં કરવું, તાખે કરવું.
- Subjection,** under, તાખે.
- Subsequently,** *adv.* પસે, તખ્યાપુદે.
- Submission,** *n.* તાખેદારી, *f.* Submissive, તાખેદાર, કેળવાગઢું.
- Submit,** *v.i.* કેળવામાં રેવું, તાખે થાવું.
- Subsist,** *v.i.* ચુલ્લરો કરવો.
- Such,** *adj.* ઈતું, એતું, તીતું, તેતું, વીતું, વેતું.
- Suck,** *v.t.* ખાવણું. To suckle ખવાડવું.
- Suddenly,** *adv.* એકદાતે, ઉપરાઠ.

Suffer,	v.i.	વેદું.
Sugar,	n.	ખાંડ, f. Sugar-candy, હાકર, f. Sugar-cane (dark) હાડો, m.; (small and light) લીલાઈ, f.
Suit,	v.i.	ગમતું, ફાવતું, ભાવણું, સાવતું. Suitable, હરફું. Suitable to, માપક.
Sultry weather,	m.	ઉનારો,
Summer,	n.	ઉનાળો, m.
Sun,	n.	દનધારસી, m.; ફૂરોય, m.
Sunday,	n.	દીતવાર, m.
Sunrise, at,		દન ઉગે, જલથ્ય કુદી ગીજાયે, ઉગતી કોરણ્યાંખાં, જલથ્ય ફાટતાં.
Sunset, at,		દન or દાઉ ચુદી ગીજાયે, આથમનાયે, આથમતે.
Sunshine,	n.	તડકો, m.; જલથ્ય, m.; રાહેણું, f.
Supercilious,	adj.	મગરડી.
Superintend,	v.t.	—નો ઉપરી રેનો. Superintendent, ફાબકો આદમી, ઉપરી.
Superior,	adj.	સરીરું.
Superstition,	n.	વેમ, m. Superstitious, વેમી.
Supply,	v.t.	પુરું પાડું. To supply with, આખવું, ઢીંગું.
Support,	n.	(maintenance) ચુનરો, m.; (prop) ટેકો, m. To maintain, ચુનરો કરવો, ખાંન ઢીંગું. To prop up, ટેકો હીનો.
Suppose,	v.t.	ખારવું. Suppose that, જણીએ, ધારો.
Suppress,	v.t.	કષ્યાનમાં કરવું.
Sure,	adj.	નકી. Surely, નકી, ખરેખરું, હાંસેહાંસ.
Surety,	n.	જમન or જમનાયો, m.
Surrender,	v.i.	તાએ થાવું; v.t. તાએ કરવું.
Surround,	v.t.	પેરવું, પેરી લીંગું.
Suspect,	v.t.	—નો વેમ રાખવો.

Suspend,	v.t.	તતુલણું, તતુલતું મૈલણું.
Suspicion,	n.	વેમ, m. Suspicious, વેમી.
Swallow,	v.t.	ગળવું, ગળી દીવું.
Sway,	v.i.	કુલવું; v.t. કુલાવણું.
Swear,	v.i.	હમ આવા, હોમન આવા. To swear falsely, ઓટા હમ આવા.
Sweat,	n.	પરવીછો or પરવેછો, m.; v.i. પરવેછો વળવો (with dat. of pers.).
Sweep,	v.t.	આરણું, વાળવું. Sweeper, ઓળગણો, m.
Sweet,	adj.	ગળદણું, મીઠું. Sweetmeat, મીઠાઢ, f.; લાડુ, f. Sweetmeat seller, કાઢોધ, m.
Swell,	v.i.	કુણું, Swelling, વરણોળી, f.; (caused by guinea-worm) એદર્સ, n.; (on the right knee) જાંતુઓ, m.; (boil) કમર્સ, n.
Swim,	v.i.	તરણું.
Swift,	adj.	ઉતારજું.
Swing,	n.	ફીરણો, m.; v.i. ફીસવણું. v.t. ફીસવણું, ફીરણો દીવે, ફીલવણું. To swing from side to side, કુણું;
Sword,	n.	તરવાર, f.

## T.

Table,	n.	મેજ, f.
Tail,	n.	પુસ્કું, n.; ડાંબોણી, n. Tailless, ખોણું.
Tailor,	n.	હણ, m. Tailor's wife, હણખેણું, f.
Take,	v.t.	દીવું, હાવું. To take away, દી નવું, હાધ દી નવું, ઉચું કરીને લો નવું. To take down, ઉતારવું. To take out, ફાડવું, નીકળવું.
Tale,	n..	વાન, f. Idle tales, ગય, f. Evil tales, સાડી, f.; સુકલી, f.; Tale-bearer, સાડુઓ.

Talk,	v.i.	બોલવું, વાત or વાતસીત કર્ણી. To talk angrily, સાધારની ખોલ્ખી બોલવું. To talk incessantly, ખોલમોલ કરવું. To talk nonsense, બકલું, બકલ્યા કરવું.
Tamarind,	n.	આમદી, f. Tamarind tree, આમદી, f.
Tame,	adj.	પાળેલું.
Tank,	n.	તળાવ, m.
Tanner,	n.	સમાર, m.
Tape,	n.	નાડું, n.
Taste,	n.	શ્વાદ, m.; v.t. સાકવું. Tasteless, મોળું, શ્રીદુઃ.
Tax,	n.	(import and export duties) દાંષુ, n.; (on the produce of land) કુલું, n.; વજ, f.; (on crops) વરાડ, m.; (on ploughs) હેળવરાડ, m.
Teach,	v.t.	ભણ્યાવવું, ડીકવણ્યું.
Teak,	n.	ઢાકડો or ઢાગડો, m.; ઢાગ, m.
Tear,	n.	આંસુ, f. To shed tears, આંસુ પાડની.
Tear,	v.t.	કાપવું.
Tease,	v.t.	અનીજવણ્યું.
Teat,	n.	મીમી, f. Cow's teat, અંસોળ, f.
Tell,	v.t.	હેતું. To tell about, —ની વાત હેવી.
Temper,	n.	મીળજ or મેળજ, m.; સખાવ, m.
Tempest,	n.	કારણું, f.
Temple,	n.	દેરો, m.
Tempt,	v.t.	પારખવું, —ની પારખા કરવી, —ની પારખા લીવી.
Temptation,	n.	પારખ, f.; પારખા, f.
Tent,	n.	કેરો, m.; તંયું, m.
Terrace,	n.	ઓટલી, f.; ઓટલો, m.
Terrible,	adj.	ખીચામણું.
Terrify,	v.t.	ખીચાડવું.

- Territory, n.** પદ્ય, m. Native Territory, રાજ્યાં, f.
- Test,** n. પારખ, f.; પારખા, f. v.t. —ની પારખા કરવી, ની પારખા લીધી, પારખાનું.
- Testify, v.i.** સાહેદી આપવી. Testimony, અ. સાહેદી, f.
- Tether,** v.t. બાંદવું, માંદવું.
- Than, prep.** કરતાં. Expressed also by the Ablative of the thing compared.
- Thank,** v.t. —નો શુષ્ણુ માનવો.
- That,** pron. વી, વેં. See §§ 14, 16, 17.
- Thatch,** n. ચાનેર, n.; v.t. સેવું. Thatched house, ચેન્યું ગેર, n.; સાપડી, n.
- Theft,** n. સોરી, f.
- Them,** pron. વખ્યાએ. See §§ 14, 16, 17.
- Then,** adv. તેર. conj. તે, તો, તીતી. Now and then, કેરેક કેરેક.
- Thence,** adv. તેઢું, તેઢાં. See § 4.
- There,** adv. હાં, વાં. Thereabouts, તત્ત્વાકાં. Therefore, તથે.
- They,** pron. વી, m.; વી, f. See §§ 14, 16, 17.
- Thick,** adj. ભાડું, મોઢું. Thickness, ભડાઈ, f.
- Thief,** n. સોર,
- Thigh,** n. હાતેળ, f.
- Thin,** adj. પાતળું; (weak) ફખ્યું. A thin man, પાતળવાનાન્દો.
- Thine,** pron. તારી.
- Thing,** n. સીજ, f.; વાત, f.; રકમ, f.
- Think,** v.t. વસારવું, વસાર કરવો, ધારવું. To think deeply, હોસ કરવો.

- Thirst, *v.* તર, *f.* To be thirsty, તર ભાગવી (with dat. of pers.).
- This, *pron.* ઇથું, એ. This very one, એજ. This year, એયાણ.
- Thistle, *n.* ઉટકાંટો, *m.*; (wild poppy) દતુરો, *m.*
- Thither, *adv.* લાં, બાં.
- Thorn, *n.* ફાંટો, *m.*
- Thoroughly, *adv.* ખુલ્લ, કારીપેઢો.
- Thou, *pron.* તુ. See § 14.
- Though, *conj.* જેકે, જોકે. Though...yet, [જેકે]...તેપણું; [જેકે]...તોપણું.
- Thought, *v.* વસાર, *m.*; સરત, *f.*; હોસ, *m.* Thoughtful, વસાર કરવાચાળું. Thoughtless, વસારવના.
- Thousand, *adj.* હજાર.
- Thrash, *v.t.* જેરથંડ ભારવો. To thrash corn, ડામેણું ફેરવણી. Thrashing-floor, અંધું, *n.*
- Threaten, *v.t.* ધાક દીની, ધમકી અતાવણી, આંખ ફેખાડવી. Threatening, ધમકી, *f.*; ધાક, *f.*
- Thread, *n.* હોરી, *f.*; હોરો, *m.*
- Three, *adj.* તણું. Three-cornered, તણુખુણું-યું.
- Threshold, *n.* અખરોટ, *m.*
- Throat, *n.* કોગળો, *m.*; ગળું, *n.* Throat disease, ગળજુણી, *f.*
- Throb, *v.i.* દુડુડ થાતું.
- Through, *prep.* માંહું.
- Throw, *v.t.* દદંતું, નાંખંતું. To throw down, પાડું, પાડી દદંતું. To throw down violently, પદકાવણું. To throw out, કાડું, નીકાળતું.

**Thrust into, v.t. પાલતું.**

**Thumb,** *n.* આંગુઠો, *m.*

**Thunder,** *v.i.* ગેઢ બાજવો.

**Thursday,** *n.* અરસવાર, *m.*

**Thus,** *adv.* ઈમ, એમ, તીમ, તેમ.

**Thy,** *pron.* તારું. Thyself, તુ ખંડા.

**Tickle,** *v.i.* કલી ધાવી (with dat. of pers.). *v.t.* કલી કરવી. Tickling sensation, કલી, *f.*

**Tidy,** *adj.* ટીક, હોય. To tidy up, હોય કરતું.

**Tie,** *v.t.* આંદંદું, માંદંદું. To tie a knot, ગાંઠ વાળવી.

**Tiger,** *n.* વાપ. Tigress, વાધેણું.

**Tight,** *adj.* કાઢું. To tie tight, તાણુંને માંદંદું. To tighten, કાઢું કરતું.

**Tile,** *n.* નાળી, *f.* Large flat tile, ટાપું, *m.* To turn tiles, ટાપું ફેરવણું.

**Till,** *v.t.* એડંદું. *prep.* લગણું, ફૂફી, જાંખગણું, જોડુફી.

**Time,** *n.* વાર, *f.*; વખત, *f.*; વળા, *f.*; કાળ, *m.* To be a long time, વાર લાગવી (with dat. of pers.). To keep one a long time, વાર લગાડવી. To put off time, વળા કરવી, એડી કરવી. To suffer hard times, વખત વેઠવી.

**Tip (of the finger),** *n.* મીપાડું, *n.*

**Tired,** *adj.* પાંડું. To be tired, પાંડવું, થાડી ઊંડું.

**To,** *prep.* લગણું, ફૂફી. Also expressed by the Dative case, or by the Locative in એ. Right up to, દેશ.

**Tobacco,** *n.* ભાંગ, *f.*; ચુકો, *m.*; તમાડું, *m.*

**To-day,** *adv.* આજે, આજો.

**Toe,** *n.* આંગુઠો, *m.*

**Together, adj.** એકું, એટકું, બેણું, બેણું. **adv.** બેણું or બેણું પાછને. To put together, બેણું કરવું, બેણું કરવું, એકું કરવું, હસ્તિવું. To meet together, બેળાં આવાં, બેળાં થાવાં, એકાં થાવાં. Together with, લારે, હાતે.

**Tomb,** *n.* ધોર, *m.*

**To-morrow, adv.** કાદે, કાલ. That which will happen to-morrow, કાલની વાત. The day after to-morrow, પરમ દાડે, પમને દાડે. To-morrow morning, હવારે.

**Tongs,** *n.* સીપીઓ, *m.*

**Tongue,** *n.* જીય, *f.* Mother tongue, બોકી, *f.*

**To-night, adv.** આજ રાતે, રાતે.

**Tonsillitis,** *n.* કાગલેલા, *m.*

**Tools,** *n.* અયુઆર, *m.*; રાસો, *n. pl.*

**Tooth,** *n.* દાંત, *m.* Tooth-brush, દાતણું, *n.* To brush the teeth, દાતણું કરવું.

**Top (of a hill, &c.), n.** કુસ, *f.*

**Torch,** *n.* અસ્પલ, *f.*

**Torrent,** *n.* રેખ, *f.* To pour in torrents, પાણી કાઢે આરવું, જળ બંધારકાર થાવું.

**Torture,** *n.* પીડા, *f.* *v.t.* હાસુ મનાવણા કરવું.

**Touch,** *v.i.* અડવું, લાગતું. *v.t.* અડાડવું, હાથ અડાડને.

**Tough,** *adj.* બાટકાદરકું (*lit. like muscle*).

**Towards,** *prep.* ગુંગ.

**Trace,** *n.* હેતાંશી, *f.*

**Trade,** *n.* વેપાર, *m.* Tradesman, વેપારી

**Tradition,** *n.* આગળની વાત, *f.*; કેવત, *f.*

**Traitor,** *n.* બેદુ.

- Trample down, v.t.** કસરવું.  
**Transactions, n.** દીકુલીણું, n.  
**Transgress, v.i.** પાપ કરવું. **Transgression, n.**  
**Transmigration, n.** જનખ અપતાર, m.  
**Transplant, v.t.** રોપવું.  
**Transport, v.t.** કાળું પાણી હતારી દીકું.  
**Trap,** n. પંજરણ, n.  
**Travel, v.i.** સપાડું કરવું. To travel together, હાત કરવેં.  
**Traveller, n.** વાટમાણું.  
**Tray,** n. (large) ધાળ, f.; (small) ધાળી, f.  
**Treachery, n.** દ્રગો, m.  
**Tread down, v.t.** કસરવું.  
**Treasure, n.** પુણી, f.; માલ, m.  
**Treat (behave towards), v.i.** —હાતે સાલવું. To treat patients,  
 એષાયદ કરવી.  
**Tree,** n. શખું, n.  
**Tremble, v.i.** કંપણું. To tremble with cold, રાત સડવી  
 (with dat. of pers.).  
**Trial,** n. પારાપ, f.; પારાપા, f.  
**Tribe,** n. ઓડેક, f.; જાત, f.  
**Trickle through, v.i.** ગળવું.  
**Trinket,** n. (gold or silver) ગણુણું or ગનણું, n.;  
 (common) એષાયર, m.  
**Trot,** v.i. હેકેવું જવું.  
**Trouble,** n. દુષ or દુષ, n.; વેલા, f.; વિપત, f. To give  
 trouble, દુષ દીકું, વિપત પાડવી, હેરાન કરવું.  
 To give intense trouble, રાનરાન પાનપાન  
 કરવું. To suffer trouble, વિપત વેઠવી, દુષ  
 થાવું (with dat. of pers.). To take  
 trouble, મેનત કરવી. Troubled, દુષી. To  
 be troubled, રજાવું, દુષી થાવું.

True,	<i>adj.</i>	ખરું, હાસું. Truly, ખરેખરું, હાસેહાસ.
		Truth, હાસું, <i>n.</i>
Trunk,	<i>n.</i>	(box) પટાહણું, <i>n.</i> ; (of a tree) ધોડ, <i>m.</i> Elephant's trunk, ધોડ, <i>f.</i>
Trust,	<i>n.</i>	બરોદા, <i>m.</i> ; વીસ્વા, <i>m.</i> ; એમન, <i>n.</i> ; <i>v.t.</i> બરોદા રાખવો, વીસ્વા રાખવો, એમન રાખતું.
Try,	<i>v.i.</i>	ઘેય કરવી.
Tuesday,	<i>n.</i>	મંગળવાર, <i>m.</i>
Tumour,	<i>n.</i>	ગાંઠ, <i>f.</i> ; જમરું, <i>n.</i>
Tumult,	<i>n.</i>	અલો, <i>m.</i> ; ઉલેર, <i>f.</i> ; સડાઈ, <i>f.</i> To raise a tumult, સડાઈ કરવી.
Tune,	<i>n.</i>	રાગ, <i>m.</i>
Turban,	<i>n.</i>	પાથડી, <i>f.</i> ; (small) છાળણું, <i>n.</i>
Turmeric,	<i>n.</i>	અલદી, <i>f.</i>
Turn,	<i>n.</i>	(a time) વારો, <i>m.</i> ; <i>v.i.</i> વળતું, ફરતું. <i>v.t.</i> વાળતું, ફેરવણું. To turn out, કાઢતું. To turn out (good or bad), નીછતું. To turn tiles, ટાપડા ફેરવણ્ણા.
Turtle-dove,	<i>n.</i>	ટેલો, <i>m.</i>
Tweezers,	<i>n.</i>	સીપીઓ, <i>m.</i>
Twilight,	<i>n.</i>	ખાયખાણું, <i>n.</i> ; હંજયાઙુંણું.
Twinkling,	<i>in a,</i>	આંખ મસતામાં.
Twice,	<i>adv.</i>	એ વાર, એ ફેરા. Twice as much, બ્યાણું.
Twins,	<i>n.</i>	નોભ્યા, <i>m. pl.</i> ; નોભ્યાં, <i>n. pl.</i>
Twist,	<i>v.t.</i>	આમળતું, મથતું. To twist a bullock's tail, કંન્યો આમળનો.
Two,	<i>adj.</i>	બે. Two and a half, અડી.
Typhoon,	<i>n.</i>	કારેણું, <i>f.</i>

## U.

**Ugly, adj.** હોકાં, બગા દાત, સીયું નાંઠ.

**Ulcer, n.** સાંદી, f.

**Umbrella, n.** ચતરી, f.; (made of leaves) પોથડી, f.

**Uncle, n.** ભાગો, કાકો, માગો, ભુગો, માહો. See § 65.

**Unconscious, adj.** બેખાંન.

**Undecided, adj.** બેમનતું. To be undecided, વસાર ખરાવે.

**Under, prep.** એટે, તળે, નીચે, નીચે.

**Understand, v.t.** બુઝવું; બુઝણું or બુજ પડવી (with dat. of pers.). Understanding, ગમ, f.; બુઝણું, f.; બુજ, f.; adj. બુજું.

**Undertake, v.t.** આદરનું.

**Uneven, adj.** સરફિતર. Uneven ground, ખાડાકુસ્તય, f.

**Unexpected, adj.** અસાધનું. Unexpectedly, અસાધ, ઉપરયાદ.

**Unfair, adj.** જેરવાજાખી.

**Unfinished, adj.** આદું, કાચું.

**Unhappy, adj.** દુખી or દુખી.

**Uniform, adj.** એકલતા.

**Uninhabited, adj.** ઉણાડ.

**Unite, v.t.** બેળું or બેનું or એકંઠું કરવું. United બેળું, બેનું, એકંઠું.

**Unmarried man,** કુઆરો, અગન કુઆરો. **Unmarried women,** કુઆરી.

**Untidy, adj.** કોઓદરીલું.

**Unoccupied, adj.** નવરી; (of a house) હુનું. To be unoccupied, નવરીધિયાવી or હોર થાવી (with dat. of pers.); નવરી થાવું; માખાં મારનાં (lit. to kill flies).

**Unsettled, adj.** બેરાળ. To lead an unsettled life, રાળાંટેણાં કરવાં.

- Until, *prep.* અગણ્ય, ફુદી, જાંખાગણ્ય, જાંખુદી.  
 Unto, *prep.* Expressed by the Dative Case.  
 Untrue, *adj.* ખાંડું, જુંકું.  
 Unused, *adj.* કોરે.  
 Unwilling, *adj.* રાજુ નહીં. Unwillingly, રાજુખુસીંહ નહીં.  
 Unwittingly, *adv.* અધૂલાએ.  
 Up, *adv.* આથે, ઉપર. Up to, તેથે, ફુદી. Upon, આથે, ઉપર.  
 Upper, *adj.* ઉપરું.  
 Upright, *adj.* ઉચ્ચાં; (good) હાઉ, ઘરં, ટીક.  
 Uproar, *n.* ખમર્સી, *f.* (generally followed by દાવી),  
 Upside down, ઉદ્દં.  
 Urgent, *adj.* તરતનું.  
 Us, *pron.* અમાં, આમાંએ, આપડાએ. See § 14.  
 Use, *n.* કામ, *n.*; (demand) ઘપ, *m.* To be of  
 use, કામાં આવણું; *v.t.* વાપરવું. To be  
 used, ઘપવું. To be used up, ઘપી જતું,  
 પણવું. Useful, કામનું. Useless, કામ વગરનું,  
 નકામનું. To lie unused, પડી રેવું.  
 Utensils, *n.* રાસાં, *n.pl.* Cooking utensils, રાંદવાનાં વાહણ્ય.  
 Utterly, *adv.* નહીં.

## V.

- Vacant, *adj.* હાલું, ખાલી. Vacancy, હાલી જગ્યા, ખાલી જગ્યા.  
 Vaccinate, *v.t.* ખુદવું. Vaccinator, ખુદારો.  
 Vain, *adj.* હાલું, ખાલી. In vain, અમણું, હાલુંહાલું.  
 Vanish, *v.t.* અલપથાતું, જતું રેવું, ખોવાઈજતું. Vanished, અલપ.  
 Variegated, *adj.* કાખરી.  
 Various, *adj.* જુહજુહુક, જુહજુહ જતનું.  
 Vegetable, *n.* ભાજ, *f.*

Vein,	n.	નેણ, m.
Vengeance,	n.	વેર, n. To take vengeance, વેર વાળતું.
Venom,	n.	નેર, n.; પણ, n.
Venemous,	adj.	નેરી.
Verandah,	n.	પડહાળ, f.
Verily,	adv.	ખરેખરે, હાંસેહાંસ.
Very,	adv.	ખાલ્યું, ખુલ્યા.
Vessel,	n.	(earthen) દાંયું, n.; (for holding ghee) પાહેરો, m.; (copper) અદમણી, f.; (iron saucer) તાવડી, f.; (the two water-vessels carried on the head) ધાડવો, m. ગોળી, f.
Vex,	v.t.	ખીજવણું, નારાજ કરવું. Vexed, નારાજ, બેરાળ. To be vexed, ખીજવું, જવ કરળવો.
Victuals,	n.	આવાજું or આતું, n.; ભાથ, n.
Village,	n.	ગામ, n. Bhil village, પાળ, f. Village chief, ગામેતી, મુખી. To wander from vil- lage to village, ગામોગામો કરવું.
Violence,	n.	લોરાવરી, f.; લોર, n.; ગજખ, m.
Virgin,	n.	કુલ્યારી.
Visible,	adj.	દેખાતું. To be visible, દેખાતું.
Visit,	v.t.	(a person) મળવા જાતું; (an idol or a superior) દરસણ કરવું. Visitor, પાંખણી.
Voice,	n.	શીદ, m.
Void,	adj.	ઠાકું, ઘાલી.
Vomit,	v.t.	ઓષ્ણણવું.
Vow,	n.	ધારા, f.; માનતા, f. To vow a vow, માનતા માનવી. To perform a vow, માનતા કરવી.
Vulture,	n.	ગરદ, m.

## W.

Wages,	n.	પગાર, m.
Waist,	n.	કુદ્દ, f. Waist-cord, કંદોરો, m. Waist-band, ગમદ્ધણું, n.; પસાડો, m.
Wait,	v.i.	ઉચ્ચું રહેવું, યોખણું. To lie in wait for, તાકવું. Waiting, ઉચ્ચું. To keep waiting, ઉચ્ચું રાખવું. એઠી ફરવી, વાર જગાડની.
Wake,	v.i.	લગતું. v.t. જગાડતું.
Walk,	v.i.	ફીઝાંદું, સાલતું. To go for a walk, ફરવા જતું.
Wall,	n.	ધીપદું, n.; ભીતા, f.; ભીતડો, m. A city wall, ડેટ, f. A back wall, પસીટ, f. An end wall, ફરેજો, m.
Wallet (fakir's),	n.	લોળી, f.
Wander,	v.i.	ભમબું, ભમતું ફરારું. To wander about, શવદું, શવડતું ફરારું. To wander from village to village, ગામેગામો ફરારું.
War,	n.	લડાઈ, f. War cry, લિફલી, f.; વાર્દ, f. To sound the war-cry, લિફલી ફરવી, વાર્દ પાડવી.
Ward (of a village),	n.	પાડા, m.; કુળો, m.
Warm,	adj.	ઉંઘું. v.t. તાખવું.
Warn,	v.t.	સેતાવણું. To be warned, સેતવું. Warning સેતાવણી, f.
Was,	v.	આતો-તી-તું.
Wash,	v.t.	ધોવું. To wash thoroughly, ધોઘ ઢારું. To wash oneself, જલતું, નાંદું.
Waste,	v.	ઉડાવણુસ, n.; adj. ઉંડાસ; v.t. ઉડાવણું.
Wasteful,	adj.	ઉડાસસ. To be wasteful, ઉડાવણુસ ફરારું, ઉડાસ હોયાં.

- Watch,** *n.* (time-piece) ધડીખાલ, *f.*; (guard) પોરો, *m.*; *v.i.* સોકી રાખવી, સોકી કરવી, પોરો કરવો, પોરો દીવો. To watch for, —ની વાટ જેવી. Watch-man, પોરાવણો, સોકીતાજો. Watch-house, સોકી, *f.*
- Water,** *n.* જળ, *n.*; પાણી, *n.* Water-course, નીક, *f.* Water-fowl, જળકુકું, *n.* Water-melon, કરણુલો, *m.* Water-trough, આગાડો, *m.* Water-wheel, રૂંડ, *f.*
- Wavering,** *n.* ઘેમન, *n.*; *adj.* ઘેમનતું.
- Wax,** *n.* મેણ્ય, *n.*
- Way,** *n.* (road) રસનો, *m.*; વાટ, *f.*; મારગ, *m.*; (method) રીત, *f.* To waylay, —હાર ઓડાઅં પેહી રેવું.
- We,** *pron.* આમાં, આપડાં. See § 14. We ourselves, આમાં પંડે, આપડાં પંડે.
- Weak,** *adj.* નખરું or નમરું, દુખરું, ધાળિદર. Weakness, નખળાઈ, *f.*
- Wealth,** *n.* ધન, *n.*; પુણ, *f.*; માલ, *m.* Wealthy, ધનવતી, પુણવાળું, પાછસાવાળું, માલવાળું.
- Wear,** *v.t.* પેરવું, ઓડવું. To give to wear, પેરાવણું. To wear fine clothes, મકલાવું.
- Weary,** *adj.* થાકું.
- Weave,** *v.t.* વણવું. Weaver, વણુકાર, *m.* Weaving, વણાઈ, *f.*
- Web,** *n.* (of cloth) થાન, *n.*; (spider's) જળ, *f.*
- Wed,** *v.t.* પણવું. Wedding, લગન, *n.*; વીવા, *m.*
- Wednesday,** *n.* ચુદવાર, *m.*
- Weed,** *v.t.* નીંદવું.

Week,	n.	આઠવાડ્ફંચું, n.
Weep,	v.i.	રોતું.
Weevil,	n.	(that bores into wood) કોડલો, m.; પીડલો, m.; (that eats grain) ધનેડો, m.
Weigh,	v.t.	જોખું Weight, ભાર, m. Weights, કાટલાં, n. pl.
Well,	adv.	ઠીક, હાડ ; (in health) હારીપોઠે ; interj. ઐર ! વાર ! હાર ! To get well, હાડ થાતું. Are you well ? મળતમાં હો ? Well-behaved, સાલવાળું. Well done ! વાદ ! વાહવાદ !
Well,	n.	કુલો, m.; (with steps) વાવ, f.
West,	n.	આથમણ્ણો દેસ. Western, Westward, આથમણ્ણું.
Wet,	adj.	નીંદું, પલણેલું. To be wet, પલણવું ; v.t. પલાળવું.
What ? pron.		કું ? What kind of ? કોણું ? or કેવું ? હેતું ? What else ? અધીજું કું ?
Wheat,	n.	ગાઉ, n.
Wheel,	n.	પાઈડી, f.; પાઈફું, n.
When,	adv.	એરે, જણીવેળા. When...then, એરે...તેરે ; જણીવેળા...તણીવેળા, When ? કેરે ? Whenever, એરેએરે...તેરેતેરે. Whence ? કું ? કેહાં ?
Where,	adv.	oir or જયાં. Where...there, જયાં...લાં. Wherever, જયાંજયાં...લાંલાં, Where ? કૃયાં ?
Which, pron.	(relat)	એ. (interrog.) કૃપાનો—ની—તું ?
While,	conj.	અતરાકમાં. A long while, ધણી વેળા, ધણી વાર.
Whip,	n.	કોષડો, m.; તાજણો, m.; જેરાંદ, m.; v.t. કોષડો or તાજણો or જેરાંદ મારવો.
Whirlwind, n.		ઝુત, m.
Whisk,	n.	બારો, m.; સભરો, m. To whisk away flies, સભરો ટોલકો.
Whistle,	n.	ફુસકારી, f.; v.i. ફુસકારી કરવી.

- Whisper, *v.i.* હેઠેજાં કરવાં, સાનેસાને કાનમાં વાત કેવી.  
 Whispering, હેઠેજાં, *n. pl.*
- White, *adj.* શાળું.
- Whither? *adv.* ક્રિમનોની-ની-નું?
- Who, *pron.* (rel.) જે. (interrog.) કોણું? See § 16, 18.  
 Whosoever, અકણું,
- Whole, *adj.* આખું, હગળું, હેઠું, બદું.
- Whose, *pron.* (rel.) જથ્યાનું, જેનું; (inter.) કોણાનું? કોનું?
- Why? *adv.* ક્રિમ? or કેમ?
- Wicked, *adj.* લુંકું, હરામી, પાપી, પાપેકું.
- Wicket-gate, *n.* ઝાંપો, *m.*
- Wide, *adj.* પોળું. Width, પોળાઈ, *f.*; પોળાઈ, *f.*
- Widow, *n.* રંડી, Widower, રંડેલો આદમી.
- Wife, *n.* ખાઈડી, વઢુ, એરાત. Wife's people, પીએર્યાં, *n. pl.*  
 The house of a wife's parents, પીએર, *n.*
- Wild, *adj.* જગતી, વગડાડ.
- Will, *n.* મન, *n.*; મરજ, *f.*; રહો, *m.* Willing, રાજ,  
 ઝુસી. Willingly, ઝુસીહું, રાજ ઝુસીહું.
- Win, *v.t.* જતવું.
- Wind, *n.* વાવરો, *m.*; પોવન, *m.* Hot wind, છ, *f.*
- Window, *n.* ખારી, *f.*
- Wing, *n.* પાખ, *f.* Winged, ચાંધું.
- Wink, *v.i.* ચાંખ ભસવી, ચાંખ ભરયારવી.
- Winnow, *v.t.* ઉણું દીંદું.
- Winter, *n.* હીનાળા, *m.* Winter-solstice, ઉત્તરાશુ, *n.*
- Wipe, *v.t.* પોસવું, લુસવું, લુસવું. To wipe out, પોસી દાવું,  
 લુસી દાવું.
- Wire, *n.* તાર, *m.*
- Wise, *adj.* અહૃતવાળું, હમજુ. Wisdom, અહૃત, *f.*

Wish,	n.	મન, n.; મરળ, f.; રહો, m.; v.t. સાહું.
Witch,	n.	ડાકેણુ. Witch-craft, ડાકેણુનું સોટવું. Witch-finder, બોપોા, કુરાડ.
With, prep.		કને or કેને, પાહે. Along with, લારે, હાતે, હાતેહાતે.
Wither,	v.i.	ફૂકાવું, ફૂકાઈ જવું.
Within, prep.		માં, માંય.
Without, prep.		(except) વગર, વના; (outside) ખાયદી.
Witness,	n.	ગવાણી, સાહેદી, હાક્કી; (testimony) સાહેદી, f. v.i. સાહેદી આલવી.
Woe,	v.	દુખ or દુખ, n.; બેળા, f.; interj. અરે!
Woman,	n.	ઘાઢી, લોગાઈ. Old woman, તોકરી, તોસી, તોકી. Bad woman, પૃદ્રાંજલી, પાતર, ભક્તાની.
Wonder,	n.	ગજાય, m.; નવાઈ, f.; v.i. નવાઈ લાગવી (with dat. of pers.), એરાન પામી રેવું.
Wool,	n.	ઉન, n.
Wood,	n.	લાકડું, n. Block of wood, દીગણું, n. Wood-apple, કખીયું, n. Wood-apple tree કખીથી, f.
Word,	n.	વાત, f.; (promise) વસન, n.
Work,	n.	કામ, n.; v.i. કામ કરવું. To work diligently ઘેપ કરવી. To work hard, કેદ તોડવી. To work overtime, વખત વેઠવી.
World,	n.	દુન્યા, f.; કળગસ, f.
Worm,	n.	આળીલીદું, n.
Worn out, adj.		ધાકેણું; (of clothes) ઉતરેલાં. To be worn out, ચાકી જવું.
Worry,	n.	દુખ, n.; v.i. દુખણું; v.t. ખીજવણું, દુખ કરવું.
Worship,	n.	પુજા, f.; ભગતી, f.; ભજન, n.; સેવા, f.; v.t. પુજાનું, —ની ભગતી કરવી, —નું ભજન કરવું. Worshipper, ભગત, m.

Worth,	n.	મોખ, n.; કીમત, f. What is it worth? એનું મોલ કું હે?
Wound,	n.	ધા, m.; જરડોા, m.; જેખમ, m.; v.t. ધાયશ કરવું. Wounded, ધાયશ.
Wrap,	v.t.	પોથવું.
Wrath,	n.	રીણ, f. Wrathful, રીહાણ્ય.
Wrestle,	v.i.	ખાથાં પડવું, લથાખથી કરવી.
Wring,	v.t.	નસોવણું. To wring out, નસોવી ઢરવું.
Write,	v.t.	લખવું. To write a letter, કાગદ કરવો.
Wrong,	adj.	ઓઢું, ઠીક નહીં.

## Y.

Yam,	n.	રતાળુ, m.
Yawn,	n.	ઘગાઢી, f.; v.i. ઘગાઢી હોયાવી. To yawn excessively, ઘગાઢી તાણ્યાવી.
Year,	n.	વર, n.; સાલ, f. A year of scarcity, હથકું વર. This year, ઓણ્ય. Last year, Next year, પોર. The year before last, The year after next, પરાર.
Yellow,	adj.	પીળું.
Yes,	adv.	હા, હોયે.
Yesterday,	adv.	કાલ or કાલે. The day before yesterday, પરમદાડે, પમને દાડે.
Yoke,	n.	ઓહડી, n.
Young,	adj.	જેવન. A young man, મોતીઆર. The young of any animal, ટેકું, n.

## SHORT SPECIMEN SENTENCES.

---

How are you ? ...	... ... ... ... ... ... ...	કીમ હો ? હાઉ હો ? મનમાં હો ? મય કને આવો. એવાં ને એવાં આવો. વળી આવનો. જણે પોગે નાઓ, તણે પોગે પાસો આવનો.
Come at sunset,...	...	દન ખુડી જાને તેરે આવનો.
Are you coming ?	...	આવો કે ?
(You) must come back,		પાસું આવણું પડે.
Where have you come from ?	... ... ...	કેદા આવજ્યા ?
Where are you going ?		ક્યાં જો ?
I must go,...	... ...	મારે જતું હે.
I wish to go, ...	...	મય જાતાંતું મન હે.
Go and see,...	... ...	જોઈને આવો.
He said he would go,		હું જાણી, ધીમ કેળ્યું.
He has already gone,		વી જઈ રેન્યો હે.
Can you go as far as Kherwara to-day ?		ભેરવાડા કુદી આજ તથ જવાય.
I shall go as far as I can,		મય જવાય તેમ જાણી.
He goes about very dirty,		ધાંસી હરડા યાઈને ફરતો હોડ.
She goes along singing,		વે ગાતી જય.
One of the men went,		આદમ્યાંમાંહોા એક ગીજ્યેટ.
How long ago ?...	...	કંયાંતું ?
Ever so long ago,	...	કંયાંતું.

That was long ago, ...	કંન્ધાનું થાજયું.
What do you think ?...	તમું હું લાગે ?
I think the same, ...	મય છતુંજ લાગે.
About twenty, I think,	આરી અર્દ્દશાસ્ત્રમાં વીહેક.
Whatever you like, ...	સરતમાં આવે તીમ.
I like it, ... ... ...	મય હાઉ લાગે.
Just as you like, ...	તારી નજરમાં આવે તીમ,
Ask him, ... ... ...	વણ્ણાય પુસો.
Do what you are told,	કેળ્યું કામ કરો.
I want some medicine,	મારે એખાદ લીવી હે.
I don't remember, ...	મય હોતે નહીં.
Which is the next village?	કું ગામ આવે ?
What did it cost? ...	એનું હું બેઠું ?
What kind of wood is this?	ઇયે લાકડી હેની હે ?
How high is it? ...	ઉસાઈમાં કટાડું હે ?
What is the meaning of this? ... ...	એ તણ્ણું હું ?
How may the loss be made good?... ...	એનું ઉણું કેઠું થાય ?
Is the work finished ?	કામ થાઈ રેણ્યું કે ?
The work was done by me,	મારાહું કામ થાજયું.
Work with all your heart,	જોરહું કામ કરો.
Help him to do the work,	આણ્ણાય કામ કરવા લાગો.
Do the work, whatever it is,	ગમે તીવું કામ વે, વી કરો.
Send whomsoever you like,	ગમે તણ્ણાય મોકલો.
However ill he may be, he may get better.,	ગમે તીવો ભાંદો વે, વી હાઉ થાય.
I cannot eat food, ...	મય અન ખવાતું નહીં.

I cannot see anything,  
Don't deceive me, ...  
It has begun to be light,  
If I fall, you fall, ...  
He shews me kindness,  
He will fine me forty  
rupees,... ... ...  
He looks very angry,...  
You are mistaken, ...  
You have lost your way,  
You will get (it) from  
the man, ... ...  
May you prosper ! ...  
Support him as long as  
he lives, ... ...  
Drink it as long as it lasts,  
This is better than that,  
There is nothing except  
that, ... ... ...  
You never know where  
you have him. ...  
Lend me five rupees for  
a month, ... ...  
I owe the Bania five  
rupees,... ... ...  
I had a pleasant journey,

મય કંઈ દેખાતું નહીં.  
મયહું હગો રખે કરો.  
આજવાળું થાવા માંદનયું.  
કું પડતો તો તું પડતો.  
મારે ભાયે વી નજર રાખે.  
વી મારે ભાયે એ વીહ રૂપીઆનો  
કંડ કરહે.  
કાળોકાળો થાઈને વી ડોળા કાડે.  
તમાં જુલા ખો.  
તમાં જુલા પડજ્યા હો.  
આઝમી કનેહું તથ મળહે.  
તમારે હાર ટીક થાલે !  
જવે સાંભગણું ખાંન આશો.  
પુરો અતરા ઝેરા પીઓ.  
આણું ધયું હાઉ હે.  
વણું ઘીનું કણું નહીં.  
એમનો જય ને તેમનો જય.  
મહીનાને કાસે પાંસ રૂપીઆ હસીનાં  
જય આશો.  
કું વાણીઆતું પાસ રૂપીઆતું દેખું  
રાખું.  
હોનો વાયરોન અડ્યુનો તેમ આણગેનું

## BHIL PROVERBS.

---

આજ કરવાનું કાશને માયે ન રાખવું. Put not off till to-morrow what is to be done to-day.

આપ ભલા ને જંગ ભલા. If you are kind (to the world) the world will be kind to you.

ઉપાડણું કુતર્ણ તે ફું આપડો કરે? How can a carried dog hunt?

ઓખાં ગળણું નહીં ઉંમે. No medicine can be sweet. [Reproof is never pleasant].

કમાઉ સેરો આઈ ખાપને વાસો લાગે. A son who earns money is dear to his parents.

કામ કળેછું ધાપ અતિ બોરેછું નહીં ધાપ. More work can be done by persuasion than by force. [Fair and softly go far in a day].

ખાડો ખણું તી પડે. He who digs a pit falls into it.

બોંગડતો ઉઠ પક્ષાણવો નહીં, ગાગડું મનખ કામ કરાવણું નહીં. Don't load a grunting camel, don't make a grumbling man work.

અનીજથો વખત પાસો આવતો નહીં. Time once gone does not come back.

શુદ્ધ કરતાં સેલા વઢારે. Scholars (often) go ahead of their teachers.

ગેરનાં સોરાં ભુઘે ભરે ને ઉપાધથો કે મય આટો. While the children of the house are starving, the mendicant priest says, "Give me flour". [Quoted to shew the greed of the Brahmans].

ગેર બાળને લીરથ કરવા જતું. To burn one's house and go on a pilgrimage. [To neglect one's own work in order to do the work of another ].

અય લેરી તો હતો અથક વેરી, If the tongue is venomous, the whole country is hostile.

દાઢ જાણ પણ ટેવ ન જાણ. Dandruff may go, but habits won't go. [ What is bred in the bone does not come out in the flesh ].

નાગો નહ હતરીને નસોને ફું? What has a naked man to wring out when he crosses a river? [ As poor as a church mouse ].

પાણ્ણી કેજું કાદું ન મળો. You spoke of water, there is not even mud to be got. [ Said to one who has disappointed another after raising false hopes ].

પાખનો ધૂમો ભસણો તી કુદો. His cup of iniquity, being full, has burst. [ Said of a man who has at last been punished after a long career of wickedness ].

પારકા ઝેતરાંની જી નહો વાવીએ. Let us not sow seed in the fields of others. [ Don't meddle with other people's business ].

પારકુ એખ હગાડવી નાલી. Don't expose the faults of another.

પારકું કામ ક્રીધે જાળ ભરાય પણ પેટ ન ભસાય. By doing the work of another our cheeks may get filled but not our stomachs.

પારકુ રૂપ દેખી દા ન હગાડવીએ. Do not let us deceive our hearts by the looks of others. [ Don't trust appearances ].

ખાયણે નીકળયો ખાર હાય ને ગેર ગીજયો રોડ વેત, When he is abroad he is twelve cubits high and when he is at home he is a span and a half. [Said of one who keeps up false appearances].

ભદળું કુતરું નહીં કરો, બહન્યો ભીલ નહીં મારો. A barking dog doesn't bite, a chattering Bhil doesn't strike. [Great barkers are not great biters].

શીમનું રેર ઉદેચ ન ખાય. White ants can't eat away a Bhil's vengeance.

જૂત કરતાં બોપા વદારે. There are more ghost-layers than ghosts. [Said to a superstitious person to soothe his fears].

મારે તેની તરવાર ને મેનત કરે તેની ઘેડ. He who slays his is the sword, and he who labours his is the farm. [Every one to his trade].

મુખેલા મુખાનું કામ નહીં સદરે. A man without spirit is useless. [lit. The work of a dead face is not effectual].

વસન આથતાં મોરેઢો વસાર કરવો. Think before making a promise. [Look before you leap].

લાડ વગર વીમો નહીં સડે. A creeper can't climb without a hedge.

હરકત તેવી ખરકત. As is the difficulty, so is the blessing. [No cross, no crown].

હાય લાંઘો ને ધો પોળી, A snake is long and a bis-cobra broad. [Six of one and half a dozen of another].

કુંસે હરએ કરે તેનું કામ સદરે, He who works energetically and willingly works effectually.

---

## A Bhil's Prayers when presenting his offerings.

---

મારી મા, હાઉ રાખને ! ... O goddess-mother, keep me well !

મારી મા, કહેળખેમમાં રાખને ! O goddess-mother, keep me in comfort !

મારી મા, હાજેતાને રાખને ! O goddess-mother, keep me safe and sound !

When the Bhils make an offering to their deceased ancestors they make the following requests in front of the memorial stones, the former before the અગાઠ, the latter before the સોદલી :—

જ સહાતું તી બોગ લીને, ભારા ભંધાપ ખાવસી, O honoured father, accept the offering which I offer !

જ સહાતું તી બોગ લીને, મારી મા, O mother, accept the offering which I offer !

## A SPECIMEN BHIL BALLAD.

---

नैा ने मुठेठी, हुरभा सौवांछे २.  
 भाप बेटानो ४ल्लो, हुरभा सौवांछे २.  
 ओछो ४ल्लो भागो, हुरभा सौवांछे २.  
 भोटो राज वाले, हुरभा सौवांछे २.  
 हाँसु आँहु राज वाले, हुरभा सौवांछे २.  
 हाँसु हेनो ४ल्लो भागो, हुरभा सौवांछे २ ?  
 हाँडे जभीर पाणोनो, हुरभा सौवांछे २.  
 वजे तेनो ४ल्लो भागो, हुरभा सौवांछे २.  
 छउरे भदाराज, हुरभा सौवांछे २.  
 राज ४भीर दिंगल, हुरभा सौवांछे २.  
 भारी ४ल्लो भागो, हुरभा सौवांछे २.  
 हाँसु वाहो काढे ४डे, हुरभा सौवांछे २ ?  
 ओवे छउरे भदाराज, हुरभा सौवांछे २,  
 तीते वाहो काढे, हुरभा सौवांछे २.  
 छन्यु ते नहीं भाने, हुरभा सौवांछे २.  
 भारवेटे नीकल्लो, हुरभा सौवांछे २.  
 हाँसु रयां कुवर जयरे, हुरभा सौवांछे २ ?  
 हाँडे भगरामां हें द्वारकी, हुरभा सौवांछे २,  
 लां ते कुवर जयरे, हुरभा सौवांछे २.  
 भारवेटे जयरे, हुरभा सौवांछे २.  
 हाँडे लां ते राज जयरे, हुरभा सौवांछे २.  
 पायजे बथ्यानो, हुरभा सौवांछे २.  
 वजे पायजे द्वानो, हुरभा सौवांछे २,  
 वजे थोडीलां अंदानो, हुरभा सौवांछे २,  
 भगरामां हें द्वारकी, हुरभा सौवांछे २.  
 वजे लां ते गड चथ्यानो, हुरभा सौवांछे २,

## TRANSLATION OF THE BALLAD.

---

The towns of Mow and Mudeti, O Hurma Chawan.  
 A quarrel between father and son, O Hurma Chawan.  
 A petty quarrel arose, O Hurma Chawan.  
 (The son) is reputed a great king, O Hurma Chawan.  
 He is reputed an indomitable king, O Hurma Chawan.  
 What kind of a quarrel took place ? O Hurma Chawan.  
 It was a quarrel about a land boundary, O Hurma Chawan.  
 About that a quarrel arose, O Hurma Chawan.  
 At Idar there is the Maharaja, O Hurma Chawan,  
 King Hamirsingji, O Hurma Chawan.  
 A serious quarrel arose, O Hurma Chawan.  
 Who will settle the dispute ? O Hurma Chawan.  
 The king of Idar, O Hurma Chawan.  
 He settles a dispute, O Hurma Chawan.  
 They did not attend to what he said, O Hurma Chawan.  
 (The son) went forth as an outlaw, O Hurma Chawan.  
 Where does the prince go ? O Hurma Chawan.  
 In the hills dwell the Farki Bhils, O Hurma Chawan.  
 There the prince goes, O Hurma Chawan.  
 He goes as an outlaw, O Hurma Chawan.  
 There the (young) king goes, O Hurma Chawan.  
 He built a stable, O Hurma Chawan.  
 He fixed (stakes) in the stable, O Hurma Chawan.  
 And tethered the horses there, O Hurma Chawan.  
 The Farki Bhils dwell in the hills, O Hurma Chawan.  
 He built a fort there, O Hurma Chawan.

સ્થાર સો અહીના રે, હુરમા સૌવાંશે રે.  
 કુનર આંડી લીયે, હુરમા સૌવાંશે રે.  
 દાલાં કે તરવારાં, હુરમા સૌવાંશે રે.  
 લડાઈ કરવા ઉઠોતો, હુરમા સૌવાંશે રે.  
 પાંડવાંદે બોલાવે, હુરમા સૌવાંશે રે.  
 હાંકે ધોડીલા પલાણો, હુરમા સૌવાંશે રે.  
 વળી કાઢા તંગે બીડા, હુરમા સૌવાંશે રે.  
 કુનર લડાઈ લયરે, હુરમા સૌવાંશે રે.  
 એવે મુદેટી નઈ લાગે, હુરમા સૌવાંશે રે.  
 ભારી છજુઓ ભાગો, હુરમા સૌવાંશે રે.  
 હાંકે રાણ મેલાં\* બેઠો, હુરમા સૌવાંશે રે.  
 લાંતે લડાઈ થાયરે, હુરમા સૌવાંશે રે.  
 એવે ભારી લડાઈ થાયરે, હુરમા સૌવાંશે રે.  
 એવે રાણ જલમ હીંગળ, હુરમા સૌવાંશે રે.  
 એવે તીતે ગોખડાં\* બેઠો, હુરમા સૌવાંશે રે.  
 એવે વળે હાથાંમાંય બંદુકે, હુરમા સૌવાંશે રે.  
 એવે ભારી લડાઈ થાયરે, હુરમા સૌવાંશે રે.  
 બંદુકોની ધામારાળો ઉડે, હુરમા સૌવાંશે રે.  
 ભાલડીઓનો છરભર મેલાં\* વરહે, હુરમા સૌવાંશે રે.  
 હાંકે તરવારાંની વીજળી જખુડે, હુરમા સૌવાંશે રે.  
 એવે બંદુકે તે ચુટી, હુરમા સૌવાંશે રે.  
 રાણ જલમ હીંગળ, હુરમા સૌવાંશે રે.  
 એવે રાણ ગોળી લાગી, હુરમા સૌવાંશે રે.  
 એવે આંગળી ગોળી લાગી, હુરમા સૌવાંશે રે.  
 હાંકે તે રાણ પસતાયરે, હુરમા સૌવાંશે રે.  
 એવે ડારા કાગદ લખે, હુરમા સૌવાંશે રે.  
 હાં વળે છડેરે ભહારાણ, હુરમા સૌવાંશે રે.  
 એવે લાંતે કાગદ મોકલો, હુરમા સૌવાંશે રે.  
 એવે ભારી હખરાન વાને, હુરમા સૌવાંશે રે.

And remains four or six months, O Hurma Chawan.  
 The prince nursed his revenge, O Hurma Chawan.  
 (With) shields and swords, O Hurma Chawan,  
 He rose up to fight, O Hurma Chawan.  
 He calls the syces, O Hurma Chawan.  
 And says, "Saddle the horses", O Hurma Chawan.  
 "And tighten the girths", O Hurma Chawan.  
 The prince goes to war, O Hurma Chawan.  
 He starts for Mudeti, O Hurma Chawan.  
 (There) a great fight began, O Hurma Chawan.  
 The king was sitting in his palace, O Hurma Chawan.  
 There the fight takes place, O Hurma Chawan.  
 A serious fight takes place, O Hurma Chawan.  
 The king, Jalam Hingji, O Hurma Chawan,  
 He was sitting in the window, O Hurma Chawan.  
 He had a gun in his hand, O Hurma Chawan.  
 A serious fight begins, O Hurma Chawan.  
 A terrific sound of guns arises, O Hurma Chawan.  
 A shower of arrows falls in the palace, O Hurma Chawan.  
 The flashes of swords glitter, O Hurma Chawan.  
 A gun is fired, O Hurma Chawan,  
 (At) the king Jalam Hingji, O Hurma Chawan.  
 The ball hit the king, O Hurma Chawan.  
 The ball hit him in the finger, O Hurma Chawan.  
 The king then gives in, O Hurma Chawan.  
 He writes on a piece of blank paper, O Hurma Chawan.  
 He writes to the king of Idar, O Hurma Chawan.  
 And sends the letter there, O Hurma Chawan.  
 (The king of Idar) is a great chief, O Hurma Chawan.

ક જુસી હે બાંમથ્યું, કુરમા સૌવાંશે રે.  
 ઓને બાંમુલુ ધાંમા દોડે, કુરમા સૌવાંશે રે.  
 ઓને છડેર નઈ ભાગો, કુરમા સૌવાંશે રે.  
 ઓને રાણ મેલાં\* બેઠો, કુરમા સૌવાંશે રે.  
 ઓને બાંમથ્યું નાધ લાયું, કુરમા સૌવાંશે રે.  
 હાંક ખોળે કાગદ નાંશે, કુરમા સૌવાંશે રે.  
 હાંક કાગદ વાંસી જેથ, કુરમા સૌવાંશે રે.  
 વળે બડાયડ કાગદ ખોલે, કુરમા સૌવાંશે રે.  
 હાંક મૈને ને મુડેટી, કુરમા સૌવાંશે રે.  
 ની લાં તે કળગો ભાગો, કુરમા સૌવાંશે રે.  
 ઓને બાધ બેટાનો કળગો, કુરમા સૌવાંશે રે.  
 ઓને વાંદો કાડી આલો, કુરમા સૌવાંશે રે.

The words ઓને, હાંક, હાંશુ, occurring occasionally at the beginning of a line, are mere affirmations which need not be rendered in the English translation.

\*મેલાં=મેલભાં ; ગોખડાં= ગોખડાભાં.

(Jalam Hingji) sends a Brahman, O Hurma Chawan.  
The Brahman runs quickly, O Hurma Chawan.  
He sets off to Idar, O Hurma Chawan.  
The king is sitting in his palace, O Hurma Chawan,  
The Brahman goes to him, O Hurma Chawan.  
He puts the letter into his lap, O Hurma Chawan.  
(The king) reads through the letter, O Hurma Ohawan.  
He reads the letter, muttering, O Hurma Chawan.  
"Mow and Mutedi", O Hurma Chawan.  
"There is a fight there", O Hurma Chawan.  
"A fight between father and son", O Hurma Chawan,  
He settled the dispute, O Hurma Chawan.

---

Some of the Bhil clans in Rajputana  
and Gujarat.

NAME.	PLACE.	DEITY.
અરીઆત or હરીઆત,	મધુગામડા,	કાલિકા માતા, f.
અસારી or આહારી,	નીલાક,	શુદ્ધેં, m.
કટારા,	નતારા,	માલો, m.
કળાહુચા,	કાગદર,	એલો, m.
ખરાડી,	ઘેરબો,	અંભાવ, f.
ચુમાર,	ભંસનાડા,	અંભાવ, f.
ગોડાડામેર,	ખંકાવાડા,	વાનેડ, f.
ઘાધરા,	વડા,	મસીતલો, m.
ઉમરા.	તથુડાવાડા,	લીણેસ, f.
ડાભી,	શુજરાત,	વડવેલ, f.
ડામેર,	ખંકાવાડા,	કન્યાળો, m.
ડાણુ,	થુર,	થુર, f.
તવન્યાડા,	લંખાવાડા,	બેડ, f.
તેલેત,	સરારા,	પીપળાહેણુ, f.
દામા,	ઘેરવાડા,	થુર, f.
નનાંમા,	ઘેખર,	થુર, f.
નાડા,	થુર,	થુર, f.
પરમાર,	સરારા,	પીપળાહેણુ, f.
પાંડેર,	લીમડા,	પીપળાહેણુ, f.
ક્રારગી,	સાવંદ,	કરહેણ, f.
ખળીડા,	કંઠારીઆ,	થુર, f.
ખાંમણુા,	ઉપરી,	કન્યાળો, m.
ઝોડાત,	ઝુરી, હામીમાલી,	કન્યાળો, f.
બાગોરા,	ખાણલનાડા,	કરહેણ, f.

માંદુણી,	સેદાવાડા,	કુનેલ, f.
મેણ્ણાત,	જડન,	દીભેસ, f.
મોડીઆ,	દીમડા,	પીપળાહેણુ, f.
વગાત,	ઘળવાડા,	થુર, f.
વીઢાત,	મોરી,	કન્યાળો, m.
સોળવીઆ,	ધનહેઠ,	કન્યાળી, m.
કુરાત,	મોડ,	પેડ, f.
હેટા,	થુર,	થુર, f.

## Districts in the Hilly Tracts.

ખરવા,	Kherwara, Jawas, Pada, Chani, Thana.
ગીરવા,	The country around Udaipur.
ઓલાનાર,	The country from Ori to Palasia.
ટંકા,	The Tanka-Tunka district.
જેરસો નાડુર or નાડુર,	The Jura district.
પાંદેર or ભાંદેર,	The Panarwar district.
ખામર or વાગર,	The country to the South of Parsad.
ખાર્દ,	The Dungarpur district, especially to the South-West.
બીલવાડા,	The country from Jura to Sirohi.
મેચાડ,	The country to the East of Udaipur.
સપન,	The Dhebar and Salumbar districts.
કોંક,	The country about Kalianpur.





WHILE the manuscript was passing through the  
Press the following additional equivalents  
for Bhili words came to hand.

*Bhili words.*

અડેલું	Hiring cattle for ploughing.	સુ'ટેલ or ફુ'ટેલ.
છનણી	A small <i>sari</i> .	ઓઠણી.
એકાહણું	A fast for one day.	એકાહારણું.
ઓળગણ્ણો	A sweeper.	ઓળગણ્ણો.
કસરો	A feverish cold.	M. કસરો
કુકુ	Sound made in calling a dog.	કુરકુર.
કુણું	A small bamboo.	ખપેકું.
ખચું	Rough.	કરકર.
ઘાડીબાજું	A stile.	ઘાડીબાડ.
ઘાલો	A donkey.	ઘાલો.
ગળાંમ રાત	About 2 A. M.	ગુલાભી sleep.
ગોઅદ	A herd of cattle,	ગોઅદ.
ઘાગળો	The throat,	ઘાધળો.
જનાણું	Bankrupt.	? જનાદી.
જમારી	Lasting.	જનમારો.
આરી	The bottle-bird,	આરી a goblet.
ઓટો	A web of cloth,	? લેટો.
એટો	The curlew.	ટિટાડી.
થીખરણ	A certain wild fruit.	થિખરવાં.
હુટ્યો	An arm (without a hand),	હુંકુ.
ડકુઅણું	To grope.	? હુદલું.
ડમણું	A boil.	ઢીમડું.
ડળી	Pad-cloth placed under a saddle.	ડળી.
ડાડલાં	The jaws.	ડાદ.
ડાડલું	The chin.	"
નફું	At all, wholly.	ગણખુદ.

પરમે	Beyond.	પરમ as in પરમદાય.
પાગેળ	A cattle-shed.	પાયગા.
પાઠકુ	A kid.	પાઠરી.
પૈથડું	To wrap round.	પૈથડું.
બડોળ	Enlarged spleen.	બરોળ.
ઝુંક	The bottom of anything.	ઝુંક.
ખોડું	An ornament for the forehead.	ખોનિયું.
મગરો	A hill.	મંગરો.
મરદી	An ear-ring worn by men.	મરકીઓ.
માલ્યુ	Measure containing 12 seers.	માલ્યુ.
માંદળુ	An earthen drum.	મ. માદ્યક.
માલવું	To boast.	મહાલવું.
વાડી	An earthen vessel.	વહાડી.
વીસ્યું	A toe-ring.	વિંછનો.
હલુસો	A brick mould.	સાંચો.
હુસંધી	A whistle.	Word formed from the sibilant sound હસ.

## CORRIGENDA ET ADDENDA.

---

Page	3	line	8	for ગંતું read ગંત.
"	5	"	12	after <i>not</i> insert <i>often</i> .
"	14	"	23	for જેરણ રેદ જેરણ.
"	16	"	16	„ <i>expression</i> „ <i>expressions</i> .
"	24	"	13	„ § 24 „ § 25.
"	25	"	19	„ Subunctive „ Subjunctive.
"	26	"	26	„ આમાં „ અમાં.
"	31	"	25	„ Monosyllable „ Monosyllabic.
"	31	"	25	„ ઈ „ ઈ.
"	34	"	14	„ મોકલાહે „ મોકલાહે.
"	34	"	26	„ જાઈ „ જાકી.
"	36	"	11	„ It „ If.
"	36	"	25	„ regarding „ regarded.








The borrower must return this item on or before the last date stamped below. If another user places a recall for this item, the borrower will be notified of the need for an earlier return.

*Non-receipt of overdue notices does not exempt the borrower from overdue fines.*

Harvard College Widener Library  
Cambridge, MA 02138      617-495-2



Please handle with care.  
Thank you for helping to preserve  
library collections at Harvard.



